

B.R.

Crn.

Swami Jethmalji

Kathiyavad Jain Sthanak-  
vasi Directory / Jethmalaji  
Swami --- Limbudi : Sri Jaish  
Acc.no. - wcmtsinh Painting Press. 1927  
7605 vi, 20x P.; 18 cm.

11.10.63.

Rs. 1.00.

25.21 ५१८  
१३७

Jain directory - 1927.


• श्री महावीराय नमः  
काठियावाड जैन स्थानकवासी  
**गीरेकटरी.**

लखनार.  
४२६  
जैनालय स्वामी।  
लींगडी संप्रदाय.  
(जैनालय श्रीमान् लखण स्वामीना ज्वनचरित्र,  
तथ रत्नात्मक धर्म उद्दीप त्रीतत्र वर्णन अने संवाद  
साथे समाजनु दिग्दर्शन, वर्गेरेना कर्ता.)

छपावी असिंद्र करनार.  
ओक जैन ग्रहस्थ.

वीर संवत २४५३ वीकम संवत १६८८ सने १६२७

श्री जशवंतसिंह प्रीटीग्रे प्रेस—लींगडी.  
मृत. १०००,  
भूम्य—ओक रुपियो।



## પ્રસ્તાવના.

આ પુરુષ લખતાની જરૂરીયાન અને શરૂઆત વિષે મહારા મનમાં આવેલ વિચારો જગ્યાવા અહિં ઉચિત માનું છું. જાણકાલ આવા સુધરેલા જમાનામાં હરેક વર્ગની ડીરેક્ટરી યા વસ્તિપત્રક જેવામાં આવે છે, ત્યારે આપણા સ્થાનકવાસી વર્ગમાં તેની ખામી હુતી, તે ખામી હુર કરવો જેહાએ દિગ્ભર અને રોતાંબર બને ઝોરકામાં ડીરેક્ટરીએ તૈયાર થાય છે. ડીરેક્ટરી એ સમજતું એક પ્રકારનું હર્ષણ છે, તેનાથી આપણા સમજની વ્યવહારીક અને, ધાર્મિક વિધિનો ખરો ખ્યાલ આપણુને આવી શકે છે, આપણા સમજની કેવી સ્થિતિ છે? કેટલા ગામ? કેટલા પુરુષ? કેટલા ખ્રી? કેટલા ખાળક? કેટલી જાતી જૈન સ્થાનકવાસી ધર્મ માટે છે? કેટલા જાણુલ? કેટલા અભિષુ? કેટલી જાણા? કેટલી ડીઓ? કેટલા સામાયક પડિકમણું જાણું છે? કેવી વિધવા? કેટલી સધવા? કેટલા વેપારો? કેટલા ધંધા વારના? કુયાં? કુયાં? ઉપાશ્રય? જૈનશાળા? લાધુફેરો અને પાડશાળા વગેરે ધાર્મિક સંસ્થાએ છે? તેનો આણેહુઅ ચિત્તાર સમજને આથી આવી શકે છે. એથી સમજની આગળ રણું કરવામાંજ ખરી સેવા સમાચેતી છે. જીન પ્રતિદિન સ્થાનકવાસી સમજ કેટલો હબાતો. જય છે, તે જાણુવા અને જેવાને માટે આ પુરતક એક અરીસા કિંવા હર્ષણુર્દ્ધ્ર થઈ પડશે. આની અંદર ખાસ કરીને સાધુ સાધીના નામ અને સ્થાનકવાસી ત્યાંગી કિંવા ગૃહસ્થના બનાવેલા પૂસ્તકો એટલે કે સ્થાનકવાસી પ્રેરક વીસમી સહીનું સાહિત્યનું લીસ્ટ, કર્તાનું નામ, વગેરે જાણું ધારું અગત્યનું અથવા જરૂરનું છે. એમ જગ્યાતા સંબૌ રૂહની ની સાલમાં જુનાગઢ સુકામે આ સંખાંધી કેટલાક મહાશયો સાથે ચરચા થતા તેમના તરફથી આ દશામાં પ્રયાસ, થવા ઈચ્છા બતાવવામાં આવતા મહારા મન ઉપર તેની સારી અસર ઉત્પન્ન થઈ અને તે કાર્ય હુથ ધરવા સંકલ્પ કર્યો. આ કાર્યમાં પ્રથમ તો આર્થિક મજૂહની પહેલી જરૂર પડે એ વાસ્તવિક છે, ગવર્નર્ન (સરકાર) પણ જ્યારે વસ્તિપત્રક કરે છે, ત્યારે હજરે।

દ્વિપિયા અને હુલરો માણુસોની જરૂર પડે છે ત્યારે આખું મહાન કાર્ય  
એક હુશુ અને તે પણ મહા વગર કરવું એ કેટલું બધું અશક્ય  
ગણ્યાય તે સમજનું સહજ છે. જ્યારે આ કામ હુશુ ધર્યું ત્યારે ઘણા  
સાધુઓ અને અહુસ્થો અને ચરચા કરતા લાગ્યા એટલું જ નહિ પરન્તુ મહા  
કરવી એ તો બાળુ ઉપર રહી પણ સામા વિરુદ્ધ પડિ અનેક ખરપણે  
ઉડાવી કાર્ય તોડી પાડવા કટીબંધ થયા. એટલું જ નહિ કિન્તુ સંવત  
૧૯૮૮ની સાલનું ચાતુર્માસ વઠવાણ શહેર પસાર કરવા સોરઠમાંથી  
આવતા વઠવાણ એટલું બધું વિરુદ્ધ, પડો ગયું કે જેની હુદ નહિં  
અનેક રીતે ખરપણ કરવા સાથે છાપામાં આર્ટિકુલ આપી લોકોમાં  
ખરીણ અસર ઉત્પન્ન કરવા પ્રયત્ન કર્યો, ધામે ધીમે એ ખરપણે ગંભીર  
ઝપ પકડયું અને છેવટ લોંબડી કે જે અમને પુછી શકવા હુક્કાર છે,  
તો ત્યાંથા પણ પત્રોદારા અને ઝણઝણ મજજુર કાર્ય બંધ કરવા હોયાણ  
થવાથી હું નથી ધારતો કે આ સ્થાને બાજુ વ્યક્તિ હુથ ધરેલ કાર્ય  
પૂર્ણ કરો શકે. આ કાર્ય માટે જેટલી વાતાવરણું પ્રતિકુળતા એટલીજ  
કાર્યની વિકિર્તા હોવાથી આખા કાઢિયાવાડની ડિરેક્ટરી કરવી. તેમાં  
કેટલા ગામ ? કૃયાં ? કૃયાં ? કેટલા શ્રાવકો વગેરે હુક્કાકત મેજવવી અને  
તે પણ હુંક વખત અને હુંક સમયમાં પહોંચી વળવું એ ઘણું હુદ્યાને  
હુતાશ પમાડનાં+કાર્ય હતું. પ્રથમ તો સમાજની અજ્ઞાનતા અને  
બેદ્રકારીને લઈ પત્રકો જ્યાં મોકદ્દમામાં આવે તે ભરીને પાછા મો-  
કદ્દમાને ભરીને જવાબ સરખો પણ ન મળો. ઘરી ઉવરાણુના અંતે પત્રકો  
ગુમ થઈ જવાથી બોલ મેકડો. આવો વસ્તુ સ્થિતિ થવાથી મેં મહારી  
લાગવગનો ઉપયોગ કરવામાં સમય અને નાણુનો શ્રી સંઘને મહોદો  
ક્રાયદો થવા સાથે મહેનતની સાથે હેતુ બર આવશે એમ માનો “ કાઢિ-  
યાવાડના રાજ મહારાજાઓ અને એજન્સી થાણાના અમ-  
લહારો ” ને પોત પોતાના તાજાના ગામોમાંથી કરી આપવા લખી પત્રકો  
મોકલો આપતા જે કાર્ય સેંકડો દ્વિપિયા અરનુતા નથઈ શકે અને ન કરી  
આપે તે કાર્ય લક્ષ્ય પ્રાય ઉદ્દાર મનના રાજકૃતાઓએ ફક્ત જૈનાચાર્ય શ્રીમાન  
લખણ સ્વામીની લક્ષ્યની ખાતર પોતપોતાના રાજયોમાંથી પત્રકો  
ભરાવી મોકલી આપ્યાં. તેની પૂર્ણ માહેતો આ બુકની આગળ હાખલ  
કરેલ “ રાજ મહારાજાઓ ” ના પત્રો આપે છે.

‘કેટલીક વાર આપણે આપણી સર્કારીનું દ્વારા કાર્ય ભીજનો નિર્ધિષ્ટ  
કરીએ છીએ. પણ ખરી રીતે તેમ ન થવું જોઈએ. તેમ કરવામાં ખરે  
ખર આપણે પોતાની પ્રગતિનો અવશેય કરવા સાથે આપણા સાંકડા  
વિચારો જણાવી આપીએ છીએ. આજ સુધી રાજ મહારાજએ અને  
કાડિ ગીરાસીયા વગેરે સાથેના મુહારા પરિચયને મારે ઘણેણ અણુગમે  
અતાવી તે વળનો પરિચય ન રાખવા સંબંધી અનેક ખટપોત્તી કરી  
સમાજમાં મને હુલઝુ પાડવા જેવી પ્રવૃત્તિ થવા મારે હુસ્ય ઉત્પન્ન  
થાય છે. તે એવે સુધી કે જ્યાં સુધી કાડાં અને રેંટને નહિ છોડે ત્યાં સુધી  
તેમને અમે માનવાના નથી, વગેરે જે અધ્યતીત શબ્દોનો ઉપયોગ ત્યાં  
સાથે ગણુગણું કરવામાં અ.વે છે તે અહીં વખત ઉચિત ધારતો નથી.  
પરંતુ આ ઉપરથી ખડો લેવા જેવું એટલું છે કે સાંધુ પુરુષોના પ-  
રિચયથી સમાજને નુકસાનને બદલે લાભ છે, સાંધુ પુરુષોના પરિચય  
અને લાગવા તેમના મારે નથી. પણ લોકોના મારેજ છે, તે આવા  
પ્રસંગે જરૂર પડે ત્યારેજ તેની કિંમત અંકાય છે. આથી સમાજને તેમના  
તરફથી કેટકેટલા ક્રાયદા થયા છે તે જે લખું તો અનેક પાના ભરી  
શકાય તેવું છે. પરંતુ આતો લેંસ આગળ આગવત જેવું થાય છે.’’  
આ કાર્ય પૂર્ણ થતાં તેને બે વર્ષ થયા છે. કામ પૂર્ણ થતાં તેને સ-  
માજની આગળ રચ્છુ કરવા ઘણું કૈન લાઇયો અને ગામોગામના શ્રી  
સંધની માગણીએ અને સમંતી મજફુર વહિતપત્રકની ચોપડી છાંપાવી  
મહાર પઢવા મારે મગજાથી તેને પુસ્તકાડારે જપાવી હુથ ધરેલ કાર્ય  
પૂર્ણ કરી ફરજ બાળવી સમાજનું ડશું યાંચિત અદ્દ કરી ઉપકૃત  
થડું છું. (મુહારે કહેવું જોઈએ કે લવિષ્યમાં હવેથી સમાજના કોઈ  
પણ કાર્યમાં લાગ લેવા હૃદ્ય સાંકે સાંકે ના પાડે છે. મને જે  
કોઈ પુછે તો હું લાઈબેરીએ, બોઈંગો, અને ઉપાશ્ર્યો વગેરે  
મારે કહિ પણ સહાય કે સલાહ આપવાને બદલે મૈન લજવા લ-  
લચાડી.) ભરાયેલ પત્રકોના સૈરવાળા કર્ફ દરેક ગામના પત્રકોના આં-  
કડા તારવાનું કાર્ય એટલું બધું શુંચવાડા અને મુસ્કેરી બધું હતું  
કે જરૂર મારી મહેનત નિર્દ્દેશ જાત પરંતુ આવા મગજમારીના કા-  
મમાં વઠવાણું તાણાના ગામ રામપુરામાં સંવત ૧૯૮૨ ની સાલમાં આ-  
તુર્માસ થતાં ત્યાંના સેવા પ્રેમી બન્ધુએ? પૈકી લાઇ મંગળ]

માણેકયંહ શાહ, જીવણ કરસન, મગનલાલ વેલસી,  
 શાન્તિલાલ મોહનલાલ, હિમયંહ મોર અને ચોટીલાવાળા  
 શા., પોપટલાલ રણથોડ વગેરે મહાશયોએ ચાર માસમાં આપ્યા  
 કાઢ્યાવાડના પત્રકોમાંથી સરવાળા આપી આંકડા તારવી કઠવાનું  
 કામ કરેલ છે, કે કાર્ય (રા. ૨૫) ના પગારદાર રોડી ન કરી શકાય  
 તે સેવા, ધરનું કામ જોઈ થઈ કરેલ છે. બીજુ નોંધ લેવા કેવી સેવામાં  
 માટે કાળો જેતપુરના શ્રીમંત અચેસર ચહુણ્યાંકમદાર જીવરાજ  
 દેવચંહનો છે. તેમણે આ કામમાં ટપાલ ખરચ આહિ દરેક  
 પત્રકો લગતા કાર્યમાં આર્થિક મદદ મહોટા પ્રમાણમાં કરી છે,  
 ભાગવી આપવામાં રાજ મડારાજ મેના સરવાળા આપી આંકડા તારવી  
 કાઢવામાં રામપુરના ઉપરના છ ભાઇઓની અને ટપાલ ખરચ વગેરે  
 માટે જેતપુરના શા. જીવરાજ દેવચંહની અને પત્રચ્યવહાર  
 માટે વઠવાણ રાજ્યના કુળ રણીખાતાના વડા અધીકારી રા. ૨।  
 કાગીદાસ નગિરદાસ શાહ એમ. એ હાજુરાજ હાઇસ્કુલના છેડમા-  
 સ્તરની આ ડિરેક્ટરીનો સંબંધો પત્ર ચ્યવહાર તેમના નામથી તેમની  
 મારદન કરવા અને સંઘર્ષ સાહિત્ય પત્રકો ટપાલ વગેરે પોતાના હુસ્તક  
 રાખવા વગેરે ભાઇઓની મહાંથીજ આવું સમાજેપદોળી મહાભારત  
 કામ થઈ શક્યું છે.

સુરોષુ કિરણહુના.

લી.

લીખી. જેઠ શુક્રવર્પદ  
 ૧૫ પૂર્ણિમા.  
 તા. ૧૪-૬-૨૭ મંગળ નાર.

જૈન લિખ્નુ જેઠમલજ.

## ડીરેક્ટરી કરી આપનાર સ્ટેટોના આવેલા પત્રો

પોરથંદર. તારીખ. ૧૯-૬-૨૫.

સ્વામી શ્રી જેઠમલજી,

આપના તા. ૫-૬-૨૫ તથા તા. ૧૧-૬-૨૫ ના લખેલા કાગળો મળ્યા છે. પ્રથમ અભ્યન્તરીના તરફથી જે ડીરેક્ટરીના ક્ષારમોં આવેલ તે તળપદ પોરથંદરને માટે ગ્રહનીસીપાદીની આતા તરફ અને મહાદેવને માટે રેવન્યુ આતા તરફ મોકલ્યાઈ જવામાં છે અને સાથેની નકલ મુજબ પરાયાં ક્ષાર્મ લરી મોકલવા માટે તે ખાતાં તરફ લખવામાં આવેલ છે તો વધુ માહિતી માટે તે ખાતાં તરફ સીધુ લખશોાલ.

વીનાંતી સેવક,

પ્રતાપસિંહજી,

હિવાન, રાજ પોરથંદર.

૬-૫-૧૯.

આજમ ગ્રહનીસીપાલ સેકેટરી.

દીગર લખવાનું કે આ સાથે કાંઈયાચાડ જૈન સ્થાનકુળસી ડીરેક્ટરીના ૧૫ ક્ષારમ મોકલેવ છે તો તે જૈનોના આગેવાનોને સાથે રાખી ભરવાની તરજી કરશે. અને ભરાય રહેથી તે નીચેના શિરનામે મોકલી આપશો.

રા. રા. કાળીદાસ નાગરદાસ શાહ. એમ. એ.

હેડમાસ્ટર, દાણરાજ હાઈસ્કુલ,

વઠવાણુ શહેર

વધારે ક્ષાર્મ લઈએ તો તે શાહ કાળીદાસ નાગરદાસ પાસેથી મંગાવા દેશોાલ.

તા. ૧૫-૬-૧૯૨૫.

પ્રતાપસિંહજી,

હિવાન, પોરથંદર.

૬-૫-૧૮.

રા. રા. રેવન્દુ કુમીરનર સાહેં,  
સલામ સાથ લખવાનું કે આ સાથે કાડિયાવાડ જેન સ્થાનકવાસી  
હૃદૈકટરીના ૧૦ દશ ફ્રાર્મ મોકલેવા છે તે આ રાજ્યસ્થાનમાં ગામડા-  
ઓમાં મોકલી હેલ તેમાં જેઠરી હૃદીકત જેનો પાસે ભરાવી હું તે  
જ્ઞાર્મો નીચેના શિરનામે મોકલાવી આપશો.

રા. રા. કાળીદાસ નાગરદાસ શાહ. એમ. એ.  
હેડ માસ્ટર, દાણરાજ હુઈસ્કુલ,

વઢવાણ શહેર.

વધારે ફ્રાર્મ જેઠાં તો તે શાહ કાળીદાસ નાગરદાસ પાસેથી  
મંગાવી વેશોળ.

તારીખ ૧૫-૮-૧૯૨૫.

પ્રતાપસિંહજ,

હિવાન, પોરબંદર.

ક્રાંગઢા તા. ૨૧-૭-૨૫.

સ્વામી શ્રી જેઠમલજ,

વઢવાણ શહેર.

આપના બને પત્રો મજ્યા છે. તેની સાથેના ઝાર્મો અહી મ.  
હાલોમાં મોકલાવી આપ્યા છે અને તેની સાથે સૂચના કરેલ છે કે જેને  
હૃદૈકટરી અરીદવી હોય તે આપને લગ્ની જણાવશે. આપના સાહસને  
મદદદ્યપ થાય તેટલા માટે જેઠલી બને તેટલી અહેળી પ્રસિદ્ધી ઝાર્મો  
મોકલી દરેક મહાલોમાં કરવામાં આવેલ છે.

શુભેચ્છા,

માનસિંહજ,

સી. આઈ. એ.

(હિવાન સાહેં, ક્રાંગઢા રાજ્ય.)

મોડુઅ. તા. ૧૩-૮-૨૫.

પૂજય સ્વામી શ્રી જેઠમનજી.,

વઠવાણ શહેર,

સવિનય વિનંતિ કે આપનો કૃપાપત્ર તા. ૩૧-૭-૨૫ નો અમારા  
નામદાર મહારાજા સાહેબ ઉપરનો પહોંચ્યો છે. તેના જવાણમાં વિદિત  
કરવાનું કે આ સ્વસ્થાન તાખાના ગામો માટે ચોણ્ય જણ્યાય તેંલા ક્રમો  
આપ ખુશીથી મોકલ્યો આપશો એટલે તે આવેથી સુચનાએ સાથે મ.  
હાલોમાં મોકલવામાં આવશે.

સ્નેહાધિન,

રણુંઠોડાસ પટવારી,

બી. એ. એલ. એલ. બી.

(દ્વિનાન સાહેબ, મેરાણી રાજ્ય.)

હન્દુર મૌઝીસ,

વાંકાનેર. તા. ૭-૮-૨૫.

પૂજય સ્વામી શ્રી જેઠમનજી મહારાજ,

વઠવાણ શહેર.

આપનો તા. ૧-૮-૨૫ નો પત્ર ખુ. નામદાર મહારાણા રાજ સાહેબ  
બહાદુરને મજ્યો છે. આપે લખ્યા મુજબ આપના તરફથી આવેલ ક્રમો  
અહીના મહાલોમાં મોકલવા રા. રા. નાયા દ્વિનાન સાહેબ તરફ મો-  
કલાવી આખ્યા છે.

પૂજય ગુરુશ્રીને મારા સવિનય વંદણા કરેશો.

વીનંતી શુલેચ્છક,

દેવશાહી જયકૃષ્ણ દાદે. રાવ બહાદુર,

બી. એ. એલ. એલ. બી.

ના માનપૂર્વક પ્રણામ.

(દ્વિનાન સાહેબ, વાંકાનેર રાજ્ય.)

પાલીતાણા. તા. ૧૫-૮-૨૫.

રા. રા. કાળીહાસ નાગરદાસં શાહુ. એમ. એ.

વઠવાણુ શહેર.

આપનું તા. ૮-૮-૨૫ નું પોસ્ટ કાર્ડ મળ્યું છે. આ સ્ટેટમાં  
સ્થાનકવાચી જૈનની વિની નથી તેથી આપના તરફથી આવેલ પત્રકો  
ભારવવામાં આવેલ નથી. પત્રકો જુદા બુકપોસ્ટથી પાછાં મોકલ્યાં છે.

અમનલાલ ગીરધરલાલ મહેતા,  
ઝી. એ. એલ. એલ. ઝી.

(દિવાન સાહેબ, પાલીતાણા રાજ્ય.)

હિન્દૂવન પેલેસ,

લીંબડી. તા. ૨૬-૭ ૨૫.

પૂજય સ્વામી શ્રી જેઠમહાલ,

વઠવાણુ શહેર.

આપનો તા. ૨૨મી.નો તથા ત્યારથાન તા. ૨૫મી.નો પત્ર સાથેના  
તમામ કાગળો મળ્યા છે. આપના કાગળ સાથેના પત્રકો તમામ ગા-  
મડાઓમાં મોકલવા તરજીઓ કરી છે. આપના હરેક સારા પ્રયાસમાં  
અમારાથી બનતી મહા હુમેશ કરવી જેઠાં પૂજય શુરુશ્રીને ધ્યાન  
કરુશો. હુલ એજ. આપના ક્ષેમ કુશળ ચાહુ છું.

વિનાત સેવક,

દૈલતસિંહજી.

કુ. સી. આઈ. ઈ.

(કાર્કિર સાહેબ, લીંબડી.)

શ્રી. હંજુર અંહીસ.

વઠવાણું સ્ટેટ. તા. ૩૧-૭-૨૫.

પૂજ્ય સ્વામી શ્રી જેઠભલજી મહારાજ,

વઠવાણું શહેર.

આપનો તા. ૩૧-૭-૨૫ નો પત્ર નામદાર હંજુર સાહેબને, વાચાતા તેઓ નામદારે આપે મોકલેલ ક્રીમી ગામડામાં લરવી મોકલવા માટે ફરમાન કરેલ છે. તો હરેક ગામે મોકલવામાં આપણો પૂજ્ય ગુરુશ્રીને સંવિનય પ્રણામ.

વિનંતી,

ભીમજી,

બી. એ. એલ. એલ. બી.

(દિવાન સાહેબ, વઠવાણું રાજ્ય.)

રા. રા. કાળીદાસ.

ક્રીમી મળતા આપના સ્થાનકવાસી અગ્રેસરને આપેકીં છે ભરાઈને તૈયાર થયેથી મળણે એટલે આપને મોકલવામાં આવણો. વળતો પત્ર કામ સેવા લખણો. તા. ૧૨-૮-૨૫.

સે.

નાનશ્રી પુનચંદ સંધ્વી,

(મુખ્ય કારબારી સાહેબ, લખતાર)

સાયલા તા. ૭-૮ ૨૫.

પૂજ્ય સ્વામી શ્રી જેઠભલજી,

આપના તરફથી તા. ૮-૨૫ નો પત્ર તથા સર્વોપયોગી વાક્યોની કોઈ ત્રણું મોકલવી તે પહોંચી છે. આપના લખત્રા સુજા “કાઢિયાવાડ જૈન સ્થાનકવાસી ડીરેક્ટરી” માટે રા. રા. મોહનદાલ સાથે આવેલ ક્રીમી લરવી મોકલવા આંહી તાણાના ગામોના વેવટદાણને ક્રીમી મોકલેલ છે, તો ભરાઈ આવેથો મોકલવી આપીશ. આ તરફનું કામકાજ લખણો. તા. ઝંડર.

મદારસાહું,

ડકોર સાહેબ,

સ્વ. સાયલા

ચુડા હુ. પ્ર. જા. નં. ૧૧૭૫.

### સ્વામીજી શ્રી જેઠમલજી સ્વામી.

મુદ્રા. રામપુરા.

આપના તા. ૫-૬-૨૬ ના પત્રના ઉત્તરમાં લખવાનું કે, સ્થાનકવાસી  
કૈન ડીરેક્ટરીના પત્રકો મોકલવશો એટલે તે ભરાવી આપનાની ગોડવણુ  
કરવામાં આવશે.

તા. ૬-૬-૨૬. ચુડા.

### હરીલાલ રાનલ.

બી. એ, એલ. એલ. બી.  
( મેનેજર સાહેબ ચુડા.)

જસદાણ. તા. ૨૦-૭-૨૫.

### મહેરભાન સાહેબ,

વદવાણુ શહેર.

આપનું પોસ્ટ કાર્ડ મળ્યું તે સાથે સ્થાનકવાસી જૈનોના વસ્તિ  
પત્રકના ઝર્મો પણ મળ્યા છે, તે ભરાવી મોકલવા ગોડવણુ કરી છે.

વિનતિ સેવક,

શેલશાંકર લઙ્ઘમીશાંકર અક્ષી,  
બી. એ. એલ. એલ. બી.,  
(દિવાન સાહેબ, જસદાણ રાજ્ય.)

દ્રોગ. તા. ૬-૮-૨૫ શુક્રવાર.

### મહેરભાન સાહેબ.

આપના પત્રો મળ્યાં છે. તે સાથે સ્થાનકવાસી જૈનોના વસ્તિ  
પત્રકના ઝર્મો પણ મળ્યા, મોહી હોલતચંદ રામજી મારકૃત મળ્યા છે,  
તે ભરાવી મોકલવા ગોડવણુ કરવામાં આવેલ છે.

પૂજ્ય સ્વામીશ્રી જેઠમલજીને અમારા ધઠીત કહેશો. તા. સદ્ગ.

શિનસિંહજી મુળા,

શેવન્યુ કારલારી,

દ્રોગ.

થાણુહેવળી. તા-૧૧-૬-૨૫.

જવાબમાં સલામ સાથે લખ્યાતું, કે અંધી તથા તાખાના ગામોમાં તજવીજ કરતા જૈન સ્થાનકવાસી આ તાલુકામાં નથી. જેતપુર, મેંહરડા વગેરે સ્થળો હોવાથી સંસ્કર છે. અને તે મજમું ગામો હોવાથી અંધીથી પત્રક ભરી શકાય તેમ ન હોવાયો પત્રકો ભર્યા વિન્યા પાછા મોકદેલ છે.

મગનલાલ દૈલતરાય સ્વાદીયા,  
મુખ્ય કારલારી, તાલુકા થાણુહેવળી.

વડીયા. તા. ૨૧ ૬-૨૬.

મી. કાળોદાસ નાગરદાસ શાહુ. એમ. એ.

વઠવાણુ શહેર.

તમાડ તા. ૧-૮-૨૫ નું પોસ્ટ ક્યાર્ડ મહિયું. તે પછી સ્થાનકવાસી જૈન કોમના પત્રકો ભરી મોકલવા છાપેલ ક્રમો આવતા આ સેટના ને ને ગામમાં સ્થાનકવાસી જેનો રહે છે તેવા ગામવાર પત્રકો ભરાવી મંગાવતા તે આજરાજ તમારા નામે બુક પોસ્ટથી રવાના કરવામાં આવ્યા છે. તે પહોંચશો.

હજુર હુકમથી,  
પ્રાણજીવન અંદરજી,  
હજુર શિરસ્તેદાર, વડીયા તાલુકા.

અખંડ ગ્રોડ પ્રતાયી નેક નામદાર ખુદાનીં વળા ઠડોકાર સાહેભ  
અહાદુરની હજુરમાં.

સલામ સાથે અરજ કરવાની કે આ વળા ગામોમાં કે તાખાના ગામોમાં સ્થાનકવાસી જૈનોના પત્રકો ભરી રજુ કરવા રૂભર કરમાન થતા તપાસ કરતાં તેવા કોઈ સ્થાનકવાસી જૈન આ સેટના તાખાના ગામોમાં રહેતા નથી તેથી પત્રકો લન્દોમાં આવેલ નથી. નોકરીયાત છે તે બહાર ગામના રહીશ હોવાથી નામ લખગામાં આવેલ નથી તે રોશન થાય. એજ અરજ. તા. ૧૩-૮-૨૫ વળા.

અવેરચંડ રાયચંડ શોઠ.

શૈવન્દુ સેકેટરી વળા.

મેતા શુલાખચંડ જીવાલાઈ સહી દા. પોતે.

વળા. હુ. ઓ. આ. નં. ૨૭૮૫.

રા. રા. કાળીદાસ નાગરદાસ શાહુ. એમ. એ.  
દાલુરાજ હાઈકુલ હેડમાસ્ટર સાહેબ,  
વઠવાણું શહેર.

ઉપરનાથી આપના જોવામાં આવશે. પત્રકો જે મના તેમ મોકલ્યાં  
છે. તા. ૧૩-૮-૨૫

( સહી )

કારલારી, વળા સ્ટેટ.

અજાણા. તા. ૩૦-૭-૨૫.

રા. રા. કાળીદાસ નાગરદાસ શાહુ. એમ. એ.

હેડમાસ્ટર, દાલુરાજ હાઈકુલ,  
વઠવાણું શહેર.

આપનો અજાણા મેનેજર સાહેબ રા. બાલુલાઈ ગોવરધનદાસ  
પટવારી ઉપરના પત્રના જવાબમાં લખવાનું કે અજાણા તરફથી લાવસાર  
સ્થાનકવાસી છે અને તેના ગામોમાં પીપઢી અને ભિદ્ધસરમાં વીશા  
વાળીએ સ્થાનકવાસી છે તેના પત્રકો ત્રણું ભરાવી આગરોજ યુક પોટથી  
મોકલ્યા છે.

વિનંતી,

તં બકલાન દેવચંદ રાહુ,  
ચીકુ રેવન્યુ કારલારી, અજાણા સ્ટેટ.

લાડી તા. ૨૮-૬-૨૬.

સ્વામીજ જેઝભલજ.

રામપુરા.

આપનો તા. ૨૩-૬-૨૬ નો પત્ર તથા તે સાથેના પત્રકો મળ્યા.  
આ સ્ટેટના તાખામાં હસ ગામો છે. જે પૈકી જે ગામોમાં કૈન સ્થા-  
નકવાસીની વસ્તિ છે તેના પત્રકો તૈયાર કરાવી આ સાથે મોકલ્યા છે.

લી. સેનક,

અચ્યરતલાલના

યથાયોગ્ય વાન

( મેનેજર લાડી. )

માણીયા. તા. ૨૬-૮-૨૫.

રા. રા. કાળીદાસ,

તમારો પત્ર તા. ૨૨-૮-૨૫ નો વાંચી હકીકત જાણી. તે સાથે લગેલ પત્રકો અહીં હજુ આવ્યા નથી માટે તે મોકલશો એટલે ચોગ્ય થશો. પરમ પૂજ્ય મહાત્મા શ્રી લખલુ સ્વામી તથા પૂજ્ય સ્વામી શ્રી જેઠમહલુ સ્વામી વીજેરે સ્વામીજીની સેવામાં મહારા વંદન જાહેર કરશો.

અમરસિંહજી રાણુન,

કામહાર, માણીયા.

વીરપુર, તા. ૧૧-૬-૨૫.

માસ્તર પુરુષોત્તમ લખલુ,

વદ્વાણુ.

તમારા તરફથી સ્થાનકવાસી જૈન ડિરેક્ટરી બનાવવા માટેના ફ્રેમ્ આવેલ પરંતુ અહીં કોઈ સ્થાનકવાસી જૈન નથી પરંતુ અહીંના મહાલ ખરેડીમાં સ્થાનકવાસી જૈન લોકેની વસ્તી છે તેથી ત્યાં મોકલ્યાં છે. આ બાધતમાં ખરેડી ગાંધી મેઘલુ અજરામર સાથે પત્રભ્યવહાર કરશો.

ના. ઠાકોર સાહેબના હુકમથી.

છોટાલાલ રેવાશાંકર.

જેતપુર, તા. ૮-૮-૨૫.

સુજા અહૃદાશય,

આપના તરફથી આવેલા ઝારમેં અહીંના બન્ને ગામ ચુડા અને રાણુપુર મોકલવામાં આવેલ છે. ઝારમેં લરાઈ આવેથી તમારી તરફ મોકલવામાં આવશો. પ્રજના કાર્યમાં બનતી મહા આપવામાં ઉપકાર કરતા નથી.

ઉત્તમચંદ રિપસી કામહાર:

એલલવાળા એસ્ટેટ.

આપના તરફથી પત્રકો મને તુરત મળ્યેથી તે કામ હુાથમાં લઈ-  
લેવરાવું તેથી તુરત મોકલબા વિનંતી કરું છું. અને તે કામ પુરતું ભારે  
કટલું કરવાનું તેની સ્પષ્ટ સમજુત પણ મને મળશે એમ આશા  
રાખું છું.....સુખાકારી ચાહું છું.

લીઠ શિવલાલ પુરુષોત્તમ ગોસળીયા,

(વતી) મેનેજર, કાંથડવાળા એસ્ટેટ,

બીલખા.

બીલખા તા. ૫-૮-૨૫.

રા. રા. કાળીદાસ નાગરદાસ શાહ,

વઢવાણ શહેર.

આપના તરફથી તા. ૩-૭-૨૫ નો જવાબ ડીરેક્ટરીના ડેઅ પત્રકો  
આંહું આવેલ નહીં હોવાથી ભરીને મોકલ્યા નથી. આવા કામમાં સૌથી  
પહેલો હું ભાગ લગ્યા પણ દીલગીર છું કે તેવા પત્રકો આંહું આવ્યાજ  
નથી.....આ કૃયાઈ લખાયા  
પછી આજની ટપાલમાં પત્રકો આવ્યા છે. હવે ભરાવી મોકલી આપીશ.

સહી

મેનેજર, આલાવાળા એસ્ટેટ,

બીલખા.

અગસ્ત્રા. તા. ૮-૮-૨૫.

વિશેષ વિનંતી કે-

આપના તરફથી કેન વર્સિટીપત્રકના ઝર્નાલ્સ આવેલા આંહુના સુવાંગ  
જામમાં ડેઅ પણ કૈન રહેતો નહીં હોવાથી ઝર્નાલ્સમાં કાંઈપણ લરવાપણું  
નહેતું. અગસ્ત્રા તલપદમાં માહુજન તરફથી કામ કરનાર મેધાણી રેવા-  
શંકર હેમયંદને આ બાધ્યત પુછતાં તેની માગણી ઉપરથી સદર ઝર્નાલ્સ  
તેને આપી દેવામાં આવ્યા છે. એટલે તે ભરાવી આપને મોકલી આપશો.

ઇંદ્રજિત હંગારીંકર,

કામદાર, હડાળા-અગસ્ત્રા.

૧૧.

બૃગસરા. ભાયાણી. તા. ૨૫-૬-૨૬.

રા. ૨૮. કાળીદાસ નાગરદાસ શાહ એમ. એ.

હેડમાસ્ટર, દાણરાજ હાઇકુલ,

વઠખાણ શહેર.

જવાબમાં લખવાનું કે, આ તાલુકાના સુવાંગ ગામો પૈકી માત્ર એક હામાપુરમા જન સ્થાનકવાસીની વસ્તિમાં માત્ર એજ ધર છે. તેમી હક્કિતનું પત્રક આ સાથે ભરીને મોકલ્યું છે. તે હક્કિત પૂજ્યપાદ શુરૂ મહારાજ (લવળ સ્વામી) ને જણુવશોળ.

હુકમથી.

Devchand H.

કામદાર,

નામદાર દરખાર શ્રી મોટા રામવાળા તાલુકા.

મેંદરડા. તા. ૭-૮-૨૫.

રા. રા. કાળીદાસ નાગરદાસ શાહ, એમ. એ.

આ તાલુકાના સુવાંગ ગામ કોલડામાં માત્ર જૈન ધર્મના એક વેપારીનું ધર છે, આવેલ પત્રડો ભરી મોકલ્યા તેઓઝીને સોંપવામાં આવ્યાં છે, એટલે તેઓઝી તે ભરી આપની સંસ્થા તરફ મોકલી આપશે તે જાણુશો.

કામદાર,

માણસીઅવાળા તાલુકા-મેંદરડા.

જેતપુર. તા. ૧૩-૮-૨૫.

વિનંતી કે—આપના તરફથી આવેલ ક્રાર્મ ગામડામાં મોકલી દીઘેલ છે, ભરાઈ આવેથી તુરત મોકલી દીઘેલ. તાકીદ પણ કરેલ છે. પૂજ્ય સ્વામીલ જેડમદાલ સ્વામી ત્યાં બિરાજતા હુશે તેમની સેવામાં પ્રણામ કહેવા વીનંતી છે. આપ ખુશી મજામાં હુશો. કામ સેવા લખી આલારી કરશો. જવાબની ઢીલ માટે મારી આપશો.

લી. સેવક,

બેચરલાલ બાંપુલાઈ ઝાલા,

મેનેજર ભીજડીયા-જેતપુર તાલુકા.

દસાડા. તા. ૨૬-૭-૨૫.

તાલુકા જૈનખાનજી જા. નં. ૧૩૭૨.

રા. રા. કાળીદાસ નાગરહાસ શાહુ. એમ. એ.

હેડ માસ્તર, ડાયરાજ હુક્કિસ્કુલ,  
વદવાણુ શહેર.

જૈન સ્થાનકુવાસીની ડીરેક્ટરી ખનાવવા તમે ને હુક્કીકિત માગેલ છે  
તે સંબંધે લખવાતું કે આ તાલુકાના ગામોમાં એક પણ જૈન સ્થા-  
નકુવાસીનું ઘર નથી.

વળુભા,

(મેનેજર, જૈનખાન તાલુકા.)

ગવર્નીદ. તા. ૨૦-૭-૨૫.

રા. રા. કાળીદાસ નાગરહાસ શાહુ. એમ. એ.

તમારા તરફથી જૈન ડીરેક્ટરીના પત્રકો આંહી આવ્યા છે. આ તા-  
લુકામાં તમામ જૈન સમાજને આપવામાં આવ્યા છે. તેની સાથે સૂચના  
પણ કરેલ છે કે પત્રકો બરી અમારી પસે રણુ કરે એટલે અમારી  
મારફતે તમારી તરફ મોકલી દેવામાં આવશે.

ભવાનિસિંહજી.

દરખાર સાહેબના હુકમથી  
ગવર્નીદ તાલુકા.

કોડારીયા. તા. ૩૧-૭-૨૫.

રા. કાળીદાસ નાગરહાસ શાહુ. એમ. એ.

વદવાણુ શહેર.

આપ સાહેબ તરફથી મે. કોડારીયા તાલુકદાર સાહેબ તરફ ક્ષારમો  
વગેરે આવ્યા તે ભરી આ સાથે બીડી પોસ્ટ કરેલ છે. આ તાલુકાના  
ઘોરાણું ગામમાં જૈન સ્થાનકુવાસીના પ ખર છે તે પણ આ સાથે છે  
સિવાય નથી.

હુકમથી.

લી. સેવક,

ખુશાલયંદ વાલજી મોઈ,

ક્રોનદાર, કોડારીયા તાલુકા.

શાપર. ( ગોટલ રીખા ) ગોંડલ રેલવે.  
તા. ૨૭-૭-૨૫.

મહેરખાન સાહેબ,

વીનંતી કે આપનું ચાલતા માસનું પતુ આંહીના નામદાર દરખાર સાહેબ ઉપરનું મળ્યું છે. આપેના દરખાર સાહેબના ઉપર જૈન સ્થાનકવાસી ડીરેક્ટરીના પત્રકો મોકલ્યાનું લખેલ છે પરંતુ તે તેમને હજુ સુધી મળ્યા નથી. આ તાલુકાના માત્ર ચાર નાનાં નાનાં ગામો છે તેમાં માત્ર એક કે એજ જૈન છે તેંબું પત્રકો મળ્યા નથી તો ઇની મોકલ્યાની આપણો એટલે જોનો પાસે ભરાવીને ઘણી ખુશીથી આપના તરફ મેક્ટી આપવામાં આવશે.

હજુર હુકમથી.

સાહેબ. શાપર તાલુકા કામદાર સાહેબ.

જેઠમલજ સ્વામી,

રામપુરા.

તાલુકે પાલ, ભાડવા મેનેજરના જયળનેંદ્ર વાંચશો. વિ. આપે “જૈન સ્થાનકવાસી ડીરેક્ટરી” મારે આ તાલુકાના જૈન સ્થાનકવાસીની હુકીકત મગાવી તે બાબતમાં જણાવવાનું કે આ બન્ને તાલુકાના ગામોમાં તપાસ કર્યાવતા જૈન સ્થાનકવાસીની વસ્તિ નથી એમ જહેર થાય છે. વિદાંખ થયો તે મારે માર્ક કરશો. આપના પરમ પૂજ્ય શુરૂ શ્રી લવજ સ્વામીને ઝુારી ઘણીજ વિનંતી સાથે જયળનેંદ્ર કહેશો.

તા. ૨૫-૧૦-૨૬.

લિંગ સેવક.

જયસુખલાલ હરિલાલ ખુચ,

મેનેજર પાલ, અને ભાડવા-તાલુકા.

બાળીયા હેવાણી. તા. ૨-૮-૨૫.

રા. રા. હેડમાર્ટર સાહેબ,

વી. કે આપનું પતું પહોંચ્યું. જવાખમાં લખવાનું કે આપના લખવા પ્રમાણે ક્ષારમો ભરી મોકલવા ગોડવણું કરીશું તો ક્ષારમો મોકલવા મહેરખાની કરશી.

વિનંતી.

હરલુવન કેસવજ,

મેનેજર, બાળીયા હેવાણી.

વાંસાવડ. તા. ૧૧-૮-૨૫.

રા. રા. અહા મહેરખાન ફાળીદ્વાસ નાગરકાસ શાહ,

વઠવાણ શહેર.

આપના તરફથી કોઈ મારફત સ્થાનકવાસી પત્રકો મળ્યા. તે આજે ભરી કાલ રેણે આપના તરફ રવાના કરીશું. તથા તાખાના ગામોમાં પત્રકો ભરવા મોકલ્યા છે. તો તે અરાધેથી આપના તરફ મોકલીશું.

## શોડ ગોપાળજી ભાઈચંદ.

વાંસાવડ તાલુકા.

પ. જા. નં. ૨૦૬.

ઇ. આ. પો. પેટેલ. હુધરેજ, ભડવાણા, જેરાળી, લાલીયાદ, ભથાણ, શુંહીઆળા, આળા, ઝાંપોહડ, પરતાળા, કટારીયા, તલસાણા, વડોદ, કેસરીયા, અને મુજપર.

તમરા તરફ વઠવાણ ડીસ્ટ્રીક્ટ થાણુદાર-હીંગર લખવાનું કે જેન સ્વામીજી શ્રી લવજી સ્વામીએ કાદિયાવાડ જૈન સ્થાનકવાસી ડીરેક્ટરી બનાવવા જોડવણ કરી છે. તો આ સાથે પંદર છાપેલાં કારમો મોકલ્યા છે. તેમાં દરેક જાતની માંગેલી હક્કિકત કાળજીપૂર્વક ભરી ઉત્તરોત્તર દરેક પોલિસ પેટેલને મોકલતા જ્યાંના નામવાળા પો. પેટેલે આ કારમો પુરી હક્કિકત સાથે આ નીચે રિપોર્ટ સાથે મોકલવા ભૂલ થવી ન જોઈએ. દેવળીયા અને વણુની હક્કિકત આવી ગઈ છે. જેથી મોકલ્યા નથી.

૨. દેસાવર રહેતા હોય તેના નામ જે ગામમાં રહેતા હોય તે ગામના પત્રકમાં ફાળવું કરવા. આ વસ્તિપત્રક સ્થાનિક માણુસનું નથી પણ ગામમાં ધર બાર હોય પણ ધંધા અથે બણાર ગામ લલે ગયા હોય તેનું નામ ભરવું. એણ બણાર ગામના ધંધા અથે તથા નોકરી માટે આવેલા બણાર ગામના માણુસોના નામ લખવાના નથી. તેમના નામ તેમના ગામોમાં લખાશે. આ લીષ્ટ મુણ વતની ગામનું છે. આ સૂચના પણ ખાસ ધ્યાનમાં રાખી પત્રકની હક્કિકત લખવી. તા. ૬-૬-૨૬.

## લાભરાંકર.

વઠવાણ, ડી. થાણુદાર.

૧૫૦

ચોટીલા. ૧૦-૪-૨૫.

રા. રા. કાળીહાસ નાગરદાસ શાહ, એમ. એ.

હેડમાસ્તર, હાજરાજ હાઈસ્કુલ,

વાણાણ શહેર.

આપનો કાગળ આંદો, સ્થાનકુલાસીના વન્દિપત્રકના ફોર્મો માટે હાજરાજશ્રીની દેખરેખ નીચે આ યાણુના ગામડાના ભરણું છે. અહીં સર્વો સ્થાનકુલાસી સંધા સુખી છે. અને આપે આ કુમ ઉપાડ્યું છે તે આતે આપને ધન્યવાહ છે.

ઠગનલાલ ખોડીહાસના

જયળનેંદ્ર.

( થાણુદાર, ચોટીલા થાણુા. ).

ચોક. તા. ૨૦-૭-૨૫.

આપનો તા. ૧૫-૭-૨૫ નો પત્ર મળ્યો છે. જવાણીમાં લખવાનું કે તજવીજના અંગે આ તરફ દુંઢીયા જૈન લોકો બીલકુલ નથી. આ તરફ તો હેરાવાસી જૈન લોકો રહે છે. તે જાણુશો. પાલીતાણુની આસપાસ દુંઢીયા જૈન નથી એમ તજવીજથી જાણુય છે. તો પણ કોઈ આવશે તો તેને હેરા અહીંના વકીલ મી. વીરચંદ ગોરધનહાસનો ભરવા માટે આપ્યા છે. તો તેમને હું આ સંખ્યે લખશો.

ચુનીલાલ.

( થાણુદાર સાહેખ, ચોક. )

સોનગઢ. તા. ૨-૮-૨૫.

મહેરખાન સાહેખ,

સર્વિનય વીનંતી જે આપના તરફથી આપના જણાયા સુજબ આંહી પત્રકો આંદો નથી. તો તેવા પત્રકો અને જે કોઈ વિશેષ હુકીકતની આપને જરૂર હોય તો તે લખી મોકલવા કૃપા કરશો, એટલે હુકીકત મેળવી હું મોકલી આપીશ.

ઉજમશી દુંગરશી કોડારી,

( થાણુદાર સાહેખની વતી. )

દસાડા. તા. ૨૩-૭-૨૫.

શ્રીયુત રા. રા. કાળીદાસભાઈ,

આપનું પતુ મળ્યું. પરંતુ આપના તરફથી વસ્તિપત્રકના ફોર્મ હજુ મળ્યા નથી. આવેથો આપના લખવા મુજબ અમલ કરાવીશ. આ તરફનું કામકાજ હોય તે લખાવશો.

એજ વિનંતી.

ત્રિભૂતનહાસ રામલુના

સલામ.

( થાણુદાર સાહેબ, દસાડા. )

ભાવનગર. તા. ૨૧-૮-૨૫.

પૂજય સ્વામીજી શ્રી જેઠમલજી સ્વામીની સેવામાં,

વદ્વાણું શહેર.

વ. કે-આપના પત્ર તથા ફોર્મો મળ્યા છે. મહુવા તરફ ડીર્ટ્રીક્ટમાં ગયેલ તેથી તરત જવાબ આપી શક્યો નહી તો તે ક્ષણતથ્ય લેખાશે. જોઈતી હુકીકત મેળવવા માટે મોકલેલ ફોર્મ દરેક મહાલના ફોર્મારોને એક એ દિવસમાં મોકલવા રવાના કરવામાં આવશે. પૂજય ગુરુશ્રીને મારા સવિનય પ્રણામ કહેશો.

લી. સેવક,  
નેરાવરસિંહજી.

ના. સીવીનય પ્રણામ.

( વદ્વાણુનાંમાલ દિવાન સાહેબ અને હુલ  
પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ, ભાવનગર રાજ્ય. )

ઉમરડા. તા. ૮-૧૦-૨૬.

મહારાજ સાહેબ,

સુ. રામપુરા.

જવાબમાં વિનંતી સાથ લખવાનું કે, આપની માગણી અનુસાર જૈન સ્થાનકવાસીનું પત્રક લરી આ સાથે મોકલવામાં આવેલ છે. તે સંભાળી લેવા કૃપા કરશોાલ.

કનુભા,

( વહિવટદાર, ઉમરડા હુલ, સંસ્થાન પ્રાંગધા. )

अज्ञान तिमिर व्यासि, मपाकृत्य यथायथम् ।  
जिन शासन महात्म्य, प्रकाशः स्यात्पभावना ॥०१ ॥

अर्थ—अज्ञानद्वयी अंधकारनो नाश करी जैन धर्मनी महता अर्थात् तेनो महिमा वधारवो तेतुं नाभज साची प्रबावना समजधी. तेथी દરेक ખी પુરષોએ જैन અંશો વાંચવા અને ધીજાને વાંચવા. તદુપરાંત નિર્ધિને શાસ્ત્ર હાન આપી તેને જ્ઞાની બનાવવા. ધનવાનોએ અંશો છપાવી જહેરમાં પાણીના મૂદ્યે મક્ષત ઠેંચી ધનને સર્કલું કરવું જોઈએ. આ સમયમાં એનાં જેવું કોઈ પુણ્ય કર્ય નથી.

—૪૫(૦)૪૫—

વીસમી સદીમાં રચાયેલ જैન સ્થાનકવાસી  
સાહિત્ય સંગ્રહ.

છપાયેલા પુસ્તકો.

ગાંધી પુસ્તકો.

લીંખડી સંપ્રદાયના ભાર્તાંડ. પંડિત, શતાવધાની,  
રત્નચંદ્રાલ સ્વામીકૃત પુસ્તકો.

- ૧ આગમકોષ ભાગ ૧-૨-૩-૪. (૨) માર્ગ લાખાનું વ્યાકરણ.
- ૩ કર્તાજ્ય કૌમુદી. સંસ્કૃત-અર્થ-લાલાર્થ અને નિવેચન સહિત.
- ૪ લાલાના શતક. સંસ્કૃત અર્થ-લાલાર્થ અને નિવેચન સહિત.
- ૫ મહુંમ જैનાચાર્ય શ્રીમાન અજ્રામરાલ સ્વામીનું લુચન ચરિત્ર.
- ૬ રત્નગઢ માલિકા. (૭) કૃથા પંચક. (૮) બાર વૃત.

લીંખડી સંપ્રદાયના કુવિવર્ય, પંડિતરાજ, રમથ્વકતા, નાનચંદ્રાલ  
સ્વામીકૃત પુસ્તકો.

- ૧ સુઓધ સંજીતમાળા. ભાગ ૧-૨-૩. (૨) જैન પ્રશ્નોત્તર કુસુ-માવળી. (૩) રેસીટિશન લા. ૧-૨-૩-૪. (૪) સામાયકતું સ્વરૂપ. (૫) જैન સુઓધ કુસુમાવળી.

લીખડી સંપ્રદાયના મહુમ જૈનાચાર્ય શ્રીમાન લાધાળંસ્વામીકૃત.

૧ પ્રકરણ સંખ્યા ૫૪૩૫૩ થોકડા લા. ૧ લો.

લીખડી સંપ્રદાયના મહુમ પંડિતરાજ તત્ત્વજ્ઞ ઉત્તમચંદ્રજી  
સ્વામીકૃત પુસ્તકો.

- ૧ વિવિધ બોધ સંખ્યા.  
૨ પ્રકરણ સંખ્યા થોકડા ૧૬ લાગ ૨ ને.

લીખડી સંપ્રદાયના લેખક, કૃષ્ણજી સ્વામી કૃત પુસ્તકો.

૧ મહાસતી ચંદ્રનાભાળાનું ચરિત્ર. (૨) પ્રેનોત્તર જ્ઞાનમાળા.

૩ ચા બીડીથી થતા ગેરકૃયદા.

લીખડી સંપ્રદાયના લેખક, છાયાલાલજી સ્વામી કૃત પુસ્તકો.

૧ મહુમ જૈનાચાર્ય શ્રીમાન લાધાળ સ્વામીનું જીવન ચરિત્ર.

૨ લક્તામ્ભર મહાત્મ્ય. (૩) વિદ્યાસાગર. લા. ૧-૨-૩.

૩ પવિત્ર પ્રમાણનું પ્રાક્તમ. (૪) માંદાની માવજત.

જૈનાચાર્ય શ્રીમાન લાધાળસ્વામી કૃત. દશવિકાલીક સૂત  
ઉપર કરેલ વિવેચન.

લીખડી સંપ્રદાયના જૈનાચાર્ય શ્રીમાન લાધાળ સ્વામીના શિષ્યકૃત  
પુસ્તકો.

૧ જૈનાચાર્ય શ્રીમાન લાધાળ સ્વામીનું જીવન ચરિત્ર, આવૃત્તિ ૧-  
૨-૩-૪-૫.

૨ ત્રીત્ત્વ વર્ણન. (૩) સંવાદ અને સમાજનું હિંદુર્ણન.

૪ કાહિયાવાડ જૈન સ્થાનકુલાસી ડિઝિકટરી.

ગોંડળ સંપ્રદાયના મહુમ તપશિલ માણેકચંદ્રજી સ્વામીકૃત  
પુસ્તકો.

૧ કાળ દર્શન ચિંતામણિ. (૨).....(૩).....યાદીમાં નથી.

અરવાળાં સંપ્રદાયના કુવિ, લેખક, વિનયચંદ્રજી સ્વામી કૃત પુસ્તકો.

૧ વૈરાગ્ય શાંતક. ભા. ૧-૨. (૨) વિનય લિનોએ. (૩) ગુજરાત ગુલતાન.

અરવાળાં સંપ્રદાયના મહુંમ આચાર્ય પંડિત, કુવિવર્ય, ઉમેદ્ધચંદ્રજી સ્વામીકૃત.

૧ સિદ્ધાન્ત તરંગમાળા- થોકડા ઉપ્ય

શ્રાંગધ્રા સંપ્રદાયના મહુંમ કુવિવર્ય, ગુલાભચંદ્રજી સ્વામીકૃત.

૧ કુસુમરાય ભાવની વજલાષામાં કુવિત.

પાલણપુરવાળા મહુંમ પંડિતરાજ, જયેષ્ઠમહીલ સ્વામીકૃત.

૧ સમકિત સાર ભા. ૧ લો.

લીંખડી સંપ્રદાયના સંધીવીના નાના ઉપાશ્રયના સાધુજીકૃત પુસ્તકો.

આચાર્ય મોહનલાલજી સ્વામીકૃત પુસ્તકો.

૧ હૃતં શિક્ષા. (૨) શ્રી પ્રેનોત્તર મોહનમાળા પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ.  
મણિલાલજી સ્વામીકૃત પુસ્તકો.

૧ પ્રેનોત્તર મણિરતનમાળા. ભા. ૧-૨. (૨) ધર્મનો દરવાજે.

૩ જૈન પાડમાળા. (૪) જૈન કન્યાશિક્ષણ. (૫) મહારી વિશ્વુદ્ધ  
ભાવના. (૬) આત્માનુભવપ્રકાશ. (૭) આત્માનુભવ પ્રવેશિકા.

૮ શુદ્ધધાત્મ વિચાર, (૮) સાડા અઠાર હજાર વર્ષનું પંચાંગ.

૧૦ તત્ત્વ ચિંતામણિ યાને અંતરના ઉદ્ગાર. (૧૧) તત્ત્વ વિચાર.

૧ આગાર ધર્મ, કર્તા વકીલ અલેયંદ કાળીદાસ જેતલસર.

૧ આવશ્યક ભાવાર્થ, કર્તા લેખક કૃષ્ણજી નંદલાલ શાહ રાજકોટ.

૨ ગુલાભ સન્માર્ગ ગીતા. કર્તા સહર.

કુચ્છ આઠકેટી મોટી પક્ષના સાધુઓ કૃત પુસ્તકો લેખક, ત્રિલોકચં-  
દ્રજી સ્વામી કૃત પુસ્તકો.

૧ આવશ્યક સ્પષ્ટિકરણ. (૨) આચાર્ય વજપાલજી સ્વામીનું જીવન ચરિત્ર

- ૧ કરકંદુષ. કર્તા પંડિત, લેખક દેવચંદળ સ્વામી, કુંઘ માટી પદ્ધ.  
 ૧ શ્રી પંચ પરમેષ્ઠપ્રલાંબ કર્તા માણેકચંદળ સ્વામી બોટાદ સંપ્રદાય.

- 
- અમદાવાદના મહુમ દાકતર જીવરાજ વેલાભાઈ એલ. એમ.  
 એન્ડ એસ કૃત પુસ્તકો.  
 ૧ આચારાગજ સૂત્ર શાણાર્થ-ભાવાર્થ સહિત.  
 ૨ ઉત્તરાધ્યયન સૂત્ર શાણાર્થ-ભાવાર્થ સહિત.  
 ૩ દશવિકાલીક સૂત્ર શાણાર્થ-ભાવાર્થ સહિત.  
 ૪ ઉપાશક દસંગ સૂત્ર શાણાર્થ-ભાવાર્થ સહિત.  
 ૫ બૃહત્કલ્પ સૂત્ર. (૬) સૂપગડાંગજ સૂત્ર ભાષાન્તર.
- 

- મારવાડી કનેરામજ મહારાજ કૃત પુસ્તકો.  
 ૧ જૈન તત્ત્વ સોધક અંથ. (૨) સિદ્ધાન્ત સાર.  
 ૧ શાળાપચોણી જન પ્રસ્નોત્તર. કર્તા અવેરચંદ જાહેર કુમદાર રજુકોટ.

- 
- માંગરોળ વાળા હુરળવન માંગળજ ચીતલીયા કૃત પુસ્તકો.  
 ૧-૨-૩-૪-૫-૬ વગેરે નામ યાદ નથી.
- 

- ૧ મહુમ જૈનાચાર્ય શ્રીમાન શ્રીલાલજ સ્વામીનું જીવન ચરિત્ર. કર્તા મેરણીના સેવા પ્રેમી અવેરી દુર્લભજ ત્રિભૂવન.

- 
- પંનથી વિહુષિ, પંડિત, લેખક, બાળ પ્રકાચારી આર્યાજ પાર્વતી-  
 બાઈ કૃત પુસ્તકો.  
 ૧ શાન્દાપિકા. (૨) દુર્વીદ મુખ્યપેટીકા. (૩) સત્યાર્થ અંદ્રોદ્ય.  
 ૪ સમ્યકૃત સૂર્યોદય.
- 

- મારવાડી ત્રિલેંકચંદળ સ્વામી કૃત.  
 ૧ નવતત્વ પ્રસ્નોત્તર સાધુ સમાચારી.

Rec. - ૮૦ . ૭૬૦૫ દાદ-૧૧.૧૦.૬૩ રૂ. ૧.૦૮

સાયદા સંમેધાયના મહુંમ આચાર્ય મેધરાજજી સ્વામી કૃત.

૧ .....નામ યાક નથી.

---

શ્રીયૂત લેખક, પ્રસિદ્ધવક્તા, વાડીલાલ મોતીલાલ શાહ કૃત  
પુસ્તકો અમદાવાદ.

- ૧ નમીરાજ. (૨) ધર્મતત્વ સંશ્ઠુ. (૩) સતી ધમયન્તિ.
  - ૪ સદ્ગુણુ પ્રાપ્તિનો ઉપાય. (૫) હિંદ્યયાત્રા. (૬) ખરા સુખની કુંચીએ.
  - ૭ ક્યા ઈશ્વરે આ જગત રચ્યું? (૮) સંસારમાં સુખ ક્યાં છે?
  - ૯ બાર વૃત. (૧૦) મધુ માધ્યની. (૧૧) જૈન સાધમાર્ગી ઈતિહાસ.
  - ૧૨ જાતાળનું ભાષાન્તર. (૧૩) ઉપાશક દસાંગનું ભાષાન્તર.
  - ૧૪ અંતગડ દસાંગનું ભાષાન્તર. (૧૫) અણુત્તરોવવાઈનું ભાષાન્તર.
  - ૧૬ વિપાકનું ભાષાન્તર. (૧૭) નિરીયાવલિકાનું ભાષાન્તર.
  - ૧૮ આપક વૃત વચ્ચાર. (૧૯) જૈનવૃત શક્ષાપત્રી.
- 

જૈન હિતેચુભુ માસિક પત્રના મહુંમ તંત્રી શ્રીયૂત મોતીલાલ  
મનઃસુખલાલ શાહ કૃત પુસ્તકો-અમદાવાદ.

- ૧ સદ્ગુરેશમાળા. (૨) પ્રાણિ હિંસા અને પ્રાણિ ઐશ્વર્ય નિરેધક.
  - ૩ ગુજરાતી શાણ કોષ.
- 

મારવાડી ખાવીસ ટોલાવાળા પંડિત, લેખક, ખાળાધ્યાચારી  
અમેલખ રૂષિણ કૃત પુસ્તકો.

- ૧ જૈન તત્વ પ્રકાશ.
- ૨ પરમાત્મ માર્ગ ઝર્ણક.
- ૩ મુક્તિ સોયાન.
- ૪ ધર્મતત્વ સંશ્ઠુ.
- ૫ ધ્યેન કલ્પતરઢ.
- ૬ અદ્વોદ્ધાર કથાગાર.
- ૭ મહન શોઠ ચરિત્ર.
- ૮ ચંદ્રશોષ્ય લીલાવતી ચરિત્ર.

- ૬ જયશોષુ વિજયશોષુ ચરિત્ર.  
 ૧૦ વીરશોષુ કુશાળ ચરિત્ર.  
 ૧૧ જુનહાસ સગુણી ચરિત્ર.  
 ૧૨ સિંહલકુમાર ચરિત્ર.  
 ૧૩ મંહીરા સતી ચરિત્ર.  
 ૧૪ ભૂવન સુંદરી ચરિત્ર.  
 ૧૫ સંવેગ શુધાશોષી ચરિત્ર.  
 ૧૬ લીમસેન હરીસેન ચરિત્ર.  
 ૧૭ શ્રી કેવળજીવિ જીવન ચરિત્ર  
 ૧૮ સંચ્ચી સંવત્સરી.  
 ૧૯ સધર્મ ખોધ ચરિત્ર.  
 ૨૦ જૈન મૂલ્ય શુધાપદ.  
 ૨૧ તત્ત્વ નિર્ણય.  
 ૨૨ નન્દ સમરણ.  
 ૨૩ નિત્ય પઠન.  
 ૨૪ તીર્થાંકર સહશ્રી.  
 ૨૫ પ્રાતઃ પાઠ.  
 ૨૬ શ્રી વીર સ્તુતિ.  
 ૨૭ શાસ્વોદ્વાર ભિમાંસા.

આટલો પુસ્તકો લખવા ઉપરાંત આ મહુતમાંએ બત્તીસ સૂત્રોનું હિન્દિમાં ભાષાન્તર કરી જેન સમાજ ઉપર અસાધારણ અને માડુપકાર કરેલ છે. ત્રણ પુરુષોએ જુદા જુદા ત્રણ મહુન કામ કરેલ તે પૈકી.

આડકોઈ સ્થાપક મુળ પુરુષ ધર્મસિંહલુ સ્વામી નેઓએ તર બત્તીસ સૂત્રોનો એહો પુરી (પાઠ ઉપર ચુજરાતી અર્થ પુરી) આગમો સરલ કર્યો.

વર્તમાનમાં લીંખડી સંપ્રદાય માર્ટાંડ પંડિત, શતાવ્ધાની રત્નચંદ્રજી સ્વામીએ તર બત્તીસ આગમનો શાષ્ટકાષ કર્યો. અને ખાળ અન્ધુચારી પંડિત અમોલભ ઇથિલુએ તર બત્તીસ આગમોનું (હિન્દિમાં ભાષાન્તર કર્યું).

---

## રાસ છપાયેત.

પદ્મ અંથો.

- ૧ સમકિત ડોમુદીનો રાસ.  
કર્તા-સુર્યમલળુ મહારાજ કુચછી આડ કોટી.
- ૨ અહૃદત ચક્રવર્તિનો રાસ.
- ૩ ઐડાળુ કૃત કાંયમાળા.
- ૪ અંજણુ સતીનો રાંસ.  
કર્તા-પ્રસિદ્ધ કુવિરાજ ઐડાળુ સ્વામી ગોંડળ સંપ્રદાય
- ૫ મદ્દન કુમારનો રાસ.  
કર્તા-જૈનાચાર્ય શ્રીમાન લવજસ્વામી લીંખડી સંપ્રદાય.
- ૬ ચંદ્રરાજનો રાસ.  
કર્તા-ખાળ અહૃદચારી ગોવરધનળુ સ્વામી લીંખડી સંપ્રદાય.
- ૭ નમીરાજનો રાસ.  
કર્તા-કવિ આંખાળુ સ્વામી ગોંડળ સંપ્રદાય.
- ૮ વીરભાણુ ઉદ્ય લાણુનો રાસ.  
કર્તા-સદર.
- ૯ યુણુસુંદરીનો રાસ.  
કર્તા-સદર.
- ૧૦ સુરસુંદરીનો રાસ.  
કર્તા-કૃષ્ણલુ સ્વામી લીંખડી સંપ્રદાય.
- ૧૧ સોમશયાનો રાસ. લખેલ  
કર્તા-સદર.
- ૧૨ ગાવીલ સુંદરીનો રાન્ન. લખેલ.  
કર્તા-સદર.
- ૧૩ નવકાર મંત્રનો રાસ.  
કર્તા-નથમલળુ સ્વામી કુચછી આડ કોટી.
- ૧૪ પરહેશી રઙ્જનો રાસ લખેલ  
કર્તા-સદર.
- ૧૫ છ આરાનો રાસ. ઉદ્ર્દી ભરત મહારાજની ઢાળુ લખેલ.  
કર્તા-મારવાહી.

१६ છલાઈનો રાસ.

કર્તા-મારવાડી.

૧૭ આર્દ્રકુમારનો રાસ.

કર્તા-આચાર્ય પ્રસિદ્ધ વક્તા કુવિષ્ય ઉમેદ્યંદ્રળ સ્વામી.  
અરવાળા સંપ્રદાય.

૧૮ ઉમેદ્યંદ્રળ કૃત ક્રાંત્ય સંથળ. કર્તા-સહર.

૧૯ મૂર્ખી સમગ્રાજુણની ઢાળુ.

કર્તા-ખાળ પ્રદ્યાચારી જોવરધનલુ સ્વામી લીંબડી સંપ્રદાય.

૨૦ કર્મ રક્ષિત કુમારનો રાસ. કર્તા સાણુંદના શ્રાવક.

૨૧ કેવળ કૃત નેમ વિવાહ કર્તા કેવળદાસ લાવસાર.

૨૨ સુમત પ્રથોધિદ્ર તેરા પંથી ઉપર કર્તા સહર.

૨૩ સિદ્ધાન્તસારની ઢાળુ દેરાવાસી ઉપર.

૨૪ જૈન સુઓંધ ચિંતામણિ.

કર્તા જીરધરલાલલુ આચાર્ય સ્વામી ખંભાત સંપ્રદાય.

૨૫ વિવિધખોંધ ચિંતામણિ કર્તા સહર.

૨૬ રાજ્યંદ્ર કાવ્યમાળા.

કર્તા શ્રીમાન રાયચંહ રવળલાઈ કુવિ વવાણીયા.

૨૭ હરીહૃદય માલિનિ.

કર્તા કુવિ હરીલાઈ લાઈચંહ મોરખી.

જૈન સ્થાનકુવારી નકસાએ છપાયેલ તેની યાદી.

૧ અનુયોગ દ્વારનો નકસો. (૨) નવ તત્વનો આંખો.

કર્તા મણીલાલલુ સ્વામી લીંબડી સંપ્રદાય.

૩ જૈન સ્થાનકુવારી મુનિ કદ્યદુમ કર્તા સહર.

૪ વચનામૃતો લિન્ન લિન્ન. કર્તા શતાવધાની પંડિત રલચંદ્રલુ સ્વામી  
કૃત લીંબડી સંપ્રદાય.

૫ વચનામૃતો લિન્ન લિન્ન કર્તા કુવિષ્ય પ્રસિદ્ધ વક્તા પંડિત નાન-  
યંદ્રલુ સ્વામી લીંબડી સંપ્રદાય.

- ૬ ઉપહેશી, વિચારવાચોયાય અને સ્વર્વૈપચોણી વાકચો.  
કર્તાં જેડમલજુ સ્વામી લીખિડી સંપ્રદાય.
- ૭ જૈન સાધુ સાંદ્રીલુને વિડાર કરવાનો કાઢિયાવાડનો નકરેંાં  
અને તેની ગાઈડ. કર્તાં જેડમલજુ સ્વામી લીખિડી સંપ્રદાય,

શ્રી લીખિડી સંપ્રદાયના મોયા ઉપાશ્રયના મર્હુમ  
જૈનાચાર્ય શ્રીમાન્ અજરામરજુ સ્વામીના સાધુ  
સાંદ્રીલુની અનુક્રમ નામાવલી.

- ૧ જૈનાચાર્ય શ્રીમાન્ પૂજય સાહેબ શ્રી લવજુ સ્વામી.
- ૨ મહારાજ શ્રી શુલાખ્યાંદ્રજુ સ્વામી.
- ૩ મહારાજ શ્રી વીરજુ સ્વામી.
- ૪ મહારાજ શ્રી નાગજુ સ્વામી.
- ૫ મહારાજ શ્રી દૃષ્ણાલુ સ્વામી.
- ૬ મહારાજ શ્રી ટેઝરશી સ્વામી.
- ૭ મહારાજ શ્રી સુંહરજુ સ્વામી.
- ૮ મહારાજ શ્રી રાયચાંદ્રજુ સ્વામી.
- ૯ મહારાજ શ્રી પ્રાગજુ સ્વામી.
- ૧૦ મહારાજ શ્રી કર્મચાંદ્રજુ સ્વામી.
- ૧૧ મહારાજ શ્રી ધનજુ સ્વામી.
- ૧૨ મહારાજ શ્રી શામજુ સ્વામી.
- ૧૩ મહારાજ શ્રી સવજુ સ્વામી.
- ૧૪ મહારાજ શ્રી કેશવલાલજુ સ્વામી.
- ૧૫ મહારાજ શ્રી નાના શામજુ સ્વામી.
- ૧૬ મહારાજ શ્રી અમિચાંદ્રજુ સ્વામી.
- ૧૭ મહારાજ શ્રી હિરાચાંદ્રજુ સ્વામી.
- ૧૮ મહારાજ શ્રી રત્નચાંદ્રજુ સ્વામી.
- ૧૯ મહારાજ શ્રી છેટાલાલજુ સ્વામી.
- ૨૦ મહારાજ શ્રી લક્ષ્મીચાંદ્રજુ સ્વામી.

- ૨૧ મહારાજ શ્રી શિવલાલજુ સ્વામી.  
 ૨૨ મહારાજ શ્રી નાનચંદ્રલુ સ્વામી.  
 ૨૩ મહારાજ શ્રી અહવજુ સ્વામી.  
 ૨૪ મહારાજ શ્રી જેઠમલજુ સ્વામી.  
 ૨૫ મહારાજ શ્રી ઝ્પચંદ્રજુ સ્વામી.  
 ૨૬ મહારાજ શ્રી અનુપ્ચંદ્રજુ સ્વામી.  
 ૨૭ મહારાજ શ્રી લાલચંદ્રજુ સ્વામી.  
 ૨૮ મહારાજ શ્રી સુળજુ સ્વામી  
 ૨૯ મહારાજ શ્રી નાના ગુલાખચંદ્રજુ સ્વામી.  
 ૩૦ મહારાજ શ્રી હર્ષચંદ્રજુ સ્વામી.

લીધડી સંપ્રદાયના કૃચ્છમાં વિચરતા આયોજણો.

૧ મોટાભાષુભાઈ આર્યાજુના ચેલીએ.

- ૧ આર્યાજુ મોટા ડાડીભાઈ.
- ૨ આર્યાજુ બાળઅલ્લાચારી જોમતીભાઈ.
- ૩ આર્યાજુ મેંધીભાઈ.
- ૪ આર્યાજુ કુવરભાઈ.
- ૫ આર્યાજુ ધનભાઈ.
- ૬ આર્યાજુ લુલોભાઈ.
- ૭ આર્યાજુ બાળ પ્રકુલ્લાચારી હિવાળીભાઈ.
- ૮ આર્યાજુ બાળ પ્રકુલ્લાચારી પાર્વતીભાઈ.
- ૯ આર્યાજુ બાળ પ્રકુલ્લાચારી સેનકુવરભાઈ.
- ૧૦ આર્યાજુ સુંહરભાઈ.
- ૧૧ આર્યાજુ ગંગાભાઈ.
- ૧૨ આર્યાજુ લક્ષ્મીભાઈ.
- ૧૩ આર્યાજુ પંડિત સંતોકભાઈ.
- ૧૪ આર્યાજુ મણુભાઈ.
- ૧૫ આર્યાજુ કેશરભાઈ.
- ૧૬ આર્યાજુ વેલભાઈ.

૧૭ આર્યાજુ માણુકખાઈ.

૧૮ આર્યાજુ દેવકુંવરખાઈ.

૧૯ આર્યાજુ પ્રેમખાઈ.

૨ કેશરખાઈ આર્યાજુની ચેતીઓ.

૧ આર્યાજુ પુરીખાઈ.

૨ આર્યાજુ નાથીખાઈ.

૩ આર્યાજુ નાનખાઈ.

૪ આર્યાજુ બાળ અસ્થિયારી ખાંચીખાઈ.

૫ આર્યાજુ ડાહીખાઈ.

૬ આર્યાજુ કુંવરખાઈ.

૭ આર્યાજુ અમૃતખાઈ.

૮ આર્યાજુ લાડકુંવરખાઈ.

૯ આર્યાજુ રતનખાઈ.

૧૦ આર્યાજુ દીવાળીખાઈ.

૧૧ આર્યાજુ લક્ષ્મીખાઈ.

૧૨ આર્યાજુ અંદરખાઈ.

૧૩ આર્યાજુ લાણુખાઈ.

૩ પુરીખાઈ આર્યાજુની ચેતીઓ.

૧ આર્યાજુ પાનખાઈ.

૨ આર્યાજુ જનખાઈ.

૩ આર્યાજુ નાથીખાઈ.

૪ આર્યાજુ દેવકુંવરખાઈ.

૫ આર્યાજુ નાનખાઈ.

૬ આર્યાજુ સુર્ખીખાઈ.

૭ આર્યાજુ પ્રેમખાઈ.

૮ આર્યાજુ પાર્વતીખાઈ.

૯ આર્યાજુ ગંગાખાઈ.

૧૦ આર્યાજુ રતનખાઈ.

૧૧ આર્યાજુ કુંવરખાઈ.

૧૨ આર્યાજુ દિવાળીખાઈ.  
કુલ ઢાણું ૪૪ કચ્છમાં આર્યાજુનાં વિઘમાન છે.

## લોખડી સંપ્રદાયના કાહિયાવાડમાં વિચરતા સાંધીજુની નામાવળી.

૧ જનખાઈ આર્યાજુની ચેલીઓ.

- ૧ આર્યાજુ તાપસ્વીજુ રામકુંવરખાઈ.
- ૨ આર્યાજુ બાળ પ્રહૃદયારી જીવીખાઈ.
- ૩ આર્યાજુ મણુણાઈ.

૨ ડાહીખાઈ આર્યાજુની ચેલીઓ.

- ૧ આર્યાજુ ટેવકુંવરખાઈ.
- ૨ આર્યાજુ કનુણાખાઈ.
- ૩ આર્યાજુ સમૃતખાઈ.
- ૪ આર્યાજુ મેતીખાઈ.
- ૫ આર્યાજુ કપુરખાઈ.
- ૬ આર્યાજુ પાર્વતીખાઈ.

૩ સંતોકખાઈ આર્યાજુની ચેલીઓ.

- ૧ આર્યાજુ વીજળીખાઈ.
- ૨ આર્યાજુ શિવખાઈ.
- ૩ આર્યાજુ જડાવખાઈ.
- ૪ આર્યાજુ પાર્વતીખાઈ.
- ૫ આર્યાજુ જવલખાઈ.
- ૬ આર્યાજુ સમૃતખાઈ.

૪ સંતોકખાઈ આર્યાજુની ચેલીઓ.

- ૧ બાળ પ્રહૃદયારી આર્યાજુ લક્ષ્મીખાઈ.

કુલ લોંખડી સંધાડાના સાધુ સાધ્વી ઢાણું છે. ૬૦ સંવત ૧૯૮૩



**શ્રી લીંબડોના સંધ્વીના ઉપાશ્રયના સમધુ-સાંવીળીની  
નામાવળી.**

- ૧ પૂજ્ય મેહનલાલજી સ્વામી.
  - ૨ મહારાજ શ્રી નથજી સ્વામી.
  - ૩ મહારાજ શ્રી માણુલાલજી સ્વામી.
  - ૪ મહારાજ શ્રી એઘરાભજી સ્વામી.
  - ૫ મહારાજ શ્રી ત્રિભૂવનજી સ્વામી.
  - ૬ તપસ્વી મહારાજ શ્રી ઉત્તમચંદ્રજી સ્વામી.
  - ૭ મહારાજ શ્રી વાલજી સ્વામી.
  - ૮ મહારાજ શ્રી ધર્મશી સ્વામી.
  - ૯ મહારાજ શ્રી વૃજલાલજી સ્વામી.
  - ૧૦ મહારાજ શ્રી નાગજી સ્વામી.
- 

**સાંવીળના નામ.**

- ૧ આર્યાજી હિરખાઈ.
- ૨ આર્યાજી પાર્વતીખાઈ.
- ૩ આર્યાજી સાંકળીખાઈ.
- ૪ આર્યાજી શિવખાઈ.
- ૫ આર્યાજી દ્રિવાળીખાઈ.
- ૬ આર્યાજી મણિખાઈ.
- ૭ આર્યાજી રતનખાઈ.
- ૮ આર્યાજી મોટાં સંતોકખાઈ.
- ૯ આર્યાજી ઝુકુલખાઈ.
- ૧૦ આર્યાજી સુંદરખાઈ.
- ૧૧ આર્યાજી ધનીખાઈ.
- ૧૨ આર્યાજી લુલુકેરખાઈ.
- ૧૩ આર્યાજી જખુખાઈ.
- ૧૪ આર્યાજી માણુખાઈ.

૧૫ આર્યાજુ નાના પાર્વતીખાઈ.

૧૬ આર્યાજુ સંઝોકુણાઈ.

૧૭ આર્યાજુ ચંપાખાઈ.



### ગોંડળ સંપ્રદાયના સાધુ—સાંધીજુની નામાવળી.

- ૧ પૂજય મહારાજ શ્રી કેચંદ્રજુ સ્વામી.
- ૨ મહારાજ શ્રી હેવર્શા સ્વામી.
- ૩ મહારાજ શ્રી હેવચંદ્રજુ સ્વામી.
- ૪ મહારાજ શ્રી જાહેરજુ સ્વામી.
- ૫ મહારાજ શ્રી ગોવિંદજુ સ્વામી.
- ૬ મહારાજ શ્રી ગુલાબચંદ્રજુ સ્વામી.
- ૭ મહારાજ શ્રી કનણ સ્વામી.
- ૮ મહારાજ શ્રી નિરિધરસાલજુ સ્વામી.
- ૯ મહારાજ શ્રી પુરુષોત્તમજુ સ્વામી.
- ૧૦ મહારાજ શ્રી કર્ણ આંધ્રાજુ સ્વામી.
- ૧૧ મહારાજ શ્રી ભીમજુ સ્વામી.
- ૧૨ મહારાજ શ્રી ખીમાજુ સ્વામી.
- ૧૩ મહારાજ શ્રી પેથરાજજુ સ્વામી.
- ૧૪ મહારાજ શ્રી હેવરાજજુ સ્વામી.
- ૧૫ મહારાજ શ્રી જીવરાજજુ સ્વામી.
- ૧૬ મહારાજ શ્રી રાજપાણજુ સ્વામી.
- ૧૭ મહારાજ શ્રી મંગળજુ સ્વામી.
- ૧૮ મહારાજ શ્રી નાના કેચંદ્રજુ સ્વામી.
- ૧૯ મહારાજ શ્રી કશળચંદ્રજુ સ્વામી.
- ૨૦ મહારાજ શ્રી પ્રાણુલાલજુ સ્વામી.
- ૨૧ મહારાજ શ્રી વીરજુ સ્વામી.



ગાંગ સંપ્રદાયના આર્યાજીની નામાવળી.

- ૧ મોટા સંતોકખ્યાધ આર્યાજીનો પરીવાર.
  - ૧ આર્યાજી મણુભાઈ.
  - ૨ આર્યાજી પાર્વતીભાઈ.
- ૨ સુહરણાધ આર્યાજીનો પરીવાર.
  - ૧ આર્યાજી પુરીભાઈ.
  - ૨ આર્યાજી રમદુંવરણાધ.
  - ૩ આર્યાજી જવલગાધ.
- ૩ મોટા હૃથીભાઈ આર્યાજીનો પરીવાર.
  - ૧ આર્યાજી રળીયાતભાઈ.
  - ૨ આર્યાજી હેમદુંવરભાઈ.
  - ૩ આર્યાજી બાલુભાઈ.
  - ૪ આર્યાજી મીડીભાઈ.
  - ૫ આર્યાજી જ્યાળાધ.
- ૪ અવેરણાધ આર્યાજીનો પરીવાર.
  - ૧ આર્યાજી લીઢણાધ.
  - ૨ આર્યાજી જવેરીભાઈ.
  - ૩ આર્યાજી વેણીભાઈ.
  - ૪ આર્યાજી સુહરણાધ.
  - ૫ આર્યાજી લુરીભાઈ.
  - ૬ આર્યાજી ભાગ પ્રઘચારી પાર્વતીભાઈ.
  - ૭ આર્યાજી જડાવગાધ.
  - ૮ આર્યાજી મેંદીભાઈ.
  - ૯ આર્યાજી સુંતોકભાઈ.
  - ૧૦ આર્યાજી કનુંભાધ.
  - ૧૧ આર્યાજી પુરીભાઈ.
  - ૧૨ આર્યાજી નાના સંતોકખાધ.
  - ૧૩ આર્યાજી મોટા જડાવભાઈ.
  - ૧૪ આર્યાજી નાના જડાવણાધ.

## ૫ મીઠીયાઈ આર્યાજીનો પરીવાર.

- ૧ આર્યાજી હેવકુંવરખાઈ.
- ૨ આર્યાજી ડેઝમખાઈ.
- ૩ આર્યાજી મણિયાઈ.
- ૪ આર્યાજી કુલકુંવરખાઈ.
- ૫ આર્યાજી વૃજકુંવરખાઈ.
- ૬ આર્યાજી સંતોકખાઈ.
- ૭ આર્યાજી મોતીયાઈ.
- ૮ આર્યાજી અંભાયાઈ.

## ૬ પ્રેમકુંવરખાઈ આર્યાજીનો પરીવાર.

- ૧ આર્યાજી કુલકુંવરખાઈ.
- ૨ આર્યાજી રળીયાતખાઈ.
- ૩ આર્યાજી સ્થામકુંવરખાઈ.
- ૪ આર્યાજી વિહુષિ બાળઘ્રહયારી મણિયાઈ.
- ૫ આર્યાજી છેમકુંવરખાઈ.
- ૬ આર્યાજી નવદિક્ષિત છેમકુંવરખાઈ.

## ૭ સાડરખાઈ આર્યાજીનો પરીવાર.

- ૧ આર્યાજી રળીયાતખાઈ.
- ૨ આર્યાજી અંભાયાઈ.
- ૩ આર્યાજી સ્મૃતાયાઈ.
- ૪ આર્યાજી ગલાલખાઈ.
- ૫ આર્યાજી મણિયાઈ.
- ૬ આર્યાજી મોતીયાઈ.
- ૭ આર્યાજી સ્મૃતખાઈ.

## ૮ જીવીયાઈ આર્યાજીનો પરીવાર.

- ૧ આર્યાજી રળીયાતખાઈ.
- ૨ આર્યાજી જેતુખાઈ.
- ૩ આર્યાજી મોંધીયાઈ.
- ૪ આર્યાજી જેરેખાઈ.

- ૫ આર્યાજુ છખલખાઈ.  
 ૬ આર્યાજુ મળિયાઈ.  
 ૭ આર્યાજુ મોતીયાઈ.  
 ૮ એનકુંવરણાઈ આર્યાજુનો પરીવાર.  
 ૧ આર્યાજુ જનુયાઈ.  
 ૨ આર્યાજુ અવલખાઈ.  
 ૩ આર્યાજુ મળિયાઈ.  
 ૪ આર્યાજુ હૃથીયાઈ.  
 કુલ ૪૮ આર્યાજુએ છે.
- 

### ગોંડળ સંઘાણી સંપ્રહાયના આર્યાજુની નામાવળી.

- ૧ આર્યાજુ સંતોકયાઈ.  
 ૨ આર્યાજુ જડાવખાઈ.  
 ૩ આર્યાજુ પુરીયાઈ.  
 ૪ આર્યાજુ કચુંયાયાઈ.  
 ૫ આર્યાજુ ચતુરખાઈ.  
 ૬ આર્યાજુ બાળઅદ્વયારી મળિયાઈ.  
 ૭ આર્યાજુ છખલખાઈ.  
 ૮ આર્યાજુ ગલાંખાઈ.  
 ૯ આર્યાજુ મોંધીયાઈ.  
 ૧૦ આર્યાજુ ચતુરખાઈ.  
 ૧૧ આર્યાજુ બાળઅદ્વયારી જડાવખાઈ,  
 ૧૨ આર્યાજુ રંલાયાઈ.  
 ૧૩ આર્યાજુ કચુંયાયાઈ.  
 ૧૪ આર્યાજુ છેખકુંવરણાઈ.  
 ૧૫ આર્યાજુ હિવાળીયાઈ.  
 ૧૬ આર્યાજુ મોતીયાઈ.  
 ૧૭ આર્યાજુ પ્રેમકુંવરણાઈ.  
 ૧૮ આર્યાજુ સુરજખાઈ.  
 ૧૯ આર્યાજુ મોટા રેવાકુંવરણાઈ

૨૦ આર્યાજુ નાના રેવાકુંવરખાઈ.

૨૧ આર્યાજુ હૃથીખાઈ.

આ સંપ્રદાયમાં સાધુજુ નથી ઇકત સાંબીજુ છે, છતાં સંપ્રદાય સારી રીતે ચલાવે છે એ એ મગરૂણ થવા જેવું છે.

### બોટાઈ સંપ્રદાયના સાધુજુની નામાવળી.

- ૧ મહારાજ શ્રી માણેકચંદ્રજુ સ્વામી.
- ૨ મહારાજ શ્રી મુળચંદ્રજુ સ્વામી.
- ૩ મહારાજ શ્રી જગલુવનજુ સ્વામી.
- ૪ મહારાજ શ્રી મોટા કાનજુ સ્વામી.
- ૫ મહારાજ શ્રી નાના કાનજુ સ્વામી.
- ૬ મહારાજ શ્રી શિવલાલજુ સ્વામી.
- ૭ મહારાજ શ્રી રાયચંદ્રજુ સ્વામી.
- ૮ મહારાજ શ્રી લુલાખુજુ સ્વામી.
- ૯ મહારાજ શ્રી કેઠાલાલજુ સ્વામી.

આ સંપ્રદાયમાં આર્યાજુ નથી.

### અરવાળા સંપ્રદાયના સાધુ-સાંબીજુની નામાવળી.

- ૧ પૂજય વડતા શ્રી મોહનલાલજુ સ્વામી.
- ૨ મહારાજ શ્રી જેમલજુ સ્વામી.
- ૩ મહારાજ શ્રી વિનયચંદ્રજુ સ્વામી.
- ૪ મહારાજ શ્રી સોમચંદ્રજુ સ્વામી.
- ૫ મહારાજ શ્રી ભાવચંદ્રજુ સ્વામી.
- ૬ મહારાજ શ્રી લુલાખુજુ સ્વામી.
- ૭ મહારાજ શ્રી છોટાલાલજુ સ્વામી.

### અરવાળા સંપ્રદાયના સાંબીજુની નામાવળી.

- ૧ આર્યાજુ હિવાળીખાઈ.
- ૨ આર્યાજુ અચરતખાઈ.

- ૩ આર્યાલુ રતનખાઈ.  
 ૪ આર્યાલુ નાનખાઈ.  
 ૫ આર્યાલુ ગલાલખાઈ.  
 ૬ આર્યાલુ બાળપ્રક્ષયારી જડાવખાઈ.  
 ૭ આર્યાલુ જેટીખાઈ.  
 ૮ આર્યાલુ અંજવાળીખાઈ.  
 ૯ આર્યાલુ બાળપ્રક્ષયારી જતનખાઈ.  
 ૧૦ આર્યાલુ દિવાળીખાઈ.  
 ૧૧ આર્યાલુ કેસરખાઈ.  
 ૧૨ આર્યાલુ માણેકખાઈ.  
 ૧૩ આર્યાલુ સંતેકુખાઈ.  
 ૧૪ આર્યાલુ જ્યાંકુંવરખાઈ.  
 ૧૫ આર્યાલુ ઉજમખાઈ.  
 ૧૬ આર્યાલુ અખકુખાઈ.  
 ૧૭ આર્યાલુ કસ્તુરખાઈ.  
 ૧૮ આર્યાલુ મોટા લહેરીખાઈ.  
 ૧૯ આર્યાલુ નાના લહેરીખાઈ.  
 ૨૦ આર્યાલુ પશિખાઈ.  
 ૨૧ આર્યાલુ સમજુખાઈ.  
 ૨૨ આર્યાલુ અવેરીખાઈ.  
 ૨૩ આર્યાલુ વીજલીખાઈ.  
 ૨૪ આર્યાલુ સમૃતખાઈ.

### સાયલા સંપ્રદાય.

- ૧ પૂજય શ્રી સંઘળુ સ્વામી.  
 ૨ મહુરાજ શ્રી લક્ષ્મિભયંદ્રલુ સ્વામી.  
 ૩ મહુરાજ શ્રી ભગનલાલલુ સ્વામીઃ  
 ૪ મહુરાજ શ્રી કાનલુ સ્વામી.  
 આ સંપ્રદાયમાં આર્યાલુ નથી.

### ધરાંગધરા સંપ્રદાય.

મહુંમ આચાર્ય 'શ્રી અમૃતસિંહજી સ્વામીના સંપ્રદાયમાં તેમની પાછળ ચાદર ઓઢાડેલ શિષ્ય મહારાજ શ્રી હસળવનજી સ્વામી પૂજય જાણ્ય છે.

આ સંપ્રદાયમાં આર્યાજી નથી.



### ખંભાત સંપ્રદાયના મહુંમ જૈનાચાર્ય શ્રીમાન લવજ અણગારનો પારવાર.

- ૧ પૂજય શ્રી ગીરીધરલાલજી સ્વામી
- ૨ મહારાજ શ્રી છગનલાલજી સ્વામી.
- ૩ મહારાજ શ્રી રત્નચંદ્રજી સ્વામી.
- ૪ મહારાજ શ્રી છેટાલાલજી સ્વામી.
- ૫ મહારાજ શ્રી ચત્રભૂજજી સ્વામી.
- ૬ મહારાજ શ્રી ગુલાબચંદ્રજી સ્વામી.
- ૭ મહારાજ શ્રી ષેચરજી સ્વામી.
- ૮ મહારાજ શ્રી પીમચંદ્રજી સ્વામી.

### આર્યાજીના નામ.

- ૧ આર્યાજી નવલખાઈ.
- ૨ આર્યાજી શિવખાઈ.
- ૩ આર્યાજી ડાહીખાઈ.
- ૪ આર્યાજી જમનાખાઈ.
- ૫ આર્યાજી મોટા સુરજખાઈ
- ૬ આર્યાજી મોટા સંતોકખાઈ.
- ૭ આર્યાજી નાનીખાઈ,
- ૮ આર્યાજી મોટા પ્રશ્નખાઈ.
- ૯ આર્યાજી નાના સંતોકખાઈ.
- ૧૦ આર્યાજી પાર્વતીખાઈ.
- ૧૧ આર્યાજી નાના સુરજખાઈ

૧૨ આર્યાજુ ચંચલભાઈ.

૧૩ આર્યાજુ નાના પ્રેનૃથાઈ

**શ્રી દરિયાપુરી સંપ્રદાયના સાંહુજનાં નામો.**

- ૧ જૈનાચાર્ય પૂજય શ્રી હુથીજુ સ્વામી.
- ૨ મહારાજ શ્રી ઉત્તમયંદ્રજુ સ્વામી.
- ૩ મહારાજ શ્રી પુરુષોત્તમજુ સ્વામી.
- ૪ મહારાજ શ્રી ધર્મદાલજુ સ્વામી.
- ૫ મહારાજ શ્રી નગીનલાલજુ સ્વામી.
- ૬ મહારાજ શ્રી મોતીલાલજુ સ્વામી.
- ૭ મહારાજ શ્રી હર્ષચંદ્રજુ સ્વામી.
- ૮ મહારાજ શ્રી ઉત્તમયંદ્રજુ સ્વામી.
- ૯ મહારાજ શ્રી મુળચંદ્રજુ સ્વામી.
- ૧૦ મહારાજ શ્રી ગણુપતજુ સ્વામી.
- ૧૧ મહારાજ શ્રી કુલ્યાણજુ સ્વામી.
- ૧૨ મહારાજ શ્રી યુદ્ધરજુ સ્વામી.
- ૧૩ ગહુરાજ શ્રી હરજીવનજુ સ્વામી.
- ૧૪ મહારાજ શ્રી છાટલાલજુ સ્વામી.
- ૧૫ મહારાજ શ્રી કૃષ્ણજુ સ્વામી.
- ૧૬ મહારાજ શ્રી લાઈચંદ્રજુ સ્વામી.
- ૧૭ મહારાજ શ્રી નરસિંહજુ સ્વામી.
- ૧૮ મહારાજ શ્રી માણેકચંદ્રજુ સ્વામી.
- ૧૯ મહારાજ શ્રી અમૃતલાલજુ સ્વામી.
- ૨૦ મહારાજ શ્રી લુલાણજુ સ્વામી.
- ૨૧ મહારાજ શ્રી અમુલભજુ સ્વામી.
- ૨૨ મહારાજ શ્રી પોપટલાલજુ સ્વામી.
- ૨૩ મહારાજ શ્રી છગનલાલજુ સ્વામી.
- ૨૪ મહારાજ શ્રી લવજુ સ્વામી.
- ૨૫ મહારાજ શ્રી લગ્નાનજુ સ્વામી.
- ૨૬ મહારાજ શ્રી ચુનીલાલજુ સ્વામી.
- ૨૭ મહારાજ શ્રી નાનચંહજુ સ્વામી.

### દરીરાપુરી સાધ્વીલના નામ.

- ૧ આર્યાલુ હરકેરખાઈ.
- ૨ આર્યાલુ પાર્વતીખાઈ.
- ૩ આર્યાલુ મોટા રૂકીમણીખાઈ.
- ૪ આર્યાલુ મોટા અમૃતખાઈ.
- ૫ આર્યાલુ મોટા જડાવખાઈ.
- ૬ આર્યાલુ મોટા (શવખાઈ).
- ૭ આર્યાલુ જડાવખાઈ.
- ૮ આર્યાલુ મહુકેરખાઈ.
- ૯ આર્યાલુ નાનીખાઈ.
- ૧૦ આર્યાલુ રમૃતખાઈ.
- ૧૧ આર્યાલુ વીજકેરખાઈ.
- ૧૨ આર્યાલુ મોટા ચંચળખાઈ.
- ૧૩ આર્યાલુ નાના ચંચળખાઈ.
- ૧૪ આર્યાલુ ઉજમખાઈ.
- ૧૫ આર્યાલુ સંતોકુખાઈ
- ૧૬ આર્યાલુ ડાહીખાઈ
- ૧૭ આર્યાલુ કંકુખાઈ.
- ૧૮ આર્યાલુ સમુખાઈ.
- ૧૯ આર્યાલુ પ્રશ્નખાઈ.
- ૨૦ આર્યાલુ મણુખાઈ.
- ૨૧ આર્યાલુ પાર્વતીખાઈ.
- ૨૨ આર્યાલુ વિજકેરખાઈ.
- ૨૩ આર્યાલુ જડાવખાઈ.
- ૨૪ આર્યાલુ મોંઘીખાઈ.
- ૨૫ આર્યાલુ ચંહનખાઈ.
- ૨૬ આર્યાલુ છખલખાઈ.
- ૨૭ આર્યાલુ નાથીખાઈ.
- ૨૮ આર્યાલુ ડાહીખાઈ.
- ૨૯ આર્યાલુ રંભાઈ.

- ૩૦ આર્યાજુ બાહુભાઈ.  
 ૩૧ આર્યાજુ અર્ચીભાઈ.  
 ૩૨ આર્યાજુ સતોકભાઈ.  
 ૩૩ આર્યાજુ માણેકભાઈ.  
 ૩૪ આર્યાજુ મેંઘીભાઈ.  
 ૩૫ આર્યાજુ કંકભાઈ.  
 ૩૬ આર્યાજુ પાર્વતીભાઈ.  
 ૩૭ આર્યાજુ જબકભાઈ.  
 ૩૮ આર્યાજુ મેતીભાઈ.  
 ૩૯ આર્યાજુ મણુભાઈ.  
 ૪૦ આર્યાજુ ઘેલીભાઈ.  
 ૪૧ આર્યાજુ મોટા સુરજભાઈ.  
 ૪૨ આર્યાજુ નાના સુરજભાઈ.  
 ૪૩ આર્યાજુ ચંચળભાઈ.  
 ૪૪ આર્યાજુ મણુભાઈ.  
 ૪૫ આર્યાજુ મંચાભાઈ.  
 ૪૬ આર્યાજુ ઈંચાભાઈ.  
 ૪૭ આર્યાજુ નંદકોરખાઈ.  
 ૪૮ આર્યાજુ સુરજભાઈ.  
 ૪૯ આર્યાજુ છખલખાઈ.  
 ૫૦ આર્યાજુ સુરજભાઈ.  
 ૫૧ આર્યાજુ જડાવખાઈ.  
 ૫૨ આર્યાજુ સુરજભાઈ.  
 ૫૩ આર્યાજુ ચંચળખાઈ.  
 ૫૪ આર્યાજુ, પાર્વતીભાઈ.  
 ૫૫ આર્યાજુ સમૃતખાઈ.  
 ૫૬ આર્યાજુ કેસરખાઈ.  
 ૫૭ આર્યાજુ પુલીભાઈ.



**મારવાડી સંઘાડાના સાધુલુના નામ.**

- ૧ મહારાજ શ્રી કેમલજી મહારાજના સંઘાડામાં.  
સાધુલુ ૫૦ આર્યાલુ ૧૫૦
- ૨ અમરસિંહજી મહારાજના સંઘાડામાં.  
સાધુલુ ૨૫ આર્યાલુ ૫૦
- ૩ વિનયચંદ્રજી મહારાજના સંઘાડામાં.  
સાધુલુ ૧૪ આર્યાલુ ૪૦
- ૪ નાનગજી મહારાજના સંઘાડામાં.  
સાધુલુ ૫૦ આર્યાલુ ૩૦
- ૫ સ્વામીદાસજી મહારાજ સંઘાડીનામાં.  
સાધુલુ ૨૫ આર્યાલુ ૬૦
- ૬ શિતલહાસજી મહારાજના સંઘાડામાં.  
સાધુલુ ૧૦ આર્યાલુ ૬૦
- ૭ નથુરામજી મહારાજના સંઘાડામાં.  
સાધુલુ ૪૦ આર્યાલુ ૧૦૦
- ૮ અમરસિંહજી મહારાજના સંઘાડામાં.  
સાધુલુ ૫૦ આર્યાલુ ૩૦૦
- ૯ હકમચંદ્રજી મહારાજના સંઘાડામાં.  
સાધુલુ ૨૦૦ આર્યાલુ ૨૦૦
- ૧૦ લોખરાજજી મહારાજના સંઘાડામાં.  
સાધુલુ ૧૦ આર્યાલુ ૫૦
- ૧૧ જેઠમલજી સ્વામી અમરસિંહજી સ્વામી.
- ૧૨ રતનચંદ્રજી સ્વામી અજમેરી.
- ૧૩ નાનકજી સ્વામી મેવાડ.
- ૧૪ શિતલહાસજી સ્વામી માલવા.
- ૧૫ કાનજી રખજી હુડોની ઝુંદીકોટા, દેલતચંદ્રજી  
તેરાપથી સંપ્રદાયના જૈનાચાર્ય શ્રીમાન પૂજ્ય કાલુરામજી આદ્દ  
સાધુલુ ૧૦૫ આર્યાલુ ૨૫૦
- ૧૬ કંઈ આઠકોઈના સાધુલુ સાંધીલુનું લિએ ન મળવા માટે  
દીલગીર.

શ્રી મહાવીરાય નમ

# કાઠિયાવાડ જૈન સ્થાનકવાસી ડિરેક્ટરી.

## સોરઠ પ્રાંત.

ગામ ૧૨૦૦

વર્ષિત ૬૭૭૪૮૭ માણુસની.

### જુનાગઢ સ્ટેટ.

ગામ ૬૬૬

વર્ષિત ૩૬૫૩૨૮ માણુસની.

આ શહેર સારા સેરઠ ઉદ્દેશ્યે સોરઠનું પાઠનગર ગણાય છે.  
પાછરમાં કુમર કસીને ગીરીરાજ અથવા ગીરનાર પર્વત શહેર અને  
સારા સેરઠનું રક્ષણ કરતો ઉભો છે. આખા કાઠિયાવાડ કિંચા સેરઠમાં  
સૌથી પૂરાતની એટલે જાહેરકુળમણિ શ્રી કાણુ મહારાજના સમયનું  
આ શહેર હોવાની ધર્તિકાસ સાક્ષિ પુરે છે. હુલ રાજક્રત્તી બાધી  
નામદાર નવાખ સાહેખ મહાભતખાનજી કે. શ્રી. એસ. આઈ.  
રાજ કરે છે. મુસલમીન રાજ હોવા છતાં હિન્દુ અને મુસલમીનપણુંનો  
દેશ માત્ર પણ પક્ષપાત વગરનું ઉદાર રાજ્ય છે. લગભગ સાડાત્રણસેં  
ગામ તો હિન્દુ અને મુસ્લિમને ઐરીયત (ધર્માદામાં) આપેલ છે. કહેવત  
કે કે, મોઝ બાધીઓની, વિવેક રજુપુતોનો અને વેડ કાઠિયોની વખણાય  
છે, તદાનુસાર જુનાગઢ સખાવતે બહાડુર છે. નવાખ સાહેખ જેવાજ તેમના  
ઉદાર હીલાવર હીલના મર્હુમ, વજીર શેખ અહુદીનલાઘ જી. આઈ.  
પ્ર. અને હુલતેમના લગ્નીજ હિવાન શેખ અહુમુહલાઘ જેવા સુખાનીઓ  
લોકપ્રિય થઈ પડ્યા છે. નેમનાથ લગવાનની પવિત્ર દિક્ષા, કૈવલ્ય અને  
નિર્બાણ ભૂમિમાં જૈનોની સંખ્યા ઘણી થોડી છે. આ ગામમાં લીંબડી  
અને ગોંડળ એમ બન્ને સંપ્રતિયનું છે. બન્નેના ચાતુર્માસ વાર-  
કુરતી એકજ સ્થાનકમાં થાય છે. બન્નેનો એકજ સંધ છે. લીંબડીમાં

ચોકસી કરુંયાંદ નાથાભાઈ અને ગોંડળમાં ચોકસી ગોલનજી ગૌરધરવાળા અવેરચાંડસાઈ, અગેસરો છે. 'બનને' શ્રીમત અને ધર્મપ્રેમી છે. એકાંદર આ ગામમાં સંપ ધણો પ્રશંસાપાત્ર છે. ધાર્મિક મિતકૃત અને સંસ્થામાં એ ઉપાશ્રય, એક ધર્મશાળા અને લાઈફ્રેરી તથા જૈનશાળા વગેરે સારી દ્વારાખેખ નીચે હુયાતી ધરાવે લે.

જૈન સ્થાનકવાસીની વસ્તિનો સંખ્યાંક.

ઘર.	મારણુસે.	પુરુષ.	સ્ત્રી.	પરણુલ	પુરુષ.	વિધુર.	કંવાર.	સધવા.
૧૩૭	૮૫૬	૩૨૬	૩૩૦	૧૨૭	૨૮	૧૭૧	૧૨૭	

વિધવા.	કંવારી.	વિસ્તા.	હસ.	ભાવસાર.	ખત્રી.	સોરઠીયા.
૬૫	૧૩૮	૩૨	૪૮૩	૧૦	૨૦	૧

ભણુલ	પુરુષ.	અલણુ.	ભણુલ સ્ત્રી.	અલણુ.	બાળક.	ભાષા ગુજરાતી
૨૪૨	૨૬	૧૫૨	૧૨૩	૧૧૩		

અંગ્રેજી	ભણુલ	પુરુષ.	ડાચા.	સામાયક.	પડિકમણુા.	વેપાર.	નાકરી.
૮૨	૬	૨૭૩	૬૬	૨૫૭	૬૫		

દાક્તર વક્તીલ.  
૨ ૨

### બુનાગાઠ રાજ્યના મહાલો.

#### ૧ ભેંસાણ મહાલ.

આ ગામમાં ગોંડળના ચાતુર્માસ થાય છે, ઉપાશ્રય છે. સંઘમાં આગેવાન છે. જૈન સ્થાનકવાસીની વસ્તિનો સરવાળો ૬૬ માણુસ. ૩૫ પુરુષ. ૩૧ સ્ત્રી.

#### ૨. વિસાવદર મહાલ.

આ ગામ ગોંડળ સંધનું છે, જૈન સ્થાનક ૧ છે. આગેવાન ગણ્યાય છે. જૈન સ્થાનકવાસીની વસ્તિ ૧૭૫ માણુસ. ૬૩ પુરુષ ૮૨ સ્ત્રી.

### ૩ નવાગઠ મહાલ.

આ ગામમાં ગોંડલ સંપ્રદાય અને લીંબડી સંપ્રદાયના ધર છે.  
ઉપાશ્રય પડી ગયો છે અંગ્રેસર શા. તલકુચંહ ટેવળુ છે જૈન સ્થાનકુચંહ  
વાસીની વસ્તિ ૧૭ માણુસ. ૮ પુરુષ. ૮ સ્ત્રી.

### ૪ વંથલી મહાલ.

આ ગામમાં સ્થાનકુચંહ વાસી બીલકુલ નથી. હેરાવાસી છ. ૧૫ માણુસ.  
૧૦ પુરુષ. ૫ સ્ત્રી.

### ૫ કુતીયાણા મહાલ.

આ ગામમાં જૈન સ્થાનકુચંહ નથી. હેરાવાસી છ.

### ૬ શિલ મહાલ.

આ ગામમાં જૈન સ્થાનકુચંહ ૧૨ માણુસ. ૬ પુરુષ. ૬ સ્ત્રી.

### ૭ કેશોદ મહાલ.

આ ગામમાં જૈન સ્થાનકુચંહ ૧૮ માણુસ. ૧૮ પુરુષ. ૩ સ્ત્રી.

### ૮ હાટીના માડીયા મહાલ.

આ ગામમાં ગોંડલના શ્રાવકો છે. સ્થાનક અંગ્રેસર  
છ. વસ્તિનો સરવાળો ૧૧૦ માણુસ. ૬૦ પુરુષ, ૫૦ સ્ત્રી.

### ૯ વેરાવળ મહાલ.

આ શહેર હરીયા કિનારે આવેલું સુંદર ઇમારતો અને ધનવાન  
લોકોથી ભરચુક વસ્તિવાળું દર્શાનિક છે. અહિ ગોંડળ સંપ્રદાયના ચાતુર્ય-  
માસ થાય છે. જૈન સ્થાનક એ છે. લાઇબ્રેરી અને જૈનશાળા આહિ  
ધાર્મિક સંસ્થાઓ છે. અંગ્રેસર શા. મહનળ જુઠા છે. સુંધ આખાદ  
વિધિવાળો છે. આ શહેર બંધરી હોવાથી લોકો સુખી છે.

જૈન સ્થાનકવાસીની વર્ણિતઃ—

ધર.	માણુસ.	પુરુષ.	સ્ત્રી.	પરણેલ પુરુષ,
૧૨૫	૫૦૬	૨૫૩	૨૫૬	૧૧૨
વિધુર.	કુંવારી.	સધવા.	વિધવા. કુંવારી.	વિસા ઓસવાળ.
૨૯	૧૧૨	૧૧૨	૫૭	૮૧
ડસા શ્રીમણી.	ભાગેલ પુરુષ.	ભાગેલ સ્ત્રી. „અમણું સ્ત્રી.	બાળક.	
૧૪૬	૨૨૬	૧૫૩	૩૮	૬૨
અંગેળું ભાગેલ પુરુષ. અરણી ભાગેલ પુરુષ.		દીન્દ્રી.	વેપાર.	
૧૫	૧૧	૧		૨૨૧
નોકર.	પરિકુમણ્યા.		સામાચક.	
૩૨	૧૦૩		૨૬૦	

૧૦ પાટણ મહાલ.

આ ગામ પ્રલાસપાટણુર્થી ઓળખાય છે. જૈન સ્થાનકવાસીની વર્ણિત નથી.

૧૧ તલાલા ગીર મહાલ.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વર્ણિત ઉ૧ માણુસ. ૧૮ પુરુષ. ૧૩ સ્ત્રી.

૧૨ ઉના મહાલ.

આ ગામમાં જૈન સ્થાનકવાસી નથી. હેરાવાસી છે.

૧૩ બાધરીયાવાડ ગાંધકડા મહાલ.

આ ગામમાં જૈન સ્થાનકવાસી નથી.

૧૪ માંગરોળ મહાલ.

આ



## જુનાગઢ મહાલ પંચકોશી.

### ૧ વડાલ.

આ ગામમાં ઉપાશ્રય ઘણ્ણો સરસ છે. આ સ્થળ જોંડળ સંપ્રદાયનું છે. કોઠારી ભૂદરળ જેચાંદલાઈ આગેવાન છે. ૨૫૪ માણુસો છે. ૧૩૬ પુરુષ ૧૧૮ સ્ત્રી.

### ૨ કાથરોટા.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વર્સિતઃ—૨૬ માણુસ. ૧૨ પુરુષ, ૧૪ સ્ત્રી.

### ૩ મજેવડી.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વર્સિત પ૭ માણુસ. ૩૦ પુરુષ, ૨૭ સ્ત્રી.

### ૪ ગોમાધર.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વર્સિતઃ—૮ માણુસ. ૮ સ્ત્રી.

### ૫ માલણુખર.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વર્સિતઃ—૭ માણુસ. ૫ પુરુષ, ૨ સ્ત્રી.

### ૬ વધાવી.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વર્સિતઃ—૮ માણુસ, ૪ પુરુષ, ૪ સ્ત્રી.

### ૭ પળાંસવા.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વર્સિતઃ—૨૮ માણુસ. ૧૨ પુરુષ, ૧૬ સ્ત્રી.

### ८. वीणापुर.

आ गाममां उपाश्रय नथी. जैन स्थानकवासीनी वस्ति:—

धर	माणुस,	पुरुष,	स्त्री.	परेषुल पुरुष,	कुंवारा,	सधवा,
१	१३	६	७	२	४	२
विधवा,	कुंवारी,	दशा,	भणेश्वर पुरुष.	अलग्यु स्त्री,	आणक,	
१	४	१३	४	४	४	५
वेपार,	सामायक.					
४	३					

### २. वंथली महाल.

#### १. भाटीया.

आ गाममां उपाश्रय नथी. जैन स्थानकवासीनी वस्ति:—६ माणुस.  
२ पुरुष, ४ स्त्री.

#### २. आभा.

आ गाममां उपाश्रय नथी. जैन स्थानकवासीनी वस्ति:—२२  
माणुस, १० पुरुष, १२ स्त्री.

#### ३. रवनी.

आ गाममां उपाश्रय नथी. जैन स्थानकवासीनी वस्ति:—३८ मा-  
णुस, २० पुरुष, १८ स्त्री.

#### ३. क्षेत्रोद महाल.

#### १. शिळोदर.

आ गाममां उपाश्रय नथी. जैन स्थानकवासीनी वस्ति:—५ माणुस.  
३ पुरुष, २ स्त्री.

## २ अगतराय.

आ गाममां उपाश्रय छे. जैन स्थानकवासीनी वस्तिः—३६ माणुस.  
१७ पुरुष, २२ स्त्री।

## ३ मंगलपुर.

आ गाममां उपाश्रय नथी. जैन स्थानकवासीनी वस्तिः—५ माणुस.  
२ पुरुष, ३ स्त्री।

## ४ विसावदर भडाल.

### १ कालसारी.

आ गाममां उपाश्रय छे. जैन स्थानकवासीनी वस्तिः—८० माणुस.  
३७ पुरुष, ४३ स्त्री।

### २ अंभाला.

आ गाममां उपाश्रय नथी. जैन स्थानकवासीनी वस्तिः—५ माणुस.  
४ पुरुष, १ स्त्री।

### ३ लतडी.

आ गाममां उपाश्रय नथी. जैन स्थानकवासीनी वस्तिः—३७ माणुस.  
१६ पुरुष, १८ स्त्री।

### ४ लंबुडा.

आ गाममां उपाश्रय नथी. जैन स्थानकवासीनी वस्तिः—४१  
माणुस, १८ पुरुष, २३ स्त्री।

### ५ मोटी खीडाखाड़.

आ गाममां उपाश्रय नथी. जैन स्थानकवासीनी वस्तिः—४ माणुस.  
पुरुष, २ स्त्री।

### ૬ નાના હડમતીયા.

આ ગામમાં ઉપાશ્રય નર્થી. જેન સ્થાનકવાસીની વસ્તિ:-૬ માણુસ.  
૩ પુરુષ, ૩ સ્ત્રી.

### ૭ રીખ્યપર.

આ ગામમાં ઉપાશ્રય નર્થી. જેન સ્થાનકવાસીની વસ્તિ:-૧૬ માણુસ.  
૮ પુરુષ, ૮ સ્ત્રી.

### ૮ છાલડા.

આ ગામમાં ઉપાશ્રય નર્થી. જેન સ્થાનકવાસીની વસ્તિ:-૧૬  
માણુસ, ૯ પુરુષ, ૭ સ્ત્રી.

### ૯ દેરાઈ વડાળા.

આ ગામમાં ઉપાશ્રય નર્થી. જેન સ્થાનકવાસીની વસ્તિ:-૩ માણુસ.  
૩ પુરુષ.

### ૧૦ હંદુરીયા.

આ ગામમાં ઉપાશ્રય નર્થી. જેન સ્થાનકવાસીની વસ્તિ:-૧૫  
માણુસ, ૯ પુરુષ, ૬ સ્ત્રી.

### ૧૧ માંડાવડ.

આ ગામમાં ઉપાશ્રય નર્થી. જેન સ્થાનકવાસીની વસ્તિ:-૨૨  
માણુસ, ૧૦ પુરુષ, ૧૨ સ્ત્રી.

### ૧૨ રાવણી.

આ ગામમાં ઉપાશ્રય નર્થી. જેન સ્થાનકવાસીની વસ્તિ:-૨૦  
માણુસ, ૧૧ પુરુષ, ૮ સ્ત્રી.

### १३ ब्रुनी चावंड.

आ गाममां उपाश्रय नथी. जैन स्थानकवासीनी वस्तिः—४  
माणुस. २ पुरुष. २ स्त्री.

### १४ मोणीया.

आ गाममां उपाश्रय हे. जैन स्थानकवासीनी वस्तिः—४३ माणुस.  
२० पुरुष. २३ स्त्री.

### १५ मोटा हड्डतीया.

आ गाममां उपाश्रय नथी. जैन स्थानकवासीनी वस्तिः—२५  
माणुस. १२ पुरुष. १३ स्त्री.

### १६ नवी चावंड.

आ गाममां उपाश्रय नथी. जैन स्थानकवासीनी वस्तिः—५  
माणुस. २ पुरुष. ३ स्त्री.

### १७ हुरीपर.

आ गाममां उपाश्रय नथी. जैन स्थानकवासीनी वस्तिः—१७  
माणुस. ८ पुरुष. ८ स्त्री.

### १८ मोणुपरी.

आ गाममां उपाश्रय हे. जैन स्थानकवासीनी वस्तिः—७८ माणुस.  
४३ पुरुष. ३५ स्त्री.

### १९ प्रेमपरा.

आ गाममां उपाश्रय नथी. जैन स्थानकवासीनी वस्तिः—१३  
माणुस. ६ पुरुष. ७ स्त्री.

### ૨૦ લીલીયા.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વસ્તિ:-૭  
માણુસ. ૪ પુરુષ. ૩ સ્ત્રી.

### ૨૧ શેમરાળા.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વસ્તિ:-૧ માણુસ.  
પુરુષ. "

### ૨૨ અગડુ.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વસ્તિ:-૧૩  
માણુસ ૭ પુરુષ. ૬ સ્ત્રી.

### ૨૩ ઝામકા.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વસ્તિ:-૧૭  
માણુસ. ૮ પુરુષ. ૬ સ્ત્રી.

### ૨૪ ઘેલા.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વસ્તિ:-૧૦  
માણુસ. ૫ પુરુષ. ૫ સ્ત્રી.

### ૨૫ લોટકા વડાલા.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વસ્તિ:-૧  
માણુસ. ૧ પુરુષ.

### ૨૬ અહાદુરપુર.

આ ગામમાં ઉપાશ્રય નથી જૈન સ્થાનકવાસીની વસ્તિ:-૧૨  
માણુસ. ૫ પુરુષ. ૭ સ્ત્રી.

## ૫ નવાગદ મહાલ.

## ૧ નવાગદ.

આ ગામમાં ઉપાશ્રય નહિ જેવો છે. જૈન સ્થાનકવાસીની વસ્તિ:—

ઘર,	માણુસ,	પુરુષ,	ઝી,	પુરુષ પરણેલ,	કુંવારા
૪	૧૭	૧૧	૬	૪	૭

સધવા,	વિધવા,	કુંવારી,	દસા,	ખત્રી,	બણેલ પુરુષ,
૪	૧	૧	૧૩	૪	૨

અમણુ ઝી,	બાલક,	વેપાર,	નોકરી,	સામાયક,
૪	૨	૮	૧	૩

પાડકમણુ.

૧

## ૨ ગુંદાળા.

આ ગામમાં ઉપાશ્રય નહિ જેવો છે. જૈન સ્થાનકવાસીની વસ્તિ:—

ઘર,	માણુસ,	પુરુષ,	ઝી,	પરણેલ પુરુષ,	વિધુર,
૧	૧૨	૮	૪	૨	૨૦

કુંવારા,	સધવા,	વિધવા,	કુંવારી,	દસા,	બણેલ પુરુષ,
૪	૨	૧	૧	૧૨	૫

અમણુ પુરુષ,	અમણુ ઝી,	બાલક,	વેપાર,	નોકરી,	સામાયક,
૧	૪	૨	૫	૩	૧

## ૩ વાવડી.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસોની વસ્તિ:—૧૫  
માણુસ. ૬ પુરુષ. ૬ ઝી.

## ૬ ભેંસાણુ મહાલ.

## ૧ મોટા ગુજરીયા.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વર્સિતઃ—૧૬  
માણુસ. ૮ પુરુષ. ૮ સ્ત્રી.

## ૨ વાવડી.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વર્સિતઃ—૩૩  
માણુસ. ૧૮ પુરુષ. ૧૫ સ્ત્રી.

## ૩ વિસલ હડમતીયા.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વર્સિતઃ—૧૮  
માણુસ. ૧૦ પુરુષ. ૮ સ્ત્રી.

## ૪ કરીયા.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વર્સિતઃ—૮  
માણુસ. ૫ પુરુષ. ૩ સ્ત્રી.

## ૫ મેદ્પરા.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વર્સિતઃ—૧૮ માણુસ.  
૧૦ પુરુષ. ૮ સ્ત્રી.

## ૬ ચારણીયા.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વર્સિતઃ—૧૬ મા-  
ણુસ. ૮ પુરુષ. ૮ સ્ત્રી.

## ૭ અંકરોળા.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વર્સિતઃ—૨૨ માણુસ.  
૧૪ પુરુષ. ૮ સ્ત્રી.

४३.

### ૮ ખાવલ અરવાળા.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વર્ષિતઃ-૧૧૫ માણુસ.  
૮ પુરુષ. ૬ સ્ત્રી.

### ૯ તોરી.

આ ગામમાં ઉપાશ્રય છે. જૈન સ્થાનકવાસીની વર્ષિતઃ-૬૦ માણુસ.  
૪૬ પુરુષ. ૪૪ સ્ત્રી.

### ૧૦ અરજશુસુખ.

આ ગામમાં ઉપાશ્રય નથી. ૧૬ પુરુષ. ૧૫ સ્ત્રી.

### ૧૧ અભિજનીયા.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વર્ષિતઃ-૧૦ માણુસ.  
૬ પુરુષ. ૪ સ્ત્રી.

### ૧૨ ખાણદીયા.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વર્ષિતઃ-૫ માણુસ.  
૪ પુરુષ. ૧ સ્ત્રી.

### ૧૩ ચોરવાડા.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વર્ષિતઃ-૧૪ માણુસ.  
૮ પુરુષ. ૬ સ્ત્રી.

### ૧૪ ખાણરાહંમતીયા.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વર્ષિતઃ-૨૨ માણુસ.  
૧૩ પુરુષ. ૮ સ્ત્રી.

### ૧૫ અમૃતાપર.

આ ગામમાં ઉપાશ્રય છે. જૈન સ્થાનકવાસીની વર્ષિતઃ-૬૬ માણુસ.  
૩૮ પુરુષ. ૩૧ સ્ત્રી.

### १६ देवगाम.

आ गाममां उपाश्रय नथी. जैन स्थानकवासीनी वस्तिः—८ माणुस.  
५ पुरुष. ३ स्त्री.

### १७ बामणिया.

आ गाममां उपाश्रय नथी. जैन स्थानकवासीनी वस्तिः—२ माणुस.  
१ पुरुष. १ स्त्री.

### १८ भाणीया मङ्गल.

#### १ अभरापुर.

आ गाममां उपाश्रय नथी. जैन स्थानकवासीनी वस्तिः—२ माणुस.  
२ पुरुष.

### २ आदरी.

आ गाममां उपाश्रय नथी. जैन स्थानकवासीनी वस्तिः—५५ माणुस.  
३० पुरुष. २५ स्त्री.

### ३ चोरवाड.

आ गाममां उपाश्रय नथी. जैन स्थानकवासीनी वस्तिः—२१ मा-  
णुस. ११ पुरुष. १० स्त्री.

### ४ पाटण मङ्गल.

#### १ सोनारीया.

आ गाममां उपाश्रय नथी. जैन स्थानकवासीनी वस्तिः—४ मा-  
णुस. १ पुरुष. ३ स्त्री.

### ५ गोरभमठी.

आ गाममां उपाश्रय नथी. जैन स्थानकवासीनी वस्तिः—१ माणुस.  
१ पुरुष.

## ૮ શિલ.

ગીર મહાલ.

૧ રામપુરા.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વસ્તિ:-૫ માણુસ.  
૧ પુરુષ. ૪ સ્ત્રી.

૧૦ ઉના મહાલ.

૧૧ બાધરીયાવાડ મહાલ..

૧૨ ગાધકડા મહાલ.

૧૩ કુંતીયાણા મહાલ.

એ ચાર રહાતમાં હાત સ્થાનકવાસી નથી.

કુલ એકદંડ તારીજ.

૧	ઝુનાગઠ મહાલ પંચડોખી.	૪૦૦ માણુસ. ૨૦૫ પુરુષ. ૧૯૫ સ્ત્રી.
૨	વંથલી મહાલ ૮૧ માણુસ.	૪૨ પુરુષ. ૩૬ સ્ત્રી.
૩	કશેલ મહાલ ૬૮ માણુસ.	૩૮ પુરુષ. ૩૧ સ્ત્રી.
૪	વિસાવદર મહાલ. ૬૮૮ માણુસ.	૩૫૧ પુરુષ. ૩૩૮ સ્ત્રી.
૫	નવાગઠ મહાલ. ૫૭ માણુસ.	૨૬ પુરુષ. ૨૪ સ્ત્રી.
૬	બેંસાણુ મહાલ. ૮૨૨ માણુસ.	૪૪૫ પુરુષ. ૩૭૭ સ્ત્રી.
૭	માળીયા મહાલ. ૧૮૮ માણુસ.	૧૦૩ પુરુષ. ૮૫ સ્ત્રી.
૮	પાટણુ મહાલ. ૪૫૫ માણુસ.	૩૦૨ પુરુષ. ૨૫૩ સ્ત્રી.
૯	શિલ મહાલ. ૧૨ માણુસ.	૬ પુરુષ. ૬ સ્ત્રી.
૧૦	ગીર મહાલ. ૭૬ માણુસ.	૫૮ પુરુષ. ૧૭ સ્ત્રી.
૧૧	ઉના રહાત.	.....
૧૨	બાધરીયાવાડ મહાલ.	.....
૧૩	ગાધકડા મહાલ.	.....
૧૪	કુંતીયાણા મહાલ.	.....
	કુલ માણુસ.	પુરુષ. સ્ત્રી.
	૨૬૦૪	૧૫૪૦ ૧૩૬૪

## પોરથંડર.

ગામ.

આપેં રાજ્યની કુલ વસ્તી.

આ સંસ્થાન હરીયાના કંડા ઉપર વસેલું ચુંદર અને ભાગ ઈમારનોથી મનહુર દેખાય છે. લોકો શ્રીમંત અને સુઅણી એ. સોરઠ પ્રાંતનું આ પહેલા વર્ગનું રાજ્ય છે. રાજકોતી હતુમાન વંશના હુમકી ધણી રાણી હુમણુ કેવા અને સેનગાળીની એલાદ જેઠા કુલમણી મહારાણા નાયારસિંહજી રાજ કરે છે. રાણી સોરઠના બૂધણુ રૂપ અને પ્રણ પાલક હોવાથી જનરમેન્ટ હુમણુજ તેમને “મહારાજ” નો ઐતાય આપી કહેર કરી છે.

આ સ્થળ ગોંડળ અને ગરવાળાનું ગણ્યાય છે. ગોંડળ સંપ્રદાયમાં મેધે. ઉપાશ્રય અને સંઘાળી ઉપાશ્રય અંમ વણુ સંપ્રદાયના જુહા જુહા ઉપાશ્રય છે. જૈનશાળા અને લાઉઝેરી વગેરે ધાર્મિક સંસ્થાઓ છે. ગોંડળના મોદા ઉપાશ્રયમાં અને સંઘાળીમાં

શેડ હુરથયંહ વેદળ અને ગ્રહવાળા સંઘમાં અંગ્રેસર ગણ્યાય છે. સંઘ ધણેં હીપતો અને સંપીંડો છે. આ ગમમાં જૈન સ્થાનકવાસીની વસ્તિને સંઘાંક નીચે સુજાય છે:-

તણે સંઘના માણુષો.	પુરુષ.	પરણેડ વિધુર.	કંચારા
-------------------	--------	--------------	--------

૫૭૬	૨૬૫	૧૩૯	૩૦
-----	-----	-----	----

૧૩૧	૧૨૪		
-----	-----	--	--

વિધવા.	કંચારી.	દાસા.	ભણેલ પુરુષ.
--------	---------	-------	-------------

૮૧	૭	૫૭૬	૨૪૬
----	---	-----	-----

અણક.	વેપાર.	નોકરી.	વઢીલ.
------	--------	--------	-------

૬૦	૨૬૦	૩૫	૧
----	-----	----	---

સામાયક.	ર્યાંકમણુ.		
---------	------------	--	--

૨૨૪	૧૬૭		
-----	-----	--	--

## પોરથંડર મહાલો.

### ૧ રાણુાવાન મહાલ.

આ ગામ ગોંડલ સંપ્રદાયનું એ. ગામમાં ઉપાશ્રય છે.

અહિ જૈન સ્થાનકવાસીનો ધર્મી ઓછી વર્સિ છે તે આ મુજબ:-						
ધર. માણુસ.	પુરુષ.	સ્ત્રી.	મરણેલ પુરુષ.	સંધ્વા.	હુસા.	
૧	૪	૨	૨	૨	૨	૪
ભણેલ પુરુષ.	ભણેલ સ્ત્રી.	અલગુ સ્ત્રી,	વેપાર.	નોકરી	સામાયક.	
૨	૧	૧	૧	૧	૧	૨

પડિકમણ્ણા.

૨

### માંગરોળ બંહર.

આ સંસ્થાન હરીયાના કીનારા ઉપર આવેલું જુનાગઢ  
સૌરઠ ગ્રામનું રાજ્ય છે. રાજકર્તા નવાખ સાહેબ  
રાજ કરે છે. શાહેર ધર્માં રમણીક અને ધનાક છે. આ ગ્રામમાં ગોંડળ  
સંધના મેટા ઉપાશ્રય અને સંધારુનીના ચાતુર્માસ થાય છે. બન્નેના  
ઉપાશ્રય અલગ અલગ છે. બન્ને સંધને બધે ઉપાશ્રય જૈનશાળા વગેરે  
ધાર્મિક સંસ્થાએ છે. મેટા સંધમાં  
અને  
સંધારુનીમાં  
અંગેસર ગણ્ણાય  
છે. આ ગ્રામમાં જૈન સ્થાનકવાસીની વર્સિ:-

પત્રકો એ વાર મેઝલવા છતાં ન ભરાઈ આવવા માટે દીલગાર.



### ગોંડળ.

આ પહેલા વર્ગનું સંસ્થાન ગોંડલી નહીના કર ઉપર હાલાર  
પ્રાંતમાં આવેલું છે. રાજકર્તા જનભેલ વંશના રાજકોટથી ઉત્તરેલ મહારાજ  
શ્રી ભગવતસિંહજી, લુ. સી. આઈ. ઈ, એમ. ડી., એલ. એલ. ડી., એફ.  
આર. સી. પી., એફ. આર. એસ. (એડિનિયર); ડી., સી. એલ. (એડિસિફેડ);  
એમ. આર. આઈ. (એટિથ્રિટન); એફ. સી. પી. એન્ડ એસ. (મુંબઈ);  
ફ્રેલો મુંબઈ યુનિવર્સિટી; રાજ્ય કરે છે. આ ડાકાર સાહેબે બધાં કરતાં

ધોરાળ જેવી ભાતથર મુસ્કીમ બેમણુ પ્રજમાંથી હુમેશના માટે થતો ગોવધ ણંધ કરાવી અમર નામના મેળવી છે. હવે ઇકત આખા સોરઠ દ્વલાકુામાં ર્થયા તો હાલ ઓળ ખાતા કાઠિયાતાડ દ્વલાકુના એક ઇકત બુનાગઠ તળપદ સિવાય ગોવધ કૃયાંય થતો નથી. બીજુ નોંધ લેવી રહી જય છે કે નામહાર ઠાકેર સાહેબને જીવ હિંસા ઉપર ખડુ ચીડ છે. સાથે દાડ અક્ષીણુ અને બીડી. સોપારી એવું એક પણ વ્યસન નહોવા ઉપરાંત હિંગલાનંડમાં ઉંચી કેળવણી મેળવવા છતાં આર્ય વેશ પૈકી પાઈજમે અંગરણું અને મજલીનાની પાઘડી એ એમનો એક રંગિત પહેરવેશ છે. જીવન સાહુ અને વ્યવસ્થાઈ છે, રાજમાં એક પણ કર નથી, છેતાલીસ કર ગાઈએ એડા પછી મહારાજ શ્રી લગવતસિંહજીએ કાઢી નાંખ્યા છે. આવક જવક ઉપર પણ કશો લાગો ટકો નથી. આખા કાઠિયાવાડમાં ગોંડળ રાજ્યના રસ્તા ધણુજ સારા રાખવામાં આવે છે જેથી સુંગા પણ એને સુખ થયું છે. પ્રજની પ્રગતિનો આધાર સીંગો ઉપર છે તે સિધ્ધાંતને અનુસરીને ગોંડળ રાજ્યમાં સ્વી કેળવણી દ્વરદ્ધાત છે. બાર વરસના ઉમર ચુંધી નિશાળે લાણુવા મોકલવાની દ્વરજ કુન્યાચોના મા ખાપુ ઉપર રાખવામાં આવી છે.

આ સ્થળ લીંબડી જેટલુંજ પ્રતિષ્ઠિત છે. લીંબડીની માફક આંહુ પણ પુન્યપાદ્મ શ્રીમાન જનાચાર્ય ડુંગરસી સ્વામીની ગાહાનું ગામ છે. અતે પણ લીંબડીની માફક સંધાર્ણી સંધાડો જુદો પડ્યો. તેથી મોટો ઉપાશ્રય અને નાનો સંધાર્ણીનો ઉપાશ્રય કહેવાય છે. પૂર્વ કાળમાં ગોંડળની જહેજલાલી લારે કહેવાતી હતી. વાણીયાના ખારસો ધર હતા, વર્તમાનમાં બધી રીતે સામાન્ય છે. મોટા ઉપાશ્રયમાં ૨૦ સાધુ અને ૪૮+૨૧ સાધી છે, સંધાર્ણીના ઉપાશ્રયમાં સાધુ નથી. માત્ર સાઈંગોજ સંપ્રદાયનું સુખાન અછી રીતે ચલાવે છે. રહોટા ઉપાશ્રયના સંધમાં શેડ વૃજપાતલાઈ અને સંધાર્ણીમાં જગન્નાથલાઈ અગ્રેસરો છે. અનેને અથે ઉપાશ્રય અને લાઈંગેરી તથા જૈનશાળા વગેરે ધાર્મિક સંસ્થાઓ છે. ગોંડળ સંપ્રદાયના ક્ષેત્રો લીંબડી કરતાં સારા અને જાંખ્યામાં વર્ષે તેવાં છે. જેવી રીતે ગોંડળ રાજ્યનો જમીનનો વીધો વખણ્યા છે તેમ પુન્ય ડુંગરસી સ્વામીના ક્ષેત્રો વખણ્યા છે.

## મોટો ઉપાશ્રય.

### સંધાણી સંઘ.

બન્ને સંઘમાં રૂખરૂ અને પત્રાથી પત્રકો મોકલી મહેનત કરવા છતાં પત્રકો ન ભરાઈ આવવા માટે હીલગીર.

### ગોંડળના મહાલો.

#### ૧ ધોરાળ મહાલ.

આ શહેર સફરા નહી ઉપર વસેનું ગોંડલથી પણ અધીક સૌંદર્યતા અને લગ્નયતાવાળું મેમણું પ્રજાથી સારા હિન્દમાં પ્રસિદ્ધ છે. અહિંથી ગોંડળ નરેસ સર લગવતસિંહલુએ કાયમને માટે સહનતર જોવધ બધું કરેલ છે. અહિ લીંબડી અને ગોંડળ એમ બન્ને સંપ્રદાયના જુદા જુદા સંઘ અને ઉપાશ્રય છે. ગોંડળ સંઘના ઉપાશ્રયમાં જૈનશાળાઃ અને જૈન પુસ્તક ભંડાર હુસ્તિમાં છે, તેમાં “ સર્વજ્ઞ મહાવીર જૈન પુસ્તક ભંડાર ” એક અતી વિશાળ, સુંદર અને અમૃત્ય ગણ્યું છે. આખા કાઠિયાવાડમાં અનેડ સંસ્થા છે એટલે તેનો નોટો નથી મકાન લગંલગ પચીસ હુબરની કિંમતનું છે. આ પુસ્તકાલયના ઉત્પાદક પુરુષ મહુંમ તપ્રીવીજુ માણેકચંદ્રજી સ્વામી છે. એ મહુતમાંથી લગીરથ શ્રમને નથાનકવાની સમાજને અપૂર્વ વાર્સો બક્ષીસ કર્યો બહલ તેમને મુખારક ધરે છે.

લીંબડી ઉપાશ્રયમાં પણ મંગલ જૈનશાળા અને “ શ્રીઅગ્રામરજી જૈન પુસ્તક ભંડાર ” જેવી સંસ્થાઓ હસ્તી ધરાવે છે. પુસ્તક ભંડાર ધણો સુંદર અને લગ્ન છે. આનુ માન શતાવ્દીની પંડિતરાજ રત્નચંદ્રજી સ્વામીને ધરે છે. આ ગામમાં હોશી પુરષોત્તમ વાસણું જારે પ્રસિદ્ધ માણુસ થઈ ગયાછે રજવાડામાં તેમની મારદૂત આરખ લોકોને બોલાવતા હતા. તેમણે ધર્મની પાંચો ધોરાળમાં નાણથો હતો. હાલ લીંબડી સંઘમાં શા. ન્યાલચંહ જેચંહ અને દાનવીર શેડ શા. લક્ષ્મીચંહ વાલજી અને ગોંડલ સંપ્રદાયના સંઘમાં કામગાર પોપડ વનમાલી અગ્રેસર ગણ્યું છે.

### લીંબડી સંઘની સંખ્યા.

ધર	માણુસ	પુરુષ	સ્ત્રી	પરણેલ પુરુષ	વિધુર પુરુષ
૧૩૩	૬૩૩	૩૨૬	૩૦૪	૧૪૨	૨૮

કુંવારા પુરુષ.	સ્ત્રી પરણેલી.	વિધવા સ્ત્રી.	કુંવારી સ્ત્રી.
૧૫૯	૧૪૨	૧૧૬	૧૦૩
દસા શ્રીમાલી.	ખતરી લણેલ પુરુષ.	અલંષ પુરુષ.	લણેલ સ્ત્રી.
૫૨૪	૧૦૪	૨૬૧	૩
અભણુ. સ્ત્રી.	બાળક.	અંગેજ લણેલ.	ડીમી.
૧૧૦	૧૪૭	૨૫	૩
વકીલાં	પડિકમણ્ણા.	સામાયક.	નોકરી.
૬૬		૨૧૬	૭૪

### ગોંડળ સંઘની સંખ્યા.

ઘર.	માણુસ.	પુરુષ.	સ્ત્રી.	પરણેલ.	વિધુર.	કુંવારા.
૬૪	૩૫૬	૨૦૮	૧૦૮	૭૭	૧૩	૧૧૮
સંઘવા.	વિધવા.	કુંવારી.		દસા.	લણેલ પુરુષ	
૫૭	૨૫	૬૬	૬૬	૩૫૬		૧૭૪
ભણેલ સ્ત્રી.	અભણુ.	બાળક.	વેપાર.	નોકરી.	સામાયક પડિકમણ્ણા	
૫૪	૫૮	૬૫	૧૨૬	૪૦		૪૫
સામાયક	વકીલ	અને હાકિતર.				
૩૦૬	૧	૧				

### ૨ ઉપદેશ અહાલ.

આ ગામ નહીના ત્રટ ઉપર આવેલું છે. હિન્હુએ કરતા મેમણુની મારી સંખ્યાવાળું શ્રીમંત છે આ ગામ ખરવાળા સંપ્રદાય નીચે છે. ઉપાશ્રય અને જૈનશાળા વગેરે છે. અંગેસરમાં શેડ ત્રીલુલન હેઠકરણ વાળા માણુસ અને પેસે ટંકે આયાદ શ્રીમંત છે. સંખ્યાકઃ—

પત્રકો બખેવાર મોકલી ધણુા ઉધરાણી પત્રો લખખા છતાં પત્રકો ભરાઈ ન આવ્યા.

### ૩ ભાયાવદર મહાલ.

આ ગામ ગોંડલ સંપ્રદાયમાં છે, ઉપાશ્રય છે. આગેવાન  
વસ્તિનો સરવાળો:—

પત્રકો મેઠકદ્યા પણ હજુ લરાઈ ન આયા.

### ૪ પાટણુવાવ મહાલ.

આ ગામ ગોંડલ સંપ્રદાયનું રાગી છે. ઉપાશ્રય છે, અંગેસર  
છે, સંઘની સંખ્યા:—

### ૫ સરસાઈ મહાલ.

આ ગામ ગીરમાં આવેલ ગોંડલ સંઘાડામાં છે, ઉપાશ્રય અંગેસર  
તરીકે ગણ્યા છે, વસ્તિનું પ્રમાણુઃ:—  
પત્રકો નથી આયા.

### ૬ સુલતાનપુર મહાલ

આ ગામ ગોંડલ સંઘાડામાં છે, જન સ્થાનક છે, અંગેસર  
છે વસ્તિ:—પત્રકો નથી આયાં.

### કોલીથડ મહાલ.

#### ૧ કોલીથડ.

આ ગામમાં ઉપાશ્રય નથી. જન સ્થાનકવાસોની વસ્તિ:—  
દર માણુસ પુરુષ. સ્ત્રી પરણેલા કુંવારા સધવા વિધવા કુંવારી  
૩ ૪૦ < ૨૨ < ૧૦ < ૧ ૧૩

દસા	ભણેલ પુરુષ	ભણેલ સ્ત્રી,	અભણુ.	બાળક,	વેપાર,
૪૦	૧૨	<	૬	૧૨	૧૦

પઢિકમણુ, 'સામાયક.

૧ ૧૩

## ૨ રીખ.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વસ્તિ:—

ધર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી.	પરણેલ પુરુષ,	કુંવારા,
૧	૮	૬	૩	૨	૪
સધવા,	કુંવારી,	દસા,	પરણેલ પુરુષ,	ભણેલ સ્ત્રી.	
૨	૧	૮	૬	૩	
અંગ્રેજુ ભણેલ પુરુષ,	વેપાર,	પડિકમાણું,	સામાયકુ.		
૧	૬	૧	૨		

## ૩ આંધરડી.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વસ્તિ:—

ધર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી.	પરણેલ,	કુંવારા,
૨	૧૪	૮	૫	૨	૭
સધવા,	વિધવા,	કુંવારા,	દસા,	પરણેલ પુરુષ,	
૨	૧	૨	૧૪		૭
અલણુ સ્ત્રી.	બાળક,	વેપાર,	સામાયક,		
૪	૩	૫	૧		

## ૪ મુંગાની વાવડી.

આ ગામમાં જૈન ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વસ્તિ:—

ધર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી.	પરણેલ પુરુષ,	કુંવારા,
૧	૧૬	૭	૮	૩	૪
સધવા,	વિધવા,	કુંવારી,	દસા,	ભણેલ પુરુષ,	
૨	૨	૫	૧૬		૭
ભણેલ સ્ત્રી.	બાળક,	વેપાર,	સામાયક,		
૨	૩	૪	૧		

૬૩

### ૫ હડમતાળા.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વસ્તિ:—

ધર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી.	પરણેલ,	વિધુર,
૩	૩૧	૧૫	૧૬	૪	૧

કુંવારા,	સધવા,	વિધવા,	કુંવારી,	દસા,
૧૦	૪	૪	૮	૩૧

ભણેલ પુરુષ,	ભણેલ સ્ત્રી.	અલણુ સ્ત્રી.	ખાલક,
૧૩	૨	૧૦	૬

વેપાર,	નોકરી,	સામાયક
૬	૪	૬

### ૬ વેકરી.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વસ્તિ:—

ધર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી.	પરણેલ પુરુષ,	કુંવારા,
૩	૧૬	૧૧	૮	૩	૮

સધવા,	વિધવા,	કુંવારી,	દસા,	ભણેલ પુરુષ,	ભણેલ સ્ત્રી,
૩	૧	૪	૧૬	૮	૪

અલણુ સ્ત્રી,	ખાલક,	અંગેજ ભણેલ પુરુષ,	વેપાર,	સામાયક.
૪	૨	૨	૮	૮

### ૭ ચરખડી.

આ ગામમાં ઉપાશ્રય છે, જૈન સ્થાનકવાસીની વસ્તિ:—

ધર,	માણુસ,	પુરુષ	સ્ત્રી,	પરણેલ પુરુષ,	વિધુર,	કુંવારા,
૧૪	૬૦	, ૩૨	૨૮	૧૨	૨	૧૮

સધવા,	વિધવા,	કુંવારી,	દસા,	ભણેલ પુરુષ,
૧૨	૬	૧૦	૬૦	૨૪

અલણુ સ્વી.	ભણેલ સ્વી.	બાળક,	અંગ્રેજ ભણેલ પુરુષ,	વેપાર,
૬	૧૪	૧૫	૧	૨૧
નોકરી,	પડિકમણુ,	સામાયક.		
૬	૪	૩૮		

## ૮ ડાલીયા.

આ ગામ કુમારકી બાલુલાનું લાયાતી ગામ છે, ઉપાશ્રય નથી.  
જૈન સ્થાનકવાસીની વર્સિત:-

ઘર	માણુસ.	પુરુષ.	સ્ત્રી.	પરણેલ પુરુષ,
૫	૩૬	૧૭	૨૨	૫
વિધુર	કુંવારા	સધવા,	વિધવા	કુંવારા છસા,
૨	૧૦	૪	૩	૧૫ ૩૬
ભણેલ પુરુષ,	ભણેલ સ્વી.	અલણુ સ્વી.	બાળક.	વેપાર,
૧૪	૬	૬	૭	૨૨
નોકર,	પડિકમણુ,	સામાયક.		
૭	૧૫	૧૬		

## ૯ મેટા મૈકા.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વર્સિત:-

ઘર.	માણુસ,	પુરુષ.	સ્ત્રી,	પરણેલ પુરુષ,	વિધુર
૨	૧૫	૧૧	૪	૩	૧
કુંવારા,	સધવા.	વિધવા,	છસા,	ભણેલ પુરુષ.	
૭	૩	૧	૧૫	૬	
ભણેલ સ્વી.	અલણુ સ્વી.	બાળક,	અંગ્રેજ ભણેલ પુરુષ,	વેપાર,	
૨	૨	૨	૧	૬	

સામાયક  
૬

૬૫

### ૧૦ પીપરડી.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વસ્તિ:-

ધર	માણુસ	પુરુષ	સ્ત્રી	કુંવારા.	વિધવા.	દસા.	ભણેલ પુરુષ.
૧	૩	૨	૧	૨	૧	૩	૨

અભણુ સ્ત્રી. વેપાર.

૧ 2

### ૧૧ ભાડુકીયા.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વસ્તિ:-

ધર.	માણુસ.	પુરુષ.	સ્ત્રી.	પરણેલ.	કુંવારા	સધવા.
૧	૮	૩	૫	૧	૨	૧

કુંવારી.	દસા.	ભણેલ પુરુષ.	ભણેલ સ્ત્રી.	ખાળકુ.	વેપાર
૪	૮	૩	૨	૩	૨

નોકરી. સામાયક.

૧ 3

### ૧૨ નગર પીપળીયા.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વસ્તિ:-

ધર.	માણુસ	પુરુષ	સ્ત્રી	પરણેલ પુરુષ	કુંવારા	સધવા	વિધવા
૬	૫૧	૨૭	૨૪	૧૦	૧૭	૧૦	૮

કુંવારી,	દસા,	ભણેલ પુરુષ,	અભણુ પુરુષ,	ભણેલ સ્ત્રી,
૬	૫૧	૨૦	૨	૬

અભણુ સ્ત્રી, ખાળક, વેપાર, નોકરી, પડીકમણુ, સામાયક.

૧૧ ૬ ૧૨ ૬ ૪ ૨૩

૬૬

### ૧૪ નાના મૈકા.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વસ્તિ:-

### ૧૫ પાઈડે.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વસ્તિ:-

### ધોરાજ મહાલ.

#### ૧ ચરેલ.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વસ્તિ:-

ધર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ પુરુષ,	કુવારા,	સધવા,
૧૦	૭૮	૪૫	૩૪	૧૭	૨૮	૧૭

વિધવા,	કુવારી,	છસા,	ભણેલ પુરુષ,	ભણેલ સ્ત્રી,	અલણું સ્ત્રી,
૪	૧૩	૭૮	૪૦	૬	૨૧

બાળક,	વેપાર,	નોકરી,	પડિકમણું,	સામાયક.
૬	૨૨	૧૪	૩	૩૪

#### ૨ તોરણીયા.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વસ્તિ--

ધર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ પુરુષ,	કુવારા,	સધવા,
૧	૫	૩	૨	૧	૨	૧

કુવારી,	છસા,	ભણેલ પુરુષ,	બાળક,	વેપાર,	સામાયક.
૧	૫	૨	૨	૩	૨

#### ૩ હુધીવદર.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વસ્તિ:-

ધર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ પુરુષ,	કુવારા,	સધવા,
૪	૧૩	૭	૬	૧	૬	૧

૬૭

વિધવા,	કુંવારી,	દસા,	ભણેલ પુરુષ,	ભણેલ સ્ત્રી,	બાળક,
૪	૧	૧૩	૬	૧	૧
વેપાર,	પડિકમણું,	સામાયક.			
૭	૧	૩			

#### ૪ મોટી મારડ.

આ ગામમાં ઉપાશ્રય છે. જૈન સ્થાનકવાસીની વસ્તિ:--

ધર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ પુરુષ,	વિધુર,	કુંવારા
૨	૭	૪	૩	૧	૧	૨
સધવા,	વિધવા,	કુંવારી,	૧	દસા,	ભણેલ પુરુષ,	
૧	૧	૧		૭	૪	
ભણેલ સ્ત્રી	અંગેજુ	ભણેલ પુરુષ,	૧	વેપાર,	નોકરી,	સામાયક.
૨				૩	૧	૩

#### ૫ ઝાંઝમેર.

આ ગામમાં જૈન ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વસ્તિ:--

ધર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ પુરુષ,	કુંવારો,	સધવા,
૧	૬	૨	૪	૧	૧	૧
કુંવારી,	દસા,	ભણેલ પુરુષ,	૧	બાળક,	નોકરી,	સામાયક.
૩	૬			૩	૨	૧

#### ૬ પીપલીયા.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થા. વસ્તિ:—

ધર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ પુરુષ,	કુંવારા,	સધવા,
૨	૧૬	૧૧	૫	૨	૬	૨
કુંવારી,	દસા,	ભણેલ પુરુષ,	૧૦	ભણેલ સ્ત્રી,	બાળક,	અંગેજુ ભણેલ પુરુષ,
૩	૧૬			૨	૨	૪
વેપાર,	સામાયક.					
૧૧	૪					

૬૮

### ૭ મોવૈયા

આ.ગામમાં ઉપાક્રય ઘણો સરસ છે. જૈન સ્થાનકવાસીની વર્તિ:-

ધર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણોલ પુરુષ,	વિધુર,	કુંવારા,
૧૬	૮૮	૪૨	૪૬	૧૬	૭	૧૬

સંધવા,	વિધવા,	કુંવારી,	દસા,	લણોલ પુરુષ,	લણોલ સ્ત્રી,
૧૬	૮	૨૧	૮૮	૩૬	૧૨

અલણુ સ્ત્રી,	ખાલક,	વેપાર,	નોકરી,	અંગ્રેજ લણોલ,	પડિકમણા,
૨૧	૧૬	૩૮	૩	૧	૪

સામાયક.

૪૧

### ૮ ખાખી જળીયા.

આ. ગામમાં ઉપાક્રય છે. જૈન સ્થાનકવાસીની વર્તિ:-

ધર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણોલ પુરુષ,	કુંવારા,	સંધવા,
૧૨	૬૬	૪૨	૨૪	૧૦	૨૮	૧૦

વિધવા,	કુંવારી,	દસા,	લણોલ પુરુષ,	લણોલ સ્ત્રી,	ખાલક,
૪	૧૦	૬૬	૩૪	૧૨	૧૮

અંગ્રેજ લણોલ પુરુષ,	વેપાર,	નોકરી,	પડિકમણા,	સામાયક.
૧	૪૦	૨	૧૬	૨૬

### ૯ તણસવા. ઉપલેટા તાખે.

આ ગામમાં ઉપાક્રય નથી. જૈન સ્થાનકવાસીની વર્તિ:-

ધર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પુરુષ પરણોલ,	વિધુર,	કુંવારો,
૧	૭	૩	૪	૧	૧	૧

સંધવા,	વિધવા,	કુંવારી,	દસા,	લણોલ પુરુષ,	લણોલ સ્ત્રી,
૧	૧	૨	૭	૩	૧

અલણુ સ્ત્રી,	ખાલક,	અંગ્રેજ લણોલ પુ.	વેપાર,	સામાયક,	પડિકમણા.
૨	૧	૨	૩	૨	૧

ફુલ

### ૧૦ ચોયડી.

આ ગામમાં ઉપાશ્રય છે. જૈન સ્થાનકવાસીની વસ્તિ:-

ઘર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પુરણેલ પુરુષ,	વિધુર,	કુંવારા,
૪	૬	૭	૨	૧	૧	૫

સધવા,	વિધવા,	દસા,	ભણેલ પુરુષ	અલણું સ્ત્રી,	વેપાર,	નોકરી,
૧	૧	૬	૭	૨	૬	૧

પઢિકમણું સામાયક.  
૧                   ૧

### ૧૧ પાટીદ.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વસ્તિ:-

ઘર	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ પુરુષ,	કુંવારા,	સધવા,
૩	૨૫	૧૮	૧૩	૩	૬	૩

વિધવા,	કુંવારી,	દસા,	ભણેલ પુરુષ,	ભણેલ સ્ત્રી,	અલણું સ્ત્રી,
૩	૭	૨૫	૧૦	૨	૭

આલક,

વેપાર,	નોકરી,	સામાયક.
૬	૧૧	૧
૩	૪	

### ૧૨ નાના મૈકા.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વસ્તિ:-

ઘર,	માણુસ,	પુરુષ,	વિધુર,	કુંવારા,	દસા,	પુરુષ ભણેલ,
૧	૩	૩	૧	૨	૩	૩

વેપાર.  
૩

### જેતલસર.

આ ગામમાં ઉપાશ્રય ઘણો સુંદર છે. જૈન સ્થાનકવાસીની વસ્તિ:-

ઘર	માણુસ,	પુરુષ,	સ્ત્રી.	પરણેલ પુરુષ,	કુંવારા,	સધવા,
૬	૪૪	૨૪	૨૦	૮	૧૬	૮

વિધવા,	કુંવારી,	દશા,	અણેલ પુછ્ય.	લગેલ સ્ત્રી;	અલણુ સ્ત્રી.
૭	૫	૪૪.	૧૮	૬	૧૨
ખાળણું,	વેપાર,	નોકરી.	સામાયક.		
૮	૨૧	૩	૬		

### જેતપુર.

ગામ રૂપો વસ્તિ આખા રાજ્યની કુલ ૫૦૬૬૨૪૮ માણુસની.

આ સંસ્થાન ભાદર નહીના કાંડા ઉપર વસેલ છે. રાજ્યમણે અને શ્રીમંત હિન્દુ સુસલમાન પ્રજના અભ્ય મકાનોથી પ્રેક્ષકોને આંજુ નાંદે તેલું સુંદર સુશોભિત શહેર રહેલું છે. આ રાજ્યસ્થાન વાળા કાઠિ દરખારેનું લગભગ ૩૦ લાખની ઉપજવાળું સોરઠ પ્રાંતમાં વીજા વર્ગનું ગણ્યાય છે. તાલુકો ખાર ભાગદાર વચે જુદો જુદો ૦હેંચાઈ ગયેલ છે તેમાં થાણુદેવણી, વડીયા, પીડડીયા અને ધીદાખા એંધાર ૩ લાખના મહોટા લાગદારે પૈકી થાણુદેવણી, વડીયા, વીજા વર્ગમાં પીડડીયા ચોથા વર્ગમાં અને ધીદાખા કુંથડવાળા તાલુકો પાંચમા વર્ગમાં છે. દરખારે વીરાણી અને બેઈતાણી એમ લાઈનો પરીવાર છે તેઓ ધણુ લાયક, દ્વાળુ અને ઉદાર દીલાવર દીલના છે.

અહિ પણ ધોરાળની માર્ક લીંબડી અને ગોંડલ એમ ઘને જુદા જુદા સંધ છે. ઘનેનાં ચાતુર્માસ દરવર્ષે જુદે જુદે ઉપાશ્રય થાય છે. ઘનેને બબે ઉપાશ્રય જૈનશાળા અને લાઇન્ફેરીઓ છે. આગેવાનો પૈકી લીંબડી સંધમાં કામદાર લગવાનાં નરભેરામ અને ગોંડલ સંધમાં કામદાર શામળા જોડા લખાય છે. ઘને એકજ કુટુમ્બ છે. તે પૈકી કામદાર લગવાનાં જાઈના વડા કામદાર નરભેરામ જોપાલા અને ગોપાલા ચતુર્ભૂજ એક વખત જેતપુરની રાજ્યસત્તા તેમના હુસ્તક હતી. તેઓ દ્વિવાન દરજાએ હુદ્ધ બાંધે છોડે બાખરીયાજેવી સત્તા ધરાવતા હતા. ઘને બાધ દીકરાનો એમ એ ગેડી સુધી એક હશુ કારલાર હતો. જોપાલા ચતુર્ભૂજના માટે કાઠિયાવાડના પોલીટીકલાયેજન્ટ કર્નિલ લાંક સ્નીફેનને ભારે માન હતું ક્રાંતી માટે થયેલ હુકમ પોતે રદ કરાવી શકતા હતા. તેમના અવસાનથી લાંક સાહેયે ધણી દીલગીરી ખલાવી હતી. તેઓએ સંધ

સેવા, સમાજ સેવાનું અને રાજ સેવા કરીકારે નામના મેળવીહતી ઉપાશ્રયો ઘરના બંધાવેલ છે. હાલ તેમના દીકરા મૂનસિંગભાઈ અને ભગવાનજીલાલાધના. દીકરા નૌતમલાલલાધ હુયાત છે. ગોંડલ સંઘમાં શામળા એડા હુમણું સુધીં હુયાત હતા તેઓએ પણ ઘરના ઉપાશ્રય બંધાવી સંઘ સેવા કરી ભારે કીર્તિ મેળવી છે. ગોંડલ સંઘમાં ગોંડલ સંપ્રદાયના તપદ્વીજી માણેકચંદ્રજી સ્વામીના અસાધારણું શ્રમ અને ભગીરથ પ્રયત્નથી “જૈન પાઠશાળા” અને “સર્વજ્ઞ મહુાવીર જૈન પુસ્તક ભંડાર” જેવી અજેડ જેનો જેણો ન મળો તેવી સુંદર સંસ્થાઓ હુયાતી ધરાવે છે. પુસ્તક ભંડાર અને પાઠશાળા માટે નામદાર દરખારશી લક્ષમણું વાળા સી, આઈ, ઈ. એમણે એક લાખ ડિપિયાની કિમતનોં પોતાનો દરખારગઢ તપદ્વીજીના બોધ્યથી અર્પણ કરી હીધેા છે. એ દાખલો તપદ્વીજીના અતિશય માટે અને દરખારશીની અસાધારણું ઉદ્ઘારતા માટે અદ્વીત ગણી શકશો. આ સંસ્થા પાસે લગભગ લાખ ડિપિયાનું ભંડોળ કહેવાય છે. જૈન સ્થાનકવાસીની વસ્તિ પૈકી:—

### લીંબડી સંઘ.

ધર.	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ પુરુષ,	વિધુર,
૧૨૬	૬૪૧	૩૫૬	૨૮૫	૧૩૪	૧૫
કુંવારા પુરુષ,	સંધવા સ્ત્રી,	વિધવા,	કુંવારી,	વિસા શ્રીમાળી	
૨૦૭	૧૩૪	૪૪	૧૦૭	૩૭	
દસા,	ખતરી,	સેરહીયા,	મેચ્ચી,	અણેલ પુરુષ,	અમણું પુરુષ,
૫૦૮	૧૬	૧૨	૧૪	૨૮૦	૧૧
ભણેલ સ્ત્રી,	અલણું સ્ત્રી,	બાળક,	અંગેજી લણેલ પુરુષ,	વેપાર,	
૧૨૬	૭૩	૧૭૪	૭૪	૨૮૫	
નોકરી,	વડીલ,	ઢાકૃતર,	મંડિકમણું,	સામાયક,	
૬૮	૨	૨	૬૨	૧૬૩	
ગોંડલ સંઘ.					
ધર.	માણુસ.	પુરુષ.	સ્ત્રી.	પરણેલ પુરુષ.	
૧૩૧	૮૫૦	૪૫૧	૩૬૮	૧૬૪	
વિધુર.	કુંવારા.	સંધવા.	વિધવા.	કુંવારી.	વિસા શ્રીમાળી.
૨૭	૨૩૦	૧૬૪	૪૭	૧૫૭	૧૩

હસા શ્રીમાણી.	પત્રી.	લણેલ પુરુષ.	અભણુ પુરુષ	લણેલ જી.
૮૦૬	૩૧	૩૧	૭	૧૬૮
અલણુ સ્વી.	બાળક.	અંગેળુ લણેલ પુરુષ.	ડીઢી.	વેપાર.
૧૨૩	૧૬૧	૧૧૫	૨	૩૬૬
નોકરી.	વકીલ.	ફાક્ટરી	પડિકમણ્ણા.	સામાયક.
૬૬	૨	૨	૧૦૨	૩૩૪

### જેતપુરના તાલુકા.

#### ૧ ભીલખા તાલુકો.

આ ગામ ગોંડલ સંપ્રદાયનું છે. ઉપાશ્રય પણું છે, દરખારો ગામમાં રહે છે. જેતપુર તાલુકા કોઈની સત્તા નીચે આ તાલુકો આવેલ છે, આ ગામ ગોંડલ સંપ્રદાયનું છે. અંગેસર વકીલ સોમણુ વેલળ લખાય છે. અહિ જૈન સ્થાનકવાસીની વસ્તિ:—

પત્રક શુભ થવા માટે હીલગોર.

#### ૨ મેંદ્રડા તાલુકો.

આ ગામ ગીરમાં આવેલ છે, ગામમાં હરખારશ્રી માણુસીયાવાણા રહે છે, આ તાલુકાની સત્તા જેતપુર તાલુકા કોઈની છે, ગોંડલ સંઘાડાનું આ સ્થળ છે, અંગેસરમાં હિરાણી અને માવાણી લખાય છે.

આ ગામમાં ઉપાશ્રય વગેરે છે જૈન સ્થાનકવાસીની વસ્તિ:—

ધર,	માણુસ,	પુરુષ,	સ્વી,	પરણેલ પુરુષ,	વિધુર,	કંવારા
૬૨	૫૨૬	૨૬૧	૨૩૫	૮૮	૧૬	૧૮૬

સધવા,	વિધવા,	કુંવારી,	હસા,	લણેલ પુરુષ,	અભણુ પુરુષ,
૮૮	૪૫	૧૦૧	૫૮	૨૧૦	૧૮
લણેલ જી,	બાળક,	. અંગેળુ	લણેલ પુરુષ,	વેપાર,	નોકરી
૪૮	૧૧૪	૧૩		૧૧૧	૫૭
પડિકમણ્ણા,	સામાયક,				
૩૮	૨૨૫				

### મેંડરડા તાણે.

#### ૧ ચીરોડા.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વસ્તિ:—

ઘર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ પુરુષ,	કુંવારા,	સંધવા,
૬	૨૦	૧૩	૭	૪	૬	૪
વિધવા,	દસા,	ભણેલ પુરુષ,	ભણેલ સ્ત્રી,	બાળક,	વેપાર,	
૩	૨૦	૧૧	૧	૨	૬	

નોકરી.

૪

#### ૨ કેલડા.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વસ્તિ:—

ઘર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ પુરુષ,	કુંવારા,	સંધવા,
૧	૬	૩	૩	૨	૧	૨
વિધવા,	દસા,	ભણેલ પુરુષ,	બાળક,	વેપાર,	નોકરી	સામાયક.
૧	૬	૨	૧	૧	૧	૨

### જેતપુર, ખીલખા તાણે, કંથડવાળા તાલુકે.

#### મોણુપર.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વસ્તિ:—

ઘર	માણુસો,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ પુરુષ,	કુંવારા	સંધવા,
૬	૫૭	૩૭	૨૦	૧૦	૨૭	૧૦
વિધવા.,	કુંવારી	દસા,	ભણેલ પુરુષ,	ભણેલ સ્ત્રી,	અલણુ સ્ત્રી,	
૨	૮	૫૭	૩૦	૧	૧૨	

બાળક,  
૧૪                  વેપાર.  
                    ૩૭

#### ૧ ખરવાળા જેતપુર—ખીલખા.

આ ગામમાં ઉપાશ્રય છે, જૈન સ્થાનકવાસીનો વસ્તિ:—

ઘર,	માણુસો	પુરુષ,	સ્ત્રી,	પરણેલા પુરુષ,	વિધુર,	કુંવારા
૧૭	૮૦	૪૩	૩૭	૧૨	૫	૨૬

સધવા,	વિધવા	કુંવારી,	હસા	સોરઠીયા	લણેલ પુરુષ,
૧૨	૧૦	૧૫	૪૦	૪૦	૪૦

અભણુ પુરુષ,	લણેલ ઝી,	અભણુ ઝી,	વેપાર,	નેકર
૩	૨૬	૧૧	૩૩	૧૦

પડિકમણ્ણા, સામાયક.  
૩ ૧૪

### ચોરવાડી જેતપુર તાણે.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વસ્તિ:—

ધર,	માણુસ,	પુરુષ,	ઝી,	પરણેલ પુરુષ,	કુંવારા,	સધવા
૧	૧૧	૬	૫	૨	૪	૨

વિધવા,	કુંવારી,	હસા,	લણેલ પુરુષ,	અભણુ ઝી,	બાળક,
૧	૨	૧૧	૪	૬	૪

વેપાર, સામાયક,  
૬ ૧

### અંધાળા જેતપુર તાણે.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વસ્તિ:—

ધર,	માણુસ,	પુરુષ,	ઝી,	વિધુર,	કુંવારો,	વિધવા,
૨	૫	૨	૩	૧	૧	૧

કુંવારી,	હસા,	લણેલ પુરુષ,	લણેલ ઝી,	બાળક,	વેપાર,
૨	૫	૨	૧	૧	૨

સામાયક,  
૧

### પીખળીયા જેતપુર તાણે.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વસ્તિ:—

ધર,	માણુસ,	પુરુષ,	ઝી,	પરણેલ પુરુષ,	કુંવારો,
૪	૧૪	૬	૮	૨	૪

૭૫

સધવા,	વિધવા,	કુંવારી,	હસા,	ભણેલ પુરુષ,	અભણુ સ્ત્રી,
૨	૩	૩	૧૪.	. ૫	. ૪
બાળક,	વેપાર,	પર્ડિકમણું,	સામાયક,		
૫	૬	૧	૩		

### નવાણીયા જેતપુર તાણે.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વસ્તિ:-

ઘર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ પુરુષ,	કુંવારા,
૧	૧૦	૪	૫	૧	૪
સધવા,	કુંવારી,	હસા,	ભણેલ પુરુષ,	ભણેલ સ્ત્રી,	
૧	૪	૧૦	૨	૧	
બાળક,	વેપાર,	સામાયક,			
૫	૫	૨			

### સોલાવડલા જેતપુર તાણે.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વસ્તિ:-

ઘર,	માણુસ,	પુરુષ	સ્ત્રી,	પરણેલ, પુરુષ,	કુંવારા,
૨	૭	૪	૩	૨	૨
સધવા,	વિધવા;	હસા,	ભણેલ પુરુષ,	ભણેલ સ્ત્રી,	વેપાર,
૨	૧	૭	૪	૧	૪

સામાયક,

૭

### ખારચીયા જેતપુર તાણે.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વસ્તિ:-

ઘર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પૂરણેલ પુરુષ,	વિધુર,
૩	૨૫	૧૫	૧૦	૬	૧

૭૬

કુંવારા,	સધવા,	વિધવા,	કુંવારી,	દસા,	ભણેલ પુરુષ.
<	૬	૧૦	૩	૨૫	૧૧
બાળક,	વેપાર,	પડિકમણું,	સામાયંક,		
<	૧૫	૧	૬		

### અકાળા ખીલખા કાંથડવાળા તાલુકા.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વस્તિ:--

ઘર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ પુરુષ,	વિધુર,
૦૬	૨૮	૧૮	૬	૭	૧
કુંવારા,	સધવા,	વિધવા,	દસા,	ભણેલ પુરુષ,	
૧૧	૭	૨	૨૮		૧૭
ભણેલ સ્ત્રી,	બાળક,	વેપાર,	નોકરો.		
૨	૦	૨	૧૬	૩	

### મેઘા પીંપળીયા જેતપુર તાણે.

આ ગામમાં ઉપાશ્રય નથી, જૈન સ્થાનકવાસીની વસ્તિ:—

ઘર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ પુરુષ,	કુંવારા,
૫	૩૧	૧૫	૧૬	૭	૮
સધવા,	કુંવારી,	દસા,	ભણેલ પુરુષ,	ભણેલ સ્ત્રી,	
૭	૬	૩૧	૧૨		૮
અલણું સ્ત્રી,	બાળક,	અંગ્રેજ ભણેલ પુરુષ,	વેપાર,	નોકરો.	
૧૧	૬	૧	૧૨	૩	

### અરવાળા જેતપુર તાણે.

આ ગામમાં ઉપાશ્રય છે. જૈન સ્થાનકવાસીની 'વસ્તિ':—

ઘર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ પુરુષ,	કુંવારા,
૧૧	૫૨	૨૫	૨૭	૧૧	૧૪

૭

સધવા,	વિધવા,	કુંવારી,	હસા,	લણેલ પુરુષ,	બાળક,
૧૧	૪	૧૨	૫૨	૧૮	૧૨
વેપાર,					
૨૫					

### ખોજડીયા જેતપુર તાબે.

આ ગામમાં ઉપાશ્રય નથી, જેન સ્થાનકવાસીની વસ્તિ:-

ઘર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ પુરુષ,	કુંવારા,
૭	૩૭	૨૨	૧૫	૬	૧૬

સધવા,	વિધવા,	કુંવારી,	હસા,	લણેલ પુરુષ.	લણેલ સ્ત્રી
૬	૩	૬	૩૭	૧૬	૬
બાળક,	વેપાર,				
૬	૬				

### ૧ સરધારપુર ચીતલ તાબે.

આ ગામમાં ઉપાશ્રય નથી, જેન સ્થાનકવાસીની વસ્તિ:-

ઘર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ પુરુષ,	સધવા,	હસા
૧	૨	૧	૧	૧	૧	૨

લણેલ પુરુષ,	વેપાર,
૧	૧

### રેસમણી ગાળોલ ભાયાવદર તાબે.

આ ગામમાં ઉપાશ્રય નથી, જેન સ્થાનકવાસીની વસ્તિ:-

ઘર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ પુરુષ,	વિધુર,
૪	૨૭	૧૩	૧૪	૫	૧
કુંવારા,	સધવા,	વિધવા,	કુંવારી,	હસા,	લણેલ, પુરુષ,
૭	૫	૧	૮	૨૭	૬

લણેલ સ્ત્રી,	બાળક,	વેપાર,	સામાયક.
૧	૬	૭	૬



### જેતપુર.

#### ખડીયા તાલુકો.

ગામ ૧૬ વસ્તિ, આખા રાન્યંની કુલ

આ સંસ્થાન સેરઠ પ્રાંતમાં આવેલ ત્રીજ વર્ગનું છે. અહિના દરખારશ્રી વાળા કાઠિ વંશના છે. તાલુકો લગભગ એ લાખનો છે. રાજ કર્તા જેતપુરથી અહિ રાજધાની સ્થાપી રહેલ નામદાર દરખારશ્રી ખાવા-વાળા સાહેબ એક આદર્શ અને નીતિ સંપન્ન રૌજવી છે. કાઠિયાવાડમાં કાઠિ દરખારોમાં તેમનું સ્થાન ધણું ઉંચું છે. અહિં અગ્રસરમાં ડોડારી ઝવેરયંડ ભવાનવાળા છે. ઉપાશ્રયમાં લાઈફ્રેરી છે, અહિ જૈન સ્થાનકવાસીની વસ્તિ:—

ઘર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ પુરુષ,	વિધુર,	કુંવારા,
૩૪	૧૬૩	૬૭	૬૬	૩૮	૩	૫૬

સધવા,	વિધવા,	કુંવારી,		દસા શ્રીમાણી,	લણેલ પુરુષ,
૩૮	૦૧૭	૪૧		૧૬૩	૮૦

ભણેલ સ્ત્રી,	અમણુસ્ત્રી,	બાલક,	વેપાર,	નોકરી,	પડિકમણુસ્ત્રી,
૨૨	૫૬	૩૨	૪૪	૨૧	૬

સામાયક.

૬૩

#### ખડીયા તાલુકો.

##### ૧ રામપોર.

આ ગામમાં જૈન ઉપાશ્રય નથી. સ્થાનકવાસીની વસ્તિ:—

ઘર	માણુસ	પુરુષ	સ્ત્રી	પરણેલ પુરુષ	વિધુર	કુંવારા
૬	૩૬	૨૦	૧૬	૫	૧	૧૪

સધવા	વિધવા	કુંવારી	દશા	લણેલ પુરુષ	લણેલ સ્ત્રી
૫	૧	૧૩	૩૬	૧૬	૬

બાલક	વેપાર	નોકરી	પડિકમણુસ્ત્રી	સામાયક.
૧૦	૬	૩	૪	૫

## ૨ થોરખાળી.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વર્ણિતઃ—

ધર,	માણસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ પુરુષ,	કુંવારા,	સધવા,
૨	૧૨	૬	૬	૨	૪	૨
કુંવારા,	દસા,	ભણેલ પુરુષ,	બાલક,	વેપાર,	નોકરી,	સામાયક.
૪	૧૨	૫	૧	૧	૨	૫

## ૩ પીપલવા.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વર્ણિતઃ—

ધર,	માણસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ પુરુષ,	વિધુર,	કુંવારા,
૨	૨૦	૬	૧૧	૩	૧	૫
સધવા,	કુંવારી,	દસા,	ભણેલ પુરુષ,	ભણેલ સ્ત્રી,	બાલક,	
૩	૮	૨૦	૬	૪	૬	

અંગેજ ભણેલ પુરુષ, વેપાર, સામાયક.

૨	૫	૭
---	---	---

## ૪ ધુંધરાળી.

આ ગામમાં ઉપાશ્રય છે. જૈન સ્થાનકવાસીની વર્ણિતઃ—

ધર,	માણસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ પુરુષ,	વિધુર,	કુંવારા,
૧૫	૭૫	૫૦	૨૫	૧૨	૮	૩૦
સધવા,	વિધવા,	કુંવારા,	દસા,	ભણેલ પુરુષ,	ભણેલ સ્ત્રી,	
૧૨	૪	૬	૭૫	૪૩	૭	

બાલક, અંગેજ, ભણેલ પુરુષ, વેપાર, નોકરી, પડિકમણા,

૧૧	૨	૨૧	૨૫	૪
----	---	----	----	---

સામાયક.

૧૫
----

## ૫ ઉમરાલી.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વર્ણિતઃ—

ધર,	માણસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ પુરુષ,	વિધુર,	કુંવારા,
૫	૧૬	૭	૬	૪	૧	૨

संधवा,	विधवा,	कुंवारी,	दह्सा,	लघुल पुरुष,	अलशु पुरुष
४	३	२	१६	६	१

लघुल स्त्री,	बालक,	वेपार,	सामायक,
२	२	४	४

### ६ अंगर.

आ गाममां उपाश्रय नथी. जैन स्थानकवासीनी वस्ति:—

धर,	माणुस,	पुरुष,	स्त्री,	परघुल पुरुष,	कुंवारा,	संधवा,
२	१३	८	५	२	६	२

कुंवारी,	दह्सा,	लघुल पुरुष,	बालक,	वेपार,	नेकरी,	सामायक,
३	१३	७	१	१	१	३

### ७ रक्षातीया.

आ, गाममां उपाश्रय नथी. जैन स्थानकवासीनी वस्ति:—

धर,	माणुस,	पुरुष,	स्त्री.	परघुल, पुरुष,	कुंवारा,
३	१८	१०	८	३	७

संधवा,	विधवा,	कुंवारी,	दह्सा,	लघुल पुरुष,
३	१	४	१८	८

बालक,	वेपार,
२	६

### ८ तडका पीपलीया.

आ गाममां उपाश्रय नथी. जैन स्थानकवासीनी वस्ति:—

धर,	माणुस,	पुरुष,	स्त्री.	पुरुष परघुल,	कुंवारा,
२	६	३	३	२	१

संधवा,	विधवा,	दह्सा,	लघुल पुरुष,	अलशु पुरुष,
२	१	६	२	१

अलशु स्त्री,	वेपार.
३	३

## ૬ સનાતી.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકુવાસીની વસ્તિઃ—

ધર.	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ પુરુષ,	વિધુર,	કુંવારા,
૪	૧૬	૧૧	૫	૨	૨	૭

સધવા,	વિધવા,	કુંવારી,	દસા,	ભણેલ પુરુષ,
૨	૨	૧	૧૬	૧૦

આળક,	વેપાર,	નોકરી,	સામાયક.
૧	૫	૪	૮

## ૧૦ ઢોલવા.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકુવાસીની વસ્તિઃ—

ધર.	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ પુરુષ,	વિધુર,
૨	૧૨	૮	૪	૧	૧

કુંવારા,	સધવા,	વિધવા,	કુંવારી,	દસા,	ભણેલ પુરુષ.
૬	૧	૧	૨	૧૨	૭

આળક,	વેપાર,	સામાયક
૨	૪	૫

## ૩ ચીતલ તાલુકો.

આ ગામ ચીતલ સંપ્રદાય નીચે છે, જૈન ઉપાશ્રય છે.

જૈન સ્થાનકુવાસીની વસ્તિઃ—

ધર.	માણુસ.	સધવા.	વિધવા.	કુંવારી.	પરણેલ	વિધુર.
૨૬	૧૫૪	૨૭	૧૨	૨૬	૨૭	૪

કુંવારા.	આળક.	વેપાર.	ભણેલ પુરુષ.	સ્ત્રી ભણેલ	પડિકમણા.
૪૨	૩૧	૩૬	૮૦	૧૬	૮

સામાયક.

૪૪

## વીરપુર.

ગામ ૧૩ વસ્તિ શાખા રાજ્યની કુલ

આ તાલુકો સેંચ પ્રાતમાં ચોથા વર્ગમાં લખાય છે, રાજકર્તાની જામનગરથી ઉત્તરેલ જાડેજ વંશના ઠાકોર સાહેબ હમીરસિંહજી રાજ કરે છે. આ ગામમાં જૈન સ્થાનકુવાસીની વસ્તિ બીજુલ નથી માત્ર બહાર ગામના નેકરીયાત વર્ગ છે ઉપાશ્રય નથી.

## ૧ ખરેડી મહાલ.

આ ગામ ગોંડલ સંપ્રદાયનું છે, ગામમાં ઉપાશ્રય છે,

જૈન સ્થાનકુવાસીની વસ્તિ:—

ધર,	માણસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ પુરુષ,	વિધુર,	કંવારા,
૧૦	૬૮	૩૨	૩૬	૧૩	૧	૧૮
સધવા,	વિધવા,	કંવારી,	દસા,	ભણેલ પુરુષ,	ભણેલ સ્ત્રી,	
૧૩	૫	૧૮	૬૮	૨૬	૧૩	
ખાલક,	વેપાર,	નેકરી,	પરિકુમણ્ણા,	સામાયક.		
૧૬	૩૧	૧	૩	૧૫		

## રાણુપુર જુનાગઢ ભાયાત.

આ ગામ સેંચમાં આવેલ જુનાગઢથી ઉત્તરેલ ૨૪ ગામનો તાલુકો છે, તાલુકાદારો પૈકી દરખાર શ્રી બાળી શેરખાનજી અને દરખાર શ્રી બાળી મુરતુજાખાનજી રાજકુમાર કેલેજમાં ભણેલ સુશિક્ષિત પુરુષ છે. આ ગામ ગોંડલ સંપ્રદાયનું છે ગામમાં જૈન ઉપાશ્રય છે અનેસર ચોવટીયા શામળજી પ્રેમજી છે.

અહીં જૈન સ્થાનકુવાસીની વસ્તિ:—

ધર	માણસો	પુરુષ	સ્ત્રી	પરણેલ પુરુષ	વિધુર
૫૬	૩૬૬	૧૬૩	૧૭૨	૬૭	૧૧

૯૩

કુંવારા	સધવા	વિધવા	કુંવારી	દશા પુરુષ	લણેલ પુરુષ
૧૧૫	૬૭	૩૦	૭૬	૩૬૬	૧૬૪
અલણુ તૃપુ	ભણેલ સ્ત્રી	અલણુ	ખાળક અંગ્રેજી,		
૪	૪૭	૧૦૮		૩૫	૧
વેપાર,	નોકરી,	સામાયક,	પડિકમણ્ણા,		
૧૬૩	૩૦	૨૬	૫૨		

વાળા ભાલા ઉના, ગોંડવાળા તાલુકો.

જેતપુર તાખે.

૧ ચુડા.

આ ગૌમમાં ઉપાશ્રય મળનો છે. ગોંડલ સંપ્રદાયનું છે. જૈન સ્થાનકવાસીની વસ્તિ:-

ધર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ પુરુષ,
૧૧	૧૧૧	૬૦	૫૧	૧૮
વિધુર,	કુંવારા,	સધવા,	વિધવા,	કુંવારી,
૧૧	૩૧	૧૮	૭	૧૬
અલણુ પુરુષ,	અલણુ,	લણેલ સ્ત્રી,	અલણુ સ્ત્રી,	ખાળક,
૫૨	૧	૧૦	૨૨	૨૬
વેપાર,	નોકર,	પડિકમણ્ણા,	સામાયક.	
૪૬	૧૪	૨	૧૭	

વાજસુર વાળા તાલુકો.

૨ મોટા હેવલીયા.

આ ગૌમમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વસ્તિ:-

ધર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી.	પરણેલ પુરુષ,	વિધુર,	કુંવારા,
૨	૧૫	૭	૮	૪	૧	૨

સધવા,	વિધવા,	કુંવારી,	દસા,	લણ્ણેલ પુરુષ,
૪	૧	૩	૧૫	૬
લણ્ણેલ સ્ત્રી.	બાળક,	વેપાર,	પડિકમણું,	સામાયક.
૪	૫	૬	૧	૫

### નવાણીયા તાણે.

#### ૧ દુંદીયા પીપલીયાઃ

આ ગામમાં જૈન ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વસ્તિ:—					
ઘર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી.	પરણેલ પુરુષ,	વિધુર, કુંવારા
૭	૪૧	૨૩	૧૮	૧૧	૧ ૧૧,
સધવા,	વિધવા,	કુંવારી,	દસા,	લણ્ણેલ પુરુષ,	
૧૧	૩	૪	૪૧	૨૩	
લણ્ણેલ સ્ત્રી,	બાળક,	વેપાર,	નેકરી,	પડિકમણું,	સામાયક.
૩	૫	૧૪	૩	૫	૧૧

### ખીલખા ભાણવાળા તાલુકે.

#### ૧ અરવાલુ આવીસી.

આ ગામમાં ઉપાશ્રય છે, પત્રકો મોકલ્યા ને એ વર્ષો થવા સાથે અનેક ઉધરાણી પત્રો લખવા છતાં હાઈ કોણ દીઓ.

### મેટી કુકાવાવ. ખીલખા આલાવાળા.

આ ગામમાં ઉપાશ્રય છે. જૈન સ્થાનકવાસોની વસ્તિ:—

ઘર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી.	પરણેલ પુરુષ,	વિધુર, કુંવારા,
૨૩	૧૪૪	૮૪	૬૦	૨૬	૪ ૫૧
સધવા સ્ત્રી,	વિધવા,	કુંવારી,	દસા,	લણ્ણેલ પુરુષ,	અલણુ,
૩૦	૧૨	૧૮	૧૪૪	૭૭	૨

ભણેલ સ્વી, અલણુ સ્વી, બાળક, પડિકમણા, સામાયક,  
૧૨ ૨૭ ૨૬, ૬ ૨૧

વેપાર, નોકરી.  
૫૮ ૧૭

### મોદા કોટડા બીજાખા કાંથડવાળા તાલુકો.

આ ગામમાં ઉપાશ્રય છે. લીંબડીનું ક્ષેત્ર છે. અગ્રેસર રૂપાણી  
કુટુંબ છે. જૈન સ્થાનકવાસીની વસ્તિ:—

ધર, માણુસ, પુરુષ, સ્વી, પરણેલા પુરુષ, વિધુર, કુંવારા, સધવા.,  
૨૦ ૧૦૯ ૭૧ ૩૮ ૨૬ ૬ ૩૬ ૧૭

વિધવા, કુંવારી, દસ્તા, ભણેલ પુરુષ, ભણેલ સ્વી, બાળક,  
૧૧ ૧૦ ૧૦૯ ૫૮ ૩ ૧૬

વેપાર, નોકરી, સામાયક.  
૫૮ ૨ ૫૦

### નાના દેવલીયા.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વસ્તિ:—

ધર, માણુસ, પુરુષ, સ્વી, પરણેલ પુરુષ, કુંવારા; સધવા,  
૨ ૧૩ ૬ ૪ ૪ ૫ ૪

વિસા, ભણેલ પુરુષ, ભણેલ સ્વી, બાળક, વેપાર, નોકર.  
૧૩ ૬ ૧ ૩ ૩

### વાંસાવડ.

ગામ ૪ આખા તાલુકાની કુલ વસ્તિ.

આ તાલુકો નાગર થહુસ્થનો છે. આ ગામ ગોંડલ સંપ્રદાયમાં છે.  
ઉપાશ્રય નથી અગ્રેસર કદોઈ શેડ છે.  
અહિ જૈન સ્થાનકવાસીની વસ્તિ:—

ધર. માણુસ. પુરુષ. સ્વી. પરણેલ પુરુષ. વિધુર. કુંવારા.  
૧૧ ૭૫ ૩૭ ૩૮ ૨૦ ૫ ૧૨

સધવા.	વિધવા.	કુંવારી.	દસા.	લાવસાર	ભણેલ પુરુષ
૨૦	૪	૧૪	૨૮	૪૬	૩૦
ભણેલ સ્ત્રી.	અભણુ સ્ત્રી.	ખાળક.	વેપાર.	નોકરી.	પડિકમણું
૧૦	૨૦	૧૫	૨૧	૧	૬

સામાયક.

૧૬

## અગસ્તા.

આ તાલુકો વાળા હરથારેનો છે. જેતપુરના ભાચો વાળા કાઢી રાજકર્તા છે. તાલુકો કાઢ રીવાજ મુજબ ભાઈએ ભાગ પડવાથી ઠુંચાઈ ગયેલ છે. આ ગામના હરથારો પેડી હરથારકી વાજસુરવાળાં કે જેઓ પોરણંહરના એડમીનિસ્ટ્રેટર હુતા. તેમજ હરથારકી રામવાળા તથા તેમના નાના ભાઈ વીરા વાળા કે જેઓ ચુડા, લાડોના એડવાઇઝર અને પોરણંહર-બુનાગઠના મૂલ્ય દિવાન હરજન્નતું માન મેળવવા ઉપરાંત ગવર્નર્ન્ટ નોકરીમાં ગોધરા અને પાલણપુર ડેઝ્યુટી આ. પોલીટીકલ એજન્ટ હુતા. ગ્રીઝ ભાગનાર હરથારકી નાના રામ વાળા વગેરે રાજકર્તા છે. હરથારો સંસ્કારી અને કૃગવાયેલ છે. આ ગામ ગોંડળ સંપ્રદાયનું છે. ગામમાં ઊપાશ્રય બે છે. લાયફ્ટરી અને જૈનશાળા વગેરે ધાર્મિક સંસ્થાઓ છે. આગોવાન સ્થાનકવારીની વૃસ્તિ:—

ઘર.	માણુસ.	પુરુષ.	સ્ત્રી.	વિધુર.	કુંવારા.	સધવા.	
૬૭	૪૬૮	૨૬૬	૨૦૨	૨૦૧	૧૦	૧૫૫	૧૦૧

વિધવા.	કુંવારી.	દસા શ્રીમાણી.	ભણેલ પુરુષ.	અભણુ પુરુષ.
૨૮	૭૨	૪૬૮	૧૭૨	૩૦

ભણેલ સ્ત્રી.	અભણુ સ્ત્રી.	ખાળક.	અંગેજ ભણેલ પુરુષ.	વેપાર.
૨૫	૧૪૬	૬૫	૧૩	૧૪૧

નોકરી.	વડીલ.	ટાકટર.	પડિકમણું.	ખાકી.	બધા સામાયક.
૨૮	૧	૧	૨૫		

## અગસરા તાબે.

### હાલાપુર.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વસ્તિ:—

ધર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ,	વિધુર,	કુંવારા,
૨	૧૦	૫	૫	૧	૧	૩

સધવા,	વિધવા,	કુંવારી,	હસા,	ભણેલ પુરુષ,	ભણેલ સ્ત્રી,
૧	૨	૨	૧૦	૫	૩

બાળક.	અંગેજ ભણેલ પુરુષ,	વેપાર.	પડિકમણું.
૨	૧	૩	૨

### ગાયકવાડી પ્રદેશ—અમરેલી કીદલો.

#### ૧ અમરેલી.

ગામ ૩૦૨.

આ મુહાલ તલાપદ જૈન સ્થાનકવાસી ગોંડલ સંપ્રદાયમાં છે. જૈન ઉપાશ્રય બે છે લાઈથ્રેરી અને જૈનશાળા વગેરે ધાર્મિક સંસ્થાઓ છે. આ ગામમાં અધેવાર પત્રકો મેઝલી અનેક ઉદ્ઘરાણી પત્રો લખવા છતાં પત્રકો ન મેઝલવોં ઉપરાંત વર્કીલ ડા. એ. એલ. એલ. ડી. સાહેબ સામા ગુસ્સે થઈ પત્ર લખેલ તે તેમનેજ છાજે.

#### ૨ ધારી, (માણેકલાલની.)

આ ગામ ગોંડલ સંપ્રદાયનું છે. જૈન ઉપાશ્રય છે. પત્રકો ન મળવા માટે નિર્ધાર્ય.

#### ૩ કોડીનાર.

આ ગામ ગોંડલ સંપ્રદાયમાં છે. જૈન ઉપાશ્રય છે. પત્રકો ન મળવા માટે નિર્ધાર્ય.

## ૪ દામનગર.

આ શહેર વડોદરા તાણાંનું અમરેલી કૃષ્ણા નીચેનું છે. અહિં એટાદ અને ગોંડળ બન્નેના ચાતુર્મસ થાય છે. ખાસ કરીને એટાદનું ક્ષેત્ર ગણ્યાય છે. ઉપાશ્રય અને જૈનશાળાઓ છે. અગ્રેસર તરીકે કામદાર ડેશવલાલલાઈ ગણ્યાય છે. અહિં જૈન સ્થાનકુલાંની વસ્તિ:-

ધર	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ પુરુષ,
૬૦	૫૦૬	૨૭૬	૨૩૩	૬૧
વિધુર,	કુંવારા,	સધવા,	વિધવા,	કુંવારી,
૩૨	૧૫૩	૮૧	૪૦	૧૦૨
દસા,	ભણેલ પુરુષ,	ભણેલ સ્ત્રી,	ખાળક,	
૫૦૬	૨૩૪	૮૩		૮૭
અંગ્રેજી,	વેપાર,	નોકરી.	ધાર્મિક અલ્યાસ લખેલ નથી.	
૮	૧૨૭	૨૪		

## ૧ છલાડીયા.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકુલાંની વસ્તિ:-

ધર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ પુરુષ,	વિધુર,
૨	૧૨	૭	૫	૧	૨
કુંવારા,	સધવા,	વિધવા,	દસા,	ભણેલ પુરુષ,	વેપાર.
૪	૧	૪	૧૨	૭	૭

## ૨ ભીગરાડી.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકુલાંની વસ્તિ:-

ધર	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ પુરુષ,	કુંવારા,
૧	૮	૩	૫	૧	૨

सधवा,	विधवा,	कुंवारी,	दसा,	लण्ठेल पुरुष,
१	३	१	८	२
लण्ठेल स्त्री,	भाण्ड,	वेपार.		

## ३ आसोटर.

आ गाममां उपाश्रय नथी. जैन स्थानकवासीनी वस्त्रः—

घर,	माण्डुस,	पुरुष,	स्त्री,	परण्ठेल पुरुष,	विधुर	कुंवारा,
६	१६	११	५	३	१	७

सधवा,	विधवा,	कुंवारी,	दसा,	लण्ठेल पुरुष,	लण्ठेल स्त्री,
३	२	४	१६	८	२

आलड, वेपार.  
३ ६

## ४ ईगोराला.

आ गाममां कैन उपाश्रय नथी. जैन स्थानकवासीनी वस्ति:—

घर,	माण्डुस,	पुरुष,	स्त्री.	परण्ठेल पुरुष,	विधुर,	कुंवारा,
३	१६	११	५	२	२	५

सधवा,	विधवा,	कुंवारी,	दसा,	लण्ठेल पुरुष,	वेपार.
२	१	२	१६	११	१

## ५ भालवाव.

आ गाममां उपाश्रय ० नथी. जैन स्थानकवासीनी वस्ति:—

घर	माण्डुसे	पुरुष	स्त्री	परण्ठेल पुरुष	विधुर
१	४ <sup>०</sup>	२	२	१	१
सधवा,		कुंवारी,	दसा,	लण्ठेल पुरुष,	

१ १ ४

२

ભણેલ સ્ત્રી.      બાળક,      વેપાર,      નોકરી.  
 ૧                  ૧                  ૧                  ૧

## ૬ ધામેલ.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વસ્તિ:—  
 ધર,      માણુસ,      પુરુષ,      સ્ત્રી,      પરણેલ પુરુષ,  
 ૨              ૧૧              ૮              ૩              ૨  
 કુંવારા,      સધવા,      વિધવા,      દસા,      ભણેલ પુરુષ, બાળક.  
 ૬              ૨              ૧              ૧૧              ૬              ૨  
 વેપાર,      નોકરી.  
 ૪              ૨

## ૭ રાવતડ.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વસ્તિ:—  
 ધર,      માણુસ,      પુરુષ,      સ્ત્રી,      પરણેલ પુરુષ,      વિધુર,      કુંવારા,  
 ૮              ૧૦              ૬              ૧              ૧              ૧              ૭  
 સધવા,      દસા,      ભણેલ પુરુષ,      વેપાર,      નોકરી.  
 ૧              ૧૦              ૬              ૫              ૪

## ૮ પાઠરસિંગ.

આ ગામમાં ઉપાશ્રય છે. જૈન સ્થાનકવાસીની વસ્તિ:—  
 ધર,      માણુસ,      પુરુષ,      સ્ત્રી,      પરણેલ પુરુષ,      કુંવારા,      સધવા,  
 ૬              ૪૩              ૨૬              ૧૭              ૬              ૨૦              ૬  
 વિધવા,      કુંવારી,      દસા,      ભણેલ પુરુષ,      બાળક,      વેપાર,  
 ૨              ૬              ૪૩              ૨૩              ૭              ૧૨  
 નોકરી.  
 ૪

૬૧

### ૯ એકલેરા.

આ ગામમાં ઉપાશ્રય છે. જૈન સ્થાનકવાસીની વસ્તિ:—

ઘર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણોલ પુરુષ,	વિધુર,	કુંવારા,
૮	૪૬	૨૬	૧૭	૭	૨	૨૦
સધવા,	વિધવા,	કુંવારી,	હસા,	ભણોલ પુરુષ,	ભણોલ. સ્ત્રી,	
૭	૧	૬	૪૬	૨૭		૨
ખાળક,	વેપાર,	નોકરી.				
૫	૧૮	૭				

### ૧૦ ગુંદરણુ.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વસ્તિ:—

ઘર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણોલ પુરુષ,	વિધુર,	કુંવારા,
૪	૨૧	૧૩	૮	૪	૨	૭
સધવા,	વિધવા,	કુંવારી,	હસા,	ભણોલ પુરુષ,		ખાળક.
૪	૩	૧	૨૧	૧૦		૩
વેપાર.						
૭						

### ૧૧ ભુરખીયા.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વસ્તિ:—

ઘર	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણોલ પુરુષ,
૩	૨૬	૧૬	૧૩	૪
વિધુર,	કુંવારા,	સધવા,	વિધવા,	કુંવારી,
૧	૧૧	૪	૫	૪
હસા,	ભણોલ પુરુષ,	ભણોલ સ્ત્રી,	ખાળક,	વેપાર.
૨૬	૬	૪	૭	૬

## ૧૨ પીપળવા.

આ ગામમાં ઉપાશ્રય છે. જૈન સ્થાનકવાસીની વસ્તિ:—

ઘર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ પુરુષ,	વિધુર,
૭	૪૭	૩૮	૧૮	૭	૧
કુંવારા,	સધવા,	(વધવા,	કુંવારી,	હસા,	અણેલ પુરુષ,
૨૧	૭	૪	૭	૦	૪૭
અણેલ સ્ત્રી,	ખાળક,	વેપાર.			૨૭
૭	૫	૧૬			

## ૧૩ દેરડી.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વાસ્તિ:—

ઘર.	માણુસ.	પુરુષ.	સ્ત્રી.	પરણેલ પુરુષ.	કુંવારા.	સધવા.
૪	૧૬	૮	૮	૨	૬	૨
વિધવા.	કુંવારી.		હસા	અણેલ પુરુષ.		ખાળક.
૧	૫		૧૬	૭		૩
વેપાર.	નેટરી.					
૬	૧					

## ૧૪ રસનાલ.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વસ્તિ:—

ઘર,	માણસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ પુરુષ,	વિધુર,	કુંવારા,
૩	૨૭	૧૬	૧૧	૮	૧	૭
સધવા.	વિધવા.	કુંવારી.		હસા.		અણેલ પુરુષ
૮	૧	૨		૨૭		૧૬
અણેલ સ્ત્રી,	વેપાર.					
૭	૧૫					

### ૧૫ એંથરડી.

આ ગામમાં ઉપાશ્રય છે. જૈન સ્થાનકવાસીની વર્તતઃ—

ઘર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ પુરુષ,	કુંવારા,	સંધવા,
૭	૨૬	૧૫	૧૪	૪	૧૧	૪૦
વિધવા,	કુંવારી,	દસા,		ભણેલ પુરુષ,		ખાળક,
૫	૫	૨૬		૧૪		૨
વેપાર,	નોકરી,					
૬	૩					

### ૧૬ વીકદીયા.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વस્તિઃ—

ઘર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ પુરુષ,
૫	૨૩	૧૩	૧૦	૪
કુંવારા,	સંધવા,	વિધવા,	કુંવારી,	દસા
૮	૪	૪	૨	૨૩
ખાળક,	વેપાર,	નોકર.		ભણેલ પુરુષ,
૧	૮	૪		૧૨

### ૧૭ પ્રુણણીયા.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વસ્તિઃ—

ઘર.	માણુસ.	પુરુષ.	સ્ત્રી.	વિધુર.	કુંવારા	વિધવા.
૬	૧૪	૧૦	૪	૩	૪	૨
કુંવારી.	દસા:	ભણેલ પુરુષ.	ભણેલ સ્ત્રી.	વેપાર.	નોકરી.	
૨	૧૪	૧૦	૧	૪	૧	

## ૧૮ કાંચરડી.

આ ગામમાં ઉપાય્ય નથી. જૈન સ્થાનકવાસીની વર્સિતા:—

ધર.	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણુલ પુરુષ,	કુંવારા,
૬	૪૧	૨૪	૧૭	૧૧	૧૩
સધવા.	વિધવા	કુંવારી	દસા.	ભણુલ પુરુષ	ભણુલ સ્ત્રી,
૧૧	૨	૪	૪૧	૧૮	૩
ખાળક	વેપાર,	નોકરી.			
૬	૧૨	૧			

## ૧૯ જસાપર.

આ ગામમાં ઉપાય્ય નથી. જૈન સ્થાનકવાસીની વર્સિતા:—

ધર.	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણુલ પુરુષ.	વિદુર.
૩	૧૨	૪	૮	૩	૧
સધવા,	વિધવા,	કુંવારા.	દસા.	ભણુલ પુરુષ.	વેપાર.
૩	૪	૧	૧૨	૪	૪

## એઓખામંડલ.

## કારકાંખંડર.

આ ગામ ગાયકવાડ સરકારનું અમરેલી તાજાનો મહુાલ છે. સોરઠ ઇલાકાના પશ્ચિમ દિસાના છેડે દરીયાના કાંઠે આવેલ છે. આ તરફ જૈનોની વર્સિત નથી. જુઝ નોકરીયાત કાદ્ય કોઈક હોય તો પ્રભુ જણો.

“ આખા સૌરાષ્ટ્ર પ્રાંતમાં જૈન સ્થાનકવાસી ૧૯૧૭૪ માણુસની વર્સિતી છે. ”



## હાલાર પ્રાંત.

ગામ ૧૩૮૦ વસ્તિ

૮૦૦૦૦ આડ લાખ માણુસની.

### જમનગર.

ગામ ૭૦૦ અને આખા રાજ્યની કુલ વસ્તિ. ૩૩૬૧૧૬ માણુસની.

આ સંસ્થાન રંગમતીના કાંઠે આવેલ આ પ્રાંતનું પહેલા વર્ગનું અને જુનાગઢથી થીજા નમ્મારનું રાજ્ય ગણ્ય છે. રાજકર્તા કચ્છ લૂઝથી ઉત્તરેલ જડેજા હાલાજીના વંશના મહારાજા જમસાહેલ સર રાણુષીતસિંહજી જી. સી. આધ્ય. ઈ. રાજ કરે છે. તેઓ થીલકુલ પરણ્યા નથી છતાં એ દિશામાં તેમની કીતિ ગવાય છે. આ ગામમાં પુરુષ અને સ્ત્રી એમ જન્મેના જુદા જુદા ઉપાશ્રય અને જૈનશાળા છે. અહિ લીણહી અને ગોંડલ એમ જન્મે સંપ્રાયના વારાક્રસ્તી ચાતુર્માસ થતાં પરંતુ લીણહી સંપ્રાયના કોઈ નહિ જવાથી ગોંડલ સંપ્રાયના ચાતુર્માસ થાય છે. ખાસ ગોંડલનું ક્ષેત્ર કંડેવાયછે. સંઘમાં શા. પુનાતર, વારીયા અને કાશિદાસ કુપુરચંદ એમ ચાર કુટુંબ આગેવાન ગણ્ય છે અને હાલમાં વકીલ જોરધનહાસ મોરારજી સંઘમાં, ગામમાં અને રાજ્યમાં પ્રતિષ્ઠિત માણુસ ગણ્યાયછે. મહારાજા જમસાહેલ પાસે પણ તેમનું સારુ માન અને અવાજ છે. શાસ્ત્રીય વિષયમાં જમનગર આખા કાઢિયાવાડ ઈલાકામાં જાણુપણા માટે સુપ્રસિદ્ધ છે. પૈકી વારીયા તારાચંહભાઈ, શેડ સેમચંહભાઈ વકીલ અને વકીલ લીલાધરભાઈ મૂલ્ય ગણ્ય છે. સંવરકરણી અને પુન્યકરણીમાં નગર આગળ પડતુંછે. આ ગામમાં જૈન રથનકવાસીની વસ્તિનો સંખ્યાંક પૈકી

ધર	માણુસ	સ્ત્રી	પુરુષ	સધવા	વિધવા	પરણેલ પુરુષ
૪૬૦	૧૮૮૫	૮૨૧	૧૦૬૪	૫૭૧	૮૫૦	૫૧૮
વિધુર	કુંવારા	બાળક	વેપાર	નેાકરી	ભણેલ	પુરુષ
૭૪	૪૪૨	૩૭૫	૨૬૫	૧૨૧	૬૬૬	
ભણેલ સ્ત્રી	અંગેણું	ભણેલ પુરુષ		ડીથી	વકીલ	પડિકમણ્ણા
૪૫૩		૨૨		૩	૭	૧૮૧

સામાયક	વિસાના ધર	હસાના ધર	પોર્વાડના ધર	પારેખ
૮૪૩	૨૦૭	૧૬૧	૬	
ઓસવાળના ધર	અત્રીના	વિસા	દંસા	પારેખ ઓસવાળ
૧૪	૩૬	૭૩૮	૭૪૨	૧૬૧
માણુસ પોર્વાડના	અત્રી.			
૪૦	૧૭૧			

### જમનગરના મહાલો.

#### ૧ જમખંભાલીયા.

આ ગામ દ્વારા રેલવેનાં દેશનાં ભાઈયાની મોટી વસ્તિ ધરાવતું આખા જમનગર રાજ્યમાં પૈસાપાત્ર શહેર ગણ્ય છે. ભાઈયા કોમભાં ૪૦ થી ૫૦ લાખના ધણી આશાભીયો ગણ્ય છે. આવા વૈભવશાળી ગામમાં જેનોની વસ્તિ તહન કુંકી અને નિર્ધન રિથતિવાળી છે. આ ગામ ગોંડલ સંપ્રદાય નીચે છે. આ ગામમાં જેન સ્થાનકવાસો સંધવી મુજબ જગાણી બુના વખતનાં નગર શેડ ગણ્યતા હતા ગામમાં ઉપાશ્રય છે. આ ગામમાં જેન સ્થાનકવાસીની વસ્તિ નીચે મુજબ છે.

ધર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પુરુષ પરણુલ,	વિધુર,	કુંવારા,
૩૨	૧૭૪	૮૩	૬૧	૩૮	૧	૪૪
સધવા,	વિધવા,	કુંવારી,	દસા,	ભણેલ પુરુષ,	ભણેલ સ્ત્રી,	
૩૮	૧૬	૩૪	૧૭૪	૭૦	'	૧૮
બાલક,	અંગ્રેજી ભણેલ પુરુષ,		વેપાર,	નોકરી,	પાડકમણું,	
૪૦		૨	૩૮	૫	૨૬	

#### સામાયક.

૩૭

#### ૨ જમલાલપુર.

આ ગામ ગોંડલ સંપ્રદાય નીચે છે. ગામમાં ઉપાશ્રય છે અહી જેન સ્થાનકવાસીની વસ્તિ નીચે મુજબ છે:-

ધર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ પુરુષ,	કુંવારા,	સંખ્ખા,
૧૬	૧૩૫	૭૬	૫૮	૦૩૦	૪૬.	૩૦

વિધવા,	કુંવારી,	વિસા,	ખત્રી,	ભણેલ પુરુષ,	ભણેલ સ્ત્રી,
૨	૨૭	૧૦૮	૨૭	૫૮	૧૬

આલક,	અંગેજ ભણેલ પુરુષ,	વેપાર,	વડીલ,	દાક્તર,	પાડિકમણું,
૩૭	૨૦	૭૨	૩	૧	૨૬

સામાયક.

૪૮

### ૩ જામનોધપુર.

આ ગામ ખરવાળા સંપ્રદાયનું છે. જૈન ઉપાશ્રય છે. જૈન સ્થાનકવાસીનો વસ્તિ—

ધર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ પુરુષ,	વિધુર પુરુષ,
૨૨	૧૦૨	૪૩	૫૮	૨૭	૩

કુંવારા પુરુષ,	સંખ્ખા સ્ત્રી,	વિધવા સ્ત્રી,	કુંવારી સ્ત્રી,
૧૭	૨૩	૧૧	૨૫

વિસા શ્રીમાણી,	ભણેલ પુરુષ,	ભણેલ સ્ત્રી	અભણું સ્ત્રી,	આળક,
૧૦૨	૩૪	૧૮	૨૭	૨૩

અંગેજ ભણેલ પુરુષ,	વેપાર,	નોકરા,	ડીઢી,	સામાયક પાડિકમણું,
૨	૨૬	૧૩	૧	૧૨

સામાયક.

૪૯

### ૪ જામકડોરણા.

આ ગામમાં લીખડીના ચાંદુમોસ થાય છે. જૈન ઉપાશ્રય છે. આગે-વાનમાં કામદાર વાળા ઉદ્રો ડેકી વાળા લખાય છે. પૂર્વે આ લોકોનું ભારે જેર હતું. તેઓ સુણવતનો જેતપુરના છે. કામદાર દેવકુરણું મેલજી એક ધર્યા પ્રતિષ્ઠિત પુરુષ થઈ ગયા. તેઓ ધનવંતરી વૈધ ગણુતા હતા. તેમને ભગવા તેમના ઘેર જામ સાહેબ સર વિલાજ આંદ્યા હતા.

હુલમાં આગેવાન તરીકે તેમના વંશના વકીલ ગોરખનંહાસ રાધવળ  
કામ કરે છે. આ ગામમાં જૈન સ્થાનકવાસીની વસ્તિ:-

ઘર,	માણસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ પુરુષ,	વિધુર,	કુંવારા,
૧૭	૧૩૦	૭૮	૫૨	૩૦	૩	૪૫

સંધવા,	વિધવા,	કુંવારી,	દસા,	ભણેલ પુરુષ,	લણેલ સ્ત્રી,
૩૦	૪	૧૮	૧૩૦	૫૮	૩૧

આતક,	ચેંગ્રજ ભણેલ પુરુષ,	વેપાર,	નોકરી,	વકીલ,	પાડકમણા,
૨૦		૫	૧૦	૨૬	૩

સામાયક.

૭૨

#### ૫ ભાણવડ.

આ ગામ ખરડા હુંગરની નજરીક હુલામણુ જેઠવાની રાજ્યધાની  
ધુમલી પાસે આવેલું છે. જોંડળ સંપ્રદાયના ચાતુર્માસ થાય છે. ગામમાં  
ઉપાશ્રય છે. અહિં જૈન સ્થાનકવાસીની વસ્તિ નીચે મુજબ છે:-

ઘર,	માણસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ પુરુષ,	વિધુર,
૧૬	૬૩	૪૭	૪૬	૨૩	૨

કુંવારા,	સંધવા,	વિધવા,	કુંવારી,	દસા,	ભણેલ પુરુષ,
૨૨	૨૩	૭	૧૬	૬૩	૩૬

ભણેલ સ્ત્રી,	ખાળક,	વેપાર,	નોકરી,	પાડકમણા,
૧૩	૧૭	૮૫	૭	૧૦

સામાયક.

૪૮

#### ૬ સલાયાણંદર.

આ દરીયા કીનારે આવેલું ગામ છે. આ ગામમાં જૈન સ્થાનક-  
વાસીની વસ્તિ નથી.

## ૭ બારાડી—કલ્યાણપુર મહાલ.

આ ગામ બારાડી નામના પરગણમાં આવેલ મહાલ છે. આ ગામ કાણું પાણી કહેવાય છે, જમ સાહુણ અમલદાર ઉપર નારાજ થાય ત્યારે કલ્યાણપુર મહાલમાં બહલી કરે ત્યારે તેને લોકો કાણું પાણું આપ્યું કહે છે. અહિં કૈનો નથી.

## ૮ બેડીયા ખાંડર.

આ ગામ દરીયાં નળુક બે ગાડ ઉપર આવેલું છે. ગોંડળ સંઘાડાનું ક્ષેત્ર ગણ્યાય છે. જૈન ઉપાશ્રય, પુરુષ અને સ્ત્રી એમ જન્મનેના છે. જૈન સ્થાનકવાસીની વસ્તિઃ—

ધર,	માણસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ પુરુષ,	વિધુર.
૬૦	૨૬૧	૧૪૪	૧૪૭	૬૩	૮
કુંવારા પુરુષ,	સધવા સ્ત્રી,	વધવા સ્ત્રી,	કુંવારી સ્ત્રી,		
૭૧	૬૩	૩૬	૪૫		
વિસા શ્રીમાણી,	દસા શ્રીમાણી,	લણેલ પુરુષ,	અભણુ પુરુષ;		
૭૩	૨૧૮	૧૧૬	૨		
લણેલ સ્ત્રી,	અભણુ સ્ત્રી,	બાળક,	અશ્રેણ લણેલ પુરુષ,		
૫૭	૬૬	૪૭	૮		
વેપાર,	નોકરી,	વકીલ,	પડિકમણા,	સામાયક.	
૮૮	૫૩	૨	૫૭	૬૨	

## ૯ બાલંભા.

આ ગામ ગોંડલ સંપ્રદાયનુરાજી છે. ગામમાં ઉપાશ્રય છે. જૈન સ્થાનકવાસીની વસ્તિઃ— પત્રકો મેછલ્યા પણ આવ્યા નહિં:

## ૧૦ આમરણ.

આ ગામ મેરુ ખવાસથી ઓળખાય છે. અહિં ગોંડળ સંપ્રદાયના ચાતુર્માસ થાય છે. જૈન ઉપાશ્રય જુના અને નવા એમ જન્મે વાસમાં છે. અશ્રગણ્ય માટલીયા છે. પત્રકો આવ્યાં નહિં.

## ૧૧ પડખરી.

આ ગામ ગોંડળ સંઘાડમુરાળી છે. ઉપાશ્રય છે, પત્રકોન આવ્યા.

## ૧૨ કાલાવડ શિતળાનુ

આ ગામ શિતળા માતાથી એળખાય છે. ગોંડળ સંઘાડાનું અનુયાયી છે. ગામમાં ઉપાશ્રયો છે. આગેવાન પ્રેરણ કહેવાય છે. આહું જેણ સ્થાનકુનાસીની વસ્તિ:-

ધર	માણસ,	પુરુષ,	બી,	પરણેલ પુરુષ,	વિધુર	કુંવારા,
૮૮	૬૫૮	૩૩૮	૩૨૧	૧૪૨	૨૩	૧૭૩
સધવા,	વિધવા,	કુંવારી,	વિસા,	દસા,	ખત્રી,	સોરઠીયા,
૧૪૨	૫૩	૧૨૬	૧૪૮	૩૪૮	૧૭૧	૩૩
ભણેલ પુરુષ,	અભણુ પુરુષ,	ભણેલ બી,	અભણુ બી,	ખાળક		
૨૬૭	૬		૧૨૦		૧૩૧	૧૪
અંગેજુ ભણેલ પુરુષ,		ડોબ્રી		વેપાર,		નાકરી.
૬૫		૧૦		૨૬૨		૪૬
પાંડિકમણ્ણા,		સામાયકુ.				
૧૩		૨૩૭				

## ૧૩ આટકોટ.

આ ગામ ગોંડળ સંમુહાયનું છે. આગેવાન શેઠ છે ઉપાશ્રય છે, પત્રકો પાછા કોણુ મેઝલેજ !

## ૧૪ ભાડલાં.

આ ગામમાં દરેક ચોમાસા કરે છે સ્થાનક છે. અહૂં સ્થાનકવાચી કરતા દેરાવાસીની સંખ્યા મેટી છે છતાં એકત્ર છે. દેરાવાસીના ચોમાસા અતા નથી, સ્થાનકવાસીનાજ થાય છે, સ્થાનકવાસીના ધર બજુજ છે, હેરાવાસી ઉપરજ અધી કમાન છે, આવું ગામ હજુ કોઈ પણ જેયું નથી. આગે-

વાનો શોઠ ઉજમશરી મુલળ, ૩॥ ડાકેરસી રતનસી અને સંઘવી  
રૂપચંદ રામળ એ ત્રણે હેરાવાની છે, જૈન સ્થાનકવાસીની વસ્તિ:—

ધર,	માણુસ,	પુરુષ;	સ્ત્રી,	પરણુલ,	વિધુર,	કુંવારા,
૧૨	૬૫	૩૫	૩૦	૧૦	૧	૨૪

સંઘવા,	વિધવા,	કુંવારી,	યધા દસા,	ભણુલ પુરુષ,
૧૦	૭	૧૩	૬૫	૩૧.

ભણુલ સ્ત્રી,	અભણુ સ્ત્રી,	ખાળક,	વેપાર,	નેકરી,
૮	૧૭	૬	૨૬	૬

પડિકમણું,	સામાયક.
૧	૩૫

### આટકોટ ભાડલા તાણે.

#### ૧ ભાડારીયા.

આ ગામમાં ઉપાશ્રય નથી જૈન સ્થાનકવાની વસ્તિ:—

ધર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણુલ પુરુષ,	વિધુર,	કુંવારા,
૬	૪૩	૨૦	૨૩	૬	૨	૧૨

સંઘવા,	વિધવા,	કુંવારી,	દસા,	ભણુલ પુરુષ,	અભણુપુરુષ,
૬	૧૧	૬	૪૩	૧૮	૧

ભણુલસ્ત્રી,	ખાળક,	અંગ્રેજ,	વેપાર,	નેકરી,	પડિકમણુા,	સામાયક.
૧૦	૪	૧	૧૨	૮	૬	૨૬

### નમકંડોરણા મહાત

#### ૧ કેરાળી.

આ ગામમાં ઉપાશ્રય નથી જૈન સ્થાનકવાની વસ્તિ:—

ધર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણુલ પુરુષ,	કુંવારા,	કુંવારી,
૧	૫	૨	૩	૧	૧	૨

દસા,	ભણુલ પુરુષ,	અભણુ પુરુષ,	ખાલક,	વેપાર,	સામાયક.
૫	૨	૨	૧	૨	૧

## ૨ રાયડી.

આ ગામમાં ઉપાશ્રય નથી. લીંબડીનુરાગી છે, જેન સ્થાનક્વા.  
સીની વસ્તિ:—

ઘર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ	પુરુષ,	વિધુર,	કુંવારા,
૪	૧૬	૮	૮	૩	૧	૪	

સધવા,	વિધવા,	કુંવારી,	દસા,	ભણેલ	પુરુષ,	અલણુ	સ્ત્રી,
૩	૨	૩	૧૬	૭		૬	

ખાલક,	વેપાર,	પઢિકમણું,	સામાયક.
૩	૮	૧	૧૫

## ૩ ખાટલી.

આ ગામમાં ઉપાશ્રય નથી. લીંબડીનુરાગી છે, જેન સ્થાનક્વા.  
સીની વસ્તિ:—

ઘર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ	પુરુષ,	કુંવારા,	સધવા,
૬	૩૩	૧૬	૧૪	૭		૧૨	૭

વિધવા	કુંવારી,	દસા,	ભણેલ	પુરુષ,	ભણેલ	સ્ત્રી,	અલણુ	સ્ત્રી
૨	૫	૩૩	૧૪	૧		૧૩		

ખાલક,	વેપાર,	સામાયક.
૫	૧૬	૨૮

## ૪ રાધેલ.

આ ગામમાં ઉપાશ્રય નથી. લીંબડીનુરાગી છે, જેન સ્થાનક્વા.  
વાસીની વસ્તિ:—

ઘર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ	પુરુષ,	સધવા	સ્ત્રી,	વિધવા
૧	૧૦	૨	૮	૨		૨	૨	૨

કુંવારી,	દસા,	ભણેલ,	પુરુષ,	અલણુ	સ્ત્રી	ખાલક,	વેપાર,
૪	૧૦	૨		૬		૨૦	૨

સામાયક.

૨

### ૫ સનાઈ

આ ગામમાં ઉપાશ્રય નથી. લીખડીનું રાગી છે. જૈન સ્થાનકુવાસીની વસ્તિ:—

ધર	માણુસ	પુરુષ,	સ્ત્રી,	પરણેલ	પુરુષ,
૨	૧૨	૭	૫	૩	
કુંવારા,	સધવા,	કુંવારી,	દસા.	ભણેલ	પુરુષ,
૪	૩	૨	૧૨	૭	૭
પડિકમણું,	સામાયક.				
૧	૮				

### ૬ જામભેવાસા.

આ ગામમાં જૈન ઉપાશ્રય મુંદર છે. લીખડીનું રાગી છે આ-ગેવાન શા. નથુ નાનળુ છે. અહિં જૈન સ્થાનકુવાસીની વસ્તિ:—

ધર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ	પુરુષ,	વિધુર,	કુંવારા,
૧૦	૪૦	૨૦	૨૦	૮	૩	૬	
સધવા,	વિધવા	કુંવારી,	વિસા શ્રીમાઈ,	દસા શ્રીમાઈ,			
૮	૫	૭	૩	૩	૩૭		
ભણેલ	પુરુષ,	અભણુ	પુરુષ	ભણેલ	સ્ત્રી,	અભણુ	સ્ત્રી,
૧૬		૧		૬	૧૧		૩
વેપાર,	નોકરી,	પડિકમણું	સામાયક.				
૧૬	૧	૬	૧૩				

### જામતંગર તાઢે.

#### ખીલોસ.

આ ગામમાં ઉપાશ્રય છે. જૈન સ્થાનકુવાસીની વસ્તિ:—

ધર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી.	પરણેલ	પુરુષ,	વિધુર,	કુંવારા,
૨૩	૧૬૪	૮૧	૮૩	૩૮	૪	૩૬	

સધવા,	વિધવા,	કંવારી,	વિસા,	લણેલ પુરુષ,	લણેલ સ્ત્રી,
૩૮	૭	૩૬	૧૬૪	૬૩	૩૧
બાળક,	અગેણ લણેલ,	વેપાર,	નોકરી;	પડિકમણું	સામાયક.

૪૩	૫	૪૨	૪	૮	૪૪
----	---	----	---	---	----

### મોરણી.

ગામ

અને આપા રાજ્યની વસ્તિ કુલ ૮૭૩૫૩

આ સંસ્થાન, મચ્છુ નદીના કાંડા ઉપર આવેલું હોવાથી “ મચ્છુ કાંડા ” ના નામથી એળખાય છે સુધ્ય રાજ્યધાનીનું શહેર છે. અહિના રાજ્યકર્તા જહુવંશી જાડેજા કૃષ્ણ કુર્જથી ઉત્તેલા છે. હુલ નામદાર મહારાજાસાહેબ લાખધીરજ સાહેબ રાજ્ય કરેછે. આ ગામમાં લીંબડી તથા ગોંડલ સંપ્રદાયના સંધારી ઉપાશ્રયના વારાફરતી ચતુરમાં થાય છે. ગામમાં ઉપાશ્રય હે તેમાં એક પુરુષ માટે અને બીજે સ્ત્રીઓ માટે. વ્યાખ્યાન એકજ સ્થળે વંચાય છે. સંઘની વ્યવસ્થા ધણીજ સારી છે. અને જેનો દરેક કાર્યમાં આગેવાની ભર્યાં લાગ લેનારા છે. લાઇફ્ટેરી અને કન્જેનશાળા આહી મુંદર ધાર્મિક સંસ્થાઓ છે. લાઇફ્ટેરી મેટા સારા પાયા ઉપર છે. આવી સંસ્થાઓ જુઝ જેવામાં આવે છે. કાહીયાવાડમાં મોરણીના શાંધ વખણ્યાય છે. આજે આગેવાની શોડ કુટુંબની છે. તે શોડ કુટુંબના સુણ પુરુષ શોડ હામોદર ગણેશને મોરણી રાજ્યના સુણ પુરુષ ડાકોર શ્રી કંંયાજ તરફથી “ શોડ ” પહોંચ અને મશાલ શ. ૧૭૭૮ ની સાલમાં આપેલ છે તેઓશ્રીએ ખેણા પ્રમાણુમાં ગરાસ મેળોયો છે. અને તેજ સાલમાં “ રાજ્યગાંધી ” ની સ્થાપના કરી રાજ્ય નીયમ પ્રમાણે વડીલ પુત્ર ગાહી વારસ ગણ્યાય છે. ને નીયમ આજ હિન પર્યંત ચાલ્યો આવે છે. જેનો તેમજ શ્રી હશા માળી વણીક યાતો આપી વણીક કોમમાં મોરણી શોડ સીવાય “ ગાહીપતી નગરશોડ ” ની પહોંચ બીજે કયાંય નથી. તે સૌને અલીમાન રાખના જેવું છે. હાલમાં વીકુમચંદ અમૃતલાલ “ નગર શોડ ” અને સંધ પતી છે. બીજા એક મહુદ કાર્યની નેંધ કેવી રહી જય છે તે એ ને “ શ્રી વૈતાંગર સ્થાનકર્માસી જેન કોનકરસ જેવી સમાજેપથગા સંસ્થાનો જન્મ અહિજ થયો હતો. અહિના હાનવીર

શેડ અંખાવીહારસ ડોસાણી કોન્કરનસના પીતા ગણુય છે. તેઓશ્રીએ હસ્ત લેખીત ઉર સુત્રા તૃપાશ્રયન અર્થાં કર્યા છે, તેઓશ્રીએ હૈ. ૧૦૦૦૦) ની શ્રી થા કને દર શાલ સંચસરના. પારણેગંચ કરવા માટે તથા દૂ.. ચાલાશ હજર “શ્રી જન સ્થાનકવાસી બેનીંગ” જેવો સંસ્થાએ સ્થાપના નેમજ કબુનારને ચણુ અને કુતરાના રોટલા માટે કાયમ ઇંડ આપી દેશ સેવા ઉદાર હીંદે બળવી છે. આડંના મહારાજાની નોંધ લેતાં આનંદ થાય છે કે મહારાજા સાહેબ લાખધીરજ પેતે ઘણુ ગ્રન વત્સલ, ગ્રન કુલ્યાણ પણયણુ અને ગ્રન પ્રેય છે. તેઓશ્રીની લાયકાતની કંઈકમાં ગવમેન્ટે હમણાજ “મહારાજ” ને હિંકાણ વંશ પરંપરા માટે, આપીલ છે. જીવદ્યા માટે મેરાણી મશહૂર છે. મેરાણી અને જમનગર એ એ શહેર કાર્ડિયાવાડમાં ઉદાર ગણુય છે. અહિનો સંધ હીપતો અને સંધીલો છે. આડં જૈન સ્થાનકવાસીની વસ્તિ:—

ધર,	ગાણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ પુરુષ,	વિધુર,	કુંવારા,
૪૮૨	૨૫૭૪	૧૨૩૨	૧૩૪૨	૫૩૦	૮૦	૬૨૨

સુધ્વા,	વિધ્વા,	કુંવારી,	દસા,	ખત્રી,	સુતાર,	ભણેલ પુરુષ,
૫૩૦	૨૩૫	૫૭૭	૨૫૬૩	૧૦	૧	૧૦૬૦

અભણુ પુરુષ,	ભણેલ સ્ત્રી,	અભણુ સ્ત્રી,	બાલક,	અંગ્રેજ ભણેલ પુરુષ,
૪	૬૭૩	૩૨૮	૪૭૬	૩૭૧

ડીશી	વેંપાર,	નોકરી,	વક્તી	ફાક્તર,	પણિકમ,
૬	૩૦૫	૩૩૯	૬	૬	૪૨૨

સામાયક,  
૧૦/૭

### મેરાણીના મહારો.

#### ૧ વન્વાણીયા મહાર.

આ ગણુ હરીય, ડીનારે આવેલું અંદરથી અંગામાય છે, અંડં ગોંડલ સંઘાળીના ચાતુર્સીસ થાય છે. જૈન તૃપાશ્રય છે. આ સ્થળ રાયચંહ કલિની જન્મભૂમનુ છે તેમનો જન્મ અહિં થયો હતો. જૈન-સ્થાનકવાસીના વસ્તિ:—

૧૦૬

ઘર	માણુસ	પુરુષ	સ્ત્રી	પરણેલ પુરુષ	વિધુર,
૩૦	૧૫૬	૬૮	૮૮	૨૪	૬
કુંવારા,	સંધવા,	વિધવા,	કુંવારી,	હસા,	લણેલ પુરુષ,
૩૮	૨૪	૧૪	૪૦	૧૫૬	૭૩
અણેલ સ્ત્રી.	બાળક,	અરણી	વેપાર,	પટિકમણું	સામાયક.
૨૩	૨૮	૧	૩૧	૦ ૧૫	૭૧

### ૨ ટંકારા મહાલ.


આ ગામ ગોંડળ સંપ્રદાય સંધાર્ણી ઉપાશ્રયનું છે. ઉપાશ્રય છે, આ સ્થળ આર્ય સમાજ સ્થાપક માહર્ષિ હયાનાંહ સરસ્વતીની જન્મભૂમિથી પ્રસિદ્ધ છે. આ ગામમાં કૈન સ્થાનકવાસીની વસ્તિ:-

ઘર.	માણુસ,	પુરુષ.	સ્ત્રી,	પરણેલ પુરુષ,	વિધુર,
૪૩	૨૦૦	૧૦૪	૮૬	૩૧	૬
કુંવારા,	સંધવા,	વિધવા,	કુંવારી,	હસા,	લણેલ પુરુષ,
૬૦	૩૧	૨૭	૩૮	૨૦૦	૬૪
અણેલ સ્ત્રી,	બાળક,	વેપાર.	નેાકરી,	પટિકમણું,	સામાયક.
૪૦	૩૬	૮૫	૧૬	૫૦	૬૪

### ૩ કેતપુર મહાલ.

આ ગામમાં ઉપાશ્રય છે. કૈન સ્થાનકવાસીની વસ્તિ:-

ઘર	માણુસ	પુરુષ	સ્ત્રી	સંધવા	વિધવા	કુંવારી	પરણેલ પુરુષ
૬	૫૮	૨૭	૨૭	૭	૫	૪	૭
વિધુર	કુંવારા	બાળક	હસા	વેપાર	નેાકરી	લણેલ પુરુષ	
૫	૭	.૧૦	૫૪	૧૬	૨	૦	૨૫
અણેલ સ્ત્રી	અંગ્રેજ અણેલ	અણેલ પુરુષ		સામાયક	પટિકમણું		
૪		૧		૬		૨	



### ચેલા—જમનગર તાબે.

આ ગામમાં જૈત ઉપાશ્રય અને જૈનથાળા વળેરે છે. નગરની આસપાસ ઓસવાલ મહાજનના લગભગ આવન ગામ છે. મોટો ભાગ દેરા વાગીનો છે. તે બધા એકુ છે તે વૈકીનું આ ગામ પણ વિસા ઓસવાલનું છે. ધંધો જેતીવાડોનો છે. ધણા આસ્તિક છે, જૈન સ્થાનકુંવાસીની વસ્તિ:—

ધર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પણેલ પુરુષ,	કુંવાણ,	સધવા,
૩૭	૫૨૦	૨૬૮	૨૪૬	૧૩૪	૧૦	૧૧૬

વિધવા,	વિસા ઓસવાલ વણિક,	ભણેલ પુરુષ,	બાળક,
ધર	૫૨૦	૧૮૨	૮૨

વેપાન,	નોકરી,	મજૂર,	ખેતી,	સામાયક,	પદિકમણું.
૫૬	૨	૨	૬૬	૧૩૧	૬૧

### રાજકોટ.

ગામ વસ્ત આખા રાજ્યની કુલ ૪૬૬૬૦ માણુસની.

આ સંસ્થાન આજુ નહીના કિનારા ઉપર આવેલ ધીજા વર્ગનું રાજ છે. રાજકર્તા જાડેજ વંશના જમનગરથી ઉત્તરેલા ડાકોટર સાહેબ ચર લાખાઈરાજ કે. સી. આઈ. પી. રાજ કરે છે. આ શહેર જેનોની વીલાયત છે. કેળવાડી અને રાજ કારબારમાં કાડિયાવાડમાં અવલ હનજણે પરાવે છે, રાવ બહાદુર લીમજ મેચારજ, મોતીચંદ તુણસી, માણેકચંદ, તુણશરી અને ગોપાળજ ડાઢાલાઈ જેવા રાજકારી પુરુષો થન્હ જયાછે. તેઓ જૈનધરીના રાગથી રંગાયેલ, જીમાજ સેવા અને ધર્મ સેવા માં તેમનો મહેરો ઝણો હતો. ગોપાળજ ડાઢાલાઈ થાણુદ્વારે આખા જાલાવાડ પ્રદેશમાં જામો ગામ ઉપાશ્રય બંધવી અમર નામ રામેલ છે. વઠવાળું કેમ્પથી તે સામાન્ય નાના ગામડા સુધી હજુ તેમની કીતિ ગતા ધર્માલયો ઉલાછે. એવા ચોવા રાજકારી પુરુષો આ લૂભિમાં પાક્યાં છે. અને વર્તમાનમાં રાવ બહાદુર ડાકુરસી મંકનજ ધીયા, પુરુષે જાત માવજ વકીલ વળેરે અનેક સંઘસેવા પ્રેમી રાજકારી પુરુષો છે, અહું ગોંડળ સંપ્રદાયના મોટા ઉપાશ્રયના અને

સંઘાણીના નાના ઉપાશ્રયના એમ અને જુહા જુહા પોતપોતાના ઉપાશ્રયમાં  
ચાતુર્માસ કરે છે. અનેના 'મળા' ચાર ઉપાશ્રય અને જૈનશાળા લાયથ્રેરી  
વગેરે ધાર્મિક સંસ્થાઓ છે, અહિં સુંધનું કામકાજ અમુકજ કુટુમ્બ કરે તેમ  
નથી પરંતુ સંઘે એક કમીટી નામા છે, અને કમીટો એક સેક્ટરી માર્ક્ષીન  
કામકાજ લે છે. હાલમાં સેક્ટરી તરીકે ભાઈદાસ બેચરહાસ દોશી  
કામકાજ કરે છે, સંઘના ઝડોજવાની પ્રશંસનાં છે, અહિં જૈન સ્થા-  
નક્વાસીની વાસ્તા:—૧૨૦૦ ધર અને ૪૮૦૦ માણું નીછે.

### રાજકોટના મહાલો.

#### ૧ સરધાર.

આ ગામ રાજકોટની ગાઠીનું તખત ગણ્યાય છે, આદીશી રાજકોટ  
ગાઢી લઈ જઈ પાટનગર સ્થાયું. આ ક્ષેત્ર જોંગલ સંઘાણીનું છે, જામમાં  
જૈન ઉપાશ્રય તથા નગરશૈઠ મુલયંહ કરશનજના આશીત વાલતી  
“મુલયંહાઈ જૈનશાળા” તથા કરશનજલાઈ જૈન સ્થાનકવાની લાયથ્રેરી  
તથા રંભા પાઈ જૈન કંચાશાળા વગેરે ધાર્મિક સંસ્થાઓ છે. અનેસર  
મુલયંહ કરશનજ નગરશૈઠ છે. શ્રીમંત છે. ધર્મ પ્રેમી હેવા  
સાચે ધર્મોદ્ય અને સમાજોદ્ય જેવા આર્જનિક કાર્યોમાં આગલ પડતો  
લાગ લે છે, જૈન સ્થાનકવાસીના વાસ્તા:—

ધર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પુરુષ પરણેલ,	વિધુર,	કંવારા,
૨૬	૧૭૮	૧૦૬	૭૭	૩૨	૪	૬૫
અધવા.	જનરા,	કંવારી,	હસા	અણેન પુરુષ,	અણેલ સ્ત્રી,	
૩૨	૩	૩૨	૧૭૮	૮		૫૦
અધિક,	નેપાર,	નેપરી,	પાટકમણી,	નામાયક,		
૨૧	૬૬	૩૫	૩૭૦	૮૭		

#### ૨ કુવાડના મહાલ.

#### ૧ મધરનાડા.

આ ગામમાં જૈન ઉપાશ્રય નથી જૈન સ્થાનકવાસીની વાસ્તા: -

धर,	माणुस,	पुरुष,	खी.	परणेल पुरुषः	विधुर,	कुंचारा,
२	८	४	५	१	१	२०
संघवा,	विधवा,	कुंचारी,	हसा,	अणेल पुरुषः	आलक,	वेपार.
१	१	३	६	४	२	४

### २ तरवडीया.

आ गाममां कैन उपाश्रय नथी. कैन स्थानकवाचीनी वस्ति:—

धर,	माणुस,	पुरुष,	खी,	परणेल पुरुषः	कुंचारा,	संघवा,
३	१०	७	३	२	५	२
कुंचारी,	हसा,	अणेल पुरुषः	आलक,	वेपार,	सामायक.	
१	१०	५	१	३	१	

### ३ जीयाला.

आ गाममां उपाश्रय नथी. कैन स्थानकवाचीनी वस्ति:—

धर,	माणुस,	खी,	विधवा,	कुंचारी,	हसा,	आलक,
१	३	३	२	१	३	१

### ३ चीभडा महाल.

गाम गोंडल संप्रहायनुं हे. कैन उपाश्रय हे, आजेवान हे, कैन स्थानकवाचीनी वस्ति:—

धर,	माणुस,	पुरुष,	खी,	परणेल पुरुषः	विधुर,	
५	३५	१८	१७	७	१	
कुंचारा,	संघवा,	विधवा,	कुंचारी,	हसा,	अणेल पुरुषः	
१०	७	१	६	३५	१२	
लाल खी,	आलक,	वेपार,	पडिकमणा,	सामायक.		
८	१२	१८	५	१७		

## भाष्यकोषि.

## १ शेराणा.

आ गाममां उपाश्रय नथी. जेन स्थानकुवासीनी वस्तिः—

धर. माणुस. पुरुष. स्त्री. परणेल पुरुष. विधुर सधवा. कुंवारी.  
२ ७ ४ ३ २ २ २ १

हसा भणेल पुरुष. आगड. वेपार.  
७ ३ १ ४

## श्रेणी.

गाम. वस्ति आभा राज्यनी ३२६०७ माणुसनी छे.

आ संस्थान हालार ग्रांतनु भीज नभारतु छे. राजकर्ता झडेल  
वंशना लनमनगरथी उत्तरेल हाडेल आडेल—हालतसिंह७७ राज  
करै छे. उपाश्रय ऐ अने कैनशाणा आह संस्था छे. अग्रेसर भोटी  
हालतसिंह७७ राम७७ छे. आ गाममां गोंडलना चातुर्मास थाय छे. जेन  
स्थानकुवासीनी वस्तिः—

परंप्रे भणेल आवेल पणु गुम थवा माटे हीवणीर.

## श्रेणी राज्यना भालो.

## १ सरपट८ भालो.

आ गाम गोंडा संप्रदायतु छे. जेन उपाश्रय छे. आगेवान पटेल  
विसाथीभाली छे. जेन स्थानकुवासीनी वस्तिः—

धर. माणुस. पुरुष. स्त्री. परणेल पुरुष. विधुर. कुंवारा,  
४२ २१२ १०८ १०४ ४७ ८ ५३

सधवा. विवाह. कुंवारी. विसा भणेल पुरुष. असाण,  
४७ २० ३७ २१२ ८३ १

भणेल स्त्री. असाण स्त्री. आगड. अग्रेल भणेल. वेपार,  
६ ७७ ४५ १६ ८४

૧૧૧

નોકરી, પડિકમણું, સામાયક.  
૨૪            ૩૭            ૫૨

### દ્રાષ્ટા.

આ જામ જલમનગર ભાયાતનો ૨૪ જામનો તાલુકો છે. હુલાર પ્રાંતમાં જાળુય છે. જામમાં થાળું છે. તેની સત્તા નીચે આ તાલુકો છે. ઉપાશ્રય એ છે. ચ્યામાસા ગોંડળ સંપ્રદાયના થાય છે. અહીં જૈન સ્થાનકુલાંસીની વર્સિત:-

ધર,	માણસ,	પુરુષ,	બી.	પરણેલ પુરુષ,	વિધુર,	કં'વાર,
૪૫	૨૨૩	૧૧૭	૧૦૬	૪૬	૨૨	૪૬
સંખ્યા.	વિધ્વા.	કં'વારી.		બધા વિસા,	લણેલ પુરુષ	
૪૬	૨૦	૪૦		૨૨૩	૬૧	
ભાણુલ ખ્રા.	આળક,	અંગ્રેજી ભાણુલ પુરુષ,		વેપાર,	નોકરી,	
૩૫	૪૪	૩૦		૧૧૬	૧	
પડિકમણું,	સામાયક.					
૬૨	૮૩					

### ભોજનબેઠી દ્રાષ્ટા તાબે.

આ જામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકુલાંસીની વર્સિત:-

ધર.	માણસ,	દસા	ભણેલ	વેપાર.
૧	૧	૧	૧	૧

### જીસદણું.

આ સંસ્થાન હુલાર પ્રાંતમાં ભાઈ નન્દીના કાંડા ઉપર આવેલ ત્રીજી વર્જનું રહ્યું છે. રાજકર્તા કાંડિ દરખાર ખાચર આલા વાસ્કુર રાજ કરે છે. કાંડિ રાજનાંશીઓમાં ખાચર, ખુમાણ અને વાળા આ ગ્રણું સાખાયત એટલે રાજનાંશી ઉંદી જાત કાંડિમાં ગણુય છે. આ ગ્રણું ભાઈ છે. અવડતીયા એટલે ગીરાસ વગરના આડા ( હુલકા ) કાંડિ કહે-

વાય છે તે પૈકી કાડિં રજવાડામાં લાઈએ ભાગ પડતો હેવાથી જેતપુર વગેરે મોટા રાજ વીખાઈ ગયો ત્યારે જસદણું મોટા ડરખારકી આદા ખાચરે પોતાનું રાજ ન વીખતા રજપુરોન્ના માઝે ટીકાયતને ગાહી સેંપવા ગવર્નર્નામાં મંબુર કરાવવાથી જસદણમાં પાટડી કુમાર ગાડાએ છીએ છે તેથી જસદણ કાડિં રજવાડામાં જર્બથા નાદું અને આસાહ રાજ રહ્યું અને જામ્યું. હાલના રજકર્તા હરખારકી આદા ખાચર રાજ કરે છે. પોતે લાયક છે. અહિં જૈન ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીના વસ્તિ:—

ધર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ પુરુષ,
૨	૫	૨	૩	૨
સધવા સ્ત્રી,	વિધવા,	બધા હસા	પુરુષ ભાણેલ,	ખાળક,
૨	૧	૫	૨	૩

વેપાર, નોકરી.

૧      ૧

આદી બધા સ્નેહીયા વૈશુવ સંપડાયના છે.

### વિંધીયા.

આ ગામ જસદણ તાણાનો મહાલ છે. જસદણ રજનું સારામાં સારું અને મહેયામાં મહોદું ગામ ગણ્યા છે. લોંગડી સંપ્રદાયનું આ ગામ છે, એ ઉપાશ્રય અને ધાર્મિક સંસ્થામાં જૈનશાળા, જૈન લાઈએરી વગેરે છે. અચેસરમાં નગરશોડ દેવચંદ દાગા તથા ઉગડી જીવા દ્વારા ગણ્યા છે. દેવચંદ દામાનું રાજ્યમાં ભારે માન હતું. મોટા હરખાર આદનશી મહારાજ ઉદ્દેશ્ય આદા ખાચર તેમને ત્યાં રજયનું લરણું રાખતા. અને તેમનું ભારે માન આગવતાં. જૈન સ્થાનકવાસીના વસ્તિ:—

ધર,	માણુસો,	પુરુષ,	સ્ત્રી.	પુરુષ પરણેલ,	વિધુર,	કુંવારા,
૭૭	૪૮૫	૨૫૦	૨૩૫	૮૨	૬	૧૬૦

સધવા,	વિધવા,	કુંવારા,	બધા હસા,	લાણેલ પુરુષ,	ભાણેલ સ્ત્રી,
૮૨	૨૮	૧૨૫	૪૮૫	૧૬૬	૭૩

૧૧૩

અલણુ સ્ત્રી,	બાળક,	અંગ્રેજ લણેલ પુરુષ,	ડીઢી,	વેપાર,	નોકરી,	
૧૦૮	૧૦૯	૫	"	૧	૨૪૩	૮
લકીલ,	પાંડિકમણું,	સામાયક.				
૨	૧૩૨	૨૦૭				

### ૧ સંદર્ભ તાથે.

#### ૧ અણીયાળી મોટી.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસી વસ્તિ:-

ધર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ પુરુષ,	વિધુર,	કુંવારા,
૪	૨૪	૧૨	૧૨	૫	૨	૫
સધવા,	વિધવા,	કુંવારી,	છસા,	લણેલ પુરુષ,	લણેલ સ્ત્રી,	
૫	૩	૪	૨૪	૧૦		૪
બાળક,		વેપાર,				
૨		૧૦				

#### ૨ નાની અણીયાળી.

આ ગામમાં ઉપાશ્રય નથી જૈન સ્થાનકવાસીની વસ્તિ:-

ધર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ પુરુષ,	વિધુર,	સધવા,
૨	૧૭	૪	૩	૨	૨	૪
વિધવા,	છસા,	લણેલ પુરુષ,	વેપાર,			
૧	૭	૪	૪			

#### ૩ કુદુકા.

આ ગામમાં ઉપાશ્રય નથી. લીંબડીનુરાળી છે, જૈન સ્થાનકવાસીની વસ્તિ:-

ધર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ પુરુષ,	વિધુર,	સધવા,
૫	૧૭	૮	૬	૩	૫	૩

११४

विधवा, कुंवारी, हसा, भणेलपुरुष, वेपार, पडिकमणु सामायक.  
 ३      ३      १७      <      १७      १      <

#### ४ क्नेसरा.

आ गाममां उपाश्रय नथी. लीभडीनुराणी छे, जैन स्थानक-  
 वासीनी वस्ति:—

धर, माणुस, पुरुष, स्त्री, परणेल पुरुष, विधुर, सधवा विधवा  
 ५      १५      ७      <      १      ६      १      ५

- कुंवारी, हसा, भणेल पुरुष, भणेल स्त्री      वेपार,  
 २      १५      ७      १      <

#### ५ सालवडा.

आ गाममां उपाश्रय नथी. अहिं जैन स्थानकवासीनी वस्ति:—  
 धर, माणुस, पुरुष, स्त्री, परणेल पुरुष, कुंवार,  
 २      १८      ७      ५      ३      ४

सधवा, कुंवारी, (वसाशीमाणी, भणेल पुरुष, वेपार, सामायक.  
 ४      १      १२      ७      १२      ६

#### ६ कुनण्ठी.

आ गाममां जैन स्थानक मञ्जनुं छे. गोंडलनुं राणी, क्षेत्र छे.  
 अहिं जैन स्थानकवासीनी वस्ति:—

धर, माणुस, पुरुष, स्त्री, परणेल पुरुष, कुंवार,  
 ५      २८      १३      १६      ७      ६

सधवा, विधवा, कुंवारी, हसा, भणेल पुरुष, भणेल स्त्री,  
 ७      २      ५      २८      १०      ६

बाणक, वेणर, पडिकमणु, सामायक.  
 ५      १४      १२      <

૧૧૫

૭ દેવધરી.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વર્ણિતા:—

ધર.	માણુસ.	પુરુષ.	સ્ત્રી.	પરણેલ	પુરુષ.	કુંવારા
૫	૨૫	૧૬	૬	૩	૩	૧૩
સધવા.	વિસા.	ભણેલ	પુરુષ.	બાલક,	વેપાર.	
૩	૨૫	૧૩		૬	૧૦	

૮ મોદુકા.

આ ગામમાં જૈન ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વર્ણિતા:—

ધર.	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ	પુરુષ,	વિધુર	કુંવારા,
૧૩	૪૮	૨૮	૩૦	૧૦	૩	૩	૧૫
સધવા,	વિધવા,	કુંવારી,	દસા,	ભણેલ	પુરુષ,	ભણેલ સ્ત્રી,	
૧૦	૨	૧૮	૪૮	૨૧	૬		
બાલક,	વેપાર,		પાડકમણ્ણા,		સામાયક.		
૧૭	૧૧		૭	૨૨			

૯ ગુંડાળા.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વર્ણિતા:—

ધર.	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ	પુરુષ,	વિધુર,
૪	૧૩	૬	૭	૩	૩	૩
સધવા સ્ત્રી,	વિધવા સ્ત્રી,		વિસા શ્રીમાળી,		ભણેલ પુરુષ,	
૩	૪		૧૩		૫	
બાળક,	વેપાર,		સામાયક.			
૩	૬		૧૦			

૧૦ કાળાસર.

આ ગામમાં જૈન ઉપાશ્રય છે. જૈન સ્થાનકવાસીની વર્ણિતા:—

११६

धर,	माणुस,	पुरुष,	खी,	परणुल	पुरुष,	विधुर,	कुंवारा,
१३	५२	३१	२१	७	५	५	१८
सधवा,	विधवा,	कुंवारी,	दशा,	लणुल	पुरुष,	लणुल	खी,
७	६	६	५२	२३		२	
आणक,	वेपार,						
६	२५						

### ११ कोटी.

आ गाममां उपाश्रय नथी छे, जैन स्थानकवासीनी वस्ति:—

धर,	माणुस,	पुरुष,	खी,	परणुल,	विधुर,	सधवा,
२	५	२	३	१	१	२
दसा,	लणुल	पुरुष,	आणक,	वेपार,		
५		२		२	२	

### १२ नानी लाखावाड.

आ गाममां उपाश्रय नथी, जैन स्थानकवासीनी वस्ति:—

धर	माणुस,	पुरुष,	खी,	विधुर	विधवा,	दसा
१	३	१	२	१	२	३
लणुल	पुरुष,					
१						

### १३ कंधेवाणीया.

आ गाममां उपाश्रय नथी, जैन स्थानकवासीनी वस्ति:—

धर,	माणुस,	खी,	विधवा,	विसा	वेपार,	आभायक.
२	२	२	२	२	१	२

### ૧ પીપરડી અલમપર,

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વસ્તિ:—

ધર.	માણુસ.	પુરુષ.	સ્ત્રી.	પરણેલપુરુષ.	વિધુર,	કુંવારા,	સધવા,
૧૭	૬૫	૩૮	૨૭	૨૪	૩	૧૧	૨૦

વિધવા,	નિસા	અણેલ પુરુષ.	ખાળક.	વેપાર.
૭	૬૫	૩૦	<	૩૮

### ૨ ભદ્રાવડી.

આ ગામમાં જૈન ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વસ્તિ:—

ધર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ પુરુષ,	વિધુર,	કુંવારા,
૭	૩૫	૧૬	૧૬	૬	૧	૧૨

સધવા,	વિધવા,	કુંવારી,	દસા,	અણેલપુરુષ,	અણેલ સ્ત્રી,
૬	૪	૬	૩૫	૧૬	૪

વેપાર,	નોકરી,	પટિકમણું,	સામાયક.
૧૭	૨	૧	૧૮

### માળીયા મીયાણુના.

આ તાલુકો હાલાર પ્રાંતમાં આવેલ ચોથા વગ્નો છે. કંચમાંથી ઉત્તરેલ ઝાડેજ વંશના રાજક્રત્તા છે. હાલના રાજક્રત્તા ડાકેર સાહેબ રાયસિંહજી રાજ્ય કરે છે. જુવાનિસા, હાડ પરમાણી જીંદગી ભરથી ત્યાજ્ય છે. આ ગામમાં મીયાણુની વસ્તિ સર્વથી મહોટી હોવાથી અને ધણ્ણા ઝુંબાવને નીકળેલ હોવાથી મીયાણુનું માગીયું કહેવાયછે. ઉપાશ્રય છે. જૈન સ્થાનકવાસીની વસ્તિ:—

ધર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ પુરુષ,	વિધુર,	કુંવારા,	સધવા,
૧૧	૭૬	૦	૪૩	૩૬	૧૭	૩	૨૩

વિધવા,	કુંવારી,	દસા,	અણેલ પુરુષ,	અણેલ સ્ત્રી,
૪	૧૫	૭૬	૩૭	૬

૧૧૮

બાળક,	વેપાર,	જોકરી,	પડિકમણુ.	સામાયક,
૧૩	૩૬	૪.	૧૦	૨૫

### વાધરવા માળીયા તાણે.

આ ગામમાં જૈન ઉપાશ્રય નથી જૈન સ્થાનકવાસીની વર્સિતઃ—

ધર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પુરુષ પરણેલ,	કુંવારા,
૩	૨૧	૧૦	૧૧	૪	૬
સધવા,	વિધવા,	કુંવારી,	દસા,	ભણેલ પુરુષ,	ભણેલ સ્ત્રી,
૪	૧	૬	૨૧	૭	૩
અમણુ સ્ત્રી,	બાળક,	વેપાર,	પડિકમણું,	સામાયક.	
૬	૪	૧૦	૧	૫	

### રાજકોટ ભાયાત.

#### ૧ દોધીડા.

આ ગામ રાજકોટ ભાયાતનાં છે. બાર ગામનો પાંચમાં વર્ગનો અભયાર ધરાવતો તાલુકો છે, ગોંડળ સંપ્રદાયમાં ગણ્ણાય છે, ગામમાં ઉપાશ્રય છે જૈન સ્થાનકવાસીની વર્સિતઃ—

પત્રકો ગુમ થવા મારે ક્ષાંતબ્ય.

#### ૨ ખીરસરા.

આ પાંચમાં વર્ગનો અભયાર ધરાવતો બાર ગામનો તાલુકો છે, તાલુકાર રાજકોટ ભાયાત જાડેજા સ્કૂરસિંહજી છે, આ ગામ ગોંડલ સંપ્રદાયનું છે, ગામમાં ઉપાશ્રય છે, જૈન સ્થાનકવાસીની વર્સિતઃ—

ધર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ પુરુષ,	વિધુર,
૬	૭૨	૩૮	૩૪	૧૦	૫
કુંવારા,	સધવા,	વિધવા,	કુંવારી,	દસા,	ભણેલ પુરુષ,
૨૩	૧૦	૧૧	૧૩	૭૨	૩૫

૧૧૬

ભણેલ સ્વી, બાળક. અંગેજુ ભણેલ, વેપાર, નોકરી, પડિકમણા,  
૧૭ ૧૫ ૭ ૨૪ ૧૪ ૧૪

સામાયક.

૨૪

### ૩ ગવરીદૃ.

આ છ ગામનો તાલુકો પાંચમા વર્ગમાં છે. તાલુકદાર રાજકોટ  
ભાયાત જાડેજ પ્રતાપસિંહજી છે. આ ગામ ગોંડલ સંધારાનું રાજી  
છે; જૈન સ્થાનકવાસીની વર્સ્તા:—

ઘર, માણુસ, સ્વી, વિધવા, વિસા,

૧ ૧ ૧ ૧

### ૪ કોડારીયા.

આ તાલુકો રાજકોટ ભાયાતનો પાંચમા વર્ગમાં ગણ્યાય, છે, તાલુકા  
નીચે છ ગામ છે, તાલુકદાર જાડેજ પ્રતાપસિંહજી છે, આ ગામ  
ગોંડળ સંધારામાં આવેલ છે. ઉપાશ્રય છે, જૈન સ્થાનકવાસીની વર્સ્તા:—

ઘર, માણુસ, પુરુષ, સ્વી. વિધુર, વિધવા, દસા,  
૧ ૨ ૧ ૧ ૧ ૧ ૨

ભણેલ પુરુષ, નોકરી, સામાયક  
૧ ૧ ૨

### ઓરાણું કોડારીયા તાખે.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વર્સ્તા:—

ઘર માણુસ પુરુષ સ્વી પરણેલ પુરુષ વિધુર કુંવારા સધવા  
૧૦ ૨૫ ૧૬ ૬ . ૬ ૧ ૬ ૬

વિસા	ભણેલ પુરુષ	ભણેલ સ્વી	બાળક	અંગેજુ ભણેલ પુરુષ
૨૫	૧૪	૩	૨	૪

વેપાર	નોકરી	પડિકમણા	સામાયક.
૧૪	૨	૮	૧૦

## ૫ સાપ્ર.

આ છ ગામનો પાંચમાં બળની તાલુકો છે, રાજકોટથી ઉત્તરેલ છે, તાલુકદાર જાડેજ પ્રલાતસિંહજી છે, આ સ્થળમાં જૈન સ્થાનકુવાસીની વસ્તિ નથી તેમ નામદાર હરખારશ્રી લખે છે.

## ૬ ગાડકો.

આ છ ગામનો રાજકોટથી ઉત્તરેલ પાંચમા બળની તાલુકો છે તાલુકદાર જાડેજ શિવસિંહજી છે અહિ જૈન સ્થાનકુવાસીની વસ્તિ નથી.

## ૭ પાળા.

આ પણ છ ગામનો પાંચમાં બળની તાલુકો રાજકોટથી ઉત્તરેલ છે, અહિના તાલુકદાર જાડેજ લધુલા છે, ગામમાં જૈનો નથી તેમ હરખારશ્રી લખે છે.

## ૧ સાંગણવા ગવર્નરીદિનું.

આ ગામમાં ઉપાય્ય નથી. જૈન સ્થાનકુવાસીની વસ્તિ:—

ધર.	માણુસ,	સ્ત્રી વિસ્તા
૧	૧	૧

## લોધીકા તાણે ચાંદલી.

આ ગામમાં ઉપાય્ય નથી. જૈન સ્થાનકુવાસીની વસ્તિ:—

ધર	માણુસ	પુરુષ	સ્ત્રી	પરણુલ પુરુષ,	(વધુર,
૧૦	૭૮	૪૧	૩૯	૧૮	૨

કુવારા,	સધવા,	વિધવા,	કુંવારી,	દસા,	અણુલ પુરુષ,
૨૧	૧૮	૧	૧૮ "	૭૮	૩૬

અણુલ સ્ત્રી.	બાળક,	અંગ્રેજ અણુલ પુરુષ,	વેપાર,	નેકરી,
૧૫	૧૬	૭	૩૬	૫

પડિકમણું સામાયક.

૫	૪૯
---	----

### કોટડા સાંગાથી.

ગામ ૧૦

વહિત કૃલ આખા રાજની

આ ગામ નહી ઉપર વસેલુ ગોંડળથી ઉત્તરેલુ ચોથા વર્ગનું  
હાલાર પ્રાંતમાં આવેલ છે, રાજકુર્તા જાડેજ ડાહોર સાહેબ હેમતસંહાજ  
રાજ કરે છે, આ ગામ ગોંડળ સંપ્રદાયનું રાગો છે, તથન અસ્તે  
વ્યસ્ત દ્વારાજનક સ્થિતિ થઈ છે, ઉપાશ્રય લુણ્ણ થઈ ગયો છે.

જૈન સ્થાનકવાસીની વસ્તિ:-

ધર,	માણુસ,	પુરુષ,	ઓ,	પુરુષ પરણેલ,	વિધુર,	કુંવારા,	
૪	૧૬	૧૧	૪	૮	૨	૮	

સધવા,	કુંવારી,	ફસા,	લણેલ પુરુષ,	લણેલ ઓ,	બાળક,	
૨	૨	૧૬	૬	૪	૩	

નોકરી,	પડિકમણ્ણા,	સામાયક.
૪	૧	૧

### ગોંડળ ભાયાત.

૧ રાજપરા.

આ તાલુકો પાંચમાં વર્ગમાં છે. ગોંડલથી ઉત્તરેલ છે, તાલુકઢાર  
જાડેજ લાખાજ ધણા ધર્મિષ પુરુષ છે, આ ગોંડલ સંધાડાનું ગામ છે,  
ગામમાં જૈન ઉપાશ્રય છે, આગેવાન મોહી સંવચનલાધ અને બાખડા  
ગોરધનલાધ છે. જૈન સ્થાનકવાસીની વસ્તિ:-

ધર,	માણુસ,	પુરુષ,	ઓ.	પરણેલ પુરુષ,	વિધુર.	કુંવારા,	
૧૬	૧૦૬	૫૧	૫૧	૧૬	૧	૩૧	

સધવા.	વિધવા.	કુંવારી:		ફસા,	લણેલ પુરુષ
૧૬	૧૦	૨૬		૧૦૬	૪૮

અણેલ ઓ.	બાળક,	વેપાર,	નોકરી,	પડિકમણ્ણા,	સામાયક.
૧૬	૩૪	૨૮	૨૨	૧૨	૪૬

## ૨ મેંગળી.

આ ખાર ગામનો પાંચમાં વર્ગનો અખતીયાર ધરાવતો તાલુકો છે.  
 ગોંડલથી ઉત્તરેલ છે, આ ગામ ગોંડલ સંપ્રાણાયનું છે. તાલુકદારો  
 અપરિચિત હોવાથી નામ આપી શક્યા નથી, આ સ્થળ ગોંડળ  
 સંપ્રાણયનું છે. જૈન ઉપાશ્રય છે. અતે જૈન સ્થાનકવાસીની વસ્તિ:—  
 ઘર, માણુસ, પુરુષ, ક્રી, પરણેલ પુરુષ, વિધુર, કુંવાર,  
 ૧૫ ૮૩ ૪૦ ૪૩ ૧૫ " ૫ ૨૦

સધવા	વિધવા,	કુંવારી,	દસા,	ભણેલ પુરુષ,	ભણેલ સ્ત્રી,
૧૫	૬	૧૬	૮૩	૩૧	૧૫

બાળક,	વેપાર,	નોકરી.	દાક્તાર,	પડિકમણ્ણા,	સામાયક.
૧૫	૩૭	૨	૧	૭	૪૧

## ૩ ભાડવા.

આ કોટડા સાંગાણીથી ઉત્તરેલ પાંચમાં વર્ગનો ૫ ગામનો તાલુકો  
 છે. તાલુકદાર જાને બાદ સંહળ છે, આ ગામમાં જૈનની વસ્તિ બીલકુલ  
 નથી.

આખા હાલાર પ્રાંતમાં જૈન સ્થાનકવાસીના ઉદ્દેશ ઘર અને  
 ૧૫૭૬૬ માણુસની વસ્તિ છે.

## ગોહિલવાડ પ્રાંત.

ગામ ૧૦૦૦

વસ્તિ ૫૮૧૦૭૬ માણુસની છે.

## ભાવનગર.

ગામ અને આખા રાજ્યની કુલ વસ્તિ ૪૧૨૬૦૪ માણુસની છે.

આ હારયા કિનારે આવેલું લારે જાહેરલાલી કોણવતું લભ્ય અને  
 ધનીક શહેર છે. ગોહિલવાડ પ્રાંતમાં ગોહિલ રાજની રાજ્યધાનીનું પહેલાં  
 વર્ગનું રાજ છે. રાજકર્તા સગીર મહારાજ શ્રીકૃષ્ણકુમારસંહળ  
 છે. આ ગામ બરવાળા સંપ્રાણ નીચે છે, ગામમાં જૈન સ્થાનક એ અને  
 “ ચુનીલાલજી જૈન સ્થાનકવાસી લાઇઝેરી ” જૈનશાળા વરે

ધાર્મિક સંસ્થાઓએ.. લાઇફ્રેરી ઘાધાના ફરવાજે જહેર રસ્તા ઉપર સારી હાલતમાં પ્રશાંસા પાત્ર છે, અહીં સ્થાનકુવાસીની વસ્તિ ૩૦૦ ઘર અને ૧૨૦૦ માણુસની છે.

### ભાવનગરના મહાલો.

#### ૧ મહુવાખંડર મહાલ.

આ શહેર હરીયા કીનારે આવેલું બંદ્રી ગામ છે, આ ગૃહમ બરવાળા સંપ્રદાયમાં ગણ્યાય છે, જન ઉપાશ્રય છે, જન સ્થાનકવાસીની વસ્તિ:-

ધર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ પુરુષ,	વિધુર	કંવારા,
૨૭	૧૭૮	૧૧૧	૬૭	૩૬	૭	૬૮

સધવા,	વિધવા,	કંવારી,	દસા,	ભણેલ પુરુષ,	ભણેલ સ્ત્રી,
૩૬	૧૩	૧૮	૧૭૮	૬૨	૨૮

બાલક,	અંગ્રેજુ ભણેલ પુરુષ	વેપાર,	નેકરી	મડિકમણ્યા,
૩૪	૨૪	૪૨	૧૫	૧૬

સામાયક.

૩૬

#### ૨ શિહેર મહાલ.

આ ગામ કુંગરની ધડમાં ખાંધેંક છે, જેથી દેખાવ ભવ્ય લાગે છે, લાવનગરની ગાઢી પહેલી અહિં હતી અહિંથી લાવનગર લઇ ગયેલ છે, આ ગામમાં જૈન સ્થાનકવાસીનું એક ઘર છે, દેરાવાસીનું જેર છે.

#### ૩ ઉમરાળા.

આ ગામ લાવનગરના સુધી પુરુષ ગોહિલ સેજકળનું ગાઢીનું ગામ હતું, હજુ ગાડી અહિ છે, ગાઢીએ એડા પણી અંહુ આવવું પડે છે, અહિથી શિહેર અને શિહેરથી લાવનગર ગાઢી સ્થાપેલ છે. આ ગામ બરવાળા સંપ્રદાયનું ગણ્યાય છે, ગામમાં ઉપાશ્રય છે. આગેવાન શેડ રૂખડલાઈ ગણ્યાય છે, જૈન સ્થાનકવાસીની વસ્તિ નીચે સુન્દર છે.

ધર	માણુસ	પુરુષ	સ્ત્રી	પરણેલ પુરુષ,	વિધુર,
	૩૪૫	૨૦૧	૧૪૪	૬૦	૧૧
કુંવારા,	સંધવા,	વિધવા,	કુંવારી,	દસા શ્રીમાણી,	ભાવસાર,
૧૩૦	૬૦	૩૮	૪૬	૧૮૫	૧૨૭
સુતાર,	અણેલ પુરુષ,	અણેલ સ્ત્રી.	બાળક,	અંગેજ અણેલ પુરુષ,	
૩૩	૧૬૬	૩૫	૩૬	૪	
વેપાર,	નોકરી,	પડિકમણું	સામાયક.		
૧૪૪	૨૬	૫૫	૧૦૧		

## ૪ બોટાડ.

આ ગામનો સંપ્રદાય અલગ છે, હોયાદ સંધાડાથી ઓંગખાય છે. આ સંપ્રદાય પ્રાંગ્મણાના પૂજય વસ્ત્રામણ સ્વામીમાંથી નીકળ્યો છે. ગામમાં જૈન ઉપાધ્યા અને જૈનશાળા છે, સંધમાં દોશી લુદ્દરલાધ અને ગાંધી રાયચંહ રતનસી અગેસરો ગાણ્યાય છે, જૈન સ્થાનકવાસીની વાસ્ત્વા:

ધર,	માણુસ,	સંધવા,	વિધવા,	કુંવારી,	પરણેલ પુરુષ,
૩૦૨	૧૬૪૭	૨૭૪	૧૪૮	૩૩૨	૨૮૩
વિધુર,	કુંવારા,	બાળક,	વેપાર,	નોકરી,	દાક્તાર,
૫૬	૫૨૧	૩૧૦	૩૦૧	૧૬૩	૧
બાકીના ખધા વણ્ણિક.	૫૨૮	૮૮૩	૮૮૨		૧૭૨
અણેલ પુરુષ	અણેલ સ્ત્રી,	અંગેજ અણેલ પુરુષ,	પડિકમણું		
૭૬૨	૨૬૩	૮૮	૨૧૫		

સામાયક  
૮૧૧

## ૫ સાવરકુંડલા.

આ ગામ જોડલ સંપ્રદાયનું છે, ગામમાં જૈન ઉપાધ્યા, લાયથેરી અને જૈનશાળા વર્ગે ધાર્મિક સંસ્થાઓ છે, જૈન સ્થાનકવાસીની વાસ્ત્વા:

## ૬ ગઠડા મહાત.

આ ગામ સ્વામીનારાયણુના ગઠડાથી ઓળખાય છે, અહિ બોટાઈ સંપ્રદાયના ચોમાસા થાય છે, ગામમાં જૈન ઉપાશ્રય અને જૈનશાંખા આવિ છે, આ ગામમાં જૈન સ્થાનકુવાસીની વસ્તિ:—

ધર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ પુરુષ,	વિધુર,
૪૩	૨૩૧	૧૧૪	૧૧૭	૪૪	.૨૦

કુંવારા,	સધવા,	વિધવા,	કુંવારી,	દસાશ્રીમાળી,	ભાવસાર,
૬૦	૪૪	૨૭	૪૬	૧૫૭	૭૮

ભણેલ પુરુષ,	ભણેલ સ્ત્રી,	બાળક,	વેપાર.	નેકરી,
૬૮	૫૮	૨૫	૬૬	૧૮

પડિકમણ્યા,	સામાયક,
૬	૮૨

## સોનગઢ.

આ ગામ લાવનગર તાખાનું છે, ગોહિલવાડ પ્રાંતનો કેઝ્ય અહિ છે, આ ગામ બરવાળા સંપ્રદાયનું છે, ઉપાશ્રય નથી, આ ગામમાં જન સ્થાનકુવાસીની વસ્તિ:—

ધર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ,	કુંવારા,	સધવા,
૩	૨૨	૨૦	૨	૧	૧૬	૧

કુંવારી,	, દસા,	ભણેલ પુરુષ,	બાળક,	અંગ્રેજી ભણેલ,
૧	૨૨	૧૩	૭	૧

વેપાર,	નેકરી,
૧૬	૧

## ખોજડીયા.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકુવાસીની વસ્તિ:—

ધર	માણુસ,	પુરુષ,	કુંવારા,	દસા,	ભણેલ પુરુષ.	વેપાર.
૧	૨	૨	૨	૨	૨	૨

१२६

### प्रवाणा.

आ गाममां कैन उपाश्र्य नथी. कैन स्थानकवासीनी वस्तिः—

धर,	माणुस,	पुरुष,	खी,	परणेल पुरुष,	विधुर,	कुंवारा,	
१	६	३	३	१	१	१	१
सधवा,	विधवा,	कुंवारी,	हशा,	लणेल पुरुष,	वेपार.		
१	१	१	६	३	३		

### ठिंगोराणा.

आ गाममां उपाश्र्य नथी. जैन स्थानकवासीनी वस्तिः—

धर,	माणुस,	पुरुष,	खी,	परणेल पुरुष,	कुंवारा,	
१	८	४	४	१	३	
सधवा खी,	विधवा खी,		हसा श्रीमाणी,		लणेल पुरुष,	
१	३		८		२	
भाण्ड,	वेपार,		साभायड.			
२	२		१			

### उभरडा-मेटा.

आ गाममां उपाश्र्य नथी. कैन स्थानकवासीनी वस्तिः—

धर,	माणुस,	पुरुष,	खी.	परणेल पुरुष,	सधवा,	हसा,	
१	४	२	२	२	२	१	४
लणेल पुरुष			वेपार.				
२			२				

### पालीताणा.

माझा राज्यनी कुल वस्ति २८५६८ माणुसनी छे.

आ शहेर शत्रुंजय पर्वतनी तखेटामां आवेदुं डाढिलवाड प्रां-  
तनुं भीजा वर्गनुं राज्य छे, राज्कर्ता लावनगरथी उतरेल गोडिलवंशनां  
नामहार ठाकोर साहेब अडाहुरसिंह<sup>७</sup> राज करे छे. पौते धण्डा

લાયક અને ભીલમસાર સ્વભાવના છે. આ ગ્રામમાં સ્થાનકવાસીની વસ્તિ ભીલકુલ નથી એટબુંજ નહિ મરંતુ આખા રાજ્યમાં એટલે પરગણુમાં ભીલકુલ નથી, દેરાચાસીની વસ્તિ છે, આ સંઘંધી પ્રસ્તાવમાની પૂર્વે કાઠીયાવાડના રાજ મહારાજાઓ અને એજન્સી અમલદારોના આવેલ ડારેક્ટરીના રૂહાયક પત્રો છાપેલ છે, તેમાંના પાલીતાણા સૈટનો આવેલ પત્ર વાંચવાથી ખાત્રી થાય છે.

### વળા.

આખા રાજ્યની કુલ વસ્તિ ૧૩,૨૮૫ માણુસની છે.

આ ગામ આખા સોરઠ ભૂમિમાં જુનાગઢ (ક્રારકાનગરી) થી પણ પ્રાચીન છે, આનો ધૂતિદાસ ઘણો જુનો છે. વળાને પૂર્વે વલલીપુર કહેવાતું હતું. તેના પૂર્વે વિભળાપુરી કે જ્યાં ચાંદ્રાજન પ્રેમલાલચઠીને પરણવા આવ્યા હતા. તે કાળ વીસમા તીર્થીકર સુનસુવૃત્તસ્વામીનો ગણ્ય છે એમ શાંકિય ધૂતિહાસીક દ્રષ્ટિએ તેતું પુરાતન સિદ્ધ્ધ થાય છે, આ શાહેરનો એક અલગ ધૂતિહાસ લખાય તેથું છે, આ રાજ્ય ગોહિલવાડ પ્રાંતમાં આવેલું ગોહિલ રાજનું ચોથા વર્ગનું રાજ છે. રાજકર્તાં લાવનગરથી ઉત્તરેલ નામદાર ઠાકોર સાહેખ વખતસંહાર મેધરાજ રાજ કરે છે. આ ગામમાં પાલીતાણાની માડક જૈન સ્થાનકવાસીની વસ્તિ સ્થાનક તેમજ આખા પરગણુમાં ભીલકુલ નથી, એમ નામદાર ઠાકોર સાહેખનો એક્ઝિક્યુશન એર્ડર પત્ર વાંચતા જણાય છે, તે પત્ર ખુંની શરૂઆતમાં છાપેલ છે તે વાંચી જવાથી ખાત્રી થશે.

### લાડી.

ગામ ૨૨.

અને આખા તાલુકાની વસ્તિ

આ ગામ કલાપીથી વધુ પ્રસિદ્ધિને પાત્ર થયેલ છે, ગોહિલવાડ પ્રાંતનું ચોથા વર્ગનું આ રાજ્ય છે, લાવનગરથી ઉત્તરેલ ગોહિલ રાજનું છે, રાજકર્તાં નામદાર સંગીર ઠાકોર સાહેખ રાજ કરે છે, આ ગામ હોટાહ સંપ્રદાયનું છે, ગામમાં જૈન ઉપાશ્રય, જૈનશાળા વગેરે ધાર્મિક સંસ્થાઓ છે. જૈન સ્થાનકવાસીની વસ્તિ:-

ધર, માણુસ, પુરુષ, ખી, પરણોલ પુરુષ, વિધુર, કુંવારા,  
૬૧ ૪૩૫ ૨૪૯ ૧૮૬ ૮૬ ૨૨ ૧૪૧

સધવા, વિધવા, કુંવારી, દસા ભણોલ પુરુષ, અણોલ ખી,  
૮૫ ૨૬ ૪૨ ૪૩૫ ૧૬૦ ૫૬

ખાળક, અંગેળ અણોલ પુરુષ, દીથી, વેપાર, નેકરી,  
૮૬ ૨ ૧ ૨૨૬ ૨૦

પહિકમણ્ણા, સામાયક.  
૪૮ ૨૧૨

### લાડી તાઢે.

#### ૧ ભૂરભીયા.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વસ્તિ:—

ધર, માણુસ, પુરુષ, ખી, પરણોલ પુરુષ, કુંવારા, સધવા,  
૧ ૧૧ ૪ ૭ ૧ ૩ ૧

વિધવા, કુંવારી, દસા, ભણોલ પુરુષ, અણોલ ખી, ખાળક,  
૩ ૩ ૧૧ ૩ ૩ ૩ ૩

વેપાર, સામાયક.  
૪ <

#### ૨ ટેડા.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વસ્તિ:—

ધર, માણુસ, પુરુષ, વિધુર, દસા, અણોલ વેપાર, સામાયક.  
૧ ૧ ૧ ૧ ૧

#### ૩ રાજ્યપૌર્ણા.

આ ગામમાં જૈન ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વસ્તિ:—

ધર, માણુસ, પુરુષ, ખી, પરણોલ પુરુષ, કુંવારા, સધવા,  
૧ ૭ ૨ ૫ ૧ ૧ ૧

१३६

कुंवारी,	हसा	भणेल पुरुष,	भणेल स्त्री	आलक,	वेपार,
४	७	१	, १	२	२

सामायक,  
३

### हनुभाईना लीबडा.

आ गाममां उमाश्रय नथी. जैन स्थानकुवासीनी वस्ति:—

धर.	माणुस.	पुरुष.	स्त्री.	परणेल पुरुष.	विधुर,	कुंवारा.
६	२१	१२	६	२	२	८

संधवा.	विधवा,	कुंवारी,	हसा.	भणेल पुरुष.	भणेल स्त्री,
२	४	३	२१	६	१

आलक,	वेपार.	पट्टिकमण्डा,	सामायक..
५	७	३	५

### भीजडीया हाकेमना.

आ गाममां उपाश्रय नथी. अहिं जैन स्थानकुवासीनी वस्ति:—

धर.	माणुस,	पुरुष,	स्त्री,	विधुर,	कुंवारा,	विधवा,
२	४	२	२	१	१	१

कुंवारी,	हसा,	भणेल पुरुष,	वेपार.
१	४	२	२

### गढाणी.

आ गाममां उपाश्रय नथी. जैन स्थानकुवासीनी वस्ति:—

धर.	माणुस.	पुरुष.	स्त्री.	परणेल पुरुष.	विधुर,	कुंवारा,	संधवा.
६	३३	१६	१७	५	१	१०	५

विधवा,	कुंवारी	हसा	भणेल पुरुष.	भणेल स्त्री,	आलक.
४	८	३३	१४	४	४

अंत्रेषु भणेल पुरुष,	वेपार.	नोकरी.
१	६	१

## જલાલપર.

આ ગામમાં જૈન ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વર્સિતઃ—

ધર,	માણસ,	પુરુષ,	સ્ત્રી,	પરણોલ પુરુષ,	વિધુર,	કુંવારા,	સધવા,
૬	૫૦	૨૩	૨૭	૮	૩	૧૨	૮

વિધવા,	કુંવારી,	દસા,	લણોલ પુરુષ,	લણોલ સ્ત્રી,
૫	૧૪	૫૦	૨૦	૪

બાળક,	અંગેજુ લણોલ પુરુષ,	વેપાર,	નોકરી,
૧૧	૨	૧૪	૪

## માંડવા.

આ ગામમાં જૈન ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીના વર્સિતઃ—

ધર,	માણસ,	પુરુષ,	સ્ત્રી,	પુરુષ પરણોલ,	કુંવારા,
૫	૪૧	૨૧	૨૦	૮	૨૩

સધવા,	વિધવા,	કુંવારી,	દસા,	લણોલ પુરુષ,	લણોલ સ્ત્રી,
૮	૪	૮	૪૧	૧૭	૩

અંગેજુ લણોલ પુરુષ,	બાળક,	વેપાર,
૧	૮	૧૪

## અણિડા.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વર્સિતઃ—

ધર,	માણસ,	પુરુષ,	સ્ત્રી,	પરણોલ પુરુષ,	કુંવારા,	સધવા,
૧	૭	૫	૨	૧	૪	૧

કુંવારી,	દસા,	લણોલ પુરુષ,	બાળક,	વેપાર,
૧	૭	૩	૩	૨

## દસા.

આ ગામમાં ઉપાશ્રય નથી, જૈન સ્થાનકવાસીની વર્સિતઃ—

૧૩૧

ધર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ પુરુષ,	વિધુર,	કુંવારા,
૧૨	૫૮	૩૮	૨૦	૧૧	૩.	૨૫
સધવા,	વિધવા,	કુંવારી,	દસા,	ભણેલ પુરુષ,	ભણેલ સ્ત્રી,	
૧૧	૨	૭	૫૮	૩૭		૪
બાળક,	વેપાર,	નોકરી.				
૫	૧૮	૧૦				

### પીપરણી.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વસ્તિ:—


ધર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ પુરુષ,	વિધુર,	કુંવારા,
૬	૧૬	૧૨	૪	૨	૨	૮
સધવા,	કુંવારી,	દસા,	ભણેલપુરુષ,	બાળક,	વેપાર,	નોકરી.
૨	૨	૧૬	૧૧	૨	૪	૫

### રસનાલ.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વસ્તિ:—

ધર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ પુરુષ,	વિધુર,	કુંવારા,
૧૦	૪૧	૨૩	૧૮	૧૧	૨	૧૦
સધવા	વિધવા,	કુંવારી,	દસા,	ભણેલ પુરુષ,	ભણેલ સ્ત્રી,	
૧૧	૧	૧૬	૪૧	૨૦	૩	
બાળક,	અંગ્રેજી	ભણેલ પુરુષ,	વેપાર,	નોકરી.		
૫	૬	૬	૬	૬		

આખ્યા ગોઢિલવાડ પ્રાંતમાં જૈન સ્થાનકવાસીના જદુ ધર અને ૪૭૧ માણુસની વસ્તિ છે.



## અલાવાડ પ્રાત

ગામ ૬૭૧

વર્ષિત ૩,૬૫,૨૩૮ માણુસની છે.

### ધ્રાંગધ્રા.

ગામ ૧૫૫ અને વર્ષિત આખા રાજ્યની કુલ ૮૮,૪૦૬ માણુસની છે.

આ શહેર અલાવાડનું પાટનગર અને આલા રાજ્યએનાં ટીલાટનું ગણ્યાય છે. રાજકર્તા મઝ્જવાણું વંશના મહારાજા રાજ સાહેબ સર ઘનશ્યામસિંહજી જી. સી. આઈ. ઈ., કે. સી. એસ. આઈ. રાજ કરે છે. રાજના સ્થાનવિશ્વાસાં મહારાજા રાજ સાહેબના પૂર્ણ વિશ્વાસું અને પ્રેમના પાત્ર રાજ રાણુશ્રી માનસિંહજી સી. આઈ. ઈ. ના હૃથ રાજ્યનું દ્વિવાન દરકારે સુખાન રહેલું છે. ક્ષત્રીઓમાં દ્વિવાન અને મુસહી તરીકે ને કોણએ પણ નામના મેળવા હોય તો માનસિંહજીએજ મેળવેલ છે. એ સિંહનું નામ કાઢિયાવાડના દ્વિતીયાસમાં અમર રહી જશે, રાજ-પુતોને ખરેખર અલિમાન લેવા જેવું છે. અહિનો સ્થાનિક સંપ્રદાય ગણ્યાતો હતો. એટલે કે ધ્રાંગધ્રા સંપ્રદાયથી એળખાતો હતો. સંપ્રદાયના સુધી પુરુષ પુરુષ શ્રીમાન વસરામજી સ્વામીએ લીંબડીથી જુદા પડી આડું ગાદી સ્થાપી. તેમના (શાખ્યો પ્રશિષ્યો) એમ સં. ૧૬૭૩ સુધી તેમનો સંપ્રદાય ચાલ્યો. છેવટ પૂજય અમરસિંહજી અને શાખ્યન્યાલચચંહજી હતા. ન્યાલચચંહજી ધ્રાંગધ્રા ભાયાત કેંઠના રાજ-પુત ગીરાસધાર દ્વિવાન સાહેબના કુદુમ્ભી હતા. તે ન્યાલચચંહજી અને તેમના શુરૂ પૂજય અમર સંહજી સ્વામીની સં. ૧૬૭૩ ની સાલનાં ધૂને કાળધર્મ પામી જવાથી સંપ્રદાય નાખુદ થયો. એમણે મહુમ મહુમ મહારાજા રાજ સાહેબ સર માનસિંહજી જી. સ્થી. આઈ. ઈ. નો ભારે ચાહુ મેળવ્યો હતો. રાજ સાહેબ તેમને શુરૂ તુલ્ય માનતા હતા. હુલ તે સંપ્રદાયનો પેટા સંપ્રદાય તરીકે બોટાહ સંપ્રદાય ગણ્યાય છે. આજ કાલ લીંબડી સંધવીના ઉપાશ્રયના અને ફરીયાપુરી વગેરે જુદા જુદા સાધુઓના વારા ફરતી ચાતુર્માસ થાય છે, ગામમાં ત્રણ ઉપાશ્રય છે, જેન પુલટક લંડાર અને જેનશાળા વગેરે ધાર્મિક સંસ્થાઓ છે. અમરાશ-

રખના સંઘમાં હઉસાવાળા આગેવાન છે. આ ગામમાં જૈન સ્થાનકવાસીની વસ્તિની સંખ્યા નીચે મુજબ છે.

ધર,	દસાના ધર,	વિસાના ધર,	ભાવસારના ધર.	માણુસ,
૨૭૬	૧૪૭	૬૨	૪૦	૧૧૧

---

### ધ્રાંગધ્રાના મહાલો.

#### ૧ ઇળાવદ મહાલ.

આ ગામ ધ્રાંગધ્રાનું ટીલાટ ઉર્ફ્ ગાઢીનું ગણ્યાય છે, ગામ ધણ્યું મહેદું શહેર જેવું છે, પરંતુ જૈનની વસ્તિ ધારી જુદ્ધ છે. આ ગામમાં જૈન સ્થાનકવાસીનો ઉપાશ્રય છે, જૈન સ્થાનકવાસીના વસ્તિ:—  
પત્રક આવ્યા નથી.

#### ૨ સીતાપુર.

આ ગામમાં જૈન સ્થાનકવાસી સંઘમાં ઉપાશ્રય છે. ધ્રાંગધ્રા સંપ્રદાયનું ક્ષેત્ર છે. હાલ ચોમાસા સર્વ કરે છે. આગેવાન નગરશેઠ વાલજી કર્માના ફીકરા છે. આ લોકોની પૂર્વે ભારે આખર હતી. ચોવીસીના શેઠ ગણ્યાતા હતા અને હજી ગણ્યાય છે. ધ્રાંગધ્રાના વાણીયા અને સીતાપુરનું મહૃજન કહેવાતું હતું, આ ગામમાં જૈન સ્થાનકવાસીની વસ્તિ:—  
પત્રકો શુભ થવા માટે હીલગીર.

#### ૩ ટીકર રણની. ( મહાલ.)

આ ગામ રણને કાંઠે આવેલ છે. આ ગામમાં લીંખડીના નાના ઉપાશ્રયના સંઘવીના સાધુના ચોમાસા થાય છે. ગામમાં ઉપાશ્રય છે. જૈન સ્થાનકવાસીની વસ્તિ:—પત્રકો શુભ થવા માટે ટીકર.

#### ૪ ઉમરડા મહાલ.

આ ગામ લીંખડી મોટા ઉપાશ્રયનું રાગી છે. આગેવાન ગાંધી ત્રીભૂવન ગોકરણ ગણ્યાય છે. જૈન સ્થાનક છે, જૈન સ્થાનકવાસીની વસ્તિ:—

ધર, માણસ, પુરુષ, શ્રી, પરણેલ પુરુષ, વિધુર, કુંવારા,  
૧૦ ૪૨ ૧૮ ૨૪ ૬ ૨ ૭

સધવા, વિધવા, કુંવારી, હસા, ભણેલ પુરુષ ભણેલ શ્રી,  
૬ ૬ ૬ ૪૨ ૧૮ ૧૦

બાળક, અંગ્રેજ ભણેલ પુરુષ, વેપાર, નોકરી, પડિકમણા,  
૪ ૨ ૧૭ ૧ ૧૧

સામાચક.

૧૪

### ૧ કલમાદ.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વર્ણિતઃ—

ધર, માણસ, પુરુષ, શ્રી, પરણેલ પુરુષ, કુંવારા,  
૩ ૨૬ ૧૫ ૧૧ ૬ ૬

સધવા, કુંવારી, હસા, ભણેલ પુરુષ, ભણેલ શ્રી, બાળક,  
૬ ૫ ૨૬ ૧૩ ૩ ૭

વેપાર,

૧૦

### ૨ દુધધ.

આ ગામમાં જૈન ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વર્ણિતઃ—

ધર, માણસ, પુરુષ, શ્રી, પરણેલ, કુંવારા, સધવા,  
૪ ૨૮ ૧૭ ૧૧ ૫ ૧૨ ૪

વિધવા, કુંવારી, હસા, ભણેલ પુરુષ, ભણેલ શ્રી, બાળક,  
૧ ૬ ૨૮ ૧૩ ૩ ૧

વેપાર, નોકરી.

૧૦ ૨

१३५

### ३ रावलीयावदर.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વસ્તિ:—

ધર,	માણુસ,	પુરુષ,	વિધુર,	દસા,	ભણેલ પુરુષ,	વેપાર.
૧	૨	૨	૨	૨	૧	૧

---

### ४ કુન્તલપુર.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વસ્તિ:—

ધર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	કુંવારા,	વિધવા,	કુંવારી,
૧	૫	૨	૩	૨	૧	૨

---

વિસા શ્રીમાલી ભણેલ પુરુષ.  
૫                           ૮

---

### કેંદ્ર.

આ ગામ ધ્રાંગમાં ભાયાત ધ્રાંગધ્રાના હિવાન રાજરણ્ણા સર માનસંહળની જન્મભૂમિનું છે. આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વસ્તિ:—

ધર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ પુરુષ,	વિધુર,	કુંવારા,
૧૦	૫૩	૩૧	૨૨	૧૦	૨	૧૬

---

સધવા	વિધવા,	કુંવારી,	વિસા,	ભણેલ પુરુષ,	ભણેલ સ્ત્રી,
૧૦	૪	૮	૫૩	૨૭	૨

---

બાળક, વેપાર,  
૧૦                   ૩૧


---

### માલણીયાદ ટીક્કર મહાલ.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વસ્તિ:—

ધર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ પુરુષ,	કુંવારા,
૧	૩	૪	૩	૨	૪

સધવા જી,	હસા	ભણેલ પુરુષ	બાળક,	વેપાર,
૨	૬	૩	૧	૪
પહિકમણું	સામાયક.			
૨	૨			



### વાંકાનેર.

આમ ૮૪

વસ્તિ આખા રાજ્યની કુલ ૨૭૭૬૩.

આ સંસ્થાન આલાવાડ પ્રાંતનું આ રાજ સાહેબની જત માટે પહેલા વર્ગનું રાજ્ય છે. રાજકર્તા મહારાણા રાજસાહેબ સર અમરસિંહજી કે. સી. આઈ. ઈ. રાજ કુરે છે. પોતે ઘણું બાહેસ અને ચતુર રાજ્યની છે. તેમણે ગવર્નર અને રાજ પ્રજની ઘણી ચાહુના મેળવી છે. કાઢિયાવાડનું ખરેખર આદર્શ રત્ન છે. અહિં લોંબડી મોટા ઉપાશ્રય અને નાના ઉપાશ્રયના બન્નેના ચોમાસા વારાકૃતી એક ઉપાશ્રયમાં થાય છે. ઉપાશ્રય બે, જૈનશાળા અને જૈન લાયએરી વર્ગે ધાર્મિક સંસ્થાઓ છે. શોઠ વનેચંહ હેવજી સંઘપતી અને નગરશોઠ કહેવાય છે. રાજ્ય તરફથી નગરશોઠની પાદડી છે, પરાપૂર્વથી શેડાઈ તેમના ધરની ચાલી આવે છે, સંઘમાં ગંભીર થાય છે ત્યારે વીસા અને ઇસા એમ બન્ને પોતપોતાની જુદી જુદી ધર્મશાળામાં જમે છે. એકંદર સંપ્રદાયની પ્રશંસાપાત્ર છે. જંકશન ઉપર મહુંમ નગરશોઠ પ્રેમજી મનજીએ ઉપાશ્રય બંધુવેલ છે. આ ગામમાં જૈન સ્થાનકવાસીની જસ્તિ નીચે સુજબ છે. —

ખર,	માણુસ	પુરુષ,	ઝી,	પરણેલ પુરુષ,	વિધુર,
૧૭૫	૧૧૧૭	૫૮૯	૫૨૮	૨૧૭	૨૭
કુંવારા,	સધવા,	વિધવા,	કુંવારી,	વિસા,	
૩૪૫	૨૨૮	૮૭	૨૧૩	૭૨૫	
હસા,	ભણેલ પુરુષ,	ભણેલ ઝી,		બાળકો,	
૩૬૨	૪૨૭	૨૫૮		૧૮૦	

१३७

अंग्रेज लघुल पुर्णो, डीशी, वेपार, नेकरी, दाक्तर,  
२५२ ६ ४८७ १०१ १

पटिकमण्डा, सामायक.  
२१२ ४५३

### वांडानेरना गामो.

#### १ धीपलीया.

आ गाममां उपाश्रय नथी. जैन स्थानकवासीनी वस्ति:—

धर,	माणुस,	पुरुष,	खी,	परणुल पुरुष,	कुंवारा,	सधवा,
४	२८	१५	१३	६	६	६

विधवा,	कुंवारी,	विसा	लघुल पुरुष,	भाणक,
२	५	२८	१३	५

अंग्रेज लघुल पुरुष,	वेपार,	नेकरी,	सामायक.
४	१०	१	२

#### २ वासासाणु.

आ गाममां उपाश्रय नथी. जैन स्थानकवासीनी वस्ति:—

धर,	माणुस,	पुरुष,	खी,	परणुल पुरुष,	विधुर	कुंवारा,
२	८	६	२	१	१	४

सधवा,	विधवा,	विसा श्रीमाली,	लघुल पुरुष,	वेपार,
१	१	८	६	४

नेकरी सामायक.  
२ ८

#### ३ सिंहावदर.

आ गाममां उपाश्रय नथी. जैन स्थानकवासीनी वस्ति:—

धर	माणुस,	पुरुष,	खी,	परणुल पुरुष.	विधुर,
१	७	४	३	१	१

કુંવારા,	સધવા,	વિધવા,	કુંવારી,	વિસા શ્રીમાલી,	લણેલ પુરુષ,	
૨	૧	૧	૧	૭	૨	
લણેલ સ્ત્રી,	બાળક,	વેપાર,	સામાયક.			
૧	૩	૨	૩			

#### ૪ પાંચ હુવારકા.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વસ્તિ:—

ધર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ પુરુષ,	કુંવારો,	સધવા,	
૧	૩	૨	૧	૧	૧	૧	૧
વિસા શ્રીમાલી,	લણેલ પુરુષ,	વેપાર.					
૩	૨			૨			

#### ૫ કણુકોટ.

આ ગામમાં ઉપાશ્રય નથી, જૈન સ્થાનકવાસીની વસ્તિ:—

ધર.	માણુસ,	પુરુષ,	વિધુર,	વિસા શ્રીમાલી,	લણેલ પુરુષ,	વેપાર.	
૧	૧	૧	૧	૧	૧	૧	૧

#### ૬ વધાસીયા.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીના વસ્તિ:—

ધર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ પુરુષ,	સધવા,	
૧	૪	૧	૩	૧	૧	
કુંવારી,	દસા,	લણેલ પુરુષ,	વેપાર,	સામાયક.		
૨	૪	૧		૧	૧	

#### ૭ રાણુકપુર.

આ ગામમાં સ્થાનક નથી. જૈન સ્થાનકવાસીની વસ્તિ:—

ધર.	માણુસ.	પુરુષ,	સ્ત્રી.	પરણેલ પુરુષ.	કુંવારા,	સધવા.	
૬	૩૨	૧૪	૧૮	૬	૮	૬	

१३६

विधवा,	कुंवारी	इसा	भणेल	पुरुष.	लणेल	स्त्री,	भाणड.
१	११	३२	११		५		१२
वेपार.	नोडरी,		सामायक.				
५	१		१२				

### ८ देवली.

आ गाममां कैने उपाश्रय नथी. कैन स्थानकवासीनी वस्ति:-

धर,	भाणुस,	पुरुष,	स्त्री,	कुंवारा,	विधवा,	कुंवारी,
१	८	३	५	३	१	४
इसा,	लणेल	पुरुष,	भाणड,	वेपार.		
८	३	१	१			

### ९ जलीडा.

आ गाममां उपाश्रय नथी. अहिं कैन स्थानकवासीनी वस्ति:-

धर,	भाणुस,	पुरुष,	कुंवारा,	इसा,	लणेल,	पुरुष,	वेपार.
१	१	१	१	१	१	१	१

### १० रंगपुर.

आ गाममां उपाश्रय नथी. कैन स्थानकवासीनी वस्ति:-

धर,	भाणुस,	पुरुष,	स्त्री,	विधुर,	कुंवारा,	विधवा,
१	५	४	१	१	३	१
इसा	लणेल	पुरुष	वेपार,			
५	४	४				

### ११ जेधपुर.

आ गाममां उपाश्रय नथी. कैन स्थानकवासीनी वस्ति:-

धर,	भाणुस,	पुरुष,	स्त्री,	परणेल	पुरुष,	विधुर,	कुंवारा,
२	१३	७	६	२	२	२	३

१४०

सध्वा,	विध्वा,	कुंवारी,	हसा,	लण्ठेल पुरुष,	लण्ठेल स्त्री.
२	१	३	१३	७	१
भाण्ड,	वेपार,	पुडिकमण्डा	सामायक.		
१	५	२		६	

### १२ दिदालीया.

आ गाममां उपाश्रय नथी. जैन स्थानकवासीनी वस्ति:—

धर,	माण्डुस,	पुरुष,	स्त्री,	परण्ठेल पुरुष,	कुंवारा,	सध्वा,
१	६	४	५	१	३	१
कुंवारी,	हसा,	लण्ठेल पुरुष,	लण्ठेल स्त्री,	भाण्ड,	वेपार,	
४	६	२	२	३	१	

### १३ रातावीरडा.

आ गाममां उपाश्रय नथी. जैन स्थानकवासीनी वस्ति:—

धर,	माण्डुस,	पुरुष,	स्त्री,	परण्ठेल पुरुष,	कुंवारो,	सध्वा,
१	४	२	२	१	१	१
कुंवारी,	हसा,	लण्ठेल पुरुष,	भाण्ड,	वेपार.		
१	४	१		१		

### १४ पंचासर.

आ गाममां उपाश्रय नथी. जैन स्थानरवासीनी वस्ति:—

धर	माण्डुस	पुरुष	स्त्री	परण्ठेल पुरुष,	कुंवारा,	सध्वा,
१	७	३	४	१	२	१
कुंवारी,	हसा	लण्ठेल पुरुष,	भाण्ड,	वेपार.		
३	७	३		२	१	

१४९

### १५ लुण्ठसर.

आ गाममां उपाश्रय नथी. जैन स्थानकवासीनी वस्ति:—

धर.	माणुस.	पुरुष.	स्त्री.	परणेल पुरुष.	विधुर,	कुंवारा,
५	२४	१५	६	३	२	१०

सधवा.	विधवा,	कुंवारी,	हसा.	लण्डुल पुरुष.	भण्डुल स्त्री,
३	२	४	२४	११	४
भालक,	वेपार.	सामायक.			
५	६	६			

### १६ तीथवा.

आ गाममां जैन उपाश्रय नथी. जैन स्थानकवासीनी वस्ति:—

धर.	माणुस,	पुरुष,	स्त्री,	परणेल पुरुष,	कुंवारा,	सधवा,
१२	४४	२२	२२	१४	८	१४

विधवा,	कुंवारी,	हसा,	लण्डुल पुरुष,	भण्डुल स्त्री,
६	२	४४	२१	६
भालक,	वेपार,	नोडरी,	सामायक.	
३	७	५	५	

### १७ भलगाम.

आ गाममां उपाश्रय नथी. जैन स्थानकवासीनी वस्ति:—

धर.	माणुस,	पुरुष,	विधुर,	हसा,	लण्डुल पुरुष.	वेपार.
१	१	१	१	१	१	२

### १८ ठीकरीयाणा.

आ गाममां उपाश्रय नथी. जैन स्थानकवासीनी वस्ति:—

धर.	माणुस,	पुरुष,	कुंवारा,	हसा,	लण्डुल पुरुष,	वेपार.
१	१	१	१	१	१	१

### ૧૯ અરણીટીંબા.

આ. ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વસ્તિ:—

ઘર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ પુરુષ,	વિધુર,	કુંવારા,
૧૪	૪૮	૨૩	૨૫	૧૧	૧	૧૨
સધવા	વિધવા,	કુંવારી,	વિસા,	ભણેલ પુરુષ,	ભણેલ સ્ત્રી,	
૧૧	૭	૭	૪૮	૨૨	૪	
ખાળક,	અંગ્રેજી	ભણેલ પુરુષ,	વેપાર,	નોકરી.		
૫		૪		૧૦	૬	

### ૨૦ કોડારીયા.

આ ગામમાં જૈન ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વસ્તિ:—

ઘર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ પુરુષ,	કુંવારા,	સધવા,
૩	૧૭	૮	૬	૫	૩	૫
વિધવા,	કુંવારી,	વિસા,	ભણેલ પુરુષ,	ભણેલ સ્ત્રી,	ખાળક,	
૧	૩	૧૭	૫		૧	૬
વેપાર,	સામાયક.					
૬	૫					

### લોભડી.

ગામ ૮૪ અને આખા રાજ્યની કુલ વસ્તિ ૩૫૨૮૭ માણુસની છે.

આ શાહેર લોગાવાના ઉપર આવેલું સુંદર બજરો અને સુંદર મકાનોથી સુશોભિત લાગે છે. રાજકર્તાઓ જાલા કુળના પાઠીથી ઉત્તેલ મહુરાણા નામહાર ઢાકેર સાહેબ સર હૌથાતસિંહજી ડે. સી. આઇ. ઈ. જેવા ચતુર રાજ્યી રાજ કરે છે, આ રાજ્ય બીજા વર્ગમાં ગણ્યાય છે. રાજકર્તા લારે બાળાશ અને ધર્મગ્રેમી છે. બ્યવહાર કુશળતા અને વિવેક તો કુદરતે તેમને સુવાંગ અર્પણું કરેલ છે. સામાનું મન હરી લેવાની તેમનામાં વિઘૃત શક્તિ રહેલી છે. આ શહેરની જાહેરલાલી પુરાતન

કાળથી ચાલી આવે છે. એક વખત આખા જાલાવાડમાં તેની અરાધરી કોઈ કરી શકતું ન હતું અને અત્યારે પણ નથી. જુના કાળમાં લીંબડીમાં શેડ નાનજી હુંગરશીની જહોજલાલી લોક મરાહુર હતી તેઓ કોડપતિ કહેવાતા હતા. જેમણે લીંબડીના મહારાણીને બહેન કરી નવ લાખ રૂપિયા તેમના કાપડામાં આપ્યાનું કહેવાય છે. શેડ નાનજી હુંગરશીએ જૈનાચાર્ય શ્રીમાન અજરામરજી સ્વામીને લીંબડીમાં પોતાની ગાદ્યી સ્થાપવા આશ્રહ અને આમંત્રણ કરી પોતે ઉપાશ્રય બાંધી સંપ્રદાય સ્થાપિત કરાવ્યો, સંપ્રદાયની અને એ શેડની ભારે જહોજલાલી જમી. હજુસુધી શેડ નાનજી હુંગરશીના નામથી સંઘનો ઐજે ઉપાડવા સાથે સેવા બજાવવામાં આવે છે. સંઘમાં અગ્રેસર તેમના વંશજે પૈકી શેડ સુખલાલ ચચ્ચભૂજ છે. અને તેમાંથી સંવત ૧૯૫૬ માં જુહા પદેલ સંઘવાિ ઉપાશ્રયના સંઘમાં સંઘવી રવજી ધારશીલાળા આજેવાન લખાય છે. ધાર્મિક સંસ્થાઓમાં શેડના ઉપાશ્રય હસ્ત લિખિત પુસ્તકેનો મોટો સંખ્યા છે જેમાં રૂ. આવશ્યક સૂત્રની તાડપત્ર ઉપર સંવત ૧૯૧૧ ની સાતની હસ્ત લિખિત પ્રત આખા કાઢિયાવાડમાં એકજી જુની અને તાડપત્રની પ્રત છે. સંવત ૧૯૭૬ ની સાતમાં અત્રે બિરાજતા જૈનાચાર્ય શ્રીમાન પૂજ્ય સાહેબ લવજી સ્વામીના દર્શનાંથી જાલાવાડ પ્રાંતના પોલીટીકલ એજન્ટ મેજાર મોસ્ટસ સાહેબ જૈન ઉપાશ્રયનાં આવેલ તે વખતે સદરહુ પ્રતને જેઈ ધણા ખુશી થયા હતા. આ સિવાય “શ્રીમાન અજરામરજી જૈન લાયથ્રેરી, જૈન ઐડીંગ, જૈનશાળાં જેવી સુંદર સંસ્થાઓ પડિતરાજ, કુવિર્ય, પ્રસિદ્ધ વક્તા મરાજાજશી નાનચંદ્રજી સ્વામીના ઉપરેશ અને અથાગ શ્રમથી હસ્ત ધરાવે છે. નાના ઉપાશ્રયમાં પણ હસ્ત લિખિત પુસ્તક લંડાર. છાપેલ પુસ્તકેની તપાદ્યિજી ઉત્તમચંદ્રજી જહેર જૈન લાઈફ્રેરી અને જૈનશાળા વગેરે વિદ્યમાન છે.” બન્ને સંઘને બધે ઉપાશ્રય છે. લીંબડી ગાદીનું ગામ હોઈ પરહેશથી ધણા માણુસો અંવાર નવાર સાધુ પુરુષોના દર્શનાંથી આવ્યાંતા હોવાથી કુચુ લુજના રહીશ શ્રીયુત માનસંગ કચરા-લાઇએ એક લબ્ધ ગેર્સ્ટ હુડિસ (અતિથિ અહુ) બંધાવી આપેલ છે.

દીલગીરી સાથ, લખવાતું કે આટલી લાંખી લાંખી પ્રસ્તાવના લખી  
વર વગરની જન જેવું કર્યું હે કારણ ? વસ્તિપત્રકના આંકડાજ જયાં  
ન મેળે, ઘણી ઉધરાણી કરવા છતાં પત્રકો અરાણાજ નહિં.

લીંખડી અને ગોંડળ એ એ ગાહીના ગામ કહેવાય તે બન્નેના આવા  
ઉપરોગી કાર્યમાં પ્રમાદ ભાગે હીલગીર.

### લીંખડીના મહાલો.

#### ૧ સીયાણી મહાલ.

આ ગામ લીંખડીની ગાહીનું કહેવાય છે. અહિંથી લીંખડી ગાહી  
સ્થાપી. આ ગામ લીંખડી સંપ્રદાયનું છે. ગામમાં ઉપાશ્રય છે, ૧૧  
કાળુ મેઘળ આગેવાન છે, જૈન સ્થાનકવાસીની વસ્તિ:—  
પત્રકો આવ્યા નહિં.

#### ૨ ખરવાળા મહાલ.

આ ગામ ઘેલાસાના નામથી પ્રસિદ્ધ છે. “ઘેલાસાતું ખરવાળુ”  
કહેવાય છે. ઘેલાસાએ ખરવાળાની ચોવીની કાઠિના પાસેથી પડાવી  
લીંખડીને ઘરે કરી હીધી હતી. ઘેલાસા જાતે જૈન સ્થાનકવાસી હસા  
શ્રીમાણી વણુક હતા. ઘેલાસાની જહેજલાલી અને મૃહાઈ આખા કાડિ-  
યાવાડમાં શુપ્રસિદ્ધ છે જમસાહેણની કચેરીમાં થોલા આટકના પલાંઠી  
વાળની અને ખોંખાના કરવાની ખનેલ ખીના સર્વ કોઈના જાણુવામાં છે,  
તેમનો ધર્તિહાસ “સૌરાષ્ટ્ર” ની રસધારા વાંચવા આ સ્થળે લલામણ  
કરી અરુદું છું. આ સ્થળ ઘેલાસાની માઝુક ખરવાળા સંપ્રદાયથી પ્રમિદ  
છે. અહિં અલગ સંપ્રદાય છે. આ સંપ્રદાય લીંખડીથી જુદો પડ્યો છે.  
સાધુ સાંદ્વીની નામાવલી અગાઉ આવી ગઈ છે, અહિં જૈનશાળા તથા  
“શ્રી રામજીરાખ જૈન લાયખેરી” વગેરે ધાર્મિક સંસ્થાઓ છે,  
આગેવાન ઘેલાસાવાળા શર્ણ ચુનીલાલ કસ્લાચંહ છે. જૈન સ્થાનક-  
વાસીની વસ્તિ:—

ધર	માણુસ,	પુરુષ.	સ્ત્રી,	પરણેલ પુરુષ,	વિધુર,
૪૫	૨૧૫	૧૧૮	૬૭	૪૮	૧૪

१४५

કુંવારા,	સધવા,	વિધવા,	કુંવારી,	વિસા,	દસા,	ભાવસાર,
૫૬	૪૧	૨૮	૨૮	૧૩	૧૮૨	૨૦
ભણેલ પુરુષ,	ભણેલ સ્ત્રી,	બાળક,	અંગેજ ભણેલ,	ડીથી,		
૧૦૦	૩૨	૩૬	૪			૧.
વેપાર.	નોકરી,	પડિકમણું,	સામાયક.			
૧૧૨	૬	૪૫	૬૬			

### ૩ પાણુસીણું મહાલ.

આ ગામ લીખડી સંપ્રદાયમાં છે, ગામમાં ઉપાશ્રય તેમજ દીપ-  
ચંદ્રજ જેન લાઇંબેરી છે, આગેવાનમાં શોડ જવાણું સંધજનું નામ  
ચાલે છે. જૈન સ્થાનકવાસીની વસ્તિ:— ઘર ૪૦, માણુસ ૧૫૦

### ૪ મુળ બાવળા.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વસ્તિ:—

ઘર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પુરુષ પરણેલ,	કુંવારા,
૨	૬	૬	૩	૨	૪
સધવા,	વિધવા,	બધા દસા,	ભણેલ પુરુષ,	ભણેલ સ્ત્રી,	
૨	૧	૬	૫		૧
બાળક,	વેપાર,	પડિકમણું	સામાયક		
૧	૬	૧	૩		

### ૫ બાવળી.

આ ગામમાં ઉપાશ્રય મળનો મેડીબંધ છે, જૈન સ્થાનક-  
વાસીની વસ્તિ:—

ઘર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ પુરુષ,	વિધુર,	કુંવારા,
૬	૪૨	૨૪	૧૮	૭	૮	૧૫
સધવા	વિધવા,	કુંવારી,	બધા દસા,	ભણેલ પુરુષ,	ભણેલ સ્ત્રી,	
૭	૫	૬	૪૨	૧૮	૫	

બાળક,	વેપાર,	પડિકમણું	સામાયક
૧૧	, ૨૪	૧	૨૨

### ૧. હૃડાળા.

આ ગામમાં ઉપાશ્રય છે. જૈન સ્થાનકવાસીની વસ્તિ:—

ઘર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણોલ પુરુષ,	વિધુર,	કુંવારા,	
૧૩	૭૦	૩૮	૩૧	<	'	૨	૨૩

સધવા.	વિધવા.	કુંવારી.	દસા,	ભણોલ પુરુષ,	લણોલ સ્ત્રી,
૧૨	૭	૧૨	૭૦	૩૫	૩

બાળક,	વેપાર,	નોકરી.
૪	૩૫	૨

### ૨. મોળદા.

આ 'ગામમાં ઉપાશ્રય છે. જૈન સ્થાનકવાસીની વસ્તિ:—

ઘર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણોલ પુરુષ,	વિધુર,	કુંવારા,
૧૪	૫૧	૨૮	૧૩	૭	૩	૧૮

સધવા,	વિધવા,	કુંવારી,	દસા,	ભણોલ પુરુષ,	લણોલ સ્ત્રી,
૭	<	<	૫૧	૨૪	૨

બાળક,	વેપાર,	નોકરી.
૧૨	૧૫	૧

### ૩. ગલથલ.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વસ્તિ:—

ઘર,	માણુસ	પુરુષ,	સ્ત્રી,	પરણોલ પુરુષ,	કુંવારા,	સધવા,
૧	<	૫	૩	૨	૩	૨

વિધવા,	દસા,	ભણોલ પુરુષ,	લણોલ સ્ત્રી,	બાળક,	વેપાર,
૧	<	૩	૨	૨	૫

પડિકમણું,	સામાયક.
૧	૪

૧૪૭

#### ૪ અળોદ્ધ.

આ ગામમાં ઉપાશ્રય નથી, જૈન સ્થાનકુવાસીની વર્તિઃ—

ધર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ પુરુષ,	કુંવારો,	સધવા,
૧	૭	૩	૪	૨	૧	૨
કુંવારી,	હસા,	ભણેલ પુરુષ,	ભણેલ સ્ત્રી,	બાળક,	વેપાર,	
૨	૭	૦	૨	૧	૩	૨

પડિકમણું, સામાયક.

૧

#### ૧ રંગપુર.

આ ગામમાં ઉપાશ્રય ધણો સરસ છે, લીંબડીના ચોમાસા થાય છે. અગ્રેસર શા. પિતામહર જસરાજ લખાય છે. આ ગામમાં જૈન સ્થાનકુવાસીની વર્તિઃ—

ધર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ પુરુષ,	વિધુર,	કુંવારા,
૧૬	૭૩	૪૧	૩૨	૧૭	૪૧	૨૧
સધવા,	વિધવા,	કુંવારી,	બધા હસા	ભણેલ પુરુષ,		
૧૭	૨	૧૩	૭૩	૩૮		
ભણેલ સ્ત્રી,	બાળક,	અંગ્રેજ ભણેલ પુરુષ,	વેપાર,	નેકરી,		
૧૦	૧૧	૧	૩૭	૩		

પડિકમણું, સામાયક.

૧૭

#### વઢવાણ.

ગામ ત૨ અને આખા રાજ્યની કુલ વક્તિ ૩૪૮૫૭ માણુસની છે.

ભોગ્યવાના કંડા ઉપર આવેલ જાલાવાડ પ્રાંતમાં જાલારાજનું ઘીણ વર્ગનું આ રાજ, છે. રાજકર્તા પ્રાંગંધ્રાથી ઉત્તરેલ મહારાણા નામદાર ઠાકોર સાહેબ જેરાવરસિંહજી રાજ કરે છે. ઠાકોર સાહેબ ધણું દ્યાણ અને દીલાવર દીલના ધર્માત્મા હેવાથી રામરાજ્ય વર્તે છે, તેમના લલા શુણો.

માટે ધારું લખી શકાય તેવું છે. રાજ ખરેખર પાર્થીમણ્યું છે. આ શાહેર હિન્દુઓના બેરથી ધારું પ્રસિદ્ધ છે, 'લોકો શ્રીમંત છે તેમાં પણ ખાસ કરીને જૈન પ્રજ્ઞ આગાળા પડતી છે, આ ગામભમાં છ કોટી અને આઠ કોટી એમ એ પક્ષ છે એમાં છ કોટીમાં ડોસા વોરાનો અને કાકાનો એમ એ ઝાંટા છે એટલે કે સરવાલે ત્રણું ઉપાશ્રય છે, ડોસા વોરાના ઉપાશ્રયમાં કંભિટિથી કામ ચાલે છે, કાકાના ઉપાશ્રયમાં વોરા સુંદરજી ધનજી અને આઠ કોટી હરીયાપુરીના નામથી ઓળખાતા ઉપાશ્રયમાં<sup>૧૨</sup> નાથા ભવાનમાં ઝુંઝા વેલંશાના વીરચંદલાઈ આગેવાન છે. ત્રણું ઉપાશ્રય, લાયેરી અને જૈનશાળાઓ છે. આ ગામભમાં જૈન સ્થાનકવાસીની વસ્તિ નીચે પ્રમાણે ત્રણું સંઘની જુદી જુદી છે.

### લીંબડી ડોસા વોરાનો સંધ.

ધર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ પુરુષ,	વિધુર પુરુષ,	કુવારા,
૧૩૬	૬૮૩	૩૭૫	૩૦૮	૧૩૬	૩૨	૨૦૭

સંધવા,	'વિધવા,	કુવારી,	વિસા શ્રીમાલી,	દસા શ્રીમાલી,
૧૩૬	૫૭	૧૧૫	૪૨૦	૨૭૬

ભાવસાર,	ભણેલ પુરુષ,	ભણેલ સ્ત્રી,	ખાળક,	અંગ્રેજી ભણેલ પુરુષ,
૨૭	૩૨૦	૧૩૩	૬૭	૬૬

ડીબા,	વેપાર,	નોકરી,	દાકતર,	વકીલ,	પડિકમણા,	સામાયક.
૫	૨૮૪	૮૬	૧	૧	૧૦૧	૨૨૪

**નોટ:**—ઉપરનું વસ્તિપત્રક એક લીંબડી સંધનું જ છે. ખાકી હરીયાપુરી (આઠ કોટી) અને કાકાના ઉપાશ્રયના સંઘને ધારું ધારું સમજાવવા છતાં ન કરી આપવાથી અહિં છાપી શક્યા નથી. છેવટ કેન્દ્રરન્સ તરફથી ઉપદેશક આવી ખુલ્ય મયાસ કરવા છતાં પરિણામ સૂચ્ય આંધું. કેટલાક મહાશયો પેપરેમાં આર્ટિકલો આપી નાહક વગોવણી કરી સંઘમાં અશાન્તિ અને ઘોંઘાટ ઉલો કરે છે. તેના કરતાં આવા સામાજિક કાર્યમાં વેર વેર કરી પોતાનો ઝાળો આપે તો કેટલી સંધ સેવા અન્યાની શકાય ? તે સહજ છે.

## વઠવાણુના મૂહાલો.

### ૧ નાગનેસ મહાલ.

આ ગામ ભાઈર નહીના કાઠે આવેલું છે અરવાળા સંપ્રદાયનું અતુરાગી છે, ગામમાં ઉપાશ્રય છે, જૈન સ્થાનકવાસીની વસ્તિ:—

ધર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ પુરુષ,	વિધુર,	કુંવારા,	સંધવા,
૫૮	૨૫૨	૧૪૮	૧૦૪	૫૪	૧૨	૮૨૦	૩૭

વિધવા,	કુંવારી,	વિસા શ્રીમાલી,	દસા શ્રીમાલી,	ભાવસાર,
૨૪	૪૩	૭૫	૧૧૪	૬૩

ભણેલ પુરુષ,	ભણેલ સ્ત્રી,		બાળક,	અંગ્રેજી ભણેલ પુરુષ,
૧૨૪	૫૦		૩૧	૩૩

ડાઢી	વેપાર,	નોકરી,	પડિકમણા,	સામાયક.
૨	૧૩૭	૧૧	૫૮	૧૫૮

### ૨ મોટી વાવડી.

આ ગામ એટાફ સંપ્રદાયનું છે. ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વસ્તિ:—

ધર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ પુરુષ,	વિધુર,	કુંવારા,
૬	૪૨	૨૬	૧૬	૫	૧	૨૦

સંધવા,	વિધવા,	કુંવારી,	વિસા,	દસા,	ભણેલ પુરુષ,	ભણેલ સ્ત્રી,
૩	૫	૮	૨૮	૧૪	૨૨	૩

બાળક,	વેપાર,	નોકરી,	પડિકમણા,	સામાયક.
૬	૧૬	૧	૨	૮

### ૩ ઝોડીયા.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વસ્તિ: -

ધર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ પુરુષ,	કુંવારા,	સંધવા,
૨	૬	૬	૩	૩	૩	૩

દસા, ભણેલ પુરુષ, બાળક, વેપાર.  
૬. ૩ ૨ ૪

#### ૪ અરાનીયા.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનરવાસીની વસ્તિ:—

ધર, માણુસ, પુરુષ, સ્ત્રી, કુંવારો, વિધવા, દસા,  
૧ ૨ ૧ ૧ ૧ ૧ ૨

લણેલ પુરુષ. વેપાર. સામાયક.  
૧ ૧ ૧

#### ૫ માલખુપુર.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વસ્તિ:—

ધર, માણુસ, પુરુષ, સ્ત્રી, પરણેલ પુરુષ, સધવા, કુંવારી,  
૧ ૫ ૨ ૩ ૨ ૨ ૧

વિસા શ્રીમાલી, ભણેલ પુરુષ, બાળક, વેપાર. સામાયક.  
૫ ૨ ૧ ૨ ૩

#### ૨ રામપુરા મહાલ.

આ ગામ લીંખડી સંપ્રદાયનું ખાસ રાગી છે, ઉપાશ્રય અને “શ્રી લદજી સ્વામી જૈન સ્થાનકવાસી લાઇઝેરી” છે. અગ્રે-સર શા. પિતામહર હીરા અને નથુ હેવા લખાય છે, જૈન સ્થાનકવાસીની વસ્તિ:—

ધર, માણુસ, પુરુષ, સ્ત્રી, પરણેલ પુરુષ, વિધુર, કુંવારા,  
૩૦ ૧૩૩ ૭૧ ૬૨ ૨૩ ૫ ૪૩

સધવા, વિધવા, કુંવારી, વિસા, દસા, લણેલ પુરુષ, ભણેલ સ્ત્રી,  
૨૨ ૧૩ ૨૭ ૪૨ ૬૧ ૬૭ ૦ ૨૨

બાળક, અગ્રેજી લણેલ પુરુષ, વેપાર, નોકરી, પડિકમણું, સામાયક.  
૨૩ ૬ ૧૨૭ ૬ ૧૦ ૫૩

## ૨ વસ્તડી.

આ ગામમાં ઉપાશ્રય ઘણો સુંહર છે. લીંખડી સંપ્રદાયનાં ચોમાસા થાય છે. “લવળું સ્વામી જૈન સ્થાનકવાસી લાયજ્ઝેરી” છે. જૈન સ્થાનકવાસીની વસ્તિ:—

ધર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ પુરુષ,	વિધુર	કુંવારા,
૧૦	૪૮	૨૫૦	૨૩	૬	૫	૧૧

સધવા,	વિધવા,	કુંવારી,	ખધા હસા,	ભણેલ પુરુષ,	અણેલ સ્ત્રી,
૬	૩	૧૧	૪૮	૨૧	૫

બાળક,	વેપાર,	સામયક.
૧૫	૧૮	૧૬

## ૩ ખોલડીયાદ.

આ ગામમાં ઉપાશ્રય પડી ગયેલ છે. આડ કોઈનું ક્ષેત્ર છે. જૈન સ્થાનકવાસીની વસ્તિ:—

ધર	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ પુરુષ.	વિધુર,
૫	૪૨	૨૪	૧૮	૬	૧

કુંવારા,	સધવા,	વિધવા,	કુંવારી,	વિસા શ્રીમાલી,	હસા,
૧૪	૬	૪	૫	૩૧	૧૧

ભણેલ પુરુષ,	ભણેલ સ્ત્રી,	બાળક,	અંગ્રેજુ ભણેલ પુરુષ,	વેપાર
૨૧,	૫	૧૧	૨	૧૨

પડિકમણૂં,	સામયક.
	૧૭

## ૪ બલદાયા.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વસ્તિ:—

ધર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ પુરુષ,	વિધુર,	કુંવારો,
૪	૧૮	૭	૧૧	૫	૧	૧

સધવા,	વિધવા,	કુંવારી,	હસા	ભણેલ પુરુષ,	ભણેલ સ્ત્રી,
૫	૧	૫	૧૮	૭	૨

१५२

બાળક,	વેપાર,	નોકરી,	પડિકમણું,	સામાયક.
१	३	३'	२	१२

#### ૫ મુંડપર.

આ ગામમાં ઉપાશ્રય ઘણો સરસ છે, જૈન સ્થાનકવાસીની વસ્તિ:—

ધર	માણુસ	પુરુષ	સ્ત્રી	પરણેલ પુરુષ,	વિધુર,	કુંવારા,
૫	૧૮	૮	૧૦	૪'	૧	૩

---

સધવા,	વિધવા,	કુંવારી,	દસા,	ભણેલ પુરુષ,	ભણેલ સ્ત્રી,
૪	૪	૨	૧૮	૮	૩

બાળક,	વેપાર.	નોકરી,	પડિકમણું,	સામાયક.
૧	૬	૧	૩	૧૨

#### ૬ સમઠીયાળા.

આ ગામમાં ઉપાશ્રય છે. જૈન સ્થાનકવાસોના વસ્તિ:—

ધર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ પુરુષ,	વિધુર
૨	૨૦	૧૨	૮	૩	૧

---

કુંવારા,	સધવા,	કુંવારી,	દસા,	ભણેલ પુરુષ,	ભણેલ સ્ત્રી,	બાળક
૮	૩	૪	૨૦	૧૧	૨	૬

---

અંગ્રેજી	ભણેલ,	વેપાર,	નોકરી,	સામાયક.
૩	૧૧	૧	૧	૧૩

#### ૭ કોરડા.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વસ્તિ:—

ધર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ પુરુષ,	કુંવારા,	સધવા,
૩	૧૧	૬	૫	૩	૨	૩

---

પિંવા,	કુંવારી,	બંગા	દસા,	ભણેલ પુરુષ,	ભણેલ સ્ત્રી,
૨	૧	૧૧	૬	૦	૧

---

બાળક,	અંગ્રેજી	ભણેલ,	વેપાર,	નોકરી,	પડિકમણું	સામાયક.
૧	૧	૩	૩	૨	૨	૫

## ૮ ખારવા.

આ ગામમાં જૈન ઉપાશ્રય છે. આડ કોટીનું ક્ષેત્ર છે. જૈન સ્થાનક  
વાસીની વર્સ્તિ:-

ઘર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પુરુષ પરણેલ	વિધુર,	કુંવારુ,
૮	૪૨	૧૬	૨૬	૮	૧	૭

સધવા,	વિધવા,	કુંવારી,	વિસા શ્રીમાલી,	લણેલ પુરુષ,
૮	૩	૧૫	૪૨	૧૩

લણેલ સ્ત્રી	ખાળક,	વેપાર,	પદિકમણ્ણા,	સામાયક.
૮	૧૩	૧૦	૧૦	૧૩

## ૯ ટીંબા.

આ ગામમાં ઉપાશ્રય નથી. અહિં જૈન સ્થાનકવાસીની વર્સ્તિ:-

ઘર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ પુરુષ,	કુંવાચુ,	સધવા,
૩	૧૬	૧૦	૬	૨	૮	૨

વિધવા,	કુંવારી,	વિસા,	હસા	લણેલ પુરુષ	લણેલ સ્ત્રી,	ખાળક,
૩	૧	૬	૭	૮	૨	૧

વેપાર,	પદિકમણ્ણા,	સામાયક.
૪	૩	૬

## ૧૦ વાધેલા.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વર્સ્તિ:-

ઘર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	કુંવારુ,	વિધવા,	હસા,
૧	૨	૧	૧	૧	૧	૨

લણેલ,	પુરુષ,	વેપાર.
૧	૧	

## ૧૧ જેરાવરનગર.

આ શહેર દરજે ગામ સં. ૧૯૭૬ ની સાતમાં ના. ડાકોર સાહેબ  
જેરાવરસિંહજીના નામથી વઢવાણ અને કેમ્પની વચ્ચે હિવાન સાહેબ

રા. અનુપચંહ જગળવન મોહી બી. એ., એલ. એલ. બી. ના  
વખતમાં વસાવેલ છે. ગામની ખાંપણી સરસ છે, ખરેખર સેનીટેડીયમ  
( ક્ષયના દરહીઓને રહેવા લાયક ) બને તેથું છે. અહિં ઉપાશ્રય અપૂર્ણ  
પડેલ છે. જૈન સ્થાનકવાસીની વસ્તિઃ—

ઘર.	માણુસ,	પુરુષ.	સ્ત્રી,	પરણેલ પુરુષ,	વિધુર,	કુંવારા,
૧૬	૧૦૪	૫૮	૪૬	૨૨	૬	૩૦

સધવા,	વિધુવા,	કુંવારી,	વિસા,	દસા,	ભાવસાર,	લણેલ પુરુષ,
૨૨	૬	૧૮	૩૮	૫૮	૭	૫૧

લણેલ સ્ત્રી,	આગક,	અંગેજ ભણેલ પુરુષો,	વેપાર,	નોકરી,
૧૦	૩૭	૧૦	૩૫	૬

પડિકમણ્ણા,	સામાયક.
૧૩	૨૬

### ૩ ઐદુ મહાલ.

આ ગામ વઠવાણુની મુળ રાજધાનીનું છે, અહિંથી ગાહી વઠવાણુ  
સ્થાપી. આ ગામ લીંબડી સંપ્રદાયનું અનુરૂપી છે. ગામમાં ઉપાશ્રય છે.  
આગેવાન રાહેરી તરીકે પરાપૂર્વીની ડગલી લાદ્યા કુપુર નગરશીઠ ગણુય  
છે. તેમના પૌત્ર ડગલી ભણીલાલ વીરપાળ હુલ કામ કરે છે. જૈન  
સ્થાનકવાસીની વસ્તિઃ—

ઘર.	માણુસ.	પુરુષ.	સ્ત્રી.	પરણેલ પુરુષ.	વિધુર,	કુંવારા,
૧૬	૧૦૨	૫૦	૫૨	૧૭.	૭	૨૬

સધવા.	વિધવા,	કુંવારી,	વિસા શ્રીમાલી,	દસા.	લણેલ પુરુષ.
૧૭	૧૭	૧૮	૧૫.	૮૭	૪૧

લણેલ સ્ત્રી,	આગક,	અંગેજ ભણેલ પુરુષ.	વેપાર.	નોકરી,
૬	૨૧	૪	૨૬૦	૬

પડિકમણ્ણા,	સામાયક.
૧૦	૬૫

૧૫૫

### ૨ વેળાવદર.

આ ગામમાં ઉપાશ્રય નથી, જૈન સ્થાનકવાસીની વસ્તિ:—

ધર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણોલ પુરુષ,	કુંવારા,	સધવા,
૫	૩૭	૧૬	૨૧	૧૦	૬	૧૦

વિધવા,	કુંવારી	દસા	ભણેલ પુરુષ,	ભણેલ સ્ત્રી,	'ખાળક,
૬	૫	૩૭	૧૫	૧૧	૨

વેપાર.	નેકરી,	સામાયક.
૭	૨	૪

### ૩ કંડુડા.

આ ગામમાં જૈન ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વસ્તિ:—

ધર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણોલ પુરુષ,	કુંવારા પુરુષ,	સધવા,
૫	૧૭	૮	૮	૩	૫	૩

વિધવા,	કુંવારી,	દસા,	ભણેલ પુરુષ,	વેપાર,
૩	૩	૧૭	૮	૮

પડિકમણું, સામાયક.  
૧                   ૮

### ૪ લંડુડા.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વાસ્તિ:—

ધર.	માણુસ.	પુરુષ.	વિધુર,	કુંવારી,	દસા,	ભણેલ પુરુષ,
૧	૨	૨	૧	૧	૨	૨

વેપાર.	•
૨	

### ૫ આપોદરા.

આ ગામમાં ઉપાશ્રય સામાન્ય છે. આઠ કોટીનું રાગી છે. જૈન સ્થાનકવાસીની વસ્તિ:—

१५६

धर, माणुस, पुरुष स्त्री, परणेल पुरुष, विधुर डुंवारा,  
८ ४१, २८ १३ ७ २ १६

संधवा, विधवा, डुंवारी, विसा, हसा, लणेल पुरुष, लणेल स्त्री,  
७ ४ २ ८ ३३ २८ ८

बाणक, अंग्रेज लणेल पुरुष, वेपार, नोकरी, पडिकमण्य, सामायक.  
५ ३ ७ ३ १ १४

### ६ भेमक।

आ गाममां उपाश्रय नथो. जैन स्थानकवाचीनी वस्ति:—

धर, माणुस, पुरुष, स्त्री, परणेल पुरुष, डुंवारा, संधवा, विधवा,  
२ १४ ८ ६ ३ ५ ३ १

डुंवारी, विसा, लणेल पुरुष, बाणक, वेपार, सामायक.  
२ १४ ४ ४ ४ २

### ७ केराण।

आ गाम नामहार डुमार श्री अन्नोसांहुज्ञतु छे. गाममां वढ-  
वाणुवाणा शाहु डाया जेठाए उपाश्रय नवो कराठयो छे. सुंदर छे.  
जैन स्थानकवाचीनी वस्ति:—

धर, माणुस, पुरुष, स्त्री, लणेल पुरुष, विधुर, डुंवारा, संधवा,  
३ १५ १० ५ २ १ ७ २

विधवा, डुंवारी, हसा, लणेल पुरुष, लणेल स्त्री, वेपार,  
१ २ १५ १० १ ६

नोकरी, सामायक.  
४ २

### ८ देदादरा।

आ गाम राणुश्री जलभस्त्रिंहुज्ञ भाष्वर्सांहुज्ञतु छे,  
आ गाममां उपाश्रय छे. ४ केटी आठकोट अन्ने अन्ने पक्ष छे. उपा-  
श्रय एक छे. जैन स्थानकवाचीनी वस्ति:—

१५७

धर,	माणुस,	पुरुष,	स्त्री,	परणेल पुरुष,	निधुर,	कुंवारा,	संधवा,
१३	७४	३६	३८	१९	५	२०	११
विधवा	कुंवारी,	दूसा	श्रीमाणी,	हस्त,	लणेल पुरुष,	लणेल स्त्री,	
६	२१	५०	२४	३१	८		
बाणक,	वेपार,	पडिकमण्डा,			सामायक.		
१५	२३	८			१६		

### ८ कोठारीया।

आ गाम नामहार कुमारकी कुनुखासाईनु छे, गाममां उपाश्रय नथी. जैन स्थानकवासीनी वस्ति:—

धर,	माणुस,	पुरुष,	स्त्री,	परणेल पुरुष,	कुंवारा,	संधवा,
१	६	४	२	१	३	१
कुंवारी,	दूसा,	लणेल पुरुष,	बाणक,	वेपार.	सामायक.	
१	६	३	१	१	१	



### वटवाणु भायात.

२१४५२.

आ ३ गामनो वटवाणुथी उतरेल छढा वर्गनो अणतीयारी तालुको छे, आलावाड प्रांतमां छे. तालुकहार आला चांद्रसिंहल मानसिंहल छे. आ गाम लींगडी संघवीना उपाश्रयनु राठी हो. गाममां उपाश्रय तथा स्थानकमां लाईछेरी छे. जैन स्थानकवासीनी वस्ति:—

धर,	माणुस,	पुरुष,	स्त्री,	परणेल पुरुष,	कुंवारा,
१०	५१	२६	२२	१३	१६
संधवा,	विधवा,	कुंवारी,	दूसा,	लणेल पुरुष,	लणेल स्त्री,
१३	१	८	५१	२०	६

ખાણક, અંગ્રેજ લણેલ પુરુષ, વેપાર, નોકરી, પાડેકમણૂ,  
૧૪ ૧ ૨૩ ૩ ૧૧  
ખાડી સામાયક.

### લખતર.

ગામ અને આખા રાજ્યની કુલ વસ્તિ ૧૯૭૧૪ માણુસની છે.

આ સંસ્થાન સોંઠ ઈલાકાની પૂર્વ દિશામાં ગુજરાતની સરહદ ઉપર આવેલ ગ્રીન વર્ગનું જાલા રાજ્યનું રાજ છે. રાજકર્તા ધાંગધાંશ્રી ઉત્તરેલ મહારાણા ડાઝેર સાહેબ બલવીરસિંહજળ રાજ કરે છે. આ ગામ આઠકાટી (દરીયાપુરી) સંપ્રદાયનું છે. ઉપાશ્રય ૧ પુરુષને છે. છકોટીના પણ થોડાંક ઘર છે તેને લઈ છકોટીના પણ ચોમાસા વખતો-વખત થાય છે. આગેવાને પૈકી દરીયાપુરી આઠકાટીમાં શા. કાળું અ-મરદી અને છકોટીમાં શેડ ગોકળ લધુ અને વડીલ વદ્ધમાન નેસંગ છે.

પત્રકો મોકલી અનેક ઉધરાણી કરવા છતાં પત્રકો ભરાછ ન આવવા માટે દીલગીર.

### લખતરના મહાલો.

#### ૧ થાન મહાલ.

આ ગામ પંચાલ ભૂમિમાં અનલગઠ દુંગરની પાસે લખતરની રાજ્યધાનીનું ગામ છે. હાલ ગાહી લખતર સ્થાપીત થયેલ છે. આ ગામ લીઓડી સંપ્રદાયનું છે. ગામમાં જૈન ઉપાશ્રય એ અને ધાર્મિક સંસ્થામાં “શ્રી ઉમેહચંદ્રજળ જૈન પુસ્તકાલય અને નૈનશાળા” વગેરે સંસ્થાઓ છે. અંગ્રેસરમાં શાહ અંભાવીદાસ નાથા અને ગોપાળજળ લાડકા લખાય છે. જૈન સ્થાનકવાસીની વસ્તિ:—

ઘર, માણુસ, પુરુષ, સ્ત્રી, પરણેલ પુરુષ, વિધુર, ઇંવારા, સધવા,  
૭૦ ૫૧૧ ૨૨૦ ૨૬૧ ૮૧ ૧૩ ૧૨૬ ૮૧

વિધવા,	કુંવારી,	દસ્તા,	લણેલ પુરુષ,	લણેલ સ્ત્રી,
૧૮	૬૨	૫૧૧	૧૮૭	૬૭

૧૫૬

આગંક, અંગ્રેજુલાણુલ પુરૂષ, વેપાર, નોકરી, પડિકમણુ,  
૬૬ ૩૭ ૧૯૧ ૩૦ ૩૦

આમાયક.  
૧૭૩

### સાયલા.

ગામ ૪૨ અને આખા રાજ્યની કુલ વસ્તિ ૧૧૬૬૧ માણુસની છે.

આ સંસ્થાન આલાવાડ પ્રાંતમાં આલા રાજ્યનું ત્રીજી વર્ગનું રાજ ગણ્યું છે, રાજ કર્તાં પ્રાંગભ્રાથી ઉત્તેલ મહારાણા ઠાકેર સાહેબ મહાર-  
સિંહદ્રૂ રાજ કરે છે, વિવેક અને કામ કરવાની ખુલ્લી માટે સાયલા પ્રણયાત છે, ખરેખર કુદરતે હૃથ ધોઈ નાખ્યા છે. આ ગામમાં છકોટી,  
આડકોટી, (૧) છકોટી પૈકી લીંબડી અને સાયલા સંપ્રદાયો બન્ને  
મળી ત્રણું સંધ છે. સાયલા સંધાડો લીંબડીમાંથી નીકલ્યો છે.  
ત્રણું ઉપાશ્રયે અલગ અલગ એકી સાથે ચોમાસા થાય છે. લીંબડી  
ઉપાશ્રયમાં શ્રી દેવચંદ્રદ્રૂ જૈન લાઇથેરી અને સાયલા ઉપાશ્રયમાં શ્રી  
મેધસુનિ જૈનશાળા તથા દરીયાપુરી ઉપાશ્રયમાં જૈનશાળા વગેરે સંસ્થાઓ  
છે. ત્રણું સંધને બબે ઉપાશ્રયો છે. છ કોટીમાં લીંબડી સંધમાં શેડવાળા  
અને સાયલા સંધાડાના ઉપાશ્રયના સંધમાં શા. ગોબરા હોયર અને  
આડકોટી સંધમાં રથાશાવાળા વગેરે આગેવાનો છે. આ ગામમાં જૈન  
સ્થાનકુવાસીની વસ્તિ:-

પત્રકે મોકલી અનેક ઉઘરાણી કરવા છતાં પત્રકે ભરાઈ ન આવવા  
માટે હીનુંદીર. નામહાર ઠાકેર સાહેબે પરગણુમાંથી ભરાવી મોકલવા માટે  
જૈનોએ તેમને ઉપકાર માનવો ધેણે છે.

### સાયલાનાં મહાલ.

#### ૧ સરા.

આ ગામ સાયલાની ગાઢીનું છે. માથકુથી મહારાણા શ્રી  
સેંસાલાઈએ સરા આવી નિવાસ કર્યો. ત્યાંથી સાયલા જમાન્યું. આ  
ગામ લીંબડીનું રાગી છે. ઉપાશ્રય છે. અહી જૈન સ્થાનકુવાસીની વસ્તિ:-

૧૬૦

ઘર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ પુરુષ,	વિધુર,	કુંવારા,
૨૫	૧૨૬	૬૯	૬૦	૧૭	૭	૩૫
સધવા,	વિધવા,	કુંવારી,	દસા,	ભણેલ પુરુષ,	ભણેલ સ્ત્રી,	
, ૨૭	૧૦	૨૩	૧૨૬	૬૩		૪
ભાળક,	વેપાર,	નોકરી,	સામાયક.			
૩૭	૬૮	૧	૮૭			

## ૨ હેઠીયા.

આ ગામમાં ઉપાશ્રય છે. લોખડીનું રાગી છે. ઉપાશ્રય ઘણૂં સરસ છે, અથેસર ગોઝળીયા નારણું ઝુંદરજી છે. જૈન સ્થાનકવાસીની વસ્તિ:-

ઘર,	માણુસ	પુરુષ	સ્ત્રી	પરણેલ પુરુષ,	વિધુર,	કુંવારા,
૪	૧૨૫	૮	૬	૨	૩	૪
સધવા,	કુંવારી,	દસા,	ભણેલ પુરુષ,	ભણેલ સ્ત્રી,		
૨	૪	૧૫	૮			૧
ભાળક,	વેપાર.	પડિકમણ્ણા,	સામાયક.			
૩	૬	૩	૩			

## ૩ નારીયાણા.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વસ્તિ:-

ઘર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ પુરુષ,	વિધુર,	કુંવારી,
૪	૭	૪	૩	૧	૨	૧
સધવા,	વિધવા,	.	દસા	ભાવસાર	ભણેલ પુરુષ,	
૧	૨		૪	૩		૩
ભણેલ સ્ત્રી,	વેપાર,					
૧	૪					

१६२

#### ४ वर्षतपर.

आ गाममां उपाश्रय नथी. जैन स्थानकवासीनी वस्तिः—

धर,	माणुस,	पुरुष,	खी,	परणेल	पुरुष,	विधुर	कुंवारा,
३	१३	६	७	३	१	१	२
सधवा	विधवा,	कुंवारी,	हसा,	लणेल	पुरुष,	लणेल	खी,
३	२	०२	१३	५	५	१	
आणक,	वेपार,						
८	६						

#### ५ खाखराथल.

आ गाममां उपाश्रय नथी. जैन स्थानकवासीनी वस्तिः—

धर,	माणुस,	पुरुष,	खी,	परणेल	पुरुष,	कुंवारा,	सधवा,
१	११	६	५	३	३	३	३
कुंवारी,	हसा,	लणेल	पुरुष,	वेपार,			सामायक.
२	११		६	६			११

#### ६ खाटडी.

आ गाममां उपाश्रय नथी. जैन स्थानकवासीनी वस्तिः—

धर,	माणुस,	पुरुष,	खी,	पुरुष परणेल,	विधुर,
४	३५	२३	१२	५	१
कुंवारा,	सधवा,	विधवा,	कुंवारी.	विसा,	हसा,
१७	५	२	५	३१	४
लणेल	पुरुष,	लणेल	खी;	आणक,	वेपार,
१७	५		८	१३	२
सामायक,					
१२					



## ચુડા.

ગામ ૫૪ અને આખા રાજ્યની કુલ વस્તિ ૧૨૦૦૫ માણુસની છે.  
આ ગામ આલાવાડ પ્રાંતમાં આવેલું ત્રીજ વર્ગનું રાજ છે. રાજ  
કર્તા વઠવાણુથી ઉત્તેલ છે. હાલના સગીર ડાકોએ સાહેબ બાહુદુર સિંહજળ  
રાજકોટ રાજકુમાર કેલેજમાં લખે છે. આ ગામને સ્થાનિક સંપ્રદાય  
ગાણ્યાતો હતો. આ સંપ્રદાય લીંબડીથી નીકળી ચુડા જાહી સ્થાપી તે  
ગાણ્યા થાદ, સં. ૧૬૮૭ ની સાલમાં નાણું થચ્યો. અહિને સાધુઓનો જીનો  
પુસ્તક લંડાર સંઘના કૃષ્ણજનમાં છે. લંડારને ચાર તાળા મારી કેદ કર્યો છે.  
કોઈને ઉપયોગી નથી. ધાર્મિક સંસ્થામાં એક જૈન કન્યાશાળા ચાલે છે. બાકી  
ઉપાશ્રય એ છે. છેઠોટી લીંબડી સંપ્રદાય મતના છે. અગ્રેસર ગોસલીયા,  
ગાંધી અને અંધાર વગેરે છે. આ ગામમાં જૈન સ્થાનકવાસીની વસ્તિ:—  
ધર, માણુસ, પુરુષ, સ્ત્રી, પરણેલ પુરુષ, વિધુર પુરુષ, કુંવાર,  
૬૫ ૪૧૩ ૨૪૨ ૧૭૧ ૮૧ ૪૬ ૧૧૨

સંધવા,	વિધવા,	કુંવારી,	ભણેલ પુરુષ,	ભણેલ સ્ત્રી,
૭૨	૪૪	૫૫	૧૬૫	૧૦૮
આણક,	વેપાર,	નોકરી,	પડિકમણ્ણા,	સામાયક.
૮૨	૬૦	૨૨	૧૫	૨૪૨

## ચુડા રાજ્યના ગામો.

## ૧ ભડકવા.

આ ગામમાં ઉપાશ્રય છે. જૈન સ્થાનકવાસીની વસ્તિ:—
ધર, માણુસ, પુરુષ, સ્ત્રી, પરણેલ પુરુષ, વિધુર, કુંવાર,
૫ ૨૬ ૧૬ ૧૩ ૪ ૨ ૧૦
સંધવા વિધવા, કુંવારી, હસા શ્રીમાર્ણી, ભણેલ પુરુષ, આણક,
૪ ૪ ૫ ૨૬ ૧૫ ૩
અગ્રેજ ભણેલ પુરુષ, વેપાર, નોકરી, પડિકમણ્ણા, સામાયક.
૨ ૧૨ ૪ ૮ ૧૩

૧૬૩

### ૨ છત્રીયાળા.

આ ગામમાં ઉપાશ્રય છે. જૈન સ્થાનકવાસીની વસ્તિ:—

ઘર	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ પુરુષ.	કુંવારા,
૫	૨૮	૧૧	૧૭	૪	૭
સધવા,	વિધવા,	કુંવારી,	દસા શ્રીમાણી,	ભણેલ પુરુષ,	
૪	૪	૬	૨૮	૧૦	
ભણેલ સ્ત્રી,	ખાલક,	વેપાર	સામાયક.		
૩	૫	૬	૧૪		

### ૩ ગોખરવાળા.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વસ્તિ:—

ઘર,	માણુસ	પુરુષ,	સ્ત્રી,	પરણેલ પુરુષ,	વિધુર,	કુંવારે,	સધવા,
૧	૫	૩	૨	૧	૧	૧૦	૧
વિધવા,	દસા શ્રીમાણી,	ભણેલ પુરુષ,		વેપાર.			
૧	૫	૩		૩			

### ૪ વેજપટકા.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વસ્તિ:—

ઘર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી.	પરણેલ પુરુષ,	વિધુર,
૭	૩૩	૧૬	૧૭	૭	૪
સધવા,	વિધવા,	કુંવારી.	વિસા શ્રીમાણી,	દસા શ્રીમાણી,	
૭	૫	૫	૪	૩૩	
ભણેલ પુરુષ,	ભણેલ સ્ત્રી,	ખાલક,	વેપાર,	પડિકમણ્ણા,	
૧૪	૬	૪	૧૬	૪	
સામાયક.					
૨૧					

૧૬૪

### ૫ ચાચકા.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વર્સિતઃ—

ધર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ પુરુષ,	કુંવારા,
૨	૧૦	૬	૪	૩	૩
દસા શ્રીમાળી,	ભણેલ પુરુષ,	ભણેલ સ્ત્રી,	વેપાર,	પાડકમણું,	
૧૦	૬	૨	૦	૬	૧

સામાયં.

૪

### ૬ મીણુપુર.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વર્સિતઃ—

ધર,	માણુસ,	પુરુષ,	વિધુર,	દસા શ્રીમાળી,	ભણેલ પુરુષ.
૧	૧	૧	૧	૧	૧

વેપાર.

૯

### ૭ અંસનલ.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વર્સિતઃ—

ધર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ પુરુષ,	કુંવારા,	સંધવા,
૨	૧૧	૮	૩	૧	૭	૧
વિધવા,	કુંવારી,	દસા,	ભણેલ પુરુષ,	ભણેલ સ્ત્રી,	ખાળક,	વેપાર.
૧	૧	૧૧	૭	૧	૧	૮

### ૮ કુડલાં.

આ ગામમાં ઉપાશ્રય છે. જૈન સ્થાનકવાસીની વર્સિતઃ—

ધર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ પુરુષ,	કુંવારો,	સંધવા,
૫	૧૬	૧૦	૬	૩	૧	૩

१६५

विधवा,	कुंवारी,	दसा,	लण्ठेल पुरुष,	लण्ठेल स्त्री,	आणके,
१	२	१६	६	८	१

वेपार,	नेकरी.	सामायक.
८	१	१५

### ८ वेलावटर.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વસ્તિ: -

धર,	માણસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ પુરુષ,	વિધુર,	કુંવારા,
२	११	६	५	३	१	२

दસા	લણેલ પુરુષ,	આળક,	વેપાર,	નેકરી,
११	६	२	५	१

### १० ચોડડી.

આ ગામમાં ઉપાશ્રય છે, જૈન સ્થાનકવાસીની વસ્તિ: -

धર,	માણસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ પુરુષ,	કુંવારા,	ઝધવા,
३	१५	१०	५	३	७	३

કુંવારી,	दસા,	લણેલ પુરુષ,	લણેલ સ્ત્રી,	આળક,	વેપાર,
२	१५	७	२	४	१०

પાડકમણ્ણા,	સામાયક.
४	४



### મુળી.

ગામ १६ અને આખા રાજ્યની કુલ વસ્તિ.

આ ગામ સોગાવાના કીનારે ઘાંબેલ આલાવાડ પ્રાંતમાં પરમાર રાજનું ચોથા વર્ગનું રાજ ગણીય છે. રાજકર્તા જગાદેવ પરમારના વંશના પરમાર શ્રી નામદાર ઢાકોર સાહેય હરીશ્ચંદ્રસિંહજી રાજ કરે છે. ચોતે ધણ્ણા લાયકુ અને આગળ પડતા છે, મુળીને પ્રસિધ્ય કર્યું હોય તો આ ઢાકોર સાહેયજ કર્યું છે. પરમાર લોકો ધર્તિહાસીક દ્રષ્ટિચે જૈન હતા, મુળીના મુળ પુરુષ લખધિરજી અને મુંબજી એ બને પાર્શ્વનાથ

તીર્થેકરના પરમ ભક્ત હતા. હજુ મુળીમાં માંડવરાળ છે તે પરમારેના ઇષ્ટદેવ જીણાય છે. માંડવરાળ પાદી નાથપ્રલુની મુર્તિ છે. થાન પાસેના માંડળના નામના દુંગરમાં રહેલ હોવાથી ગોડી પાદીનાથને અહેલે માંડવરાળ નામ પડ્યું તેથી ખરીરીતે પરમાર જૈન છે. આ સંખ્યાની સૌશાષ્ટ્રની રૂસધારા ભાગ ૧લો વાંચવા વાચકને લલામણુ કરી આ વિષય બંધ કુરવામાં આવે છે. આ ગામના સાયલા સંપ્રદાય અને દરીયાપુરી આઠકોટો એમ અન્નેના એકજ સ્થાનકે વારાફરતી ચાતુર્માસ થાણુ છે. ધાર્મિક સંસ્થામાં લાઇષ્ટ્રેરી અને ઉપાશ્રય એક છે. આગેવાન જૈતસીહાવાળા વકીલ શ્રીકભદ્રાલ પુરુષોત્તમ અને શા. લદ્ભમીચંદ વેકસી છે. આ ગામમાં જૈન સ્થાનકવાસીની વસ્તિ:-

ઘર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ પુરુષ,	વિધુર,
૮૧	૩૪૩	૧૭૭	૧૬૬	૭૨	૨૧
કુંવારા,	સધવા,	વિધવા,	કુંવારી,	વિસા,	દસા,
૮૪	૭૨	૩૫	૫૮	૩૦	૩૧૩
ભણેલ પુરુષ,	લણેલ સ્ત્રી,	ખાળક,	અંગ્રેજ લણેલ પુરુષ,		
૧૬૧	૬૩	૩૮	૫		
વેપાર.	નોકરી,	વકીલ,	પડિકમણ્ણા,	સામાયક.	
૧૬૨	૧૩	૨	૧૮	૨૧૬	

### મુળી રાજ્યના ગામો.

#### ૧ દિઝસર.

આ ગામમાં ઉપાશ્રય તથા લાઇષ્ટ્રેરી છે. સાયલા સંપ્રદાયના ચો-માસા થાય છે. જૈન સ્થાનકવાસીની વસ્તિ:-

પત્રક ઝોટા લરાણું હોવાથી છાપેલ નથી.

#### ૨ દાણાવાડા.

આ ગામમાં ઉપાશ્રય અને લાઇષ્ટ્રેરી છે. જૈન સ્થાનકવાસીની વસ્તિ:-

૧૬૭

ધર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ પુરુષ,	. વિધુર,	કુંવારા,
૧૮	૪૬	૨૫	૨૧	૧૪	૪	૭

સધવા,	કુંવારી,	વિધવા,	દસા,	લણેલ પુરુષ,	લણેલ સ્ત્રી,
૧૪	૭	૪	૧૪	૧૬	૩

ખાળક,	વેપાર,	નોકરી,	પડિકમણ્ણા,	સામાયક.
૭	૩	૩	૪	૨૬

### ૩ ગોદાવરી.

આ ગામમાં ઉપાશ્રય છે, જૈન સ્થાનકવાસીની વર્ણિતઃ—

ધર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ પુરુષ,	કુંવારા,	સધવા,
૭	૪૪	૨૧	૨૩	૬	૧૮	૬

વિધવા,	કુંવારી	દસા	લણેલ પુરુષ,	લણેલ સ્ત્રી,	ખાળક,
૩	૧૧	૪૪	૧૫	૪	૧૦

વેપાર.	સામાયક.
૨૧	૨૫

### ૪ સેખપર.

આ ગામમાં જૈન ઉપાશ્રય છે, જૈન સ્થાનકવાસીની વર્ણિતઃ—

ધર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પુરુષ પરણેલ	વિધુર,	કુંવારા,
૩	૨૫	૧૪	૧૧	૪	૧	૬

સધવા,	વિધવા,	કુંવારી,	વિસા,	દસા,	લણેલ પુરુષ,
૪	૨	૫	૧૧	૧૪	૧૨

ખાળક,	વેપાર,	પડિકમણ્ણા,	સામાયક.
૪	૧૪	૩	૧૪

### ૫ નાયકા.

આ ગામમાં ઉપાશ્રય સરસ છે. જૈન સ્થાનકવાસીની વર્ણિતઃ—

ધર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ પુરુષ,	વિધુર,	કુંવારા,
૬	૩૬	૨૧	૧૮	૧૨	૧	૮

૧૬૮

સંઘવા, વિધવા, કુંવારી, દસા લણેલ પુરુષ બાળક, વેપાર,  
 ૧૨ ૩ ૩ ૩૬ ૧૬ ૫ ૨૧

પડિકમણ્ણા, સામાયક.  
 ૨ ૪

### ૬ ટીજી પરમારની.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વર્સ્તિ:-

ધર, માણસ, પુરુષ, સ્ત્રી, કુંવારો, વિધવા, કુંવારી,  
 ૧ ૩ ૧ ૨ ૧ ૧

દસા શ્રીમાળી, લણેલ, પુરુષ, લણેલ સ્ત્રી, વેપાર. સામાયક.  
 ૩ ૧ ૧ ૧ ૧

### ૭ કુકડી.

આ ગામમાં ઉપાશ્રય સામાન્ય છે. જૈન સ્થાનકવાસીની વર્સ્તિ:-

ધર, માણસ, પુરુષ, સ્ત્રી, પરણેલ પુરુષ, કુંવારા,  
 ૩ ૧૪ ૮ ૬ ૩ ૫

સંઘવા, વિધવા, કુંવારી, વિસા લણેલ પુરુષ, બાળક,  
 ૩ ૨ ૧ ૧૪ ૭ ૨

વેપાર, પડિકમણ્ણા, સામાયક.  
 ૮ ૧ ૧૦

### ૮ લોખલી.

આ ગામમાં ઉપાશ્રય છે આડ કોટીનું ક્ષેત્ર છે. આગેવુનમાં સંઘવી ગાંગળ ભાવળ લખાય છે. જૈન સ્થાનકવાસીની વર્સ્તિ:-

ધર માણસ પુરુષ સ્ત્રી પરણેલ પુરુષ, વિધુર, કુંવારા,  
 ૭ ૬૩ ૩૩ ૩૦ ૧૫ ૧ ૧૭

સંઘવા, વિધવા, કુંવારી, વિસા, દસા, લણેલ પુરુષ, લણેલ સ્ત્રી,  
 ૧૫ ૧ ૧૪ ૧૧ ૧૨ ૨૮ ૧૬

બાળક, વેપાર. સામાયક.  
 ૧૩ ૩૩ ૫૨

૧૬૬

### ૯ પાંડવરા.

આ ગામમાં ઉપાશ્રય છે. જેન સ્થાનકુલાસીની વર્સિતઃ—

ઘર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણોલ પુરુષ,	વિધુર,	કુંવારા
૪	૨૮	૧૨	૧૬	૬	૨	૪
(વિધવા,	કુંવારી,	હસા,	લણોલ પુરુષ,	ખાળક,	વેપાર,	
૬	૧૦	૨૮	૬	૬	૧૨	

### ૧૦ નળીયા.

આ ગામમાં ઉપાશ્રય નથી. જેન સ્થાનકુલાસીની વર્સિતઃ—

ઘર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	લણોલ પુરુષ,	કુંવારા,	સધવા,
૩	૧૪	૭	૭	૩	૪	૩
(વિધવા,	કુંવારી,	હસા,	લણોલ પુરુષ,	ખાળક,	વેપાર,	
૧	૩	૧૪	૬	૩	૧૪	

### ૧૧ સિદ્ધસર.

આ ગામમાં ઉપાશ્રય નથી. જેન સ્થાનકુલાસીની વર્સિતઃ—

ઘર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણોલ પુરુષ,	કુંવારા,	
૫	૧૮	૮	૧૦	૨	૬	
સધવા,	વિધવા,	કુંવારી,	વિસા,	હસા,	લણોલ પુરુષ,	
૨	૩	૫	૮	૧૦	૭	
ખાળક,	વેપાર,	નોકરી,	સામાયક,			
૩	૭	૧	૧			

### ૧૨. સોભાસર.

આ ગામમાં ઉપાશ્રય પડી ગયેલ જેચે છે. જેન સ્થાનકુલાસીની વર્સિતઃ—

ઘર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણોલ પુરુષ,	કુંવારા,	સધવા,
૩	૨૦	૧૦	૧૦	૪	૬	૪

૧૫૦

વિધવા, કુંવારી, હસા, લણેલ પુરુષ, બાળક, વેપાર.  
 ૧ ૫ ૨૦ ૮ ૫ ૧૦  
 માણુસ, વિધુર, કુંવારી, વિધવા હસા, લણેલ પુરુષ,  
 ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૨ ૧  
 પુરુષ, સામાયક, ૧૦

### ૧૩ ટીડાણુા.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વસ્તિ:—  
 ધર, માણુસ, પુરુષ, સ્ત્રી, કુંવારી, વિધવા હસા, લણેલ પુરુષ,  
 ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૨ ૧

નેકરી.

### ૧૪ અણાદ.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વસ્તિ:—  
 ધર, માણુસ, વિધુર, હસા, લણેલ પુરુષ, વેપાર,  
 ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧

### અણાદ.

ગામ રજુને આખા તાલુકાની કુલ વસ્તિ.  
 આ રાજ્ય જતવાહમાં ઈર્શેન ખુણની અંદર ગુજરાતની સરહદ  
 ઊપરે સ્થાયેલ ચોથા ડેક્કાસનું રાજ્ય છે. રાજ્યકર્તા મુસલમીન જત ઠા-  
 કરડા નામદાર દરખારશી કેમાલુહીનાનાં રાજ્ય કરે છે. આ ગા-  
 મમાં જૈન ઉપાશ્રય નથી. તાખાના ગામોમાં જૈન સ્થાનકવાસીની વસ્તુ છે.  
 ધર, માણુસ, પુરુષ, સ્ત્રી, પરણેલ પુરુષ, કુંવાર,

૪ ૧૮ ૭ ૧૧ ૫ ૨

વિધવા, વિધવા, કુંવારી, લાવસાર, લણેલ પુરુષ,  
 ૧૮ ૮ ૧૮ ૫

લણેલ સ્ત્રી, બાળક, વેપાર,  
 ૨ ૨ ૭

२५१

## २ पीपली.

आ	गाममां	उपाश्रय	नथी.	जैन	स्थानकुवासीनी	वस्ति:	—
धर,	भाणुस,	पुरुष,	स्त्री,	परणेल	पुरुष,	किञ्चुर,	कुंवारी
७	३१	१५	१७	५	१	६	५
विधवा	कुंवारी,	विसा	श्रीमाणी,	लणेल	पुरुष,	लणेल	स्त्री,
५	७	०	३१		१४		४
बाणी,	वेपार,	पटिकमण्डा,		सामायक.			
४	१५		३		१६		

## ३ सिंधसर.

आ	गाममां	उपाश्रय	नथी.	जैन	स्थानकुवासीनी	वस्ति:	—
धर,	भाणुस,	पुरुष,	स्त्री,	"	परणेल	पुरुष	कुंवारी
३	१५	६	६		३		६ "
सधवा,	विधवा,	कुंवारी,	विसा,	लणेल	पुरुष,	श्रीमाणी,	वेपार.
३	१	२	१५	५	५	५	५

## पाठी.

आ आलावाड प्रांतमां कुडियावाड धुलाकर्नी उत्तर दिशानां संस्कृह  
उपर जावेल चोथा वर्गनो तालुके छे. आ स्थण जाला राजना कुणीभण्यु  
प्रांगधानी मुण गाहीनु गुण्याय छे. अहिंशी हुणवद अने त्यांथी प्रांगधा,  
प्रांगधाथी जालावाड प्रांतना जाला राजना पैकी—१ वांकानेर, २ लीभडी,  
३ वढवाखु, ४ लभतर, ५ स्त्रेयला, ६ अते, ७ च्युडा, ८ अ तालुका  
उत्तरी. अहिंना हालना राजकर्ता झाटीहार=झणुणी छे, राजकर्ता इरण्यार  
श्री हौलतसिंहल राज करे छे, आ ग्राममां उपाश्रय नथी. जैन  
स्थानकुवासीनो वस्ति:

धर	भाणुस,	पुरुष,	स्त्री,	परणेल	पुरुष,	विधवा,	कुंवारी,
१५	७७	३७	४०	१८	२	१७	

સંખ્યા,	વિધવા,	કુંવારી,	વિસા,	લાવસાર,	ભણેલ પુરુષ,
૧૮	૧	૨૧	૪	૩૫	૨૪
ભણેલ બી,	બાળક,	વેપાર,	નોકરી,		
૧	૧૭	૧૨	૨		

### પાટડીના મહાદો.

#### ૧ ઘેરવા જતના.

આ ગામમાં ઉપાધ્રય છે. આઠ કેટીના ચોમાસા થાય છે. અગ્રેસર શાહ હરલીવન વર્ષ માન છે. “સર્વજ્ઞ મહાવીર જૈન લાધ-ઘેરી” છે. જૈન સ્થાનકવાસીની વસ્તિ:-

ઘર	માણુસ.	પુરુષ.	બી.	પરણેલ પુરુષ.	વિધુર,	કુંવારા,
૧૧	૬૨	૩૬	૨૭	૧૬	૬	૧૪
સંખ્યા.	વિધવા,	કુંવારી,	દસા શ્રીમાતી,	લાવસાર,	ભણેલ પુરુષ.	
૧૩	૫	૬	૩૪	૨૮	૩૦	
ભણેલ બી,	બાળક,	અંગ્રેઝ ભણેલ પુરુષ,	વેપાર.	નોકરી,		
૨	૧૨		૧	૩૧	૫	

પંડિકમણ્યા,  
સામાયક.

૮  
૨૮

#### ૩ કુમેયડા.

આ ગામમાં ઉપાધ્રય નથી. જૈન સ્થાનકવાસીની વસ્તિ:-

ઘર,	માણુસ,	પુરુષ,	બી,	પરણેલ પુરુષ,	વિધુર,	કુંવારા,
૬	૩૦	૧૨	૧૮	૪	૧	૭
સંખ્યા	વિધવા,	કુંવારી,	દસા,	ભણેલ પુરુષ,	બાળક,	વેપાર,
૪	૪	૧૦	૩૦	૭	૭	૫

૧૭૩

### ૪ વેકરીયા.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વસ્તિઃ—  
ધર, માણુસ, ઓ, વિધવા, હસા, લણેલ, વેપાં.  
૧ ૧ ૧ ૧ ૧ ૧

---

### ઉત્તેજીયા.

આ તાલુકો સોંરહ ધીકાણની પૂર્વ દિશાના છેડે લાલ પ્રદેશમાં  
ગુજરાતની સરહુદ ઉપર જીવા નીચે આવેલ છે. અખત્યાર તાલુકો છે.  
વાયેલા રાજક્રિયા સુરક્ષિત રાજ કરે છે. જૈન ઉપાશ્રય નથી.  
જૈન સ્થાનકવાસીની વસ્તિઃ—

ધર,	માણુસ,	પુરુષ,	કુંવારા,	વિસા,	લણેલ પુરુષ,
૧	૨	૨	૨	૨	૨

---

નોઠરી,  
૨



### વદવાણ થાણા.

### વદવાણ કેન્દ્રે.

આ ગામ લોગાવાના બ્રટ ઉપર આવેલું ગવર્નમેન્ટ એજન્સીની  
હુકમતનું ધીકતા વેપારતું પ્રસિદ્ધ મથક છે. અહિં રાજકોઈના એજન્ટ કુ  
ધો ગવરનર જનરલનો એજન્ટ રહે છે. હુલની નચો સિધ્યમ હાખલ  
કર્યા પછી, પ્રાંતને બદલે પોલીટીકલ એજન્ટ વેસ્ટર્ન ઇન્ડોયા સ્ટેટ્સ એજન્સી  
(Political Agent Western India States Agency) લખાય  
છે. હુલ પ્રાંત સાહેબ જે. ગોર્ડન (J. Gorden) કરીને યુરોપીયન એજન્સી-  
સર છે; આ ગામમાં છ કોટી અને આંડ કોટી. છ કોટીમાં લીંખડી મેટ્રો  
ઉપાશ્રય અને નાનો ઉપાશ્રય એમં નણે ફૂર્ઝાના વારાકરતી એકજ સ્થાનકમાં  
ચાતુર્માસ થાય છે. અન્ને શા. ઉકો ડાયાં કહેવાય છે. પેટા નામમાં  
છ કોટી નાના સંઘમાં શા. કસ્તુર હરચંદ અને આઠ કોટીમાં  
દોશી ફુલેરા ઉકો એમ પ્રાંતિક નામો ચાલે છે. ધાર્મિક સંસ્થામાં  
જૈન લાઇંઝેરી અને જૈનશાળા ચાલે છે.

૧૭૪

અહિનો ઉપાશ્રય રજકેટના મર્હમ હોશી ગોપાળજી ડાલ્યા-  
ભાઈએ પોતે આલાવાડ પ્રાંતરાં શિરક્ષેત્રાર હતા તે વખતે ચણુવી  
લાંબડીવાળા શા. ઉક્કા ડાલ્યાને પ્રણે સંઘના સાધુ સાધ્વીના ચાતુર્માસ  
માટે અર્પણુ કરેલ છે. જેમાં કૈનો કૈનેતર પૈકી ધ્રાગ્ધા, લીંબડી અને  
સ્વાયદ્વા વગેરે રજયોએ પણ ઉપાશ્રય ખાંચવામાં આર્થિક મહ્દ સારી  
કૃચીનું કહેવાય છે. આ ગામમાં જેન સ્થાનકવાસીની વસ્તિની સંખ્યા  
આ નીચેના આંકડાથી જણુશે.

ઘર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ પુરુષ,	જિધુર,
૨૬૨	૬૫૮	૪૦૫	૩૭૪	૨૨૧	૩૨
કુંવારા,	સંધવા,	વિધવા,	કુંવારી,	વિસા,	દસા,
૩૬૨	૧૯૯	૧૦૮	૧૭૨	૨૩૮	૮૧૦
ભાવસાર,		ભણેલ પુરુષ,		ભણેલ સ્ત્રી,	ખાળક,
૩૧		૪૩૧		૧૮૪	૧૫૮
અંગ્રેજી લણેલ પુરુષ,	ડીબ્રી,		વેપાર.	નોકરી,	વકીલ,
૧૧૭		૬	૫૬૮	૧૧૨	૬
દાકુતર,	પાડિકમણુા,		સામાયકુ.		
૩	૧૫૩		૫૦૮		

૧ ટુંબા.

આ ગામ દુધરેજ વઠવાળુ ભાયાતનું છે ઉપાશ્રય છે. લીંબડી  
સંપ્રદાયના ચોમાસા થાય છે. અગ્રેસર શા. ગણેસ ડ્ર્પા છે. અહિ  
જેન સ્થાનકવાસીની વસ્તિ:—

ઘર,	માણુસ.	પુરુષ,	સ્ત્રી,	પુરુષ પરણેલ,	કુંવારા,
૬	૬૫	૩૫	૩૦,	૧૨	૮૩
સંધવા.	વિધવા,	કુંવારી.	વિસા શ્રીમાળી,		દસા,
૧૧	૮	૧૩	૫૩		૧૨,
ભણેલ પુરુષ,	ભણેલ સ્ત્રી,	ખાળક,	અંગ્રેજી ભણેલ પુરુષ,		
૩૦	૮	૧૫		૨	

૧૭૫

વેપાર,	નોકરી;	પડિકમણા,	સામાયક,
૧૬	૨	૬	૧૭

### ૨ ખેરાતી.

આ ગામ વઠવાણ ભાયાતનું છે. આઠોટી હરીયાપરાનું રાજીં છે.:  
ગામમાં ઉપાશ્રય ઘણો સરસ છે. અહીં જૈન સ્થાનકવાસીની વસ્તિ:-

ઘર	માણસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ પુરુષ,	વિધુર,
૧૨	૬૦	૩૮	૨૧	૮	૩

કુંવારા,	સધવા,	વિધવા,	કુંવારી,	વિસા શ્રીમાર્ણી,	લણેલ પુરુષ,
૨૬	૭	૬	૮	૬૦	૩૭

લણેલ સ્ત્રી,	બાળક,	વેપાર	નોકરી,	પડિકમણા,
૧	૭	૨૬	૧૩	૪

સામાયક.

૧૨

### ૩ વણા.

આ ગામ વઠવાણ ભાયાતનું છે. ઉપાશ્રય ભજનો છે. આગેવાન  
શાહ ડાયા જીવણું લખાય છે. જૈન સ્થાનકવાસીની વસ્તિ:-

ઘર,	માણસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ પુરુષ,	વિધુર,	કુંવારા,
૬	૫૬	૨૫	૩૧	૧૩	૧	૧૨

સધવા.	વિધવા.	કુંવારી.	વિસા શ્રીમાર્ણી,	દસા શ્રીમાર્ણી,
૧૩	૭	૧૨	૪	૧૬

ભાવસાર,	મોચી,	લણેલ પુરુષ,	લણેલ સ્ત્રી,	બાળક,	વેપાર,
૨૮	૫	૧૬	૮	૧૦	૧૪

નોકરી પડિકમણા, સામાયક.

૫            ૫            ૨૫

૧૭૬

#### ૪ આકરથાળી.

આ ગાળો વણુણી છે. ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વસ્તિ:-

ધર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ પુરુષ,	કુંવારા,	સધવા,
૫	૨૦	૧૦	૧૦	૪	૬	૪

વિધવા,	કુંવારી,	દસા શ્રીમાળી,	લણેલ પુરુષ,	ખાળક,	વેપાર.
૧	૫	૨૦	૧૦	૩	૧૦

#### ૫ દુધરેજ.

આ ગામ વઠવાણુ ભાયાતનું છે. ગામમાં ઉપાશ્રય પડી ગચેલ  
જેવો છે. જૈન સ્થાનકવાસીની વસ્તિ:-

ધર,	માણુસ પુરુષ,	સ્ત્રી,	પરણેલ પુરુષ,	વિધુર,	કુંવારો,	સધવા,
૬	૨૨	૧૪	૮	૪	૨	૮

વિધવા,	કુંવારી,	દસા	લણેલ પુરુષ,	ખાળક,	વેપાર.
૧	૩	૨૨	૧૨	૫	૧૪

#### ૬ વડોદ.

આ ગામ વઠવાણુ ભાયાતનું છે. ઉપાશ્રય એણું નવો ગારાનો  
અનાંદો છે. છ કોટી આઠ કોટી બન્ને છે. જૈન સ્થાનકવાસીની વસ્તિ:-

ધર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ પુરુષ,	કુંવારા,	સધવા,
૧	૬	૬	૩	૨	૪	૨

કુંવારી,	દસા,	લણેલ પુરુષ,	લણેલ સ્ત્રી,	ખાળક,
૧	૬	૫	૨	૧

અંગેજ લણેલ પુરુષ, વેપાર. સામાયક.

૧      ૬      ૪

#### ૭ ગુંદીયાળી.

આ ગામ વઠવાણુ ભાયાતનું છે, આઠકોટી છે. ઉપાશ્રય ગારાનો છે.  
જૈન સ્થાનકવાસીની વસ્તિ:-

૧૭૭

ધર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	વિધુર,	કુંવારા,	સધવા,	વિધવા,
૧૨	૭૩	૩૮	૩૫	૧૦	૭	૨૧	૧૦
કુંવારી,	વિસા શ્રીમાળી,		હસા,	અણેલ પુરુષ,	અણેલ સ્ત્રી,		
<	૪૪		૨૬	૩૫	૧	.	.
બાળક,	વેપાર,	પાડકમણૂ,		સામાયક.			
૫	૩૮	૩		૨૭			

### ૮ આંપોદર.

આ ગામ વઠવાણુ ભાયાતનું છે. ઉપાશ્રય નથી, જૈન સ્થાનકવાસીની વર્સિત:-

ધર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ પુરુષ,	કુંવારા,	સધવા,
૨	<	૪	૪	૨	૨	૨
કુંવારી,	હસા,	અણેલ પુરુષ,	બાળક,	વેપાર,	સામાયક.	
૨	<	૨	૩	૨	૨	

### ૯ ખજેલી.

આ ગામ વઠવાણુ ભાયાતનું છે. ઉપાશ્રય નથી, જૈન સ્થાનકવાસીની વર્સિત:-

ધર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ પુરુષ,	સધવા,	કુંવારી,
૧	૪	૧	૩	૧	૧	૨
હસા,	અણેલ પુરુષ,	અણેલ સ્ત્રી,	વેપાર,	સામાયક.		
૪	૧	૩	૧	૨		

### ૧૦ તલસાણા.

આ ગામ લીંબડી ભાયાતનું લીંબડાનું રાગી છે. ઉપાશ્રય લુણું છે, જૈન સ્થાનકવાસીની વર્સિત:-

ધર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ પુરુષ,	વિધુર,	કુંવારા,
<	૪૭	૨૬	૨૧	૭	૧	૧૮

૧૭૮

સધવા,	વિધવા,	કુંવારી	હસા	ભણેલ પુરુષ,	ખાળક,	વેપાર.
૭	૭	૭	૪૭	૧૦	૩	૧૧

નોકરી,	પટિકમણ્ણા,	સામાયક.
૧	૬	૧૧

### ૧૧ તાવી.

આ ગામ લીંખડી ભાયાતનું છે, ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વસ્તિ:—

ઘર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	વિધુર,	કુંવારા,	વિધવા,
૨	૫	૪	૧	૧	૩	૧

હસા	ભણેલ પુરુષ,	વેપાર,	સામાયક.
૫	૪	૩	૩

### ૧૨ ગોડી.

આ ગામ લીંખડી ભાયાતનું છે, ઉપાશ્રય છે. જૈન સ્થાનકવાસીની વસ્તિ:—

ઘર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પુરુષ પરણેલ	કુંવારા,	સધવા,
૪	૨૩	૧૫	૮	૫	૧૦	૫

કુંવારી,	હસા,	ભણેલ પુરુષ,	ભણેલ સ્ત્રી,	ખાળક,	વેપાર,
૩	૨૩	૧૩	૨	૭	૮

પટિકમણ્ણા,	સામાયક.
૫	૮

### ૧૩ ભડવાણ્ણા.

આ ગામ લીંખડી ભાયાતનું છે, ઉપાશ્રય છે. જૈન સ્થાનકવાસીના વસ્તિ:—

ઘર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ પુરુષ,	કુંવારા,	સધવા,
૪	૨૨	૧૦	૧૨	૪	૬	૪

## ૧૭

વિધવા, કુંવારી; દસા ભણેલ પુરુષ બાળક, આંગ્રેજી ભણેલ પુરુષ,  
 ૧ ૭ ૨૨ ૬ ૬ ૨

વેપાર, સામાયક.  
 ૧૦ ૪

## ૧૪ પરનાળા.

આ ગામ લીંખડી લાયાતતું છે, ઉપાશ્રય નહિ જેવો છે, જૈન  
સ્થાનકવાસીની વસ્તિ:-

ધર, માણુસ, પુરુષ, સ્ત્રી, પરણેલ પુરુષ, વિધુર, કુંવારા,  
 ૪ ૧૬ ૧૦ ૬ ૫ ૧ ૪

સધવા, વિધવા, કુંવારી, દસા, ભણેલ, પુરુષ, બાળક, વેપાર.  
 ૫ ૧ ૩ ૧૬ ૬ ૩ ૧૦

## ૧૫ દેવળીયા.

આ ગામમાં ઉપાશ્રય છે. જૈન સ્થાનકવાસીની વર્ણના:-

ધર, માણુસ, પુરુષ, સ્ત્રી, પરણેલ પુરુષ, કુંવારા,  
 ૭ ૩૦ ૧૬ ૧૪ ૫ ૧૨

સધવા, વિધવા, કુંવારી, દસા ભણેલ પુરુષ, ભણેલ સ્ત્રી,  
 ૫ ૪ ૫ ૩૦ ૧૬ ૫

બાળક, વેપાર, પડિકમણુા, સામાયક.  
 ૧ ૬ ૨ ૧૨

## ૧૬ રાઈસાંકણી.

આ વસાઈના પાટીદાર ગોપાળહાસલાઈનો છડા વર્ગની! અખ-  
ત્યારી તાલુકો છે. હુલમાં થોડાક વર્ષ થયા એઝન્સીની સત્તા નીચે ગયેલ  
છે. આ ગામમાં ઉપાશ્રય પઢી ગયેલ છે જૈન સ્થાનકવાસીની વસ્તી:-

ધર, માણુસ, પુરુષ, સ્ત્રી, પરણેલ પુરુષ, કુંવારા, સધવા,  
 ૭ ૧૬ ૧૨ ૭ ૨ ૧૦ ૨

વિધવા,	કુંવારી,	દસા,	ભણેલ પુરુષ,	ભણેલ જી,
૨	૩	૧૬	૧૧	૨
બાળક,	અંગ્રેજ ભણેલ પુરુષ.	વેપાર.	નોકરી,	સામાયક,
૨	૧	૫	૩	૧

### ચોટીલા થાણા.

#### ૧ ચોટીલા.

આ ગામ ચામુંડ માતાના કુંગરની ઓથે આવેલું ખાચર (કાડો) દરખારેની રાજ્યધારીનું પંચાલમાં આવેલું છે. દરખારે પેકી દરખારકી ખાચર લોજ વાધા, દરખારકી લાણુ જેડા, દરખારકી સુરીગ સાહુલ. દરખારકી સુરીગ આદા અને જાડ લાગીયા વગેરે મુળ પાંચ તેલીઓ મોટી ગળુય છે. તાલુકદારે ધણા લોકપ્રિય અને ઉદ્ધાર દીલા-વર હીલના છે તાલુકાની સત્તા: એજન્સીની છે, ગામમાં થાણું છે, આ ગામમાં લીંખડીના ચોમાસા થાય છે, જૈન ઉપાશ્રય બે છે, સંધમાં આગે-વાન રોડ હિરાચંદ જેડા અને શા. વેલસી અવેર ગળુય છે, ધાર્મિક સંસ્થામાં કૈનાચાયં શ્રીમાનુ લખણ સ્વામીના નામનો સં. ૧૯૭૨ સને ૧૯૧૬ માં માળીયાના નામદાર ડાકેઅ સાહેબ રાયસિં-હળના મુખારક હુથથી જાહેર રસ્તા ઉપર સ્થાપન થયેલ છે. સંસ્થાનું નામ:—“શ્રી લખણ સ્વામી કૈન કું લાધુંધેરી ચોટીલા-કાડીયા-વાડ” એવું બોર્ડ રાખવામાં આવેલ છે. આ સંસ્થામાં ફક્ષણ ‘હંઈદ્રા-બાહુના’ રાજખાડાફુર સુખદેવસહાયજી જ્વાળાપ્રસાદજી કૈનુરી છપાએલ તર સૂત્રોની સૂત્ર પેટી જેની કિંમત ચાલું જમાનામાં તરફથી લ-હુયા પાસે લખાવતા લગભગ ૪ ચાર હજાર રૂપિયા થવા જાય. તે સીવાય એની સુરતના આગમોહ્ય સમિતિવાળા છાપેલ સંખૃત ટીક્કાવાળા સૂત્રો પણ અમુક છે, અને બાકીની છાપેલ ચોટીલીઓના ત્રણ કપાટ લર્યા છે. લાઈફેરીમાં ખુરસીઓ બાંકડાઓ મેજ ટેબલ વગેરે ફરનીયર છે. છાપા પણ કેટલાક રે. જુંદા વગેરે આવે છે, લાઈફેરીની વર્જાટો મોટા મોટા બુઝેપીયન ઓક્સીસરે પેકા કાડિયાવાડના વાલાસાન મે. એજન્ટ દુધી ગવરનર કર્નાલ આર. ચેસ્ટ.

પોટીંજર સાહેબ, હાલાર ગ્રામના પોતીઠીકર એજન્ટ મેજર એ. એચ. ઈ. મોસ્સ અને કર્નલ એચ. એસ. સ્ટોંગ. કાઠિયાવાડ એજન્સીની પોલીસ સુપ્રીન્ટેન્ડન્ટ. આર. એમ. ફીલીપ્સ. કાઠિયાવાડ જયુડીસીયદ એક્ઝીસર. કે. ડાલ્લયુ. બાલી. કાઠિયાવાડ અને મુંબઈ પ્રેસીન્સીના સર્જન જનરલ એચ. હુટન. અને કેપ્ટન કીલ્લી. વગેરે ચુણે-પીયન એક્ઝીસરો અને સાયલાના નામદાર ઠાકેર સાહેબ મહારાજાંહળ વગેરે રાજકુત્તાઓ અને એજન્સીના દેશી અમલદારો, જ્ઞાન, કૈનેતરની વીજાઠો થઈ છે. સંસ્થાની આગામી ઉપયોગીતા અને પ્રસિદ્ધિની સામીતિ ઉપરની વીજાઠો પૂરી પાડે છે. “આજ જૈન સંસ્થાએને લાગ્યેન આવું મેદું માન મળ્યું હુશે. દર વર્ષો કમિટી લાઇબ્રેરીનો હિસાબ વગેરે તપાસી રીપોર્ટ બહાર પાડે છે. આજ સુધીમાં ૧૦ વર્ષના દસ રિપોર્ટો છાપાઈ ગયા છે. લાઇબ્રેરીના એ. સેફ્ટરી તરીકે રા. રા. ધાયલ હેવા-ઈત રાખ્યા એનરી સેવા બળવે છે. આ સોચાય જૈન સ્થાનકમાં પણ “શ્રી લખણ સ્વામી સ્થાનકવાસી જૈન પુસ્તકાલય.” અને જન કન્યાશાળા” આહિ ધાર્મિક સંસ્થાએ છે. આ ગામમાં જૈન સ્થા-નકવાસીની વસ્તિ નીચે મુજબ છે.

ઘર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ પુરુષ,	વિધુર,	કુવારા,
૪૬	૩૪૫	૨૦૧	૧૪૪	૬૨	૧૬	૧૨૩

સધવા,	વિધવા,	કુવારી,	દસા,	લાવસાર,	ભણેલ પુરુષ,
૬૨	૧૮	૧૪	૩૩૬	૬	૧૭૩
અણેલ સ્ત્રી,	બાળક,	અંગ્રેજ અણેલ પુરુષ,	વેપાર,	નોકરી,	
૭૫	૩૮	૫	૧૭૬	૨૨	

પડિકમણું, સામાયક.  
૨૧. ૧૮૦

## ૨ આણંદપુર.

આ ગામ ચોટીલા ભાયાત ખાચર દરખારોનો ચોવોસ ગામનો તાલુકો છે. જુદા જુદા ક્ષાગરારો વચે વહેંચાઈ ગયેલ છે. દરખારો પેકી ખાચર દાદા જીવા મહેસુર વગેરેને છડા વર્ગનો અખત્યાર છે.

આ ગામ લીંખડી સંપ્રદાયનું રાગી છે ગામમાં જૈન ઉપાશ્રય નવી પાકો  
પથરખંધ થયો છે. અહિં જૈન સ્થાનકવાસીની વસ્તિ:-

ધર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ પુરુષ,	વિધુર,	કુંવારા,	
૧૦	૫૮	૪૦	૧૮	૮	૨	૩૦	

સધવા,	વિધવા,	કુંવારી,	દસા,	ભણેલ પુરુષ,	
૮	૪	૬	૫૮	૩૭	

ખાળક,	અંગેલ લણેલ પુરુષ,	ડાઢી,	વેપાર,	નેકરી,	
૪	૫	૧	૩	૭	

પડિકમણ્ણા,  
૫  
સામાયક.  
૨૬

### ૩ પીંપરાલી.

આ ગામ ચોટીલા તાખાના સણેસરા ભાયાતનું છે. લીંખડી સંપ્રદાયનું ગણ્ણાય છે. ઉપાશ્રય છે. જૈન સ્થાનકવાસીની વસ્તિ:-

ધર	માણુસ	પુરુષ	સ્ત્રી	પરણેલ પુરુષ,	વિધુર,	કુંવારા,	
૮	૫૫	૨૭	૨૮	૧૧	૨	૧૪	

સધવા,	વિધવા,	કુંવારી,	દસા,	ભણેલ પુરુષ,	ભણેલ સ્ત્રી,	
૧૧	૫	૧૩	૫૫	૨૪	૧૦	

ખાળક,	વેપાર.	નેકરી,	પડિકમણ્ણા,	સામાયક.	
૧૦	૧૭	૪	૫	૨૬	

### ૪ મોરવાડ નવી.

આ ગામ ચોટીલા દરખારોનું છે. ગામ લીંખડીનું રાગી છે. ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વસ્તિ:-

ધર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ પુરુષ,	કુંવારા,	સધવા,	
૨	૨૫	૧૬	૧૪	૭	૪	૪	

વિધવા,	કુંવારી,	દસા,	ભણેલ પુરુષ,	ભણેલ સ્ત્રી,	ખાળક,	
૩	૭	૨૫	૧૦	૫	૭	

વેપાર.      નોંકરી      પડિકમણ્ણા,      સામાયકુ.

૪      ૧      ૪                 ૫

### ૫ પોપલીયા.

આ ગામ ધાધલુનું છે. ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વસ્તિ:—  
 ઘર.      માણુસ.      પુરુષ.      સ્ત્રી.      પરણેલ પુરુષ,      સધવા,  
 ૧      ૩      ૧      ૨      ૧      ૧

કુંવારી,      દસા,      ભણેલ પુરુષ,      બાળક,      વેપાર,  
 ૧      ૩      ૧      ૧      ૧

### ૬ ખોધરાવદર.

આ ગામ આણંદપુર તાલાનું છે. ઉપાશ્રય નથી. જૈન સ્થાન-  
 કવાસીની વસ્તિ:—

ઘર,      માણુસ,      પુરુષ,      સ્ત્રી,      વિધુર,      કુંવારા      વિધવા,  
 ૧      ૭      ૪      ૩      ૨      ૨      ૨  
 કુંવારી,      દસા,      ભણેલ પુરુષ,      અંગ્રેજ ભણેલ પુરુષ,      વેપાર,  
 ૧      ૭      ૪                 ૧      ૪

### ૭ ઐરાણા.

“આ ગામ આણંદપુરનું છે. ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની  
 વસ્તિ:—

ઘર.      માણુસ,      પુરુષ,      સ્ત્રી,      પરણેલ પુરુષ,      વિધુર,      કુંવારા,  
 ૨.      ૬      ૪      ૨      ૦ ૧      ૧      ૨  
 સધવા,      કુંવારી,      દસા,      ભણેલ પુરુષ,      અંગ્રેજ ભણેલ પુરુષ,  
 ૧      ૧      ૬      ૪      ૨  
 વેપાર,      સામાયકુ.  
 ૪      ૧૦

## પાલીયાદ થાણા.

### ૧ પાલીયાદ.

આ ગામ કાઠિ હરખારોનું છે, તાલુકો ખાચર હરખારો વચે જુહા જુહા ભાગે ઠેણ્યાઈ ગયેલ છે. ગામમાં આલાવાડ પ્રાંતનું થાણું છે, આ ગામ એટાહ સંઘાડાનું છે, આ ગામમાં ઉપાશ્રય છે.

આ ગામમાં જેન સ્થાનકુષાસીની વस્તિ:—

ધર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ પુરુષ,	વિધુર	કુંવારા,
૮૮	૪૬૫	૨૭૨	૨૨૩	૬૦	૮	૧૭૪

સધવા,	વિધવા,	કુંવારી,	વિસાશ્રીમાળી,	દસાશ્રીમાળી,	લાવસાર,
૬૦	૩૩	૧૦૦.	૩૩૦	૬૭	૬૩

અણેણું પુરુષ,	અણેલ સ્ત્રી,	ખાળક,	અંગેજુ અણેલ પુરુષ,
૨૩૮ "	૮૩	૭૭	૧૪

વેપાર,	નોકરી,	પાડિકમણું,	સામાયક,
૨૨૬	૪૬	૭૬	૨૨૫

### ૨ સુદામડા.

આ ગામ કાઠિ હરખારો ખંડનું છે, આર ગામનો તાલુકો જુહા જુહા ભાગે ઠેણ્યાચેલ છે, પાણીયાદ થાણું નીચે આલાવાડ પ્રાંતમાં આવેલું છે, આ કેતે લીણડી સંપ્રદાયનું કહેવાય છે, ગામમાં એ ઉપાશ્રય છે, આગેવાન તુરખીયા કુટુંબના શેઠ એધવળ કલ્ય કહેવાય છે. તેમની લારે અહેજલાલી હર્તા, ગામમાં બાંધે છોડે તે હતા, ઘેર સદાવૃત નાપાતું, ૩૦ કાંતીને ગોરાસ ધરાવે છે. અહી જન સ્થાનકુષાસીની વસ્તિ:—

ધર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ પુરુષ,	વિધુર	કુંવારા,
૬૮	૩૪૩	૧૮૨	૧૬૧	૭૪	૧૧	૬૭

અધવા,	વિધવા,	કુંવારી,	દસા,	વેપાર,	નોકરી,	અણેલ પુરુષ,
૭૧	૩૨	૫૮	૩૪૩	૮૧	૩૭	૧૫૭

૧૮૫

ભણેલ ઓ,	અંગળ ભણેલ પુરુષ,	ત્રૈન્ય ભણેલ પુરુષ અને સી,
૫૫	૫	૫

પડિકમણ્ણા,	સામાયક.
૧૭	૪૫

### ૩ ધાંધલપુર.

આ ગામ પણ ખવડનું છે, ૧૨ ગામનો તાલુકો છે,, પાણીયાદ થાણા નીચે આદાવાડમાંતની હક્કમાનું છે, આ ગામ લીજડીનું છે, ગામમાં જેન સ્થાનક હમણુંઝ નવું ધાણું સરસ બંધાવેલું છે, આગેવાન તુરાભીયા કુટુંભમાં શાા. સુણા હરખા અને એચર હેલા લખાય છે, આ લોકોની આગલના વખતમાં ભારે જણેજલાદી હતી. કહે છે કે, ખરવાળાના ઘેલાશા હાથો લઈને તેમના ઘેર હીકરાને પરણુંવા આવતા ઘેલાશાની “ક્રકડાલ” છેલેવરાવી હતી.

આંડં સ્થાનકવાસીની વર્ણિત નીચે પ્રમાણે છે:—

ઘર,	માણુસ,	પુરુષ,	ઓ,	પરણેલ પુરુષ,	નિધુર,
૪૯	૧૮૭	૧૦૫	૮૨	૩૦	૮

કુંવારા,	સધવા,	વિધવા,	કુંવારી,	કસા,	ભણેલ પુરુષ,
૬૧	૩૦	૧૦	૩૬	૧૮૭	૮૫

ભણેલ ઓ,	ખાળક.	અંગળ ભણેલ પુરુષ વેપાર,	નોકરી,	વસીલ,	
૨૨	૪૦	૧૭	૮૮	૧૬	૧

પડિકમણ્ણા,	સામાયક.
૧૦	૪૪

### ૪ શેજકપુર.

આ ગામ પણ ખવડનું છે, ૭ ગામનો તાલુકો છે, આનો ઈતિહાસ જુનો છે, આ ગામને વસાવનાર ભાવનગરના ધાણી સેજકળ છે, સેજકળ આ હેશમાં મારવાડમાંથો આવી અંડિ વસ્યા હતા, ગામને પાછર એક પુરાતની ઢેર છે. તેમાં નવલાખ પુતલીઓનું કેતરકામ હોવાથી “નવલાખો”

૧૮૬

કહેવાય છે, ભારે નોના જાયક છે, આ ગામ લોખડીનું રાગી છે, ઉપાશ્રય  
ઘણો સરસ છે; જૈન સ્થાનકવાસીની વસ્તિ:—

ધર	માણુસ	પુરુષ	સ્ત્રી	પરણેલ	પુરુષ	વિધુર	કુંવારા	સધવા	
૧૪	૮૨	૪૫	૩૭			૧૯	૫	૨૮	૧૩

વિધવા	કુંવારી,	વિસ્તા	દસા	લણોલ	પુરુષ	લણોલ	સ્ત્રી
૭	૧૭	૭૪	૮	૪૧			૧૬

ખાણક,	વેપાર,	નોકરી,	સામાયક.
૧૮	૪૫	૬	૬૪

#### ૫ ખીટલા સુદામડા તાણે.

આ ગામમાં ઉપાશ્રય મળનો છે. જૈન સ્થાનકવાસીની વસ્તિ:—

ધર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ	પુરુષ,	વિધુર,
૧	૬૦	૫	૧			૧

કુંવારા,	સધવા,	દસા,	લણોલ	પુરુષ,	લણોલ	સ્ત્રી,
૩	૧	૬		૫		૧

વેપાર,	નોકરી,
૨	૧

#### ૬ સાંગુઈ સુદામડા તાણે.

આ ગામમાં ઉપાશ્રય નથી જૈન સ્થાનકવાસીની વસ્તિ:—

ધર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ	પુરુષ,	વિધુર,
૨	૧૨	૭	૫	૪	૪	૧

સધવા,	વિધવા,	કુંવારી,	દસા,	લણોલ	પુરુષ,
૪	૨	૮	૧૨		૪

લણોલ	સ્ત્રી,	ખાણક,	વેપાર.
૬	૩	૪	

૧૮૭

### ૭ મોદા લડલા સુદામડા તાણે.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વસ્તિ:—

ધર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ પુરુષ,	વિધુર,	સધવા,
૨	૭	૨	૩	૧	૧	૦ ૧૦

વિધવા,	કુંવારી,	દસા,	લણેલ પુરુષ,	વેપાર,	નેકરી.
૧	૧	૭	૫	૩	૨

### ૮ ભાણેજડા.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વસ્તિ:—

ધર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ પુરુષ,	વિધુર,	કુંવારા,
૪	૨૧	૧૪	૭	૪	૨	૮

સધવા,	કુંવારી,	દસા	લણેલ પુરુષ,	લણેલ સ્ત્રી,	ખાળક,
૪	૩	૨૧	૧૪	૨	૨

અંગેણ લણેલ પુરુષ,	વેપાર,	મડિકુમણા,	સામાયક
૪	૧૨	૨	૧૧

### ભોઈકા થાણા.

#### ૧ ભોઈકા.

આ ગામ લીંખડી ભાયાતનું છે, ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસી નથી. .

### ૨ મોદા નાડીયા.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વસ્તિ:—

ધર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ પુરુષ,	વિધુર,	કુંવારા,
૬	૨૭	૧૭	૧૦	૪	૩	૧૦

સધવા	વિધવા,	કુંવારી,	દસા,	લણેલ પુરુષ,	લણેલ સ્ત્રી	ખાળક,
૪	૧	૫	૨૭	૧૫	૨	૩

૧૮૮

અંગ્રેજ ભણેલ પુરુષ; વેપાર, નોકરી, પડિકમણ્ણા, સામાયક,  
૩ ૧૫ ૨ ૩ ૧૧

### ૩ કંથારીયા.

આ ગામ લીંખડી લાયાતનું છે, ઉપાશ્રય છે. જૈન સ્થાનકવાસીની વસ્તિ:—

ઘર	માણસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ પુરુષ.	વિધુર,
૧૨	૫૨	૨૮	૨૪	૮	૫
કુંવારા,	સધવા,	વિધવા,	કુંવારી,	બધા દસા	ભણેલ પુરુષ,
૧૫	૮	૮	૮	૫૨	૨૨
ભણેલ સ્ત્રી,	બાળક,	અંગ્રેજ ભણેલ પુરુષ,	વેપાર, નોકરી,	પડિકમણ્ણા,	
૬	૧૧	૨	૧૪	૪	૫

સામાયક.  
૧૭

### ૪ ઓણાળા.

આ ગામ લોધિકાનું છે. ગામમાં ઉપાશ્રયછે. જૈન સ્થાનકવાસીની વસ્તિ:—

ઘર,	માણસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ પુરુષ,	વિધુર,	કુંવારા,
૨૦	૧૩૮	૭૪	૬૪	૩૦	૬	૩૮
સધવા.	વિધવા.	કુંવારી.	વિસા શ્રીમાળી,	દસા શ્રીમાળી,		
૩૦	૧૦	૨૪	૭૪	૬૪		
ભણેલ પુરુષ,	ભણેલ સ્ત્રી,	બાળક,	અંગ્રેજ ભણેલ પુરુષ,	વેપાર,		
૬૫	૧૩	૧૬	૪	૫૧		

નોકરી સામાયક.  
૭ ૬૬

### ૫ છલાળા.

આ ગામ અડવાળનું લીંખડી લાયાતનું છે. ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વસ્તિ:—

૧૮૬

ધર,	માણુસે,	પુરુષ,	સ્ત્રી,	પુરુષ પરણેલ,	વિધુર,	કુંવારા,
૪	૨૭	૧૭	૧૦	૧૫	૧.	૧૧
સંધવા,	કુંવારી.		દસા,	અણેલ પુરુષ,	અણેલ સ્ત્રી,	
૫	૫		૨૭	૧૧		૨
ખાળક,	વેપાર,	સામાયક,				
૭	૧૪	૬				

#### ૬ ખંબનાવ.

આ ગામમાં ઉપાશ્રયના જગ્યા છે, મકાન નથી. જેન સ્થાનક-  
વાસીની વસ્તિ:—

ધર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ પુરુષ,	વિધુર,	કુંવારો,	સંધવા,
૧	૧૦	૬	૪	૨	૩	૧	૨
કુંવારી,		દસા,		અણેલ પુરુષ,	અણેલ સ્ત્રી,		ખાળક,
૨		૧૦		૫	૧		૨
વેપાર.	પડિકમણું,		સામાયક.				
૫	૧		૪				

#### ૭ અંકેવાળીયા.

આ ગામ લીંબડી લાયાતનું છે. ઉપાશ્રય છે. જેન સ્થાનક-  
વાસીની વસ્તિ:—

ધર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ પુરુષ,	વિધુર,	કુંવારા,
૭	૬૦	૨૭	૩૩	૧૨	૧૨	૧૪
સંધવા,	વિધવા,	કુંવારી,	બધા દસા		અણેલ પુરુષ,	
૧૨	૨	૧૬	૬૦			૨૫
અણેલ સ્ત્રી,	ખાળક,	અંગેજ લાણેલ પુરુષ,	વેપાર,	પડિકમણું,		
૧૨	૧૫	૩	૨૭	૪		
સામાયક.						
૨૮						

૧૬૦

### ૮ લડીયાદા, અકેવાળીયા તાંબે.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વસ્તિ:—

ધર	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ પુરુષ	કુંવારા
૧	૧૦	૪	૬	૧	૩
સધવા, વિધવા, કુંવારી, દસા, ભણેલ પુરુષ, બાળક વેપાર,	૨	૩	૧૦	૩	૨

સામાયક.

૪

### ૯ મોટા ટીંખલા

આ ગામ લોઈકાનું છે, ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીની વસ્તિ:—

ધર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ પુરુષ,	કુંવારા,	સધવા,
૨	૧૨	૬	૬	૨	૪	૨
વિધવા કુંવારી, દસા શ્રીમાળી,	૩	૧૨		૬		૨
બાળક, અંથજુ લણેલ પુરુષ, વેપાર, પડિકમણું, સામાયક.	૩	૧	૪	૧	૭	

### ૧૦ સૌકા.

આ ગામમાં ઉપાશ્રય છે. જૈન સ્થાનકવાસીની વસ્તિ:—

ધર,	માણુસ.
૪	૨૧

### ૧૧ ભલગામડા.

આ ગામમાં ઉપાશ્રય નવો ધણો સરસ છે! જૈન સ્થાનકવાસાની વસ્તિ:—

ઘર, માણુસ પુરુષ; સ્ત્રી, પરણેલ પુરુષ, વિધુર, કુંવારો, સધના,  
૫ ૬૬ ૩૦ ૩૬ ૧૭ ૧ ૧૨ . ૧૭

વિધવા, કુંવારી, દસા લણેલ પુરુષ,, લણેલ સ્ત્રી, આળક,  
૭ ૧૭ ૬૬ ૨૫ ૨ ૧૪

વેપાર. નોકરી, સામાયક.  
૧ ૧ ૪૧

### દસાડા થાણ્યા.

આ તાલુકો આલાવાડ પ્રાંતમાં આવેલ મુસલમીનનો છે, તાલુકો ભાઈએ ભાગ પાડવાના રીવાજ મુજબ એ લાખનો તાલુકો જુદા જુદા ભાગહારો વચે ઠેણુંચાઈ ગયેલ છે. દસાડા દ્વારા બહાર હતું તે ગવ-  
મેન્ટને અરજ કરી દ્વારામાં લેવરાયું. એ આ દસાડામાં ગામ રહેણું  
છતાં સ્થાનકુવાસીની વસ્તિ જુઝ છે. હેરાવાસીની સંખ્યા સારી છે. અહું  
ઉપાશ્રય નથી. જૈન સ્થાનકુવાસીની વસ્તિઃ—

ઘર. માણુસ. પુરુષ. સ્ત્રી. પરણેલ પુરુષ. સધવા. વિધવા,  
૧ ૧૭ ૬ ૧૧ ૬ ૬ ૧

કુંવારી, ભાવસાર, લણેલ પુરુષ. લણેલ સ્ત્રી, આળક, વેપાર.  
૪ ૧૭ ૪ ૩ ૩ ૩ ૫

નોકરી, સામાયક.  
૧ ૧૧

### ધૂંધુકા જીલ્દો.

#### ૧ ધૂંધુકા.

આ ગામ સોંઠ ઉદ્દી કાઠિયાવાડ ઈલાકાના પૂર્વના છેડે આવેલ  
અમહાવાહ જીલ્દા નીચે આવેલ છે. ગામમાં મામલતદાર છે. આ  
ગામમાં રાયચંદ કુવિના અનુયાયી લલ્લુણી નામના ખંલાત સં-  
પ્રદાયના સાધુંએ સ્થાનકુવાસીમાં મર્ત્યપુઅની ભાવના ફૂલાવવાથી  
ધણ્ય માણુસો હેરાસર જિય છે. આ ગામ સાયલા સંધારાનું છે. જૈન  
સ્થાનકુવાસીની વસ્તિઃ—

ધર, ૩૬	ાણસ, ૭૫૬	•પુરુષ, ૮૦	સી, ૭૬	પરણેલ પુરુષ, ૩૪	ત્રિધુર, ૩
કુંવારા, ૪૩	સધવા, ૩૫	વિધવા,, ૨૧	કુંવારી, ૨૦	દસા, ૨૭	ભાવસાર, ૧૨૬
લણેલ પુરુષ, ૬૩	ભણેલ સ્ત્રી, ૧૧	ખાળક, ૩૫	અંચ્યુનુ લણેલ પુરુષ, ૩		
વેપાર. ૫૭	મોકડી, ૨૩	પડિકમણ્ણા, ૧૦	સામાયકુ. ૭૩		

## ૨ રાણુપુર.

આ ગામ સુકલાઇના કાંડે ધુમલીના ધણી હુલામણુ જોઠવાનું વસાવેલ રાણુના નામ ઉપરથી રાણુપુર નામથી ઓળખાય છે. તેની શાક્ષીદ્રિપ હજુ રાણુનો ગઠ નહીના તરફ ઉપર ખાંડેર હાલતમાં છિલો છે. આ ગામના રાજકૃતા મુલ રાજપુત વંશના મુલીના પરમાર છે. હજુ નામ રજ્યપુતના પાડવા સાથે છેડા છેડી છેડવા મુળી માંડવરાળુંએ આવે છે. બાદશાહી વખતમાં વરલાઇને મુસલમીન થધ ગયા છે. રાણુપુર ધંધુકા લુલ્લા નીચે છે. આ ગામમાં બોટાદ સંપ્રદાયના ચોમાસા થાય છે. ઉપાશ્રય છે. આગેવાન ગોપાળું હુંગરસિ મોતી નામના જૈન વિશ્ા શ્રીમાણી છે. આ ગામમાં પૂર્વે જુડા તપસ્થિત નામના જૈન સ્થાનકવાસી મહાત્મા થઈ ગયા, તેમની આ ગામમાં ઓરડી છે. તેમને હિન્દુ અને મુસલમાન બન્ને પુને છે. તેમનો હેડ પડ્યો ત્યારે હિન્દુએ બાળવા અને મુસલમાને ફર્કનાવવા વાટાધારણ કરવાથી જુડા તપસ્થિના ફેહનો પુણ્ણનો ઢગલો થઈ ગયો. આ માટે જુડા તપસ્થિનુંનો શ્લોકો વાંચવા ખાસ લાર હઈ ભલામણુ કરવામાં આવે છે.

પત્રકો મોકલી અનેક, ઉધરાણું કરવા છતાં પત્રકો ન આવવા માટે હીલગીર.

## ૩ લોયા.

આ ગામમાં ઉપાશ્રય નથી. જૈન સ્થાનકવાસીનો વસ્તિ:—

घर, माणुस, पुरुष, स्त्री, परणेल पुरुष, विधुर, कुंवारा,  
१२ ४८ ३६ २२ ११ ५ २०

सधवा, विधवा, कुंवारी, हसा, लणेल पुरुष, लणेल स्त्री, भाणक,  
११ ३ ८ ४८ ३३ ५ ८

अंग्रेज लणेल पुरुष, वेपार, नोकरी, पडिकमणा, सामायकः  
६ ३० ६ ४ २२

### ८ नोली.

आ गाममां उपाश्रय छे. जैन स्थानकवासीनो वस्ति:—

घर, माणुस, पुरुष, स्त्री, परणेल पुरुष, विधुर, सधवा,  
११ २८ १५ १३ ५ १ ५

विधवा, अधा हसा, लणेल पुरुष, लणेल स्त्री, वेपार.  
७ २८ १५ ४ ५

### ९ नडाणी।

आ गाममां उपाश्रय नयी, जैन स्थानकवासीनी वस्ति:—

घर, माणुस, पुरुष, स्त्री, परणेल पुरुष विधुर, कुंवारा,  
४ २८ १७ ११ ५ २ १०

सधवा, विधवा, कुंवारी, हसा श्रीमाणी, लणेल पुरुष,  
४ १ ६ २८ १७

भाणक, वेपार, नोकरी.  
६ ६ १

### १० सका।

आ गाममां उपाश्रय नथी. जैन स्थानकवासीनी वस्ति:—

घर, माणुस, पुरुष, स्त्री, परणेल पुरुष, कुंवारा,  
१ १२ ४ ८ ३ १

सधवा, विधवा, भाणक, हसा, लणेल पुरुष, लणेल स्त्री,  
३ १ ३ १२ ४ ३

वेपार, सामायक, पडिकमणा,  
३ २ २

## ૫ વાગડ.

આ ગામમાં ઉપાય્યનથી, જૈન સ્થાનકવાસીની વર્સ્તા:—

ઘર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ પુરુષ,	વિધુર,	કુંવારા,	અધવા,
૧૦	૩૪	૩૬	૨૮	૧૬	૪	૧૩	૧૬

વિપવા;	કુંવારી,	ભાવસાર,	ભણેલ પુરુષ,	ભણેલ સ્ત્રી,
૩	૬	૬૪	૨૮	૧૨

ખાળક,	વેપાર,	નોકરી.
૧૪	૧૨૮	૮

## ૪ પીરભડીયાદ.

આ ગામમાં ઉપાય્ય છે. આ સાયલા સંધારાનું ક્ષેત્ર હુધ ચોમાસા તેમના થાય છે. જૈન સ્થાનકવાસીની વર્સ્તા:—

ઘર,	માણુસ,	પુરુષ,	સ્ત્રી,	પરણેલ પુરુષ,	વિધુર,	કુંવારા,
૨૮	૧૦૨	૪૭	૪૫	૨૭	૮	૨૨

સંધવા,	વિધવા,	કુંવારી,	વિસા,	ભણેલ પુરુષ,	ભણેલ સ્ત્રી,
૨૭	૧૦	૮	૧૦૨	૫૦	૧૩

ખાળક,	વેપાર,	નોકરી.
૧૬	૫૪	૩

આખા આલવાડ પ્રાંતમાં જૈન સ્થાનકવાસીના ૨૧૬૬ ઘર અને ૧૧૦૩૧ માણુસની વર્સ્તા છે.

કાઠિયાવાડ હલાકામાં હણ્ણ સુસલમાનની વર્સ્તા ૨૫, લાખ માણુસની છે. તેમાં જૈનો મુઠોલસર છે. તેમાં પણ જૈન સ્થાનકવાસી તો કુકુત —

૧ સોરઠ પ્રાંતમાં ૧૧૧૭૪ માણુસ.

૨ હાલાર પ્રાંતમાં ૩૬૮૮ ઘર. ૧૪૭૬૬ માણુસ.

૩ ગોઠિલવાડ પ્રાંતમાં ૭૮૮ ઘરું ૪૭૭૧ માણુસ.

૪ આલવાડ પ્રાંતમાં ૨૧૬૬ ઘર. ૧૧૦૩૧ માણુસ.

કુલ જરૂરી ૪૨૩૭૩ માણુસ છે.

નોટ:—ખાળકના આંકડા આખા છે તેમાંથી વર્ષની અંદરની ઉમરનાને ખાળક ગણેલ છે.

કાઠિયાવાડ જૈન સ્થાનકવાસી ડિરેક્ટરીના અગાઉથી  
થયેલ ગ્રાહક મહારાયોની મુંખારક નામાવતિ.

- |    |                                                             |          |
|----|-------------------------------------------------------------|----------|
| ૧  | શ્રી લવજી સ્વામી જૈન કો લાઇષેરી. હા. ઓનરરી                  | ચોટીલા.  |
|    | સેકેટરી ધાધલ હેવાઈટ રાણુ.                                   |          |
| ૧  | શ્રી લવજી સ્વામી જૈન સ્થાનકવાસી લાઇષેરી. રામપુરા.           |          |
| ૧  | શ્રી લવજી સ્વામી જૈન સ્થાનકવાસી લાઇષેરી. અંડ્રાઝીયા.        |          |
| ૧  | શ્રી લવજી સ્વામી જૈન સ્થાનકવાસી પુસ્તકાલય. ચોટીલા.          |          |
| ૧  | શ્રી લવજી સ્વામી જૈન સ્થાનકવાસી લાઇષેરી. વસ્તડી.            |          |
| ૧  | સર્વસા મહાવીર જૈન સ્થાનકવાસી લાઇષેરી. એરવા જતના.            |          |
| ૨  | રા. રા. અનુપચંદ જગળુંન મોહી. બી. એ.                         |          |
|    | એલ. એલ. બી. દિવાન સાહેબ                                     | ધરમપુર.  |
| ૨  | રા. રા. હેમચંદ રામજી મહેતા. મોરાણીવાળું                     |          |
|    | એલ. સી. ધ. એકુઝીકુયુટેવ એન્ઝનીયર સાહેબ                      |          |
|    | ભાવનગર સ્ટેટ રેલ્વે.                                        | ભાવનગર.  |
| ૫  | રા. રા. રાવ સાહેબ ઠાકરશિ મહનજી ધીયા, સ્ટેટ                  |          |
|    | એન્ઝનીયર સાહેબ,                                             | નુનાગઢ.  |
| ૫  | રા. રા. રાવ ખાડુદુર પ્રસાદુર ટી. કેડારી એલ,                 |          |
|    | એમ. એન્ડ. એસ. એટ્ર. શી. પી. એસ. બી.                         |          |
|    | એમ. એસ. આ. સિવીલ સર્જન. રાજકોટ કાઠિયાવાડ.                   |          |
| ૨  | રા. રા. રણુછોડાલ લાક્ષ્મિચંદ મહેતા. દિવાન સાહેબ. વળા.       |          |
| ૭૧ | રા. રા. અમરચંદ પિતામથર શાહ, પોલીસ                           |          |
|    | સુપ્રીનેન્ડન્ટ સાહેબ.                                       | પોરણંદર. |
| ૧૦ | શા. નકુલાઈ કાળુભાઈ સાયલાવાળા. આર્યનૈતિક                     |          |
|    | નાટક કુ. ના. મનેજર સાહેબ                                    | મુંખંઈ.  |
| ૧  | રા. રા. દાકેતર મોહનલાલ ચુંદરજી હેસાઈ સાયલાવાળા ટીકર્સ રણની. |          |
| ૧૧ | રા. રા. તલસાણીયા જગળુંન ઉજમશિ.                              | લીંબડી.  |
| ૫  | ,, મજૂરીયાર અમુલાખ અમીચંદ                                   | લીંબડી.  |
| ૧  | શા. જગળુંન લેરાબાઈ.                                         | લીંબડી.  |

- ૧ ન્યાલચંહ મુર્ખોતમ ગાંધી ઇલેક્ટ્રોિક એન્જિનીયર વઠવાણુ શહેર  
 ૧ રા. હાક્તર કુંવરજી ભુરાલાઈ શાહ. વઠવાણુ શહેર.  
 ૧ શા અમૃતલાલ ઓઘડ. વઠવાણુ શહેર.  
 ૧ ગાંધી છગન કેશવજી વઠવાણુ શહેર.  
 ૧ સંધવી મોહનલાલ પ્રાગજી વઠવાણુ શહેર  
 ૧ શ્રી જાનવર્ધક કુંડ લાઈએરી. વઠવાણુ કેમ્પ.  
 ૧ રા. રા. હાક્તર મનસુખલાલ તારાચંહ શાહ. વઠવાણુ કેમ્પ.  
 ૧ રા. રા. માનસંગ નરલેરામ કામહાર. જેતપુર.  
 ૧ રા. રા. નૌતમલાલ લગવાનજી જેતપુર.  
 ૧ રા. રા. જીવરાજ દેવચંહ કામહાર. જેતપુર.  
 ૧ રા. રા. વકીલ જીવરાજ વર્ધમાન શાહ. જેતપુર.  
 ૧ દોશી પ્રાગજી કાનજી હા નરલેરામ પ્રાગજી જેતપુર.  
 ૧ જૈન સ્થાનકવાસી સંધ હા. કામહાર પોપટ વનમાળી ધીરાજી  
 ૧ શા લદ્ધિમચંહ વાલજી. ધીરાજી.  
 ૧ તેજાણી ઉત્તમચંહ કમલશિ. ધીરાજી.  
 ૧ રા. રા. અમૃતલાલ ઉમેદચંહ મહેતા ન્યાયાધિસ. ચુડા  
 ૧ રા. રા. દોશી દલપત્રરામ વનમાળીદાસ, જાપિત  
     સુપ્રીન્ટેન્ડન્ટ લાયાતી જગીર. મુળી.  
 ૧ શ્રી અમરસિરખ જૈન સ્થાનકવાસી લાઈએરી રાજસીતાપુર.  
 ૧ રા. રા. નગરશેઠ ભૂહર વાલજી રાજસીતાપુર.  
 ૧ શા. જીવરાજ નાનજી. રાજસીતાપુર.  
 ૧ શા. પોપટલાલ તળશી. રાજસીતાપુર.  
 ૧ શા ઝુશાલ રતનસિ. રાજસીતાપુર.  
 ૧ શેઠ ચુનીલાલ ભાઇચંહ. રાજસીતાપુર.  
 ૧ મણુલાલ સુંદરજી દેસાઈ સાયલાવાળા. ઇલક્ટ્રા.  
 ૧ શા. દલીયંહ સૌલાખચંહ સુણીવાળા. કરાચી.  
 ૧ શા. મોહનલાલ શિવલાલ. કરાચી.  
 ૧ શા. મણુલાલ કેશવજી જુનાગઢવાળા. સાંગલી.  
 ૧ શા. હામેદરહાસ મનજી રામપુરવાળા. સાંગલી.  
 ૧ ડ્રાણી દેવચંહ શામળજી, ચાણુકા.

૧	ઝ્યાણી લુવરાજ હુસરાજ	ચાણુકા
૧	રૂપાણી રાજ્યપાળ કુણા.	ચાણુકા
૧	જૈન સ્થાનકુવાસી સંધ હા. શા. ઉમેદચંદ પુલચંદ	રંગપુર
૧	જૈન સ્થાનકુવાસી સંધ. હા. ભુરાલાલ લક્ષ્મિચંદ જેતપુર મોરણીનું	
૨	શા. આણુંહળ કુચરાલાઈ.	ભુજા.
૧	જૈન સ્થાનકુવાસી સંધ હા. પેલ મેતીચંદ લક્ષ્મિચંદ કાચ્છસુઈ	
૨	શા. નાથાલાલ પુરુષોત્તમદાસ.	પાણુસીણુા.
૧	શા. ગુલાખચંદ ગઢુંડ	પાણુશી ણુા.
૨	જૈન સ્થાનકુવાસી શ્રી લાઠેલેરી.	દ્રાષ્ટા.
૧	જૈન સ્થાનકુવાસી સંધ.	લલગામડા
૧	જૈન સ્થાનકુવાસી સંધ હા. ગાંધી કુચરા માનસંગ સુદ્ધામડા.	
૪	શા. કેશલાલ છગનલાલ	વીઠીયા.
૧	શ્રી જૈન સ્થાનકુવાસી સંધ આતે.	અગસરા.
૧	શા. નરભેરામ હેવચંદ	અગસરા.
૧	જૈન સ્થાનકુવાસી સંધ.	ચોતલ.
૧	કુકાવાવ રહુજન આતે. હા. શેઠ મુળજુ દેવકરણ મેટી કુકાવાવ.	
૧	જૈન સ્થાનકુવાસી સંધ આતે.	ટીકર રણુની
૧	જૈન સ્થાનકુવાસી સંધ આતે.	લાડલા.
૧	મેતા ખુશાલચંદ કુળીદાસ મોરણીવાળા. ટીકેર	
	માસ્તર વાંકનેર જંકશન.	


### મુંખદ.

- ૧૦ શેઠ મેધળુભાઈ થોભણુ
- '૫ શેઠ છોટલાલ કેશરજુ
- ૨ શેઠ વજલાલ કાળીદાસ
- ૨ શેઠ અમૃતલાલ રાયચંદ અવેરી
- ૨ શેઠ રતનજુ વાધળુ
- ૨ શેઠ ગોકુલદાસ પ્રેમજુ
- ૨ શેઠ કાલીદાસ અનુદભ
- ૨ શેઠ હેમવીંદ રાયચંદ
- ૨ શેઠ શાંતિલાલ ઠાકરસી

- ૨ શોઠ કેશવજી મહનજી  
 ૫ શોઠ શાન્તિહાસ આરુકરણુના માતુશ્રી  
 ૧ શોઠ ન્યાલચંદ ગુલાખચંદ  
 ૧ „ પ્રાગજી હેવચંદ હા. નવલખેન  
 ૧ „ ચત્રભૂજ ઇતેચંદ  
 ૧ „ મોહનલાલ ચતુરદાસ  
 ૧ „ રામજી નથુ  
 ૧ „ જદવજી પ્રાગજી  
 ૧ „ પ્રાણુલાલ હેમચંદ  
 ૧ „ ચુનીલાલ રાયચંદ અજમેરા  
 ૧ „ કામદાર ઝીમચંદ સુખલાલ  
 ૧ „ ગુલાખચંદ અમીચંદ  
 ૧ „ નાગરદાસ કસ્તુરચંદ  
 ૧ „ ચત્રભૂજ મોહનલાલ  
 ૧ „ ઝીમચંદ અમરસી  
 ૧ „ ત્રિલોવનદાસ ગુલાખચંદ  
 ૧ „ જગજીવન ડેસાલાઈ  
 ૧ „ વેદજી મેઘજી  
 ૧ „ ધીરજલાલ પાનાચંદ  
 ૧ „ સાહુલસિંગ કાનમલ  
 ૧ „ સાકુલચંદ જેચંદ  
 ૧ „ નાગજી કેશવજી  
 ૧ „ જસકરણુ મયાચંદ  
 ૧ „ શાંતિલાલ હેવચંદ  
 ૧ „ માનસંગ કસ્લચંદ  
 ૧ „ તલસાણીયા વાડીલાલ કર્ષુરચંદ  
 ૧ „ હીરાચંદ તારાચંદ  
 ૧ „ નરલોશમ લનચંદ  
 ૧ „ મણીયાર વલસદાસ સુખલાલ  
 ૧ „ ન્યાલચંદ કપુરચંદ

- ૧ „ નેણુસી હીરાચંદ  
 ૧ „ ગોકુલહાસ શીવલાલ  
 ૧ „ વનમાળીભાઈ જીવરાજ  
 ૧ „ વછરાજભાઈ ગુલાખચંદ  
 ૧ „ ગોસળીયા ચત્રભૂજ વનમાળી  
 ૧ „ જગળુવન મુળજ  
 ૧ „ પોપટલાલ પ્રેમચંદ  
 ૧ „ જેચંદ પ્રમાણુંદ બહાણી  
 ૧ „ મગનલાલ મોહનલાલ  
 ૧ „ હરખચંદ ક્રિલોવનહાસ  
 ૧ „ વનેચંદ મલુકચંદ  
 ૧ „ મુલજ અમરસી  
 ૧ „ મોહી જગળુવન મુળજભાઈ  
 ૧ „ નાગરહાસ નાનજ  
 ૧ „ લક્ષ્મચંદ માણેકચંદ  
 ૧ „ મનસુખલાલ ગુલાખચંદ  
 ૧ „ લાલજ વાલજ લાઠીવાળા  
 ૧ „ પરમાણુંદ ઝંબેરચંદ એરવાલા  
 ૧ „ નાગરહાસ છગનલાલ  
 ૧ „ વેલજ સુમયા  
 ૧ „ ચત્રભૂજ નરસીહાસ  
 ૧ „ ચુનીલાલ લક્ષ્મીચંદ ડંગલી  
 ૧ „ ફલીચંદ ગેમચંદ  
 ૧ „ કુલ્યાણજ શીવલાલ  
 ૧ „ પ્રભકુલાલ નાનચંદ માણીયાર  
 ૧ „ નંહલાલ ગીરધરલેલ કામદાર  
 ૧ „ નેમચંદ સુંદરજ  
 ૧ „ મોહનલાલ હોપચંદ  
 ૧ „ રામશુ અંદરજ  
 ૧ „ જેરામ રાધેજ

- ૧ „ હિમતલાલ ડેસાલાઈ શાહ  
 ૫ શોઠ દીપચંહ ગોપાળજી  
 ૫ શોઠ જેઠાલાલ સંધળ  
 ૧ „ પોપટલાલ લક્ષ્મિચંહ  
 ૧ „ મુર્ખેાત્તમ ઓઘડાસ  
 ૧ „ સુખલાલ ઓઘાલાઈ  
 ૧ „ ત્રંભકલાલ કસ્તુરચંહ  
 ૧ „ કેશવલાલ ગોપાલજી  
 ૧ „ શામલદાસ રણુછોડ



**સુધારો—**—સાધુ સાંદ્વિના લીણડી સંપ્રદાયના સાધુઓની નામાવલિમાં છોટલાલજી સ્વામી અને લક્ષ્મિચંહજી સ્વામી હાલ ઘણું વખત થયા સંપ્રદાય બઢાર છે એમ વાંચવું. અને સાંદ્વિલાલની નામાવલિમાં નીચેના ૪ આર્યાજીઓના નામ ભૂલથી રહ્યો ગયેલ તે પૈકી ૧ આર્યાજી હરીઆઈ ર આર્યાજી હેમકુવરખાઈ ત આર્યાજી રંલાખાઈ ૪ આર્યાજી પ્રલાઙુવરખાઈના નામ ઉમેરવામાં આવે છે.

એ મુજબ સુધારો કરવા કૃરક્ષ પડી છે.



## શ્રી નૈન સ્થાનકવાસી વિદ્યાલંઘ—મુખ્ય

આ સંસ્થા સંચત ૧૯૭૬ ના કારતક સુદ્ધ ૫ ના રેજિસ્ટ્રેશન સ્થાપવામાં આવેલી છે. તેને હૃતમાં આઠમું વરસું ચાલે છે. અને તેનો સાતમે વાર્ષિક રીપોર્ટ હૃતમાં ખાડુાર પડેલો છે. આ સંસ્થા હૃતમાં ઝીડી અન્નર પાટકા એલીજિ પેલા માળાપર લાવવામાં આવેલા છે. તેમાં નીચે મુજબ કામકાજ આવકનો પ્રમાણુમાં આવે છે.

- ૧ દરેક જૈનશાળા તથા શ્રાવીકા શાળામાં અભ્યાસને મોટે ધાર્મિક પુસ્તકો મફત આપવામાં આવે છે. તેમજ ગરીબ માણુસને પણ અભ્યાસ માટે પુસ્તકો મફત આપવામાં આવે છે.
- ૨ આ સંસ્થામાં ધર્મ ઉપગરહો તથા ધાર્મિક પુસ્તકો રાખવામાં આવે છે તે તે બ્યાજથી કિમતથી વેચવામાં આવે છે અને તેની ઉપજ તેજ ખાતામાં વાપરવામાં આવે છે.
- ૩ આઠમ પાણીની ટીપો દર વરસે છપાવી ખાડુાર પ્રાડવામાં આવે છે અને જ્યાં જ્યાં જરૂર હોય અને મંગાવે ત્યાં મફત મેલવામાં આવે છે.
- ૪ દર મહિનામાં દસ તીથી તથા પચ્ચાંથુના હિસ્સમાં હમેશાં જીવેને અભયહાન આપવામાં આવે છે.
- ૫ હમેશાં કણુતરને ચણું નાખવામાં આવે છે.
- ૬ ગાયોને ધાસ તથા કુતરાને રીટકા નાખવામાં આવે છે.
- ૭ ગરીબ માણુસને મહદુદ્દ તથા હવા આપવામાં આવે છે.
- ૮ સુધ્યા તથા પોજાણી વિદ્યાલયમાંથી પોતાના વપરાસ મારે મફત મળે છે.
- ૯ વિદ્યાલયના મકાનનું ભાડું આ ખાતામાંથી આપવામાં આવે છે.
- ૧૦ આ ખાતા તરફથી પોતોઓ બનાવેલો છે તે મુખ્ય મધ્યે ડેટલાક દાનથીર ગુડુસ્થોએ પોતાને ધેર તથા દુકાન પર રાખેલી છે. તે પેટી વિદ્યાલયના સેક્રેટરીએ તે સગવડતાએ આવે છે અને દરેક રકમની છપેલી પહોંચ આપવામાં આવે છે. અને તેનો નામ વાર રીપોર્ટ દર વરસે છપાવી ખાડુાર પ્રાડવામાં આવે છે.

૧૧. અવ દયા ખાતાના સૈસા ફક્ત અચ્છ થા ખાતામાં વાપરવામાં આવે છે, અને પોટીના પૈસા ઉપર ખતાવેલા ફરેક કામમાં વાપરી શકાય છે.

આશા રાખીએ છીએ કે ફરેક ખાઈએ તથા બહેનો ઉપરની જીતા ધ્યાનમાં લાગ આવો ઉપરોગી સંસ્થાને મદ્દહ કરવા ચુકશો નહિ. એજ વિતતિ લી. શ્રી સંમના સેવક.

.૨૧. ત્રિભૂવનદાસ ગુલાખયંદ. ( અમનગરાવળા. )  
તથા

ગાંધી રતનજી પાનાચંદ. ( શેરડીવાળા. )

ઓનરરી સેકેટરી

શ્રી જૈન સ્થાનકવાસી વિધાલય

ડૉ. ભૌડીખણર પાટકા બીલડીંગ મુખ્ય.

તા. કૃ.—કાવમાં કાઢિયાવાડ જૈન સ્થાનકવાસી ડૉસેક્ટરી ખાદાર પડેલા છે તે ચોપડી શ્રી જૈન સ્થાનકવાસી વિધાલયમાંથી મળી શકશો.  
કિમત રૂ. ૩૦૦

કાઢિયાવાડના સાધુ સાધી.	
સાધુ.	સાધી.
૧૧૭	૨૫૪
મારવાડી સાધુ સાધી.	
સાધુ.	આર્થા.
૫૮૮	૧૨૬૬
કુલ.	
સાધુ.	સાધી.
૭૧૬	૧૫૫૦
કુલ મુણી	
	૨૨૬૬